MIC. # 9955 (RAB. 1632)

KAPLAN, MOSHE TSEVI.

קפלן, משה צבי.

DIVRE NO‘AM: PERUSH ‘AL PIRKE AVOT.

דברי נועם: פירוש על פרקי אבות.

These images are from the collection of the Library of the Jewish Theological Seminary (JTS). JTS holds the copyrights to these images. The images may be downloaded or printed by individuals for personal use only, but may not be quoted or reproduced in any publication without the prior permission of JTS.

TEL-AVIV: 1945
ASHKENAZIC SCRIPT

הועתק והוכנס לאינטרנט
www.hebrewbooks.org
ע"י חיים תש"ע



0370

"אחרי מות" ק'

ע"פ הכתב יד של הרב קאפח זצ"ל

58. ירמיה מז פרק-בלה

Ms. 1128

LIBRARY
Jewish Theological Seminary of America

These images are from the collection of the Library of the Jewish Theological Seminary (JTS). JTS holds the copyrights to these images. The images may be downloaded or printed by individuals for personal use only, but may not be quoted or reproduced in any publication without the prior permission of JTS.

www.hebrewbooks.org
לרשימת ספרים נוספים

ગામનું નામ :-

ગામ પાછળ કોઈ ઐતિહાસિક કારણ કે પ્રસિદ્ધ વ્યક્તિ સાથે સંકળાયેલું હોય તો તે વિશે માહિતી આપો.

ગામમાં આવેલ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ, પુસ્તકાલય, વાચનાલય વગેરે શૈક્ષણિક સંસ્થાઓ વિશે માહિતી આપો.

ગામમાં આવેલ સરકારી કચેરીઓ જેવી કે પોસ્ટ ઓફિસ, તલાટી કચેરી, પોલીસ સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાનું વગેરે વિશે માહિતી આપો.

ગામમાં આવેલ ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, દેરાસર વગેરે વિશે માહિતી આપો.

ગામમાં આવેલ ઔદ્યોગિક એકમો વિશે માહિતી આપો.

ગામમાં આવેલ બેંક, સહકારી મંડળીઓ વિશે માહિતી આપો.

ગામમાં આવેલ ઉદ્યોગો, કારખાનાઓ, ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોદ્યોગ વિશે માહિતી આપો.

ગામમાં આવેલ પ્રવાસન સ્થળો, પર્યટન સ્થળો વિશે માહિતી આપો.

ગામમાં આવેલ ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો વિશે માહિતી આપો.

ગામમાં આવેલ પ્રાકૃતિક સંપત્તિ, જંગલો, ખનીજો વિશે માહિતી આપો.

ગામમાં આવેલ પરિવહન વ્યવસ્થા, રસ્તાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિશે માહિતી આપો.

ગામોનાં નામોની યાદી

ગામનું નામ, તાલુકો અને જિલ્લો, જેમાં તે આવેલું છે. ગામની વસ્તી, ગામમાં આવેલી શાળાઓ અને દવાખાનાં, ગામમાં થતી મુખ્ય પેદાશો, ગામમાં આવેલાં ઐતિહાસિક કે ધાર્મિક સ્થળો, ગામમાં જવા માટેનાં સાધનો અને ગામથી નજીકનાં મોટાં શહેરોનું અંતર વગેરે વિગતો આપવી.

ગામોનાં નામોની યાદી તૈયાર કરવા માટે ગામોની વિગતો મેળવવા માટે વિદ્યાર્થીઓ જુદી જુદી રીતો અજમાવી શકે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ગામ વિશે જાણતા હોય છ

দেশের সকল শ্রেণির মানুষের মধ্যে সুষ্ঠু সম্পর্ক বজায় রাখা এবং সকল ধর্মাবলম্বী মানুষের ধর্মীয় অনুভূতিকে শ্রদ্ধা করা প্রত্যেক নাগরিকের কর্তব্য। কোনো ব্যক্তি বা গোষ্ঠী যদি ধর্মীয় অনুভূতিতে আঘাত করে বা ধর্মীয় বিদ্বেষ ছড়ায়, তবে তা দেশের শান্তি ও ঐক্যের জন্য হুমকিস্বরূপ। তাই ধর্মীয় সহনশীলতা ও পারস্পরিক শ্রদ্ধাবোধ গড়ে তোলা অত্যন্ত গুরুত্বপূর্ণ।

ধর্মীয় সহনশীলতা বলতে বোঝায় নিজের ধর্ম পালনের পাশাপাশি অন্য ধর্মের প্রতি সম্মান প্রদর্শন করা। প্রত্যেক মানুষের নিজস্ব বিশ্বাস ও আচার-অনুষ্ঠান পালনের অধিকার রয়েছে। কারো ধর্মীয় বিশ্বাসকে উপহাস করা, ধর্মীয় প্রতীকের অবমাননা করা কিংবা ধর্মের নামে সহিংসতা ছড়ানো কোনোভাবেই কাম্য নয়। এসব কাজ সমাজে অস্থিরতা সৃষ্টি করে এবং মানুষের মধ্যে ভয় ও অবিশ্বাস তৈরি করে।

ধর্মীয় সহনশীলতা বজায় রাখতে হলে আমাদের ধর্মীয় শিক্ষার সঠিক চর্চা করতে হবে। ধর্মগ্রন্থে মানবতা, ন্যায়, ক্ষমা ও ভ্রাতৃত্বের যে শিক্ষা দেওয়া হয়েছে, তা জীবনে ধারণ করা প্রয়োজন। শিক্ষাপ্রতিষ্ঠান, পরিবার ও গণমাধ্যমের দায়িত্ব হলো শিশু ও তরুণদের মধ্যে এই মূল্যবোধ জাগ্রত করা। ধর্মীয় উৎসবগুলোতে একে অপরের বাড়িতে যাওয়া, শুভেচ্ছা বিনিময় করা এবং বিপদে-আপদে পাশে দাঁড়ানো আমাদের সমাজকে আরও সুন্দর করে তুলতে পারে।

রাষ্ট্রের দায়িত্ব হলো সংবিধানে প্রদত্ত ধর্মীয় স্বাধীনতা নিশ্চিত করা এবং ধর্মীয় সংখ্যালঘুদের নিরাপত্তা বিধান করা। কোনো ব্যক্তি বা গোষ্ঠী যদি ধর্মীয় অনুভূতিতে আঘাত করে, তবে আইনের মাধ্যমে তার সুষ্ঠু বিচার নিশ্চিত করতে হবে। একই সঙ্গে ধর্মীয় সহনশীলতা বিরোধী কার্যকলাপ প্রতিরোধে সচেতনতামূলক কার্যক্রম গ্রহণ করা জরুরি।

পরিশেষে বলা যায়, ধর্মীয় সহনশীলতা একটি সুন্দর সমাজ গঠনের মূল ভিত্তি। আমরা যদি একে অপরের ধর্মকে সম্মান করতে শিখি, তবে সমাজে শান্তি, ঐক্য ও সম্প্রীতি আরও সুদৃঢ় হবে। তাই ধর্মীয় সহনশীলতা চর্চা করা প্রতিটি নাগরিকের নৈতিক দায়িত্ব।

ભારત કૌમુદી : ૧૧૭૯

"ભારત" શબ્દ પ્રાચીન કાળથી પ્રચલિત છે. ભારત વર્ષ, ભારત ખંડ, ભારત દેશ, ભારત ભૂમિ, ભારત રાષ્ટ્ર, ભારત રાજ્ય, ભારત સામ્રાજ્ય, ભારત સંઘ, ભારત પ્રજાસત્તાક, ભારત ગણરાજ્ય, ભારત ગણતંત્ર, ભારત સંઘરાજ્ય, ભારત સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ ગણરાજ્ય, ભારત સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણરાજ્ય, ભારત સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ સંઘ ગણતંત્ર, ભારત સંઘરાજ્ય, ભારત સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ ગણરાજ્ય, ભારત સંઘ ગણતંત્ર, ભારત સંઘરાજ્ય, ભારત સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ ગણરાજ્ય, ભારત સંઘ ગણતંત્ર, ભારત સંઘરાજ્ય, ભારત સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ ગણરાજ્ય, ભારત સંઘ ગણતંત્ર, ભારત સંઘરાજ્ય, ભારત સંઘ પ્રજાસત્તાક, ભારત સંઘ ગણરાજ્ય, ભારત સંઘ

પણ પોતાનું કામકાજ છોડીને તેમની પાસે જવું પડે : ઉપરાંત તેમની પાસે જવાથી તેમના ઉપર ભાર પડે એ વિચારથી તેમની પાસે જવાનું ટાળે છે. આમ, ઉપરોક્ત ત્રણેય કારણોસર વૃદ્ધો પોતાના સંતાનોથી દૂર રહે છે. આ કારણે વૃદ્ધોનું જીવન એકલવાયું બની જાય છે. તેમને પોતાના સંતાનોનો સાથ મળતો નથી. પરિણામે તેમનું જીવન નિરસ બની જાય છે. આ કારણે વૃદ્ધોમાં ચીડિયાપણું, ગુસ્સો, ઉદાસીનતા, નિરાશા જેવી લાગણીઓ જોવા મળે છે. આ ઉપરાંત વૃદ્ધોને ઘણી વાર પોતાના સંતાનોની ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. તેમને પોતાના સંતાનો તરફથી પૂરતો પ્રેમ, હૂંફ, સહાનુભૂતિ મળતી નથી. આ કારણે વૃદ્ધોમાં ઘણી વાર ગુસ્સો, ચીડિયાપણું

ખોટા, ત્રુટક અને ભ્રામક ખ્યાલોનું નિરાકરણ કરવાની પ્રક્રિયા એટલે પ્રતિભાવ વિશ્લેષણ. આ પદ્ધતિ મુજબ, તેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમના પ્રતિભાવોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓની વિચારસરણીમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરવાની તક આપ

ग) रेखाचित्र :

प्रस्तुत पाठ का मुख्य उद्देश्य 'हामिद' के चरित्र के माध्यम से बच्चों में त्याग, सहानुभूति, संवेदनशीलता और मानवीय मूल्यों का विकास करना है। लेखक यह दिखाना चाहते हैं कि गरीबी और अभाव में पलने वाला बालक भी अपने निर्णयों में कितना परिपक्व और संवेदनशील हो सकता है। वह अपने खिलौनों की जगह अपनी दादी के लिए चिमटा खरीदता है, क्योंकि उसे पता है कि रोटी बनाते समय उसकी दादी के हाथ जल जाते हैं। इस प्रकार यह पाठ बच्चों को यह सीख देता है कि सच्चा सुख दूसरों की सेवा और त्याग में है, न कि केवल अपनी इच्छाओं की पूर्ति में।

पाठ का केंद्रीय पात्र हामिद है, जो एक गरीब परिवार में रहने वाला चार वर्ष का बालक है। उसके माता-पिता का देहांत हो चुका है और वह अपनी दादी अमीना के साथ रहता है। उसकी दादी उसे बहुत प्यार करती है, लेकिन घर की आर्थिक स्थिति बहुत खराब है। हामिद के अन्य साथी मेले में खिलौने खरीदते हैं, लेकिन वह अपनी दादी की तकलीफ को समझता है और उनके लिए चिमटा खरीदता है। यह चिमटा उसके लिए खिलौने से अधिक उपयोगी और महत्वपूर्ण है।

पाठ की शुरुआत ईदगाह के मेले के वर्णन से होती है, जहाँ बच्चे अलग-अलग खिलौनों और मिठाइयों के लिए उत्साहित हैं। हामिद के पास केवल तीन पैसे हैं, जिनसे वह अपनी दादी के लिए चिमटा खरीदता है। जब उसके दोस्त उसका मजाक उड़ाते हैं, तो वह उन्हें समझाता है कि चिमटा उसकी दादी के लिए कितना उपयोगी है। इस घटना से हामिद की समझदारी और संवेदनशीलता स्पष्ट होती है।

ਮਨ ਵਿਚ ਹਰ ਸਮੇਂ ਇਹ ਖਿਆਲ ਰਖਣਾ ਚਾਹੀਦਾ ਹੈ ਕਿ ਅਸੀਂ ਇਸ ਸੰਸਾਰ ਵਿਚ ਕਿਉਂ ਆਏ ਹਾਂ ਅਤੇ ਸਾਡੇ ਜੀਵਨ ਦਾ ਕੀ ਉਦੇਸ਼ ਹੈ। ਇਸ ਉਦੇਸ਼ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਲਈ ਸਾਨੂੰ ਕਿਹੜੇ ਕਿਹੜੇ ਕੰਮ ਕਰਨੇ ਚਾਹੀਦੇ ਹਨ ਅਤੇ ਕਿਹੜੇ ਕੰਮ ਨਹੀਂ ਕਰਨੇ ਚਾਹੀਦੇ। ਇਸ ਸਭ ਕੁਝ ਦੀ ਸਮਝ ਸਾਨੂੰ ਗੁਰਬਾਣੀ ਤੋਂ ਹੀ ਪ੍ਰਾਪਤ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਦੇ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਨੂੰ ਸੁਖ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੁੰਦੀ ਹੈ।

ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਇਕ ਵਿਦਿਆਰਥੀ ਲਈ ਆਪਣੇ ਵਿਦਿਆਰਥੀ ਜੀਵਨ ਦੌਰਾਨ ਵਿਦਿਆ ਪ੍ਰਾਪਤ ਕਰਨ ਲਈ ਕੁਝ ਨਿਯਮਾਂ ਦਾ ਪਾਲਣ ਕਰਨਾ ਜ਼ਰੂਰੀ ਹੁੰਦਾ ਹੈ, ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਹੀ ਇਕ ਮਨੁੱਖ ਨੂੰ ਆਪਣੇ ਜੀਵਨ ਦੌਰਾਨ ਕੁਝ ਨਿਯਮਾਂ ਦਾ ਪਾਲਣ ਕਰਨਾ ਜ਼ਰੂਰੀ ਹੁੰਦਾ ਹੈ। ਇਹ ਨਿਯਮ ਸਾਨੂੰ ਗੁਰਬਾਣੀ ਤੋਂ ਪ੍ਰਾਪਤ ਹੁੰਦੇ ਹਨ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ। ਗੁਰਬਾਣੀ ਅਨੁਸਾਰ ਜੀਵਨ ਬਤੀਤ ਕਰਨ ਨਾਲ ਹੀ ਮਨੁੱਖ ਦਾ ਜੀਵਨ ਸਫਲ ਹੁੰਦਾ ਹੈ।

ઉપરોક્ત પ્રમાણે ઠરાવ કરવામાં આવે છે." આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. ત્યારબાદ ઠરાવ નં. ૨ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઠરાવ નં. ૨ મુજબ "ઠરાવવામાં આવે છે કે આ સભા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યના ગૃહમંત્રીશ્રીને વિનંતી કરે છે કે તેઓશ્રી ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ ગુંડાગર્દી, લૂંટફાટ, ખૂન, બળાત્કાર, ચોરી, ધાડ, ખંડણી, અપહરણ, ગુંડાઓ દ્વારા ધાકધમકી, ગુંડાઓ દ્વારા ઉઘરાણી, ગુંડાઓ દ્વારા ખોટા કેસો કરવા, ગુંડાઓ દ્વારા ખોટી ફરિયાદો કરવી, ગુંડાઓ દ્વારા ખોટી સાક્ષી પુરાવવી, ગુંડાઓ દ્વારા ખોટા પુરાવા ઊભા કરવા, ગુંડાઓ દ્વારા ખોટા દસ્તાવેજો કરવા, ગુંડાઓ દ્વારા ખોટા સોગંદનામા

৫নং প্রশ্নের উত্তর

প্রশ্নটি নিম্ন দাগের ভাগের ভাগফল নির্ণয় সংক্রান্ত। এখানে ভাজ্য ও ভাজক উভয়ই দশমিক ভগ্নাংশ। ভাজক ও ভাজ্যকে সমান সংখ্যক দশমিক স্থানবিশিষ্ট পূর্ণসংখ্যায় রূপান্তর করে ভাগ করলে ভাগফল একই থাকে। এই নীতি অনুসরণ করে প্রশ্নটি সমাধান করা হয়েছে।

সমাধান

ভাগফল = ৩.৭৫০ ÷ ০.০৫ = ৩৭৫০ ÷ ৫ = ৭৫০

ব্যাখ্যা: ভাজক ০.০৫ এর দশমিক স্থান ২টি। সুতরাং ভাজ্য ৩.৭৫০ এর দশমিক স্থানকেও ২টি করতে হবে। তাই ভাজ্যকে ১০০ দ্বারা গুণ করা হয়েছে। ফলে ভাজ্য হয় ৩৭৫০ এবং ভাজক হয় ৫। এখন ৩৭৫০ কে ৫ দ্বারা ভাগ করলে ভাগফল ৭৫০ পাওয়া যায়। অতএব, ৩.৭৫০ কে ০.০৫ দ্বারা ভাগ করলে ভাগফল ৭৫০।

ঈদের নামাজের একটি প্রাচীন ঐতিহ্য নিয়ে লিখুন।

ঈদের নামাজের একটি প্রাচীন ঐতিহ্য হলো ঈদগাহে নামাজ আদায় করা। ঈদের দিন সকালে সবাই নতুন বা পরিষ্কার পোশাক পরে ঈদগাহে যায়। সেখানে গিয়ে তারা দুই রাকাত নামাজ আদায় করে। নামাজের আগে ইমাম সাহেব ঈদের গুরুত্ব নিয়ে বক্তব্য দেন। এই ঐতিহ্য আমাদের ভাতৃত্ববোধ ও একতা শেখায়।

ક્રમાંક:ગા.ઇ.પો.સ્ટે/૨૦૨૧૦૬૨૫૦૨૦૦૨૨૬/૨૦૨૧

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા

ગાંધીધામ, તા.૨૫/૦૬/૨૦૨૧

જાહેરનામું

"ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત"

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

ગાંધીધામ આદિપુર મહા નગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવા બાબત

[illegible]

[illegible]

[illegible]

(৫) ৮৫৮ ১৯৭ ঈসায়ী

[illegible] [illegible] [illegible] [

K Mukherjee

Q1

ক) ছবিটি ভাল করে লক্ষ্য করো। ছবিতে কী কী দেখতে পাচ্ছ লিখে ফেলো। ছবিটি দেখে তোমার কী মনে হচ্ছে তা নিজের ভাষায় লেখো। ছবিটি দেখে তোমার কোনো গল্প মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো গান মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো কবিতা মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো ছড়া মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো ঘটনা মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো অভিজ্ঞতা মনে পড়ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো অনুভূতি হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো প্রশ্ন মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো উত্তর মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো সমস্যা মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো সমাধান মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো সিদ্ধান্ত মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো মতামত মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো বক্তব্য মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো যুক্তি মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো তথ্য মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো উদাহরণ মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো ব্যাখ্যা মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো বিশ্লেষণ মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো মূল্যায়ন মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো সিদ্ধান্ত মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো মতামত মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো বক্তব্য মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো যুক্তি মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো তথ্য মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো উদাহরণ মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো ব্যাখ্যা মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো বিশ্লেষণ মনে হচ্ছে কি না তাও লিখতে পারো। ছবিটি দেখে তোমার কোনো মূল্যায়ন মনে হচ্ছে কি না তাও লিখতে পারো।

১। নিম্নের যে কোন একটি বিষয়ের উপর একটি নিবন্ধ রচনা কর :

ক) বাংলা ভাষা ও সাহিত্যে মুসলমানদের অবদান

খ) বাংলা ভাষা ও সাহিত্যে হিন্দুদের অবদান

গ) বাংলা ভাষা ও সাহিত্যে খ্রিস্টানদের অবদান

ঘ) বাংলা ভাষা ও সাহিত্যে বৌদ্ধদের অবদান

ঙ) বাংলা ভাষা ও সাহিত্যে আদিবাসীদের অবদান

২। নিম্নের যে কোন একটি বিষয়ের উপর একটি নিবন্ধ রচনা কর :

ক) বাংলা ভাষা ও সাহিত্যে মুসলমানদের অবদান

খ) বাংলা ভাষা ও সাহিত্যে হিন্দুদের অবদান

গ) বাংলা ভাষা ও সাহিত্যে খ্রিস্টানদের অবদান

ঘ) বাংলা ভাষা ও সাহিত্যে বৌদ্ধদের অবদান

ঙ) বাংলা ভাষা ও সাহিত্যে আদিবাসীদের অবদান

ক্রমশ

নিশি শুভ্র, নীরব, তারা ফুটিয়াছে শত শত, নিদ্রাগত প্রকৃতি-সতী যেন ধরণীর অঙ্কে অবিরত। মাঝে মাঝে নিশাচর পক্ষী ডাকিতেছে কিচিমিচি, ঝিল্লীরব শুনা যায় তরুতলে, ঝোপে ঝাড়ে কীচি কীচি। ঘুমায় মানব-শিশু, ঘুমায় তরুণ তরুণী, ঘুমায় প্রবীণ-প্রবীণা, ঘুমায় বৃদ্ধ বৃদ্ধানী। ঘুমায় রোগী, ঘুমায় শোকী, ঘুমায় সুখী, ঘুমায় দুখী, ঘুমায় সকল জীবজন্তু, ঘুমায় সকল পশুপাখী। ঘুমায় না শুধু চোর, ডাকাত, লম্পট, খুনী, বদমায়েস, ঘুমায় না শুধু বেশ্যা, মাতাল, জুয়াড়ী, গাঁটকাটা, পকেটমার, ঘুমায় না শুধু ভণ্ড, প্রতারক, ধর্ম্মধ্বজী, ঘুমায় না শুধু ঘুষখোর, ঘুমায় না শুধু কালোবাজারী, ঘুমায় না শুধু ধনী, ঘুমায় না শুধু মহাজন, ঘুমায় না শুধু ব্যবসায়ী, ঘুমায় না শুধু ব্যাঙ্কার, ঘুমায় না শুধু ব্যাঙ্কের ম্যানেজার, ঘুমায় না শুধু ব্যাঙ্কের ক্যাশিয়ার, ঘুমায় না শুধু ব্যাঙ্কের ক্লার্ক, ঘুমায় না শুধু ব্যাঙ্কের দারোয়ান, ঘুমায় না শুধু ব্যাঙ্কের পিয়ন, ঘুমায় না শুধু ব্যাঙ্কের সুইপার, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদার, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনী, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর ছেলে, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর মেয়ে, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর জামাই, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর বৌ, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর ননদ, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর ভাসুর, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর দেবর, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর শাশুড়ী, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর শ্বশুর, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর ভাসুর, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর দেবর, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর শাশুড়ী, ঘুমায় না শুধু ব্যাঙ্কের ঝাড়ুদারনীর শ্বশুর।

ঐ যে ডাকছে আমায় "ঐশ্বর্য দরিদ্র হেরিতে" আমাদের ঘনশ্যাম ঠাকুর
ঐশ্বর্য আছেন যাঁর তাঁর কাছে ঐশ্বর্য দরিদ্রের ঐশ্বর্যশালিতা কিছু নয়। তাই
দরিদ্রের কাছে ঐশ্বর্যশালিতা প্রকাশ করিতে তাঁহার ইচ্ছা হয়। তাই তিনি
ঐশ্বর্যশালিতা প্রকাশ করিতে ব্রজে আসিয়াছেন। ব্রজে আসিয়া তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি
ব্রজের সকল লোকের সঙ্গে ঐশ্বর্য প্রকাশ করিতে আরম্ভ করিলেন। তিনি

৫ নম্বর ঘর

মাঝারি মিনি মনে হচ্ছে। ঘরটা ঠিক কতখানি লম্বা-চওড়া বোঝা যাচ্ছে না, কারণ ঘরের ভেতরে কোনো আসবাবপত্র নেই। দেয়ালের রঙ ধূসর। ঘরের মাঝখানে একটা লোহার খাটিয়া পাতা আছে। খাটিয়ার ওপর একটা ছেঁড়া কম্বল ভাঁজ করা রয়েছে। কম্বলের রঙ ঘোলাটে সাদা। খাটিয়ার পায়ের কাছে একটা কাঠের টুল। টুলের ওপর একটা মাটির কলসি। কলসির মুখে একটা কাঁসার থালা ঢাকা দেওয়া।

ঘরের ডান দিকের দেয়ালে একটা জানালা আছে। জানালার শিক নেই। জানালার বাইরে একটা নিমগাছের ডাল দেখা যাচ্ছে। ডালে কয়েকটা পাখি বসে আছে। পাখিগুলো কিচিরমিচির করছে। ঘরের ভেতরে কোনো পাখা নেই। গরম বাতাস ঘরের ভেতর আটকে আছে। দেয়ালে কোনো ছবি বা ক্যালেন্ডার নেই। শুধু একটা পেরেকে একটা ছেঁড়া গামছা ঝুলছে।

ঘরের বাঁ দিকের দেয়ালে একটা দরজা আছে। দরজাটা ভেজানো। দরজার ওপাশে একটা ছোট উঠান আছে। উঠানে একটা তুলসী গাছ আছে। তুলসী গাছের গোড়ায় একটা মাটির প্রদীপ রাখা আছে। প্রদীপে তেল নেই। সলতেটা পোড়া।

ঘরের মেঝেতে কয়েকটা পিঁপড়ে লাইন ধরে চলছে। পিঁপড়েগুলো খাটিয়ার পা বেয়ে উঠছে, আবার নেমে যাচ্ছে। মেঝেতে কোনো মাদুর বা চাটাই নেই। মেঝেটা কাঁচা মাটির। মাটির রঙ লালচে-কালো।

ঘরের ভেতর কোনো শব্দ নেই। শুধু বাইরে পাখির ডাক আর দূর থেকে একটা কুকুরের ঘেউ ঘেউ শোনা যাচ্ছে। কুকুরটা কোথায় ডাকছে বোঝা যাচ্ছে না। ঘরের ভেতর কোনো মানুষ নেই। ঘরটা ফাঁকা।

(ঘ) প্রদত্ত তথ্যগুলি ব্যবহার করে একটি ব্যালেন্স শিট তৈরি করো।

(ঙ) ব্যালেন্স শিটের বিভিন্ন অংশের নাম লেখো।

(চ) ব্যালেন্স শিট থেকে কী কী তথ্য পাওয়া যায় তা লেখো।

(ছ) ব্যালেন্স শিট তৈরির উদ্দেশ্য কী?

(জ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ঝ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ঞ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ট) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ঠ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ড) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ঢ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ণ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ত) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(থ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(দ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ধ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ন) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(প) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ফ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ব) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ভ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ম) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(য) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(র) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ল) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(শ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(ষ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(স) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

(হ) ব্যালেন্স শিট তৈরির সময় কী কী বিষয়ে সতর্কতা অবলম্বন করা উচিত তা লিখে ব্যালেন্স শিটের একটি নমুনা তৈরি করো।

মাননীয় স্পীকার স্যার, আমি মাননীয় শ্রম মন্ত্রী মহাশয়ের দৃষ্টি আকর্ষণ করছি যে, গত ১৭ই ডিসেম্বর ১৯৯৩ তারিখে আমার নির্বাচনী এলাকা ধর্মনগর মহকুমার অন্তর্গত ৩নং ধর্মনগর ব্লকের অধীন ৩নং ধর্মনগর গ্রাম পঞ্চায়েতের ৩নং ওয়ার্ডের ৩নং বুথে ১৯৯৩ সালের পঞ্চায়েত নির্বাচনে ভোটার তালিকা সংশোধনের জন্য ৩নং ধর্মনগর গ্রাম পঞ্চায়েতের সেক্রেটারী শ্রী সুধীর দেবনাথ ও ৩নং ধর্মনগর গ্রাম পঞ্চায়েতের ৩নং ওয়ার্ডের ৩নং বুথের বুথ লেভেল অফিসার

ক্ষেত্রে, যে দাবিদার তাঁর নাম ও ঠিকানা সহকারে সুনির্দিষ্ট ভাবে উল্লেখ করে, তার দাবি সম্পর্কে তিনি যে তদন্ত করবেন তার একটি সংক্ষিপ্ত বিবরণ লিখে রাখবেন। তদন্তের ফলাফল সম্পর্কে তিনি যে সিদ্ধান্তে উপনীত হবেন তাও তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন।

(৮) তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন।

(৯) তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন। তদন্তের সময় তিনি যে সমস্ত সাক্ষীর সাক্ষ্য গ্রহণ করবেন তাদের নাম ও ঠিকানা তিনি লিখে রাখবেন।

৯. সমস্যা ও সমাধান

ক) তোমার এক বন্ধুর মোবাইল ফোনে কথা বলতে বলতে হাঁটার সময় রাস্তা পার হওয়ার অভ্যাস আছে। তুমি তাকে কীভাবে বোঝাবে যে এটা বিপজ্জনক? তার সঙ্গে তোমার যে কথোপকথন হবে, তা নিজের ভাষায় লেখো।

খ) তোমার এক আত্মীয় ফেসবুকে প্রায়ই ভুয়া খবর শেয়ার করেন। তুমি কীভাবে তাঁকে বিষয়টি বুঝিয়ে বলবে, যাতে তিনি রাগ না করেন? তোমার কথোপকথন লেখো।

গ) তোমার ছোট ভাই/বোন রাতে দেরি করে ঘুমায় এবং সকালে স্কুলে যেতে কষ্ট করে। তুমি কীভাবে তাকে সময়মতো ঘুমাতে যেতে রাজি করাবে? তোমার কথোপকথন লেখো।

ঘ) তোমার এক বন্ধু পরীক্ষার আগের রাতে সারা রাত পড়ে। তুমি কীভাবে তাকে বোঝাবে যে এটা ক্ষতিকর? তোমার কথোপকথন লেখো।

ঙ) তোমার এক আত্মীয় ধূমপান করেন। তুমি কীভাবে তাঁকে ধূমপান ছাড়তে উৎসাহিত করবে? তোমার কথোপকথন লেখো।

ઉમેદવાર બાબતે પક્ષ કોઈ નિર્ણય કરી શકે તેમ નથી. :- ઉપરના મુદ્દાઓ ઉપરાંત આ ચૂંટણીમાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કરેલા ખર્ચ અંગે ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ મર્યાદા કરતાં વધારે ખર્ચ કરેલ હોવાનું જણાય તો તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા અંગે પણ ચૂંટણી પંચ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખોટા સોગંદનામા અંગે પણ કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી. આ ઉપરાંત

ಅಧಿಕಾರಿಗಳು, ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಸಾರ್ವಜನಿಕರು ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಸಭೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರು ಸಲ್ಲಿಸಿದ ಅರ್ಜಿಗಳ ಬಗ್ಗೆ ಚರ್ಚಿಸಲಾಯಿತು. ಸಭೆಯಲ್ಲಿ ಒಟ್ಟು ೨೨ ಅರ್ಜಿಗಳು ಸ್ವೀಕೃತವಾಗಿದ್ದು, ಅವುಗಳಲ್ಲಿ ೧೬ ಅರ್ಜಿಗಳನ್ನು ಸ್ಥಳದಲ್ಲಿಯೇ ವಿಲೇವಾರಿ ಮಾಡಲಾಯಿತು. ಉಳಿದ ೬ ಅರ್ಜಿಗಳನ್ನು ೭ ದಿನಗಳ ಒಳಗಾಗಿ ವಿಲೇವಾರಿ ಮಾಡಲು ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸೂಚನೆ ನೀಡಲಾಯಿತು. ಸಭೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದ ಸಾರ್ವಜನಿಕರು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯ ಕಾರ್ಯವೈಖರಿಯ ಬಗ್ಗೆ ತೃಪ್ತಿ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು.

ಸಹಿ/-
ಪೊಲೀಸ್ ಅಧೀಕ್ಷಕರು
ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆ

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર અનુસાર જણાવવાનું કે, ગામ સિમલા ખાતે આવેલ ગ્રામ પંચાયત ભવનમાં તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ ૭૭ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા બાબત ગ્રામ પંચાયત સભ્યોની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.

ઠરાવ કરવામાં આવે છે કે, ગામ સિમલા ખાતે આવેલ ગ્રામ પંચાયત ભવનમાં તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ ૭૭ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ ગામના વિકાસ માટે ગ્રામસભા યોજવામાં આવશે. આ ગ્રામસભામાં ગામના વિકાસ માટે ચર્ચા કરવામાં આવશે. આ ગ્રામસભામાં ગામના તમામ નાગરિકોને હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

આ ઠરાવની નકલ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, સિમલા તથા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, સિમલાને જાણ સારુ મોકલવામાં આવે છે.

ગામ સરપંચ

ਸੇਵਾ ਵਿਖੇ,

ਸ੍ਰੀਮਤੀ ਮੈਨੇਜਰ ਸਾਹਿਬਾ,

ਵਿਸ਼ਾ: ਸਮੂਹ ਸਿੰਘਾਂ ਦੀ ਅੰਤਿਮ ਅਰਦਾਸ ਸਮਾਗਮ ਦੀ ਪ੍ਰਵਾਨਗੀ ਸਬੰਧੀ।

ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸਾਡੇ ਪਰਿਵਾਰ ਦੇ ਸਤਿਕਾਰਯੋਗ ਮੈਂਬਰ ਸ੍ਰ. ਹਰਜੀਤ ਸਿੰਘ ਜੀ ਜੋ ਕਿ ਮਿਤੀ 15 ਅਪ੍ਰੈਲ 2024 ਨੂੰ ਅਕਾਲ ਚਲਾਣਾ ਕਰ ਗਏ ਹਨ, ਦੀ ਅੰਤਿਮ ਅਰਦਾਸ ਸਮਾਗਮ ਮਿਤੀ 20 ਅਪ੍ਰੈਲ 2024 ਨੂੰ ਗੁਰਦੁਆਰਾ ਸ੍ਰੀ ਗੁਰੂ ਸਿੰਘ ਸਭਾ, ਸੈਕਟਰ 22, ਚੰਡੀਗੜ੍ਹ ਵਿਖੇ ਸਵੇਰੇ 10 ਵਜੇ ਤੋਂ ਦੁਪਹਿਰ 1 ਵਜੇ ਤੱਕ ਕਰਵਾਉਣ ਦੀ ਆਗਿਆ ਪ੍ਰਦਾਨ ਕਰਨ ਦੀ ਕਿਰਪਾਲਤਾ ਕਰਨੀ ਜੀ।

ਸਮਾਗਮ ਦੌਰਾਨ ਲਗਭਗ 250 ਸੰਗਤਾਂ ਦੇ ਆਉਣ ਦੀ ਸੰਭਾਵਨਾ ਹੈ। ਲੰਗਰ ਦਾ ਪ੍ਰਬੰਧ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਦੀ ਰਸੋਈ ਵਿੱਚ ਹੀ ਕੀਤਾ ਜਾਵੇਗਾ। ਪਾਰਕਿੰਗ ਲਈ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਦੇ ਨਾਲ ਲੱਗਦੀ ਖਾਲੀ ਜ਼ਮੀਨ ਵਰਤੀ ਜਾਵੇਗੀ। ਟ੍ਰੈਫਿਕ ਪੁਲਿਸ ਨੂੰ ਵੱਖਰੇ ਤੌਰ 'ਤੇ ਸੂਚਿਤ ਕੀਤਾ ਜਾ ਚੁੱਕਾ ਹੈ।

ਸਮਾਗਮ ਦੇ ਸੁਚਾਰੂ ਪ੍ਰਬੰਧਾਂ ਲਈ ਸ੍ਰ. ਗੁਰਪ੍ਰੀਤ ਸਿੰਘ ਬਰਾੜ (ਪੁੱਤਰ) ਨੂੰ ਮੁੱਖ ਪ੍ਰਬੰਧਕ ਨਿਯੁਕਤ ਕੀਤਾ ਗਿਆ ਹੈ। ਉਹ ਸਮਾਗਮ ਤੋਂ ਇੱਕ ਦਿਨ ਪਹਿਲਾਂ ਆਪਣੀ ਟੀਮ ਸਮੇਤ ਪਹੁੰਚ ਕੇ ਸਾਰੇ ਪ੍ਰਬੰਧ ਮੁਕੰਮਲ ਕਰਵਾਉਣਗੇ।

ਆਪ ਜੀ ਦੀ ਇਸ ਸੇਵਾ ਲਈ ਅਸੀਂ ਸਦਾ ਰਿਣੀ ਰਹਾਂਗੇ। ਕਿਰਪਾ ਕਰਕੇ ਸਾਡੀ ਬੇਨਤੀ ਪ੍ਰਵਾਨ ਕਰਨ ਦੀ ਕਿਰਪਾਲਤਾ ਕਰਨੀ ਜੀ।

ਧੰਨਵਾਦ ਸਹਿਤ,

ਹਸਤਾਖਰ

ਸ੍ਰ. ਗੁਰਪ੍ਰੀਤ ਸਿੰਘ ਬਰਾੜ (ਪੁੱਤਰ)

ਮੋਬਾਈਲ ਨੰ. 98765-43210

ਦੇ ਮਾਮਲਾ ਹੈ.

ਇਸ ਮੁਕੱਦਮੇ ਵਿਚ ਮੁਦਈ ਦੀ ਤਰਫ਼ ਤੋਂ ਪੇਸ਼ ਕੀਤੇ ਗਏ ਦਸਤਾਵੇਜ਼ਾਂ ਅਨੁਸਾਰ ਇਹ ਤੱਥ ਸਾਹਮਣੇ ਆਇਆ ਹੈ ਕਿ ਮੁਦਈ ਨੇ ਆਪਣੇ ਪਿਤਾ ਦੀ ਮੌਤ ਤੋਂ ਬਾਅਦ ਉਨ੍ਹਾਂ ਦੀ ਜਾਇਦਾਦ ਦੀ ਦੇਖ-ਰੇਖ ਕੀਤੀ ਅਤੇ ਉਸ ਦੌਰਾਨ ਉਸ ਨੇ ਕੁਝ ਖ਼ਰਚੇ ਵੀ ਕੀਤੇ। ਇਸ ਲਈ ਉਹ ਆਪਣੇ ਖ਼ਰਚੇ ਦੀ ਰਕਮ ਵਾਪਸ ਲੈਣ ਦੀ ਹੱਕਦਾਰ ਹੈ। ਪਰ ਇਹ ਵੀ ਸਾਫ਼ ਹੈ ਕਿ ਉਸ ਨੇ ਇਹ ਖ਼ਰਚੇ ਆਪਣੀ ਮਰਜ਼ੀ ਨਾਲ ਕੀਤੇ ਸਨ, ਕਿਸੇ ਅਦਾਲਤੀ ਹੁਕਮ ਜਾਂ ਸਮਝੌਤੇ ਦੇ ਤਹਿਤ ਨਹੀਂ। ਇਸ ਲਈ ਉਹ ਇਸ ਰਕਮ ਉੱਤੇ ਕੋਈ ਵਿਆਜ ਜਾਂ ਵਾਧੂ ਰਕਮ ਦੀ ਮੰਗ ਨਹੀਂ ਕਰ ਸਕਦੀ।

ਮੁਦਈ ਦੇ ਵਕੀਲ ਨੇ ਦਲੀਲ ਦਿੱਤੀ ਕਿ ਉਸ ਦੇ ਮੁਵੱਕਿਲ ਨੇ ਇਹ ਖ਼ਰਚੇ ਇਸ ਲਈ ਕੀਤੇ ਸਨ ਤਾਂ ਜੋ ਜਾਇਦਾਦ ਦੀ ਕੀਮਤ ਬਣੀ ਰਹੇ ਅਤੇ ਉਸ ਦੇ ਵਾਰਸਾਂ ਨੂੰ ਹੀ ਲਾਭ ਮਿਲੇ। ਇਸ ਦਲੀਲ ਨੂੰ ਰੱਦ ਕਰਦੇ ਹੋਏ ਅਦਾਲਤ ਨੇ ਕਿਹਾ ਕਿ ਜੇ ਹਰ ਕੋਈ ਵਿਅਕਤੀ ਦੂਜੇ ਦੀ ਜਾਇਦਾਦ ਉੱਤੇ ਖ਼ਰਚਾ ਕਰ ਕੇ ਉਸ ਦੀ ਵਸੂਲੀ ਦਾ ਦਾਅਵਾ ਕਰਨ ਲੱਗ ਪਵੇ, ਤਾਂ ਇਹ ਬਹੁਤ ਅਨਿਆਂਪੂਰਨ ਹੋਵੇਗਾ। ਇਸ ਲਈ ਅਦਾਲਤ ਨੇ ਮੁਦਈ ਦਾ ਦਾਅਵਾ ਖ਼ਾਰਜ ਕਰ ਦਿੱਤਾ।

ક્રમ

ક્રમ ૧૭૭

ક્રમ ૧૭૭ ક્રમ ૧૭૭ ક્રમ ૧૭૭

ক) ছাত্র ছাত্রীদের নাম লিখ।

ક્રમાંક : ૨૦૨૦/૨૦૨૧/૧૨૩૪

પ્રતિ,
શ્રીમાન કનુભા બળવંતસિંહ ચાવડા
ચીફ ઓફિસર, નગરપાલિકા, ઝાંઝરકા

વિષય : ઝાંઝરકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગાંધી ચોક ખાતે આવેલ જાહેર શૌચાલયની સાફ-સફાઈ બાબત.

ઉપરોક્ત વિષયે જણાવવાનું કે ઝાંઝરકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગાંધી ચોક ખાતે આવેલ જાહેર શૌચાલયની સાફ-સફાઈ છેલ્લા ઘણા સમયથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેના કારણે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય પ્રસરેલું જોવા મળે છે. આ શૌચાલયનો ઉપયોગ કરવા જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

આ બાબતે અગાઉ પણ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જે અત્યંત દુઃખદ બાબત છે. આથી આપને વિનંતી છે કે આ શૌચાલયની સાફ-સફાઈ માટે કાયમી ધોરણે કર્મચારીની નિમણૂક કરવામાં આવે તથા શૌચાલયમાં પૂરતા પ્રમાણમાં પાણી અને વીજળીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓ તેમજ મુલાકાતે આવતા લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ધોરણે અંત આવી શકે.

આપનો વિશ્વાસુ,

ઇ ગોરિ ન ગોરિ ને

ગિરાસદાર ગામ ગિરાસ કરી ગામવાસ વસ્તુ ન્યાયાલય ગિરાસ, ગિરાસ ગામવાસ ગિરાસ કરી ગામ ગિરાસ ગામ ગિરાસ ગામ ગિરાસ

ઉપરોક્ત ઠરાવ અન્વયે જણાવવાનું કે આ કચેરીના તા.૦૫/૦૭/૨૦૨૨ ના પત્ર અન્વયે આપવામાં આવેલ સૂચના મુજબ ગામ તા.૦૫/૦૭/૨૦૨૨ થી તા.૧૫/૦૭/૨૦૨૨ સુધી ગામમાં ઢોલ વગાડી ગામ લોકોને જાણ કરવામાં આવેલ છે. તેમજ ગામના ચોરા ઉપર તથા ગામના જાહેર સ્થળોએ નોટીસ બોર્ડ ઉપર નોટીસ લગાવવામાં આવેલ છે. તેમજ ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા ગામમાં રૂબરૂ જઈ ગામ લોકોને જાણ કર

ক্ষমতা প্রয়োগ :-

ক) ক্ষমতা প্রয়োগের ভিত্তি :

ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না।

খ) ক্ষমতা প্রয়োগের ভিত্তি :

ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না। ক্ষমতা প্রয়োগের ভিত্তি হলো ক্ষমতা। ক্ষমতা ছাড়া কোনো ব্যক্তি বা প্রতিষ্ঠান কোনো কাজ করতে পারে না।

ક

ઇ.સ.૧૯૯૯ ની સાલ

ઉપરોક્ત ટૂંકી પરંતુ સ્પષ્ટ વિગતો પરથી આપ-ડા ધ્યાને આવ્યું હશે કે મારા પિતાશ્રી ઘણા જ ઉદાર દિલના માણસ હતા. તેમણે પોતાની જિંદગીમાં ઘણા જ ઉમદા કામો કર્યા હતા. તેમણે કરેલા કામોની યાદી ઘણી લાંબી છે. પરંતુ તે બધાની વિગતો આપવા જતાં આ પત્ર ઘણો લાંબો થઈ જાય તેમ છે. તેથી તે બધી વિગતો આપવાનું મેં ટાળ્યું છે. "ઓશિયાળા" શબ્દકોષ માં ઉલ્લેખ થયેલા શબ્દો મેં જોયા નથી. મારા પિતાશ્રી ઘણા જ દાનેશ્વરી હતા એવું મારા જોવામાં આવ્યું છે. તેમણે કરેલા કામોની યાદી ઘણી લાંબી છે. પરંતુ તે બધાની

৫। নিম্নলিখিত বাক্যগুলির শুদ্ধ রূপ লিখ : ১×৫=৫

(ক) আমি তাহাকে বলিলাম যে সে যেন আমার সহিত দেখা করে।

(খ) তিনি বলিলেন যে তিনি আমাকে ভালবাসেন।

(গ) সে বলিল যে সে আমার সহিত দেখা করিবে।

(ঘ) তিনি বলিলেন যে তিনি আমাকে ভালবাসেন।

(ঙ) সে বলিল যে সে আমার সহিত দেখা করিবে।

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે વકીલશ્રી ... રોકાયેલ છે. આરોપી તરફે વકીલશ્રી ... રોકાયેલ છે.

(ख)

ज्ञापन पत्र

सेवा में,

श्रीमान् जिला मजिस्ट्रेट महोदय,
जिला — [illegible]

विषय :- [illegible]

महोदय,

निवेदन है कि [illegible] जिला [illegible] में [illegible] के [illegible] [illegible] [illegible]

ક્રમ

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે વકીલ શ્રી એમ.એમ.મુનશી તથા આરોપી તરફે વકીલ શ્રી એ.એમ.ત્રિવેદી હાજર રહ્યા હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળી, કેસના કાગળો તપાસી, ધ્યાનમાં લીધા મુજબ ફરિયાદી તરફે રજૂ થયેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાનું વાંચન કરી, આરોપીને તેમની સામે થયેલ આક્ષેપો સમજાવી, આરોપીનું નિવેદન નોંધી,

(ب) ترجمہ کریں:

ہمارے ہاں مسلمان حکمرانوں کے دور میں ہر شعبہ زندگی میں ترقی ہوئی۔ ان کے دور میں ہر شخص کو اپنے مذہب پر عمل کرنے کی آزادی تھ

ঘ) নমুনা দেখ:

একটি গরু আর দুটি ছাগল সমান। তাহলে ৩টি ছাগল ও ২টি গরুর দাম কত? ৩টি ছাগল ও ২টি গরুর দাম ১০টি ছাগলের সমান। ১০টি ছাগলের দাম ১০০০ টাকা। সুতরাং ১টি ছাগলের দাম ১০০০ ÷ ১০ = ১০০ টাকা। ১টি গরুর দাম ৩টি ছাগলের দাম। সুতরাং ১টি গরুর দাম ৩০০ টাকা। ২টি গরুর দাম ৬০০ টাকা। ৩টি ছাগল ও ২টি গরুর দাম ৩০০ + ৬০০ = ৯০০ টাকা।

ঙ) নমুনা দেখ:

দুটি সংখ্যার যোগফল ১৫ এবং বিয়োগফল ৫। সংখ্যা দুটি কত? ধরি, সংখ্যা দুটি x ও y। তাহলে, x + y = ১৫ এবং x − y = ৫। এখন, (x + y) + (x − y) = ১৫ + ৫ বা, ২x = ২০ বা, x = ১০। আবার, (x + y) − (x − y) = ১৫ − ৫ বা, ২y = ১০ বা, y = ৫। সুতরাং সংখ্যা দুটি ১০ ও ৫।

চ) নমুনা দেখ:

দুটি সংখ্যার অন্তরফল ৩ এবং বর্গের অন্তরফল ৯৬। সংখ্যা দুটি কত? ধরি, সংখ্যা দুটি x ও y। তাহলে, x − y = ৩ এবং x² − y² = ৯৬। এখন, x² − y² = (x + y)(x − y) বা, ৯৬ = (x + y) × ৩ বা, x + y = ৩২। আবার, (x + y) + (x − y) = ৩২ + ৩ বা, ২x = ৩৫ বা, x = ১৭.৫। আবার, (x + y) − (x − y) = ৩২ − ৩ বা, ২y = ২৯ বা, y = ১৪.৫। সুতরাং সংখ্যা দুটি ১৭.৫ ও ১৪.৫।

ছ) নমুনা দেখ:

দুটি সংখ্যার অন্তরফল ৩ এবং বর্গের অন্তরফল ৯৬। সংখ্যা দুটি কত? ধরি, সংখ্যা দুটি x ও y। তাহলে, x − y = ৩ এবং x² − y² = ৯৬। এখন, x² − y² = (x + y)(x − y) বা, ৯৬ = (x + y) × ৩ বা, x + y = ৩২। আবার, (x + y) + (x − y) = ৩২ + ৩ বা, ২x = ৩৫ বা, x = ১৭.৫। আবার, (x + y) − (x − y) = ৩২ − ৩ বা, ২y = ২৯ বা, y = ১৪.৫। সুতরাং সংখ্যা দুটি ১৭.৫ ও ১৪.৫।

ಸಂಖ್ಯೆ: ಸಿಆಸ್ಪ್ರೆ ೨೦೨೨

ಸೇವೆಯಲ್ಲಿರುವ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳ ಮಕ್ಕಳಿಗೆ ಮೀಸಲಾತಿಯಡಿ ಪ್ರವೇಶ ಪಡೆಯಲು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿರುವ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಪಟ್ಟಿ

ಕ್ರ.ಸಂ. | ಅಭ್ಯರ್ಥಿಯ ಹೆಸರು | ತಂದೆಯ ಹೆಸರು | ಹುದ್ದೆ | ಘಟಕ | ಸೇವಾ ಅವಧಿ | ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ ದಿನಾಂಕ | ಅರ್ಜಿ ಸಂಖ್ಯೆ | ಅಭ್ಯರ್ಥಿಯ ಸಹಿ

ಸೂಚನೆ: ಅಭ್ಯರ್ಥಿಗಳು ಸಲ್ಲಿಸಿರುವ ಅರ್ಜಿಗಳ ಪರಿಶೀಲನೆಯ ನಂತರ ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಪಟ್ಟಿಯನ್ನು ಪ್ರಕಟಿಸಲಾಗುವುದು. ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಮಾತ್ರ ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆಗೆ ಹಾಜರಾಗಲು ಅವಕಾಶ ನೀಡಲಾಗುವುದು. ಅಪೂರ್ಣ ಅರ್ಜಿಗಳನ್ನು ಪರಿಗಣಿಸಲಾಗುವುದಿಲ್ಲ. ಅಭ್ಯರ್ಥಿಗಳು ಸಲ್ಲಿಸಿರುವ ಅರ್ಜಿಗಳ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ಆಕ್ಷೇಪಣೆಗಳಿದ್ದಲ್ಲಿ ಪಟ್ಟಿ ಪ್ರಕಟವಾದ ೭ ದಿನಗಳೊಳಗೆ ಲಿಖಿತವಾಗಿ ಸಲ್ಲಿಸಬಹುದು. ನಿಗದಿತ ಅವಧಿಯ ನಂತರ ಸಲ್ಲಿಸಲಾಗುವ ಆಕ್ಷೇಪಣೆಗಳನ್ನು ಪರಿಗಣಿಸಲಾಗುವುದಿಲ್ಲ.

ಸಹಿ/-
ಪೊಲೀಸ್ ಅಧೀಕ್ಷಕರು
ಚಿತ್ರಾವತಿ ಜಿಲ್ಲೆ

ক) বাক্য গঠন করো।

খ) নিম্নরেখাঙ্কিত শব্দগুলির বিপরীতার্থক শব্দ লেখো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

গ) নিম্নরেখাঙ্কিত শব্দগুলির সমার্থক শব্দ লেখো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঘ) নিম্নলিখিত শব্দগুলির সন্ধিবিচ্ছেদ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঙ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

চ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ছ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

জ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঝ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঞ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ট) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঠ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ড) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ঢ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ণ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ত) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

থ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

দ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ধ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ন) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

প) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ফ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ব) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ভ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ম) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

য) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

র) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ল) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

শ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ষ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

স) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

হ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ক্ষ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

ত্র) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

জ্ঞ) নিম্নলিখিত শব্দগুলির সমাস বিগ্রহ করো : ১×৪=৪

(i) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

(ii) আমি তাকে ভালোবাসি।

(iii) সে সবসময় সত্য কথা বলে।

(iv) তিনি সকলের সঙ্গে ভালো ব্যবহার করেন।

১৩৫৮ সালের

ভাদ্রমাস

ভাদ্রমাস ভাদ্রমাস ভাদ্রমাস

(३)

अ.नं. ४२१७

मी दयाराम गोपाळ पाटील राहणार मौजे पिंपळगाव ता. जि. औरंगाबाद यांचेकडे मौजे पिंपळगाव येथील गट नं. ४२१ मधील ०.३० आर जमीन दि. १५/१२/१९९९ रोजी रजिस्टर्ड खरेदीने घेतली आहे. सदर जमीन मी माझ्या नावे करण्यासाठी तलाठी यांचेकडे अर्ज केला असता त्यांनी सदर जमीन ही शासनाची असल्याचे सांगितले. सदर जमीन ही शासनाची नसून माझी खाजगी मालकीची आहे. सदर जमीन माझ्या नावे करण्याचे आदेश तलाठी यांना व्हावेत म्हणून हा अर्ज.

ठिकाण :- पिंपळगाव

दि. ०१/०१/२०००

आपला विश्वासू

दयाराम गोपाळ पाटील

Jal Mfg. Co. Ltd. Jalandhar City

Jalandhar City Manufacturing Co. Ltd. Jalandhar City

ચિત્રા માણેકલાલ ત્રિવેદી ગામમાં જૂના બજારમાં એક કાપડની દુકાનમાં કામ કરતો હતો. તેનો પગાર ઓછો હતો અને કુટુંબ મોટું હતું. તેથી તેણે વધારાની આવક માટે સાંજે ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. પહેલા જ વર્ષે તેની પાસે ૧૨ વિદ્યાર્થીઓ આવ્યા. તેમાં ધોરણ ૭ થી ૧૦ના વિદ્યાર્થીઓ હતા. ચિત્રા તેમને ગણિત અને વિજ્ઞાન શીખવતો. તે ફી ઓછી લેતો અને ઘણી વાર ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી કંઈ જ લેતો નહીં.

ગામના કેટલાક લોકોને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું કે ચિત્રા ટ્યૂશન આપીને બીજા વેપારીઓનો ધંધો બગાડે છે. પરંતુ ચિત્રાનું કહેવું હતું કે તે કોઈની રોજી છીનવતો નથી, પણ જે વિદ્યાર્થીઓ ક્યાંય જતા નથી તેમને ઘરે બોલાવીને ભણાવે છે. ધીમે ધીમે તેની પ્રતિષ્ઠા વધી અને તેની આવક પણ વધી.

ચિત્રાએ પોતાની કમાણીમાંથી પહેલું કામ પોતાનું અધૂરું ભણતર પૂરું કરવાનું કર્યું. તેણે ખાનગી રીતે ધોરણ ૧૨ની પરીક્ષા આપી અને પછી બી.કોમ. કર્યું. આ બધું તે દિવસે ૧૪ કલાક મહેનત કરીને કરતો હતો. તેની પત્ની સુમિત્રાબેન પણ તેને ઘરકામમાં મદદ કરતાં અને બાળકોને સાચવતાં.

આજે ચિત્રા ત્રિવેદી પોતાની કાપડની દુકાન ઉપરાંત એક નાની ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. તેમાં ૮૦ વિદ્યાર્થીઓ ભણે છે અને ૪ શિક્ષકો કામ કરે છે. તેનો મોટો દીકરો અમદાવાદમાં ડૉક્ટર બન્યો છે અને દીકરી બેંકમાં નોકરી કરે છે. ચિત્રા કહે છે કે "ગરીબી એ અભિશાપ નથી, પણ જો તમે તેને સ્વીકારી લો તો તે જરૂર અભિશાપ બની જાય છે."

(૧) ગણોત ધારાની કલમ ૬૩ : ગણોત ધારાની કલમ ૬૩ મુજબ ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે કલેક્ટરની પરવાનગી મેળવવાની જોગવાઈ છે. આ કલમ મુજબ કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર કોઈ પણ ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરી શકાતું નથી. આ કલમ મુજબ કલેક્ટરની પરવાનગી મેળવવા માટે ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા ઇચ્છતી વ્યક્તિએ કલેક્ટરને અરજી કરવી પડે છે. આ અરજી સાથે નીચે મુજબના આધારો રજૂ કરવા પડે છે.

૧. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે કલેક્ટરને કરવામાં આવેલી અરજી.

૨. ૭/૧૨ અને ૮-અ ની નકલ.

૩. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૪. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૫. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૬. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૭. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૮. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૯. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

૧૦. ખેતીની જમીનનું બિનખેતી જમીનમાં રૂપાંતર કરવા માટે ગામ નમૂના નંબર ૭ માં કરવામાં આવેલી નોંધની નકલ.

ઉ

ન્યાયાધીશ શ્રી ૨૦૨૦

ઈશ્વરી પ્રસાદ ઉપાધ્યાય વિરુદ્ધ રાજ્ય સરકાર તથા બીજા દરમ્યાન

ન્યાયિક નિર્ણય

ઉપરોક્ત કેસમાં ફરિયાદી/અરજદાર તરફેણમાં ચુકાદો આપવા માટે રજૂ કરવામાં આવેલ દલીલો અને પુરાવાઓ ધ્યાનમાં લેતાં, આ અદાલત એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવા ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રતિવાદી/વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ફરિયાદી/અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ખોટા પાડવામાં નિષ્ફળ રહ્યા છે.

આથી, આ અદાલત એવો મત ધરાવે છે કે ફરિયાદી/અરજદાર તરફેણમાં ચુકાદો આપવો યોગ્ય અને ન્યાયી રહેશે. તદનુસાર, આ અદાલત નીચે મુજબનો હુકમ કરે છે:-

હુકમ

(૧) ફરિયાદી/અરજદાર તરફેણમાં ચુકાદો આપવામાં આવે છે.

પ્રતિવાદી તરફથી વકીલશ્રી ડી.જી.પટેલ હાજર રહ્યા હતા.

: ચુકાદો :

- ફરિયાદી - ફરિયાદ પક્ષ તરફથી કુલ ૩ સાક્ષીઓ તપાસવામાં આવેલ છે. જેમાં ફરિયાદી પોતે તથા પંચ સાક્ષી તથા તપાસનીશ અધિકારી સાક્ષી

ગુલામ હોય ત્યારે, ધર્મ કે રાજકીય કારણોસર કોઈ પણ વ્યક્તિ પર અત્યાચાર થાય ત્યારે તેમની મદદે જવું એ ઇસ્લામની ફરજ છે. આ ફરજ અદા કરવા માટે ખુદ પયગંબર સાહેબે પોતાના સાથીદારોને પ્રેરણા આપી હતી. ઇસ્લામના ઇતિહાસમાં આવા અનેક પ્રસંગો નોંધાયેલા છે. આ પ્રસંગોમાં ઇસ્લામના પ્રારંભિક સમયમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવો અહીં પ્રસ્તુત થશે.

ઇસ્લામના પ્રારંભિક સમયમાં મક્કામાં ઉમૈયા નામનો એક ક્રૂર અને જુલમી માણસ રહેતો હતો. તે ગરીબ મુસ્લિમોને ખૂબ ત્રાસ આપતો. તેમાં પણ બિલાલ નામના એક ગુલામ પર તે અત્યંત જુલમ ગુજારતો. બિલાલ હબશી હતા. તેમનો રંગ કાળો હતો. તેમની પાસે કોઈ ધન-દોલત કે સત્તા ન હતી. તેમનો એકમાત્ર ગુનો એ હતો કે તેમણે ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો. ઉમૈયા તેમને ઇસ્લામનો ત્યાગ કરવા માટે ફરજ પાડતો. તેમને ભૂખ્યા અને તરસ્યા રાખતો. તપતી રેતી પર સુવડાવતો. તેમની છાતી પર ભારે પથ્થર મૂકતો. આમ છતાં બિલાલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે ઇસ્લામનો ત્યાગ કરવાનો ઇનકાર કર્યો. ઉમૈયાના જુલમો દિવસે-દિવસે વધતા ગયા. એક દિવસ તો હદ થઈ ગઈ. ઉમૈયાએ બિલાલને ખૂબ મારવા માંડ્યા. તેમને ઢોર માર મારીને અધમૂઆ કરી નાખ્યા. તેમ છતાં બિલાલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે ઇસ્લામનો ત્યાગ કરવાનો ઇનકાર કર્યો. ઉમૈયાએ બિલાલને ખૂબ મારવા માંડ્યા. તેમને ઢોર માર મારીને અધમૂઆ કરી નાખ્યા. તેમ છતાં બિલાલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે ઇસ્લામનો ત્યાગ કરવાનો ઇનકાર કર્યો. ઉમૈયાએ બિલાલને ખૂબ મારવા માંડ્યા.

૨૭૭૫ના વર્ષમાં જ્યારે પ્રાણ્ડવો પુત્રો સહિત દ્રૌપદી સાથે વનવાસ ભોગવતા હતા ત્યારે એક દિવસ તેમની પાસે એક બ્રાહ્મણ આવીને કહેવા લાગ્યો કે "મારી ગાય કોઈ વાઘ મારી ખાઈ ગયો છે. તેથી મારા યજ્ઞ-યાગાદિ કર્મો અટકી પડ્યાં છે. તો તમે મારી ગાય પાછી લાવી આપો." આ સાંભળી પાંડવો તેની ગાય પાછી લાવવા માટે તૈયાર થયા. તેમણે ધનુષ્ય-બાણ લઈ વાઘની પાછળ જવા પ્રયાણ કર્યું. તેમણે વાઘને શોધી કાઢ્યો. વાઘ પણ ગાયને મારી ખાવા તૈયાર થયો હતો. પાંડવોએ વાઘને ઘેરી લીધો. વાઘ ગાયને મૂકીને ભાગી ગયો. પાંડવોએ ગાય પાછી લાવીને બ્રાહ્મણને આપી. બ્રાહ્મણે પ્રસન્ન થઈને પાંડવોને આશીર્વાદ આપ્યા.

૨૭૭૬ના વર્ષમાં પાંડવો પુત્રો સહિત દ્વૈતવનમાં હતા ત્યારે એક બ્રાહ્મણ તેમની પાસે આવ્યો. તેણે કહ્યું કે "મારી અરણિ (યજ્ઞ માટે વપરાતું લાકડું) એક હરણ લઈ ગયું છે. તો તમે મારી અરણિ પાછી લાવી આપો." પાંડવોએ બ્રાહ્મણને વચન આપ્યું કે "અમે તમારી અરણિ પાછી લાવી આપીશું." પાંડવો ધનુષ્ય-બાણ લઈ હરણની પાછળ ગયા. હરણ પણ અરણિ લઈને ભાગી રહ્યું હતું. પાંડવોએ હરણને ઘેરી લીધું. હરણ અરણિ મૂકીને ભાગી ગયું. પાંડવોએ અરણિ પાછી લાવીને બ્રાહ્મણને આપી. બ્રાહ્મણે પ્રસન્ન થઈને પાંડવોને આશીર્વાદ આપ્યા.

ખાનદાન કુટુંબ કબીલા જેવા ઘણા શબ્દો વપરાય છે. પણ ઉપરના બધા શબ્દોમાં જે ભાવ રહેલો છે તે ભાવ ‘ઘર’ શબ્દમાં રહેલો નથી. ‘ઘર’ શબ્દ જેટલો વ્યાપક છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો ઊંડો છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો ઊંચો છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો પવિત્ર છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો મીઠો છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સુંદર છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સુગંધી છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સ્વર્ગીય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો દિવ્ય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો અમૃતમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો પ્રેમમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો આનંદમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો શાંતિમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સુખમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સંપૂર્ણ છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો અનંત છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો અમર છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો શાશ્વત છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો નિત્ય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સત્ય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો ચૈતન્યમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો બ્રહ્મમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો પરમાત્મમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો ઈશ્વરમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો ભગવાનમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સર્વમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો વિશ્વમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો બ્રહ્માંડમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો સૃષ્ટિમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો પ્રકૃતિમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો પુરુષમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો જીવમય છે તેટલો બીજો કોઈ શબ્દ નથી. ‘ઘર’ શબ્દ જેટલો આત

ক) ঘটনাস্থল কোথায় ছিল? খ) ঘটনার সময় তার বয়স কত ছিল? গ) ঘটনার পূর্বে তার জীবনে কী কী ঘটনা ঘটেছিল? ঘ) ঘটনার পরে তার জীবনে কী কী পরিবর্তন এসেছিল? ঙ) তার জীবনের ঘটনাগুলি কি ধারাবাহিক ভাবে বর্ণনা করা হয়েছে? চ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ সময়ের সঙ্গে সম্পর্কিত? ছ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? জ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ঝ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ঞ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ট) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ঠ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ড) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ঢ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ণ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ত) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? থ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? দ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ধ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ন) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? প) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ফ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ব) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ভ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ম) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? য) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? র) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ল) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? শ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ষ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? স) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? হ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ড়) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ঢ়) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? য়) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ৎ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ং) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ঃ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ঁ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ং) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ঃ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ঁ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ং) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ঃ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ঁ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ বস্তুর সঙ্গে সম্পর্কিত? ং) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ঘটনার সঙ্গে সম্পর্কিত? ঃ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ ব্যক্তির সঙ্গে সম্পর্কিত? ঁ) ঘটনাটি কি তার জীবনের কোনো বিশেষ স্থানের সঙ্গে সম্পর্কিত? ং

ઉપરોક્ત ફરિયાદ અને સાક્ષીઓના પુરાવા ઉપરથી આરોપી વિરુદ્ધ પ્રથમદર્શી કેસ બનતો હોવાનું જણાય છે. આરોપીએ ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરેલ હોવાનું જણાય છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપવાની શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી તથા સાક્ષીઓને ધાકધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પ્રયત્ન કરે તેવી શક્યતા રહેલી છે.

૪) વધુ રજૂઆત કે) હરજામ ને રૂ દશ હજાર (રૂપિયા દશ હજાર પૂરા) ની

૨) ૧૫ - ૨૦ મિનિટ

૩) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૧) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૨) ૧૫ - ૨૦ મિનિટ

૩) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૧) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૨) ૧૫ - ૨૦ મિનિટ

૩) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૧) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

૨) ૧૫ - ૨૦ મિનિટ

૩) ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર લખો.

(ક) ઉદાહરણ ૬ : જો ૩૨૦ (૨ ૩૨૦ ૨) ઉપરોક્ત ૦૮:

ગણેશ કાપડ ભંડાર, કાપડના વેપારીઓ, ગાંધી બજાર, રાજકોટ." આ જ પ્રમાણે ગોપાલ ટ્રેડર્સ, ગોપાલ ટ્રેડિંગ કંપની, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી, ગોપાલ ટ્રેડિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ ભાગીદારી પેઢી

૧૦. ખેડૂત ખાતેદારે પોતાની જમીનમાં ઉત્પન્ન કરેલ પાકમાંથી પોતાના કુટુંબ માટે અનાજ રાખી બાકીનું અનાજ વેચવા માટે બજારમાં લઈ જવું પડે છે. આવા સંજોગોમાં તેને ખેતપેદાશ બજાર સમિતિના યાર્ડમાં વેચવા લઈ જવું ફરજિયાત છે. ખેડૂત ખાતેદાર પોતાની ખેતપેદાશ ખાનગી વેપારીને સીધી વેચી શકતો નથી. આ ખેતપેદાશ બજાર સમિતિના યાર્ડમાં જ વેચવી પડે છે. આ ખેતપેદાશ બજાર સમિતિના યાર્ડમાં ખેડૂત ખાતેદારે પોતાની ખેતપેદાશ વેચવા લઈ જતાં પહેલાં પોતાનું નામ, સરનામું, ગામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર, ખાતા નંબર, પોતાની પાસે કેટલી જમીન છે, તેમાં કયો પાક વાવ્યો છે, તે પાક કેટલા વિસ્તારમાં વાવ્યો છે, તેમાંથી કેટલું અનાજ વેચવા લઈ જવાનું છે, તે બધી વિગતો બજાર સમિતિના યાર્ડમાં આપવાની હોય છે. આ વિગતો આપ્યા પછી જ ખેડૂત ખાતેદારને પોતાની ખેતપેદાશ વેચવા માટે બજાર સમિતિના યાર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. ખેડૂત ખાતેદાર પોતાની ખેતપેદાશ વેચવા લઈ જાય ત્યારે તેની સાથે પોતાની ઓળખ માટે પોતાનું ઓળખકાર્ડ પણ લઈ જવું પડે છે. આ ઓળખકાર્ડ ખેડૂત ખાતેદારનું નામ, સરનામું, ગામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર, ખાતા નંબર, પોતાની પાસે કેટલી જમીન છે, તેમાં કયો પાક વાવ્યો છે, તે પાક કેટલા વિસ્તારમાં વાવ્યો છે, તેમાંથી કેટલું અનાજ વેચવા લઈ જવાનું છે, તે બધી વિગતો બજાર સમિતિના યાર્ડમાં આપવાની હોય છે. આ વિગતો આપ્યા પછી જ ખેડૂત ખાતેદારને પોતાની ખેતપેદાશ વેચવા માટે બજાર સમિતિના યાર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. ખેડૂત ખાતેદાર પોતાની ખેતપેદાશ ખાનગી વેપારીને સીધી વેચી શકતો નથી. આ ખેતપેદાશ બજાર સમિતિના યાર્ડમાં જ વેચવી પડે છે. આ ખેતપેદાશ બજાર સમિતિના યાર્ડમાં ખેડૂત ખાતેદારે પોતાની ખેતપેદાશ વેચવા લઈ જતાં પહેલાં પોતા

કાનૂની હક્કો અને ફરજો

તેમ તેમના પરિવારના સભ્યો પોતાની ખાનગી જિંદગીમાં, પોતાના રહેઠાણમાં અને પોતાની ખાનગી મિલકત બાબતે કોઈ પણ જાતની ગેરવાજબી દખલગીરી સામે રક્ષણ મેળવવાનો હક ધરાવે છે. આ હક્કનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ કાયદાની મદદ માગી શકે છે. આ હક્કનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ કાયદાની મદદ માગી શકે છે. આ હક્કનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ કાયદાની મદદ માગી શકે છે. આ હક્કનો ભંગ થયો હોય તેવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિ કાયદાની મદદ માગી શકે છે.

(૨) ઇન્સાફ : ન્યાયનો અધિકાર

ન્યાયનો અધિકાર એટલે કોઈ પણ વ્યક્તિ સામે ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે તેને ન્યાયી અને ખુલ્લી અદાલતમાં ન્યાયી સુનાવણી મેળવવાનો હક. આ હક્કમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :

(૧) કોઈ પણ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે તેને ન્યાયી અને ખુલ્લી અદાલતમાં ન્યાયી સુનાવણી મેળવવાનો હક છે. આ હક્કમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :

(૨) કોઈ પણ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે તેને ન્યાયી અને ખુલ્લી અદાલતમાં ન્યાયી સુનાવણી મેળવવાનો હક છે. આ હક્કમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે :

ॐ श्री गणेशाय नमः

गोपाल नगर के निवासी मुंशी हजारी लाल के पुत्र मुंशी शंभूनाथ सक्सेना, जो कि पेशे से वकील हैं, अपने पीछे पत्नी, दो पुत्र और एक पुत्री को छोड़कर दिनांक १२ मार्च १९३३ को इस नश्वर संसार से सदा के लिए विदा हो गए। उनकी मृत्यु से न केवल उनके परिवार, बल्कि पूरे नगर में शोक की लहर दौड़ गई। उनकी अंतिम यात्रा में सैकड़ों लोग सम्मिलित हुए, जो इस बात का प्रमाण है कि वे अपने पीछे कितनी गहरी छाप छोड़ गए हैं।

मुंशी शंभूनाथ का जन्म १८६५ में एक साधारण कायस्थ परिवार में हुआ था। उनके पिता मुंशी हजारी लाल एक छोटे से जमींदार थे, जिनके पास लगभग ४० बीघा उपजाऊ भूमि थी। शंभूनाथ ने अपनी प्रारंभिक शिक्षा गोपाल नगर के ही एक मदरसे में प्राप्त की। वे बचपन से ही पढ़ने में अत्यंत कुशाग्र बुद्धि के थे। उन्होंने १८८३ में प्रथम श्रेणी में मैट्रिकुलेशन की परीक्षा उत्तीर्ण की और आगे की पढ़ाई के लिए प्रयाग चले गए, जहाँ उन्होंने कायस्थ पाठशाला में रहकर कानून की पढ़ाई की।

प्रयाग से लौटने के बाद उन्होंने गोपाल नगर में ही वकालत शुरू की। शुरुआत में उन्हें कठिनाइयों का सामना करना पड़ा, क्योंकि उस समय नगर में पहले से ही तीन वकील कार्यरत थे। लेकिन अपनी मेहनत, ईमानदारी और कानून की गहरी समझ के कारण वे शीघ्र ही लोकप्रिय हो गए। उनके मुवक्किलों में न केवल हिंदू बल्कि मुसलमान और ईसाई भी बड़ी संख्या में थे, जो इस बात का प्रमाण है कि उनकी निष्पक्षता पर सभी को विश्वास था।

ગામ કોટડા તા. ધ્રોલ જી. જામનગરના વતની હાલ મુંબઈ ખાતે રહેતા મારા મિત્ર ભાઈ ચંદુભાઈ ડાયાભાઈ ગોધાણીના પિતાશ્રી ડાયાભાઈ ખીમજીભાઈ ગોધાણીનું તા. ૨૭-૧૧-૨૦૦૯ ના રોજ વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. તેઓ ખૂબ જ ધર્મપરાયણ અને સેવાભાવી વ્યક્તિ હતા. તેમના અવસાનથી ગોધાણી પરિવારને ખૂબ મોટી ખોટ પડી છે. તેમના આત્માને ચિરશાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે તેમના પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું.

ઓમ શાંતિ શાંતિ શાંતિ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ સચિવાલયમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ તથા અધિકારીઓ માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ૧૫ દિવસ ચાલી હતી. ફાઈનલ મેચ તા. ૨૫-૧૨-૨૦૦૯ ના રોજ રમાઈ હતી. ફાઈનલ મેચમાં સચિવાલય જીમખાના ટીમ અને મહેસૂલ વિભાગની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. સચિવાલય જીમખાના ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં મહેસૂલ વિભાગની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૫૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ સચિવાલય જીમખાના ટીમે ૭ રનથી વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમના કેપ્ટન શ્રી મનોજ પટેલને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે રનર્સ અપ ટીમના કેપ્ટન શ્રી રમેશ ચૌધરીને ટ્રોફી આપવામાં આવી હતી. મેન ઓફ ધ મેચ તરીકે સચિવાલય જીમખાના ટીમના બેટ્સમેન શ્રી અજય પરમારને પસંદ કરવામાં આવ્યા હતા.

ગોપાલ ને પ્રેમ

ગોપાલ ઘરમાં આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહોતું. પ્રેમ ઘરે નહોતી. ગોપાલ ઘરમાં આમતેમ ફરવા લાગ્યો. પ્રેમ ક્યાં ગઈ હશે તે વિચારવા લાગ્યો. પ્રેમ ગોપાલની પત્ની હતી. ગોપાલ પ્રેમને ખૂબ પ્રેમ કરતો હતો. પ્રેમ પણ ગોપાલને ખૂબ પ્રેમ કરતી હતી. ગોપાલ પ્રેમ વગર એક ક્ષણ પણ રહી શકતો નહોતો. પ્રેમ પણ ગોપાલ વગર રહી શકતી નહોતી. ગોપાલ પ્રેમ વગર ઘરમાં આમતેમ ફરવા લાગ્યો. પ્રેમ ક્યાં ગઈ હશે તે વિચારવા લાગ્યો. પ્રેમ ગોપાલને કહ્યા વગર ક્યારેય બહાર જતી નહોતી. ગોપાલ પ્રેમને કહ્યા વગર ક્યારેય બહાર જતો નહોતો

૨૦ મી સદીના ગુજરાતી સાહિત્યમાં દલિત વિષયક કાવ્યો

૧૯૭૦ પછીના ગુજરાતી સાહિત્યમાં દલિત સંવેદનાને વાચા આપતી કવિતા લખાઈ છે. આ કવિતા દલિત જીવનની વાસ્તવિકતા, પીડા, અપમાન અને સંઘર્ષને પોતાનો વિષય બનાવે છે. આ કવિતા પરંપરાગત કાવ્યરૂપોને બદલે મુક્ત છંદ, લોકબોલી અને રોજિંદી ભાષાનો ઉપયોગ કરે છે. તેમાં ઘણી વાર આક્રોશ, વ્યંગ અને પ્રશ્નાર્થ જોવા મળે છે. દલિત કવિઓ પોતાની જાતિ, ગામ, ઘર, મજૂરી, ભેદભાવ અને સામાજિક બહિષ્કાર વિશે સીધું અને નિર્ભીક કથન કરે છે.

આ કવિતામાં ઘણી વાર ઈશ્વર, ધર્મ અને પરંપરા સામે પણ પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે આ બધાં જ માળખાં દલિતોને સમાન માનવીય દરજ્જો આપવામાં નિષ્ફળ ગયાં છે. કેટલીક કવિતાઓમાં ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાનની પીડા એકસાથે વણાયેલી જોવા મળે છે. કવિ પોતાના પૂર્વજોની વેદના યાદ કરીને પોતાની ઓળખ શોધે છે. ક્યારેક આ કવિતા સામૂહિક અવાજ બનીને પણ રજૂ થાય છે.

આ કવિતાની ભાષા ઘણી વાર સીધી, તીખી અને ચોટદાર હોય છે. તેમાં ગામઠી શબ્દો, ગાળો, કહેવતો અને લોકગીતોની લય પણ જોવા મળે છે. કેટલીક કવિતાઓ ગીત સ્વરૂપમાં લખાઈ છે, જ્યારે કેટલીક મુક્ત કાવ્યરૂપમાં. આ કવિતા ફક્ત વેદના વ્યક્ત કરતી નથી, પણ પરિવર્તનની આકાંક્ષા પણ વ્યક્ત કરે છે. તેથી આ કવિતા ગુજરાતી સાહિત્યમાં એક નવો અને મહત્ત્વનો પ્રવાહ બની રહી છે.

(૨૧)

"ટી બ્રેક" ૧૦૦૭

ટ્રેનિંગ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેલ તમામ તાલીમાર્થીઓ : તાલીમ બાદ પોતાના ગામ/શહેરમાં ગયા બાદ પોતાના વિસ્તારમાં પોતાની ફરજ દરમ્યાન કેવી રીતે કામગીરી કરશે તે અંગે પોતાના વિચારો રજૂ કરે છે. તાલીમાર્થીઓ પોતાના વિચારો રજૂ કરે ત્યારે તાલીમ કેન્દ્રના તાલીમ સંયોજક તથા તાલીમ કેન્દ્રના અધ્યક્ષ પણ હાજર રહ

ग्रन्थ में वर्णित कथानुसार राजा भोज के समय में धारा नगरी में एक ब्राह्मण रहता था। उसकी पत्नी अत्यन्त सुन्दर थी। एक दिन राजा ने उसे देख लिया और उसे पाने की इच्छा से उसके पति को किसी बहाने से दूर भेज दिया। ब्राह्मण की पत्नी ने राजा के इस कुकृत्य को जानकर अपने सतीत्व की रक्षा के लिए एक उपाय सोचा। उसने राजा को संदेश भेजा कि वह उसके पति के लौटने पर ही उसके पास आ सकती है, क्योंकि उसके पति के बिना वह अपने शरीर को स्पर्श नहीं करने देती। राजा ने यह सुनकर ब्राह्मण के लौटने की प्रतीक्षा की। जब ब्राह्मण लौटा तो उसकी पत्नी ने उसे सारी बात बताई। ब्राह्मण ने अपनी पत्नी के सतीत्व की रक्षा के लिए राजा को दण्ड देने का निश्चय किया। उसने राजा के पास जाकर उसे एक कथा सुनाई, जिसमें एक राजा ने एक ब्राह्मण की पत्नी को छल से प्राप्त करने का प्रयास किया था। कथा सुनकर राजा को अपनी भूल का एहसास हुआ और उसने ब्राह्मण से क्षमा माँगी। ब्राह्मण ने राजा को क्षमा कर दिया और उसे धर्म का मार्ग अपनाने की सलाह दी।

(৩৫)

ঈদ উপলক্ষে ছুটি

আগামী ১৫ই জুন শুক্রবার ঈদুল ফিতর উপলক্ষে ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস ৩দিন বন্ধ থাকবে। ১৬ই জুন শনিবার ব্যাংক খোলা থাকবে। ১৭ই জুন রবিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ১৮ই জুন সোমবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ১৯শে জুন মঙ্গলবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২০শে জুন বুধবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২১শে জুন বৃহস্পতিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২২শে জুন শুক্রবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৩শে জুন শনিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৪শে জুন রবিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৫শে জুন সোমবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৬শে জুন মঙ্গলবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৭শে জুন বুধবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৮শে জুন বৃহস্পতিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৯শে জুন শুক্রবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ৩০শে জুন শনিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে।

ঈদুল ফিতর উপলক্ষে ছুটি

আগামী ১৫ই জুন শুক্রবার ঈদুল ফিতর উপলক্ষে ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস ৩দিন বন্ধ থাকবে। ১৬ই জুন শনিবার ব্যাংক খোলা থাকবে। ১৭ই জুন রবিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ১৮ই জুন সোমবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ১৯শে জুন মঙ্গলবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২০শে জুন বুধবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২১শে জুন বৃহস্পতিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২২শে জুন শুক্রবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৩শে জুন শনিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৪শে জুন রবিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৫শে জুন সোমবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৬শে জুন মঙ্গলবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৭শে জুন বুধবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৮শে জুন বৃহস্পতিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ২৯শে জুন শুক্রবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে। ৩০শে জুন শনিবার ব্যাংক, বীমা, সমবায় ও অন্যান্য সরকারি অফিস খোলা থাকবে।

ঝিনাইদহ জেলার ইতিহাস ও ঐতিহ্য

ঝিনাইদহ জেলার ইতিহাস ও ঐতিহ্য সম্পর্কে কিছু লিখতে গেলে প্রথমেই আসে জেলার নামকরণের প্রশ্ন। ঝিনাইদহ নামটি কীভাবে এলো, এ নিয়ে বিভিন্ন মত ও কাহিনি প্রচলিত আছে। কারও কারও মতে, ঝিনাই নামে একটি ছোট নদী এই অঞ্চলের পাশ দিয়ে প্রবাহিত ছিল, যা থেকে স্থানটির নাম হয়েছে ঝিনাইদহ। আবার কেউ কেউ মনে করেন, এখানে এক সময় ঝিনুক বা শঙ্খ জাতীয় জলজ প্রাণীর প্রাচুর্য ছিল বলে এই নাম হয়েছে। তবে নামের উৎস নিয়ে নিশ্চিত করে কিছু বলা কঠিন। তবে একটি বিষয় নিশ্চিত যে, ঝিনাইদহ নামটি বহু শতাব্দী ধরে এই অঞ্চলের পরিচয় বহন করে আসছে।

ঝিনাইদহ জেলার ইতিহাস ও ঐতিহ্য সম্পর্কে কিছু লিখতে গেলে প্রথমেই আসে জেলার নামকরণের প্রশ্ন। ঝিনাইদহ নামটি কীভাবে এলো, এ নিয়ে বিভিন্ন মত ও কাহিনি প্রচলিত আছে। কারও কারও মতে, ঝিনাই নামে একটি ছোট নদী এই অঞ্চলের পাশ দিয়ে প্রবাহিত ছিল, যা থেকে স্থানটির নাম হয়েছে ঝিনাইদহ। আবার কেউ কেউ মনে করেন, এখানে এক সময় ঝিনুক বা শঙ্খ জাতীয় জলজ প্রাণীর প্রাচুর্য ছিল বলে এই নাম হয়েছে। তবে নামের উৎস নিয়ে নিশ্চিত করে কিছু বলা কঠিন। তবে একটি বিষয় নিশ্চিত যে, ঝিনাইদহ নামটি বহু শতাব্দী ধরে এই অঞ্চলের পরিচয় বহন করে আসছে।

ગામમાં ઉપરોક્ત મિલકત ઉપર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો કોઈ હક્ક, હિત, સંબંધ કે જવાબદારી ન હોવાનું જાહેર કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થાને આ મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો હક્ક, હિત, સંબંધ કે જવાબદારી હોય તો તેણે આ નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૧૫ દિવસની અંદર પોતાનો હક્ક, હિત, સંબંધ કે જવાબદારી અંગેના પુરાવા સાથે લેખિતમાં રજૂ કરવાનો રહેશે. નિયત સમયમાં કોઈ રજૂઆત ન થાય તો આ મિલકત ઉપર કોઈનો હક્ક, હિત, સંબંધ કે જવાબદારી નથી તેમ ગણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, અને ત્યારબાદ કોઈની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, તેની સંબંધિત સૌ નોંધ લે.

તારીખ : ૧૭/૦૩/૨૦૨૬

(ક) મિલકતનું સ્થળ : ગામ તા. જિ. ખાતે આવેલ ખેતીની જમીન જે ખાતા નંબર ૧૨૩૪ હેઠળ સર્વે નંબર ૫૬૭/૨ પૈકી ૧ વાળી જમીન હેક્ટર ૦.૮૫૦૦ ચો.મી. (૨ એકર ૧૦ ગુંઠા) જેટલી થાય છે. આ જમીનની ચારેય બાજુની હદ નીચે મુજબ છે :-

১) দলের নাম: ৫) ২২৩ বঙ্গাব্দ ক্ল.

ঈদ মোবারক

ঈদ মোবারক, আজকের দিনে সকলের মুখে মুখে এই শুভেচ্ছা বাণী। ঈদ আনন্দের দিন, খুশির দিন। এই দিনে সকল মুসলমান ভাই-বোন একত্রিত হয়ে আল্লাহর দরবারে শুকরিয়া আদায় করে। ঈদের নামাজ পড়ার জন্য সকাল বেলা সুন্দর পোশাক পরে ঈদগাহে যায়। ঈদের নামাজ শেষে সবাই সবার সাথে কোলাকুলি করে। ছোটরা বড়দের সালাম করে। বড়রা ছোটদের আদর করে। ঈদের দিন সবাই ভালো খাবার খায়। বাড়িতে বিভিন্ন রকমের মিষ্টি তৈরি করা হয়। ঈদের দিন গরিব-দুঃখীদের মধ্যে দান করা হয়। ঈদ আমাদের শিক্ষা দেয় ধৈর্য ধরার, ত্যাগ স্বীকার করার এবং একে অপরের পাশে দাঁড়ানোর। ঈদ আমাদের মধ্যে ভ্রাতৃত্ব ও ভালোবাসা বৃদ্ধি করে। ঈদ আমাদের জীবনে নিয়ে আসে আনন্দ ও খুশি।

(૨)

પ્રતિવાદી પક્ષનો : વાદીપક્ષના આ મકાનમાં તો વાદીપક્ષના કુટુંબીજનો રહેતા હોવાનું કબૂલ કરે છે. વાદીપક્ષ તો પોતાની માલિકીનું મકાન હોવાનું જણાવે છે. પ્રતિવાદી પક્ષ તો વાદીપક્ષના કુટુંબીજનો આ મકાનમાં

"ਮੈਂ ਤੇਰੇ ਨਾਲ ਹੀ ਰਹਿਣਾ ਹਾਂ" ਦਾਸਰ ਨੇ ਸਾਰਦਾ ਨੂੰ ਸਮਝਾਉਂਦਿਆਂ ਕਿਹਾ ਤਾਂ ਸਾਰਦਾ ਨੇ ਕਿਹਾ "ਮੈਂ ਤੇਰੇ ਨਾਲ ਹੀ ਰਹਿਣਾ ਹਾਂ ਪਰ ਤੂੰ ਮੈਨੂੰ ਕਿਤੇ ਵੀ ਨਹੀਂ ਲੈ ਕੇ ਜਾਣਾ ਹੈ ਤੂੰ ਮੈਨੂੰ ਇਥੇ ਹੀ ਰਹਿਣ ਦੇ ਤੇ ਮੈਂ ਇਥੇ ਹੀ ਰਹਾਂਗੀ ਤੂੰ ਮੈਨੂੰ ਕਿਤੇ ਵੀ ਲੈ ਕੇ ਜਾਣ ਦੀ ਜਿੱਦ ਨਾ ਕਰੀਂ ਮੈਂ ਇਥੇ ਹੀ ਰਹਾਂਗੀ

(1)

શ્રી ગણેશાય નમઃ

ગુરુદેવ શ્રી મોહનખેડા તીર્થમંડન શ્રી ઋષભદેવ સ્વામી પ્રસન્નતે, શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી ભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી યતીન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિદ્યાચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી જયંત સેન સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય વિદ્યાચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય જયંત સેન સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ભૂપેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય યતીન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય મોહન સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ધનચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ધરણેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણોદય સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવંત સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવર્ધન સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિલાસ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિનય સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિમલ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિરાગ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિવેક સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિશાલ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિશુદ્ધ સૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજય ગુણવિશ્વાસ

(1)

"ના કરીને કોઈ

કોઈ-કોઈ વાર વિદ્યાર્થી મિત્રોના ઘરે જવાનું થાય છે. એમના ઘરમાં પણ એવું જ વાતાવરણ હોય છે. એમના પિતા પણ ઘરમાં કોઈ સાથે વાત કરતા નથી. એમની માતા પણ ઘરમાં ચૂપચાપ કામ કરતી રહે છે. એમના ભાઈ-બહેન પણ ઘરમાં ચૂપચાપ રમતાં હોય છે. ઘરમાં કોઈ કોઈની સાથે વાત કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સામે હસતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે મજાક કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ઝઘડતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે બોલતું જ નથી. ઘરમાં કોઈ કોઈની સામે જોતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રમતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ભણતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ખાતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે પીતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સૂતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ઊઠતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે બેસતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચાલતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે દોડતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કૂદતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગાતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે નાચતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વાંચતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે લખતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગણતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચિત્ર પણ દોરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રમકડાં પણ રમતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ટીવી પણ જોતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રેડિયો પણ સાંભળતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગીત પણ ગાતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કવિતા પણ વાંચતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વાર્તા પણ કહેતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચર્ચા પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વિવાદ પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંવાદ પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વિવેક પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સૌજન્ય પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે શિષ્ટાચાર પણ પાળતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સભ્યતા પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંસ્કાર પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંસ્કૃતિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે પરંપરા પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રીતરિવાજ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ધર્મ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કર્મ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ભક્તિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે પ્રેમ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે લાગણી પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંવેદના પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સહાનુભૂતિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સમભાવ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સમદૃષ્ટિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સમન્વય પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સમાધાન પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સમજૂતી પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સહકાર પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સહયોગ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સહાનુભૂતિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંવેદના પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે લાગણી પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે પ્રેમ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ભક્તિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કર્મ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ધર્મ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંસ્કૃતિ પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંસ્કાર પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સભ્યતા પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે શિષ્ટાચાર પણ પાળતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સૌજન્ય પણ દાખવતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વિવેક પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સંવાદ પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વિવાદ પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચર્ચા પણ કરતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વાર્તા પણ કહેતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રેડિયો પણ સાંભળતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ટીવી પણ જોતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગીત પણ ગાતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કવિતા પણ વાંચતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે રમકડાં પણ રમતું નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ભણતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ખાતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે પીતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે સૂતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ઊઠતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે બેસતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચાલતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે દોડતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે કૂદતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગાતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે નાચતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે વાંચતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે લખતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ગણતું પણ નથી. ઘરમાં કોઈ કોઈની સાથે ચિત્ર પણ દોર

ঐ বছর বিদ্যা ভেঙে হয়ে যাওয়ায় সে ছবিটা আঁকতে পারেনি। সেটি নিয়ে
সবাই কিছুটা হতাশ হলেও তার ছবির প্রতি ভালোবাসা কমেনি। সে
পরের বছর আবার নতুন উদ্যমে ছবিটা আঁকতে শুরু করে। এবার
সে ছবিটা আঁকতে বসেছিল ঠিক ভোর ৫টায়। সূর্যের আলো
যখন ধীরে ধীরে পৃথিবীকে আলোকিত করছিল, তখন সে
তার ছবিতে সূর্যের আলো ফুটিয়ে তুলছিল। ছবিটা আঁকতে
তার সময় লেগেছিল ৩ ঘণ্টা ১৫ মিনিট। ছবিটা আঁকা শেষ
হলে সে তার বাবা-মাকে ডেকে দেখায়। তার বাবা-মা ছবিটা
দেখে খুব খুশি হয়। তার বাবা তাকে বলে, "তুমি ছবিটা
খুব সুন্দর এঁকেছ। তবে ছবিটা আঁকতে আরও সময় নিলে
ভালো হতো।" তার মা বলে, "ছবিটা খুব সুন্দর হয়েছে।
তবে ছবিটা আঁকতে আরও সময় নিলে ভালো হতো।"
তার বাবা-মা তাকে আরও ভালো করার জন্য উৎসাহিত
করে। তারা বলে, "তুমি যদি আরও সময় নিয়ে ছবিটা
আঁকো, তাহলে ছবিটা আরও সুন্দর হবে।" তার বাবা-মা
তাকে আরও ভালো করার জন্য উৎসাহিত করে।

(૨૧૨)

ગાંધીજીના જીવનપ્રસંગો

ગાંધીજીના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો તેમના મુખે સાંભળવાનો લહાવો મને મળ્યો હતો. એ પ્રસંગો મારી સ્મૃતિમાં એવા તો કોતરાઈ ગયા છે કે જ્યારે પણ તેમની યાદ આવે છે ત્યારે તેમનું જીવન મારી સામે તાદૃશ થઈ ઊભું રહે છે. એ પ્રસંગો મારા જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. એમાંથી કેટલાક પ્રસંગો અહીં આપું છું.

૧. ગાંધીજીનું પહેલું ભાષણ

ગાંધીજીનું પહેલું જાહેર ભાષણ ક્યારે અને ક્યાં થયું હતું એ જાણવાની મારી ઇચ્છા હતી. એ વિષે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું: "મારું પહેલું ભાષણ ૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનૌમાં થયું હતું. એ વખતે હું ત્યાં કૉંગ્રેસના અધિવેશનમાં ગયો હતો. ત્યાં મારા કેટલાક વકીલ મિત્રોએ મને કહ્યું કે તારે પણ કંઈક બોલવું જોઈએ. મેં કહ્યું કે મારે શું બોલવું? ત્યારે તેમણે કહ્યું કે તારે ખેડા સત્યાગ્રહ વિષે બોલવું જોઈએ. મેં કહ્યું કે ભલે, હું બોલીશ. પણ મારે શું બોલવું એ મને કહો. ત્યારે તેમણે મને

यादव जमींदार परिवार में रामदत्त जैसे कुछ लोग थे जो अपने पैतृक व्यवसाय को छोड़कर दूसरा व्यवसाय अपना लेते थे। उनके इस निर्णय का परिवार में विरोध होता था। उनके इस निर्णय को अच्छा नहीं समझा जाता था। उनके इस निर्णय को अच्छा नहीं समझा जाता था। उनके इस निर्णय को अच्छा नहीं समझा जा

(૧૬)

"ના, મારે કંઈ જોઈતું નથી. પણ તમે કોણ છો? તમારું નામ શું?"

"મારું નામ ? ઉપેન્દ્ર. હું તમારો પાડોશી છું. તમારી બાજુમાં જે ઘર ખાલી પડ્યું છે ને, ત્યાં હું રહું છું. મારી પત્ની અને બાળકો ગામડે ગયાં છે. હું એકલો જ છું. તમે ક્યારે આવ્યાં ? ક્યાંથી આવ્યાં ? તમારું નામ શું ?" ઉપેન્દ્રે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા.

"મારું નામ ? મારું નામ ... મારું નામ ..." સ્ત્રી મૂંઝાઈ ગઈ. એ પોતાનું નામ ભૂલી ગઈ હોય એમ લાગતું હતું. ઉપેન્દ્રે ફરી પૂછ્યું, "તમારું નામ શું ?"

"મારું નામ ... મારું નામ ... મને યાદ નથી આવતું. મારું નામ શું છે ? હું કોણ છું ? હું ક્યાં છું ? મારું કોઈ નથી ? મારું કોઈ નથી ?" સ્ત્રી ગભરાઈ ગઈ. એ પોતાનું નામ ભૂલી ગઈ હોય એમ લાગતું હતું. ઉપેન્દ્રે ફરી પૂછ્યું, "તમારું નામ શું ?"

"મારું નામ ... મારું નામ ... મને યાદ નથી આવતું. મારું નામ શું છે ? હું કોણ છું ? હું ક્યાં છું ? મારું કોઈ નથી ? મારું કોઈ નથી ?" સ્ત્રી ગભરાઈ ગઈ. એ પોતાનું નામ ભૂલી ગઈ હોય એમ લાગતું હતું. ઉપેન્દ્રે ફરી પૂછ્યું, "તમારું નામ શું ?"

मिश्रा जी मुसाहब बना कि कोई ग्रन्थ भाषा में लिखे। सब ने कहा "आप ही लिखें।" तब उन्होंने यह ग्रन्थ लिखना आरंभ किया। इसमें ३६ अध्याय हैं। प्रत्येक अध्याय में एक एक विषय का वर्णन है

ક્રિ ઓફિસ્ટાઈમ.

ઓફિસર ઇન ચાર્જ

પ્રતિ,

ઇન્સ્પેક્ટર શ્રી/સાહેબશ્રી,
.....પોલીસ સ્ટેશન.

વિષય :- ગુમ થયેલ વ્યક્તિ અંગે ફરિયાદ કરવા બાબત.

હું નીચે સહી કરનાર મારા ઉપરોક્ત સરનામે કાયમી રહેવાસી છું. મારા ઉપરોક્ત સરનામે મારી સાથે મારા કુટુંબના સભ્યો રહે છે. મારા કુટુંબમાં મારા પત્ની, બે પુત્રો અને એક પુત્રી મળી કુલ પાંચ સભ્યો છે. મારા પત્ની ઘરકામ કરે છે. મારો મોટો પુત્ર ૧૭ વર્ષનો છે અને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. મારો નાનો પુત્ર ૧૫ વર્ષનો છે અને ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. મારી પુત્રી ૧૩ વર્ષની છે અને ધોરણ ૮માં અભ્યાસ કરે છે. મારા પત્ની, બંને પુત્રો અને પુત્રી ગઈ તા. ૨૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. તેઓ ક્યાં ગયા છે તે અંગે મને કોઈ જાણ કરી નથી. તેઓ ઘરે પરત આવ્યા નથી. તેઓ ગુમ થયા છે. તેઓ ગુમ થયા બાબતે મેં મારા સગા-સંબંધીઓ તથા મારા ઓળખીતા મિત્રોને પૂછપરછ કરી છે. તેઓ ક્યાં ગયા છે તે અંગે મને કોઈ માહિતી મળી નથી. તેઓ ગુમ થયા બાબતે મેં મારી રીતે તપાસ કરી છે. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ પુરાવો નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ શંકા નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ ફરિયાદ નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ અરજી નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ સોગંદનામું નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ સાક્ષી નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ દસ્તાવેજ નથી. તેઓ ગુમ થયા બાબતે મારી પાસે કોઈ અન્ય વિગત નથી.

વિશ્વાસુ

ઉદાહરણ :-

(1) ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તો તે ગ્રહણ ભારતમાં કયાં કયાં દેખાયું હતું ?

ઉકેલ :- ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તે ગ્રહણ ભારતમાં ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત તથા દક્ષિણ ભારત એમ ચારેય ભાગોમાં દેખાયું હતું.

(2) ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તો તે ગ્રહણ ભારતમાં કયાં કયાં દેખાયું હતું ?

ઉકેલ :- ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તે ગ્રહણ ભારતમાં ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત તથા દક્ષિણ ભારત એમ ચારેય ભાગોમાં દેખાયું હતું.

(3) ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તો તે ગ્રહણ ભારતમાં કયાં કયાં દેખાયું હતું ?

ઉકેલ :- ૨૮૯૫ ના ચૈત્ર સુદ ૧૫ ને ગુરુવારે ચંદ્રગ્રહણ થયું હતું. તે ગ્રહણ ભારતમાં ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત તથા દક્ષિણ ભારત એમ ચારેય ભાગોમાં દેખાયું હતું.

ખાસ્સો મોટો ઉપાડો લીધો. ઘરમાં ઘણા વખતથી ચાલ્યા આવતા કંકાસ, ઝઘડા, ટંટા-ફિસાદ, ગાળાગાળી, મારામારી, ખૂનામરકી, ચોરી-ધાડ, લૂંટફાટ, બદકામ, બદચલનીના બનાવો ઓછા થઈ ગયા. ઘરમાં સુખ-શાંતિ, સંપ-સહકાર, પ્રેમ-ભાઈચારો, ઉદારતા, સહિષ્ણુતા, સહકાર, સહાનુભૂતિ, સમજદારી, સમાધાનવૃત્તિ, ત્યાગ, બલિદાન, સેવા, પરોપકાર, પરગજુપણું, માનવતા, ઉદારતા, ક્ષમા, દયા, કરુણા, ધર્મ, ન્યાય, નીતિ, સદાચાર, સદ્‌વર્તન, સદ્‌વ્યવહાર, સદ્‌ભાવના, સદ્‌ભાવ, સદ્‌બુદ્ધિ, સદ્‌વિચાર, સદ્‌વિવેક, સદ્‌વિચારણા, સદ્‌વિવેકબુદ્ધિ, સદ્‌વિચારશક્તિ, સદ્‌વિવેકશક્તિ, સદ્‌વિચારબુદ્ધિ

ঘ) ধরো তোমার

ଅଧ୍ୟାୟ ୨

ଏହା ବ୍ୟତୀତ ଆମ୍ବଗଛ ଓ ଲିଚୁ ଗଛ ଥାଇ ଚେଷ୍ଟାଯାଇ ନିଜ ପୋଷ୍ୟ ପୁତ୍ରଟିକୁ ଦେଇଥିଲେ । ଏହି ଗଛ ଦୁଇଟି ଉପରେ ଗୋପାଳର ଅତ୍ୟନ୍ତ ଆଗ୍ରହ ଥିଲା । ଏଥିପାଇଁ ସେ ଗଛ ଦୁଇଟିର ଯତ୍ନ ନେଉଥିଲା ଓ ଗଛ ଦୁଇଟି ମଧ୍ୟ ତାକୁ ଅତ୍ୟନ୍ତ ଭଲପାଉଥିଲେ । ଗୋପାଳ ଗଛ ଦୁଇଟିକୁ ଯେପରି ଭଲପାଏ, ଗଛ ଦୁଇଟି ମଧ୍ୟ ଗୋପାଳକୁ ସେପରି

ঘ) সমাধান কর।

৪ নমুনা উত্তর

ক্রিয়া পদের যে রূপ দ্বারা কোনো কাজ করা বা হওয়া বোঝায় তাকে ধাতু বলে। যেমন: খা, পড়্, শো, ধর্, ভাব্, ইত্যাদি। ধাতুর সঙ্গে বিভক্তি যোগ করে ক্রিয়াপদ গঠন করা হয়। ধাতুর সঙ্গে বিভক্তি যোগ করার আগে ধাতুর শেষে যে স্বরধ্বনি যুক্ত হয় তাকে ধাতুর বিকরণ বলে। বিকরণ ধাতুর শেষে যুক্ত হয়ে ধাতুর রূপ পরিবর্তন করে। যেমন: খা + ও = খাও, পড়্ + ই = পড়ি, শো + ও = শোও, ধর্ + ই = ধরি, ভাব্ + ই = ভাবি, ইত্যাদি।

৫) সমাস: "দুই বা ততোধিক পদ একত্রে মিলিত হয়ে নতুন একটি পদ গঠন করে এবং নতুন পদটি যে অর্থ প্রকাশ করে তার পূর্বে পদগুলি যে অর্থ প্রকাশ করে তাকে সমাস বলে।" সমাস বিগ্রহ করে পদগুলির মধ্যে যে সম্পর্ক দেখা যায় তার ভিত্তিতে সমাসকে ছয়টি ভাগে ভাগ করা হয়েছে। যেমন: তৎপুরুষ, কর্মধারয়, দ্বিগু, দ্বন্দ্ব, বহুব্রীহি ও অব্যয়ীভাব। নিম্নে সমাসের প্রকারভেদ ও উদাহরণ দেওয়া হলো:

সমাসের নাম	সমাসবিগ্রহ	সমস্যপদ
তৎপুরুষ	যার পর যার	যাপর
কর্মধারয়	যে ধারা যে	যেধা
দ্বিগু	যে ধারা যে	যেধা
দ্বন্দ্ব	যে ধারা যে	যেধা
বহুব্রীহি	যে ধারা যে	যেধা
অব্যয়ীভাব	যে ধারা যে	যেধা

" " " "

ક) વસ્તાર વિષે

"ઉપર પ્રમાણેના ઠરાવ !" ઠરાવ પડ્યા પછી પ્રમુખ સાહેબે ઊભા થઈને કહ્યું કે "ઠરાવ પ્રમાણે કામ કરવા માટે કમિટી નીમવાની જરૂર છે. કમિટીમાં કોને કોને લેવા તે વિષે મારી સૂચના એવી છે કે ઠરાવ કરનાર ભાઈ ચંદુલાલ, ટેકો આપનાર ભાઈ ગોકળદાસ, ઉપરાંત ભાઈ ત્રિકમદાસ, ભાઈ ડાહ્યાભાઈ, ભાઈ મોહનલાલ, ભાઈ ગોપાળદાસ, ભાઈ ઝવેરચંદ, ભાઈ ખીમચંદ, ભાઈ મગનલાલ, ભાઈ ભોગીલાલ, ભાઈ ચુની

(૧૬)

૧૬ મુનિ કરુણા કરીને કહ્યું, કુલવૃદ્ધ મને ઉપાડો! કોણ કોણ આવ્યું છે? ત્યારે ગુરુદેવ બોલ્યા, "હે મહાત્મા! આપ ઊભા થાઓ. આપ ઊભા થાઓ. આપ ઊભા થાઓ.

ક્રિયાપદ

(૧૮)

ખાલી જગ્યામાં કૌંસમાં આપેલ યોગ્ય ક્રિયાપદ પસંદ કરીને વાક્ય પૂરું કરો.

૧. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૨. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૩. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૪. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૫. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૬. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૭. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૮. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૯. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

૧૦. ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ (પડ્યો, પડ્યું, પડ્યા) હતો.

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

ખાતે

शिवाजी महाराज के पूर्वज सिसोदिया वंश के राजपूत थे। उनके पूर्वज मेवाड़ के राणा के यहाँ सरदार थे। उनके पूर्वजों में बापा रावल, खुमाण, भर्तृभट्ट, अल्लट, कर्णसिंह, जैत्रसिंह, तेजसिंह, समरसिंह, रत्नसिंह, लक्ष्मसिंह, अजयसिंह, हम्मीर, क्षेत्रसिंह, लाखा, मोकल, कुम्भकर्ण, रायमल, संग्रामसिंह (राणा सांगा), रत्नसिंह, विक्रमादित्य, उदयसिंह, प्रतापसिंह, अमरसिंह, कर्णसिंह, जगतसिंह, राजसिंह, जयसिंह, अमरसिंह, संग्रामसिंह, जगतसिंह, प्रतापसिंह, राजसिंह, अरिसिंह, हम्मीर, भीमसिंह, जवानसिंह, सरदारसिंह, स्वरूपसिंह, शम्भुसिंह, सज्जनसिंह, फतहसिंह, भूपालसिंह, महाराणा श्री भोपालसिंह जी साहब बहादुर, जी.सी.एस.आई., जी.सी.वी.ओ., जी.बी.ई., के.सी.आई.ई., एल.एल.डी., डी.सी.एल., महाराणा, मेवाड़ राज्य।

शिवाजी महाराज के पूर्वज सिसोदिया वंश के राजपूत थे। उनके पूर्वज मेवाड़ के राणा के यहाँ सरदार थे। उनके पूर्वजों में बापा रावल, खुमाण, भर्तृभट्ट, अल्लट, कर्णसिंह, जैत्रसिंह, तेजसिंह, समरसिंह, रत्नसिंह, लक्ष्मसिंह, अजयसिंह, हम्मीर, क्षेत्रसिंह, लाखा, मोकल, कुम्भकर्ण, रायमल, संग्रामसिंह (राणा सांगा), रत्नसिंह, विक्रमादित्य, उदयसिंह, प्रतापसिंह, अमरसिंह, कर्णसिंह, जगतसिंह, राजसिंह, जयसिंह, अमरसिंह, संग्रामसिंह, जगतसिंह, प्रतापसिंह, राजसिंह, अरिसिंह, हम्मीर, भीमसिंह, जवानसिंह, सरदारसिंह, स्वरूपसिंह, शम्भुसिंह, सज्जनसिंह, फतहसिंह, भूपालसिंह, महाराणा श्री भोपालसिंह जी साहब बहादुर, जी.सी.एस.आई., जी.सी.वी.ओ., जी.बी.ई., के.सी.आई.ई., एल.एल.डी., डी.सी.एल., महाराणा, मेवाड़ राज्य।

ઉપર મુજબ ઠરાવ કરવામાં આવ્યો છે. તે ઠરાવ મુજબ ઉપરોક્ત
મિલકતો પૈકી ગામ ચોરવાડ તા. માણાવદર જિ. જુનાગઢ ની
સીમની ખરાબાની જમીન સર્વે નં. ૧૦૦૦ પૈકી ૧ વાળી જમીન
હે. ચો. મી. ૧૦૦૦૦ ચો. મી. ની જમીન ઉપર ચોરવાડ
મુસ્લિમ કબ્રસ્તાન ટ્રસ્ટ તરીકે ઓળખાતું ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરવા
તથા ટ્રસ્ટ ડીડ તૈયાર કરવા તથા ટ્રસ્ટ ડીડ રજીસ્ટર્ડ કરવા
તથા ટ્રસ્ટ ડીડ રજીસ્ટર્ડ કરવા માટે ટ્રસ્ટીઓ તરીકે
નીચે જણાવેલ ટ્રસ્ટીઓ નીમવા તથા ટ્રસ્ટીઓ તરીકે
નીમવામાં આવેલ ટ્રસ્ટીઓ પૈકી કોઈ ટ્રસ્ટી ગુજરી જાય
અથવા રાજીનામું આપે અથવા ટ્રસ્ટી તરીકે કામ કરવા
અશક્ત બને અથવા ટ્રસ્ટી તરીકે કામ કરવા ગેરલાયક
ઠરે તો તેની જગ્યાએ નવા ટ્રસ્ટીઓ નીમવા તથા
ટ્રસ્ટીઓ તરીકે નીમવામાં આવેલ ટ્રસ્ટીઓ પૈકી કોઈ
ટ્રસ્ટી ગુજરી જાય અથવા રાજીનામું આપે અથવા
ટ્રસ્ટી તરીકે કામ કરવા અશક્ત બને અથવા ટ્રસ્ટી
તરીકે કામ કરવા ગેરલાયક ઠરે તો તેની જગ્યાએ
નવા ટ્રસ્ટીઓ નીમવા તથા ટ્રસ્ટીઓ તરીકે નીમવામાં
આવેલ ટ્રસ્ટીઓ પૈકી કોઈ ટ્રસ્ટી ગુજરી જાય અથવા

ઉપરોક્ત વિષય અંગે જણાવવાનું કે, મારા પિતાશ્રી [illegible] ની [illegible] ખાતે આવેલ [illegible] ની [illegible] ખાતે આવેલ [illegible] ની [illegible] ખાતે આવેલ

અમારા પ્રતાપી પૂર્વજો કરતા ઓછી ઉંમરના કોઈ વ્યક્તિને "ભાઈ" કહેવાનો રિવાજ હતો. આજે આપણે ત્યાં "ભાઈ" શબ્દ ઘણો વ્યાપક બની ગયો છે. પોતાના પિતા કરતાં મોટી ઉંમરની વ્યક્તિને પણ આપણે "ભાઈ" કહીએ છીએ. ઉપરાંત સમાજમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને "ભાઈ" કહીને સંબોધી શકે છે. આ શબ્દ પ્રયોગ પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો હોય એવું મને લાગતું નથી. પરંતુ

ખાસ ખબરદાર કરવામાં આવે છે કે કોઈ પણ માણસ પોતાની જમીન મકાન, બાગાયત ખેતીવાડી કે બીજી કોઈ પણ જાતની મિલકત ઉપર કોઈ પણ જાતનો બોજો કે હક્ક ઊભો કરવા માંગતા હોય તો તેણે આ નોટીસ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસની અંદર પોતાનો હક્ક લેખિત પુરાવા સાથે રજુ કરવો. જો તે મુદ્દત દરમિયાન કોઈ પણ જાતનો હક્ક રજુ કરવામાં નહિ આવે તો તેવા હક્કો જતા કર્યા છે એમ ગણવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ જાતનો હક્ક ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

સહી/-

(ભાટ)

આ નોટીસ ગામના ચોરા ઉપર તા. ૨૨/૧૨/૨૦૧૨ ના રોજ ચોટાડવામાં આવી છે.

તા. ૨૨/૧૨/૨૦૧૨ ના રોજ ચોરા ઉપરથી ઉતારી લેવામાં આવી છે.

(101)

ચોથો પાઠ (ક્રિયાપદ)

ક્રિયાપદ : જે શબ્દ કોઈ કામ કરવું કે થવું બતાવે તેને ક્રિયાપદ કહે છે.

ક્રિયાપદ બે પ્રકારનાં હોય છે : (૧) સકર્મક ક્રિયાપદ (૨) અકર્મક ક્રિયાપદ

(૧) સકર્મક ક્રિયાપદ : જે ક્રિયાપદ સાથે કોઈ કર્મ જોડાયેલું હોય તેને સકર્મક ક્રિયાપદ કહે છે.

(૨) અકર્મક ક્રિયાપદ : જે ક્રિયાપદ સાથે કોઈ કર્મ જોડાયેલું ન હોય તેને અકર્મક ક્રિયાપદ કહે છે.

ઉદાહરણ :- રમેશ રમતો હતો. ત્યારે રમેશ કોણ ? રમતો હતો શું ? રમતો હતો ક્યારે ? રમતો હતો કેવો ? રમતો હતો ક્યાં ? રમતો હતો કોણ ? રમતો હતો કેમ ? રમતો હતો કેટલો ? રમતો હતો કેટલી ? રમતો હતો કેટલું ? રમતો હતો કેટલાં ? રમતો હતો કેટલા ? રમતો હતો કેટલાંક ? રમતો હતો કેટલાંક ? રમતો હતો કેટલાંક

ગીત ૬ ગુજરાત મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહંમદ અલી ઝીણા ૧૯૪૬ના ઓગસ્ટની ૧૬મી તારીખે ડાયરેક્ટ એક્શન ડે તરીકે ઉજવવા લીગના કાર્યકરોને આદેશ આપ્યો હતો. કલકત્તામાં આ દિવસે ભારે હિંસા ફાટી નીકળી હતી. ૪૮ કલાકમાં ૫૦૦૦ માણસો માર્યા ગયા હતા અને ૧૫૦૦૦ ઘવાયા હતા. ત્યારબાદ ઑક્ટોબરમાં નોઆખલીમાં હિંદુઓ પર મુસ્લિમોએ ભારે અત્યાચાર કર્યા હતા. ગાંધીજી ત્યાં ગયા અને ૪ માર્ચ ૧૯૪૭ સુધી ત્યાં રહ્યા હતા. ગાંધીજીએ નોઆખલીમાં ૧૧૭ માઈલની પદયાત્રા કરી હતી. ગાંધીજીએ ત્યાં ૧૭ જાહેરસભાઓ સંબોધી હતી. ગાંધીજીએ ત્યાં ૧૫૫ ગામોની મુલાકાત લી

১) হাতের কাছ থেকে ২) খুব দ্রুত।

যে ছোট ঘর বা জায়গায় কিছু রাখার জন্য তৈরি করা হয় তাকে কী বলে?

যে ঘরে রান্না করা হয় তাকে কী বলে?

যে ঘরে বসে পড়াশোনা করা হয় তাকে কী বলে?

যে ঘরে বসে বিশ্রাম নেওয়া হয় তাকে কী বলে?

যে ঘরে বসে খাওয়া হয় তাকে কী বলে?

যে ঘরে ঘুমানো হয় তাকে কী বলে?

যে ঘরে বসে গল্প

ઉદાહરણ :- ઉપર મુજબ દસ્તાવેજ તૈયાર કરો. પક્ષકારો પોતે જ સહી કરવા આવ્યા છે. સાક્ષીઓ તરીકે મોહનભાઈ ગોપાલભાઈ પટેલ (રહે. ગોકુલધામ સોસાયટી, રાજકોટ) અને કિશોરભાઈ ભીખાભાઈ ચૌહાણ (રહે. ૧૫, શાંતિનગર, રાજકોટ) હાજર છે. બંને સાક્ષીઓ પોતાની ઓળખ માટે આધારકાર્ડ રજૂ કરે છે.

દસ્તાવેજ તૈયાર કરવાની રીત :-

(૧) સૌ પ્રથમ દસ્તાવેજ કયા પ્રકારનો છે તે નક્કી કરવું. અહીં "બક્ષિસપત્ર" છે એ સ્પષ્ટ રીતે લખવું.

(૨) દસ્તાવેજ કરનાર પક્ષકાર (બક્ષિસ આપનાર) અને જેના તરફેણમાં દસ્તાવેજ થાય છે તે પક્ષકાર (બક્ષિસ મેળવનાર) બંનેના પૂરા નામ, સરનામા અને ઓળખ વિગતો લખવી.

(૩) મિલકતનું વર્ણન એવી રીતે કરવું કે તે મિલકત બીજી કોઈ મિલકતથી સહેલાઈથી અલગ પડી શકે. ચતુઃસીમા (ચાર હદ) સ્પષ્ટ રીતે લખવી.

(૪) બક્ષિસ આપવાનું કારણ અને સંજોગો ટૂંકમાં જણાવવા.

(૫) બક્ષિસ સ્વીકારવામાં આવ્યાનો ઉલ્લેખ કરવો.

(૬) સાક્ષીઓની સહી અને ઓળખ વિગતો લેવી.

(૭) દસ્તાવેજ પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવી અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ કરાવવો.

(1)

ઈ.સ. ૨૦૧૬ માં ૨૦૧૭ ની સરખામણીમાં ૨૦૧૭ માં ૨૦૧૬ કરતાં ૧૦૦ ટકા વધારે વરસાદ પડ્યો હોય તો ૨૦૧૭ માં ૨૦૧૬ કરતાં ૨૦૦ ટકા વધારે વરસાદ પડ્યો કહેવાય. આ વાક્યમાં ૨૦૧૬ અને ૨૦૧૭ ની સરખામણી કરવામાં આવી છે

ક) નમૂનો ભરી રજૂ કરો :

(ક) નીચેના ૨ પ્રશ્નોના ઉત્તર આપો.

૧ નીચે આપેલ ફકરાનું વાંચન કરી તેના પર આધારિત પ્રશ્નોના ઉત્તર આપો. ૧૦

ગુજરાતી ભાષા એ ભારતની સમૃદ્ધ ભાષાઓમાંની એક ભાષા છે. ગુજરાતી ભાષા બોલનારા લોકો ગુજરાત રાજ્યમાં વસે છે. ગુજરાતી ભાષા બોલનારા લોકો ગુજરાત રાજ્ય ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ

ઉપરોક્ત કેસમાં ફરિયાદી મુસ્લિમ ધર્મ પાળે છે અને તેણે પોતાની પત્ની વિરુદ્ધ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી છે. ફરિયાદીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેણે પોતાની પત્ની સાથે ૧૯૮૫માં નિકાહ કર્યા હતા. તેમને બે સંતાનો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે તેની પત્ની તેની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરતી હોવાથી તે પોતાનું ઘર છોડીને જતી રહી છે. ફરિયાદીએ પોતાની પત્ની પાસે પરત આવવા માટે ઘણી વખત વિનંતી કરી હોવા છતાં તેની પત્ની પરત આવવા તૈયાર નથી. ફરિયાદીનું કહેવું છે કે તેની પત્ની પોતાની મરજીથી તેને છોડીને જતી રહી છે. ફરિયાદીએ પોતાની પત્ની પાસે પોતાની સાથે રહેવા

ક્રમ વિષય ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪

मुलाकात करने आया। अरोड़ा साहब ने अपने पास बैठे हुए एक सज्जन से उनका परिचय कराया। वे सज्जन "दिनेश" कार्यालय के सम्पादक थे। उन्होंने मेरा परिचय पाकर मुझसे कुछ प्रश्न पूछे। मैंने उनके उत्तर दिये। इसके बाद वे अपने कार्यालय में चले गये। मैं अरोड़ा साहब के साथ बैठा रहा। उनसे कई विषयों पर बातचीत होती रही। उनके व्यवहार से मुझे बड़ी प्रसन्नता हुई। उन्होंने मुझे अपने घर पर आने का निमन्त्रण दिया। मैंने उनका धन्यवाद किया और उनसे विदा ली।

शाम को मैं अपने कमरे में बैठा हुआ था। तभी मेरे एक मित्र आ गये। उनके साथ एक और सज्जन थे। मित्र ने उनका परिचय कराया। वे सज्जन "दिनेश" कार्यालय के सम्पादक निकले। मैं आश्चर्य में पड़ गया। मैंने उनसे पूछा कि क्या वे वही सज्जन हैं जिनसे मैं आज मिला था। उन्होंने उत्तर दिया कि हाँ वही हैं। मैंने उनसे क्षमा माँगी कि मैंने उन्हें पहचाना नहीं। उन्होंने कहा कि कोई बात नहीं। फिर हम लोग इधर-उधर की बातें करने लगे। उन्होंने मुझसे कहा कि मैं उनके कार्यालय में आऊँ। मैंने उनसे कहा कि मैं अवश्य आऊँगा। फिर वे चले गये।

"ਸਾਡੇ ਕੋਲ ਤੁਹਾਡੇ ਦਾ ਦੇਸ਼ਮੁਖ ਦੀ ਕਾਰਵਾਈ ਦੀ ਕਾਪੀ ਹੈ ਜੋ ਤੁਸੀਂ ਕੱਲ੍ਹ ਦਿੱਤੀ ਸੀ, ਉਸ ਵਿੱਚ ਤੁਸੀਂ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਕੱਲ੍ਹ ਸਵੇਰੇ ਸਾਢੇ ਦਸ ਵਜੇ ਤੋਂ ਸਾਢੇ ਗਿਆਰਾਂ ਵਜੇ ਤੱਕ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਸੀ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ। ਤੁਸੀਂ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਉਸ ਸਮੇਂ ਦੌਰਾਨ ਸੁਰਿੰਦਰ ਕੌਰ ਦੇ ਘਰ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਗਏ।

ઈ.સ. ૧૯૭૯ ના માર્ચ મહિનાની ૨૭ મી તારીખે સાંજના ૭ વાગ્યે ગામના ચોરામાં ગામ આખું ભેગું થયું હતું. ગામના સરપંચ શ્રી ભીખાભાઈ પટેલ અધ્યક્ષસ્થાને હતા. ગામના ૩૫૦ પુરુષો અને ૧૨૦ સ્ત્રીઓ હાજર હતી. ગામમાં ૪૨ કુટુંબો છે. ગામની વસ્તી ૨૧૦૦ છે. ગામમાં પ્રાથમિક શાળા છે. ગામમાં ૩ કૂવા છે. ગામમાં ૨ હેન્ડપંપ છે. ગામમાં ૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. ગામમાં ૧ પોસ્ટ ઓફિસ છે. ગામમાં ૧ સહકારી મંડળી છે. ગામમાં ૧ દૂધ ડેરી છે. ગામમાં ૧ વાચનાલય છે. ગામમાં ૧ પુસ્તકાલય છે. ગામમાં ૧ રમતનું મેદાન છે. ગામમાં ૧ સ્મશાન છે. ગામમાં ૧ કબ્રસ્તાન છે. ગામમાં ૧ ઈદગાહ છે. ગામમાં ૧ મસ્જિદ છે. ગામમાં ૧ મંદિર છે. ગામમાં ૧ ચર્ચ છે. ગામમાં ૧ ગુરુદ્વારા છે. ગામમાં ૧ જૈન દેરાસર છે. ગામમાં ૧ બૌદ્ધ વિહાર છે. ગામમાં ૧ પારસી અગિયારી છે. ગામમાં ૧ યહૂદી સિનેગોગ છે. ગામમાં ૧ બહાઈ મંદિર છે. ગામમાં ૧ શીખ

(ख) सुरेश ने अपने पिताजी को पत्र लिखकर अपने मित्र के जन्मदिन पर आने के लिए आमंत्रित किया है। पत्र लिखिए।

प्रिय मित्र सुरेश,

सप्रेम नमस्ते,

मेरे जन्मदिन पर तुम्हारा आना मेरे लिए बहुत ही खुशी की बात होगी। मैं तुम्हारे आने की प्रतीक्षा करूँगा। आशा है तुम अवश्य आओगे।

तुम्हारा मित्र,
अमित

(ग) अपने पिताजी को पत्र लिखकर अपने विद्यालय में पढ़ाई की उचित व्यवस्था न होने की शिकायत करते हुए अपने गाँव के विद्यालय में पढ़ाई की उचित व्यवस्था करने का अनुरोध कीजिए।

सेवा में,
श्रीमान जी,
सादर प्रणाम,

मैं आपका पुत्र हूँ। मैं आपको यह पत्र लिखकर अपने विद्यालय की पढ़ाई की उचित व्यवस्था न होने की शिकायत करता हूँ। मैं आपसे अनुरोध करता हूँ कि आप मेरे गाँव के विद्यालय में पढ़ाई की उचित व्यवस्था करें।

आपका आज्ञाकारी पुत्र,
रमेश

(ભાગ)

ઉપરોક્ત ટેસ્ટ ૨ પ્રમાણે ઉપરોક્ત ટેસ્ટ ૧ ના

(ङ) दस्तावेज़

दस्तावेज़ की प्रस्तुति के समय दस्तावेज़ लेखक/दस्तावेज़ लेखक के प्रतिनिधि को दस्तावेज़ पर हस्ताक्षर करने होते हैं। यदि दस्तावेज़ लेखक/दस्तावेज़ लेखक के प्रतिनिधि द्वारा दस्तावेज़ पर हस्ताक्षर करने से इंकार किया जाता है तो दस्तावेज़ लेखक/दस्तावेज़ लेखक के प्रतिनिधि के हस्ताक्षर प्राप्त करने के लिए दस्तावेज़ को न्यायालय के समक्ष प्रस्तुत किया जाता है। न्यायालय के समक्ष दस्तावेज़ की प्रस्तुति के समय दस्तावेज़ लेखक/दस्तावेज़ लेखक के प्रतिनिधि को न्यायालय द्वारा शपथ दिलाई जाती है कि वह न्यायालय के समक्ष सत्य कथन करेगा/करेगी। इसके पश्चात् दस्तावेज़ लेखक/दस्तावेज़ लेखक के प्रतिनिधि से न्यायालय द्वारा पूछा जाता है कि क्या दस्तावेज़ पर हस्ताक्षर उसके द्वारा किए गए

(ঘ) কোন কোন ক্ষেত্রে ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অক্ষম হতে পারে। এমন ক্ষেত্রে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়। প্রতিনিধি নিয়োগ করা হয় দুটি কারণে। প্রথমত, যখন কোন ব্যক্তি নাবালক বা পাগল হয়। দ্বিতীয়ত, যখন কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক হয়। এই দ্বিতীয় ক্ষেত্রে প্রতিনিধি নিয়োগ করা হয় আদালতের মাধ্যমে। আদালত কোন ব্যক্তিকে তার অধিকার প্রয়োগ করতে অনিচ্ছুক বলে ঘোষণা করলে তার পক্ষে অন্য কোন ব্যক্তি তার অধিকার প্রয়োগ করতে পারে। এমন ব্যক্তিকে ঐ অধিকারের প্রতিনিধি বলা হয়।

(ঙ) ব্যক্তি অধিকার ও সমাজ

(ક્રમશઃ)

૧૬ " ૩૫ ૧૯૫૨ ૧૮

પ્રતિ,
મેનેજર સાહેબશ્રી,
ધી ગુજરાત કોમર્શિયલ કોર્પોરેશન લિ.,
ગોધરા.

વિષય:- ટ્રાન્સફર ઓફ ફ્રી હોલ્ડ પ્લોટ નં. ૧૭૫ ટી.પી. સ્કીમ નં. ૧૦ ગોધરા ખાતે આવેલ પ્લોટ ટ્રાન્સફર કરવા બાબત.

સાહેબશ્રી,

ઉપરોક્ત વિષયમાં જણાવવાનું કે, આપની કંપનીએ ગોધરા ટી.પી. સ્કીમ નં. ૧૦ ના ફાઈનલ પ્લોટ નં. ૧૭૫ ની જાહેર હરાજીમાં રૂ. ૨૫,૦૦૦/- (અક્ષરે પચીસ હજાર પૂરા) ની બોલી બોલી હતી. આ બોલી આપની કંપનીના ડિરેક્ટર શ્રી મનસુખલાલ ચુનીલાલ ગાંધીએ તા. ૧૨/૦૫/૧૯૫૨ ના રોજ મંજૂર કરવામાં આવી હતી. આ પ્લોટની કુલ કિંમત પૈકી રૂ. ૫,૦૦૦/- (અક્ષરે પાંચ હજાર પૂરા) આપની કંપની તરફથી તા. ૧૫/૦૫/૧૯૫૨ ના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હતા. બાકીની રકમ રૂ. ૨૦,૦૦૦/- (અક્ષરે વીસ હજાર પૂરા) પૈકી રૂ. ૧૦,૦૦૦/- (અક્ષરે દસ હજાર પૂરા) આપની કંપની તરફથી તા. ૨૫/૦૬/૧૯૫૨ ના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હતા. બાકીની રકમ રૂ. ૧૦,૦૦૦/- (અક્ષરે દસ હજાર પૂરા) આપની કંપની તરફથી તા. ૩૦/૦૯/૧૯૫૨ ના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હતા. આમ આપની કંપની તરફથી પ્લોટની કુલ કિંમત પૈકી રૂ. ૨૫,૦૦૦/- (અક્ષરે પચીસ હજાર પૂરા) ભરપાઈ કરવામાં આવ્યા છે.

આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીના ડિરેક્ટર શ્રી મનસુખલાલ ચુનીલાલ ગાંધીએ તા. ૦૫/૧૦/૧૯૫૨ ના રોજ અરજી કરી હતી. તે અરજી અનુસંધાને આપની કંપનીને જણાવવાનું કે, આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ નીચે મુજબની શરતોનું પાલન કરવું પડશે.

૧. આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ ટ્રાન્સફર ચાર્જીસ પેટે રૂ. ૨૫૦/- (અક્ષરે બસો પચાસ પૂરા) ભરપાઈ કરવાના રહેશે.

૨. આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. ૧૨૫/- (અક્ષરે એકસો પચીસ પૂરા) ભરપાઈ કરવાના રહેશે.

૩. આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. ૧૨૫/- (અક્ષરે એકસો પચીસ પૂરા) ભરપાઈ કરવાના રહેશે.

૪. આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ કુલ રૂ. ૫૦૦/- (અક્ષરે પાંચસો પૂરા) ભરપાઈ કરવાના રહેશે.

૫. આ પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આપની કંપનીએ કુલ રૂ. ૫૦૦/- (અક્ષરે પાંચસો પૂરા) ભરપાઈ કરવાના રહેશે.

ઉદાહરણ ૧૦ "ક્રિયાપદ"

ક્રિયાપદ એટલે એવો શબ્દ જેમાં કંઈક કરવાનો અર્થ થતો હોય, કંઈક થવાનો અર્થ થતો હોય, કોઈ સ્થિતિમાં હોવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ધરાવવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ મેળવવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ આપવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ લેવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ગુમાવવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ શોધવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ખોવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ખરીદવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ વેચવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ચૂકવવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ઉધાર લેવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ઉધાર આપવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ભાડે લેવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ભાડે આપવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ગીરો મૂકવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ ગીરો લેવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ વીમો લેવાનો અર્થ થતો હોય, કોઈ વસ્તુ વીમો

ઉપરોક્ત મિલકત ખરીદવા માટે ઉપરોક્ત સરનામે રહેતા મેસર્સ "પટેલ ટ્રેડર્સ" ના ભાગીદારો તરફથી તેમના અધિકૃત પ્રતિનિધિ તરીકે કામ કરતા શ્રી રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ મગનભાઈ પટેલ, બંને રહે. ૧૨, સરદાર ચોક, નવા બજાર, તા. ધોળકા, જિ. અમદાવાદ, તરફથી તેમના અધિકૃત વકીલ શ્રી હસમુખલાલ ત્રિકમલાલ દવે, બી.એ., એલ.એલ.બી., રહે. ૪૫, ગાંધી ચોક, ધોળકા, તા. ધોળકા, જિ. અમદાવાદ, પિન કોડ ૩૮૭૮૧૦, મોબાઈલ નં. ૯૮૨૪૫ ૬૧૩૦૭, ઈ-મેઈલ hasmukh.dave@gmail.com, તેમજ શ્રી રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ મગનભાઈ પટેલ, બંને રહે. ૧૨, સરદાર ચોક, નવા બજાર, તા. ધોળકા, જિ. અમદાવાદ, તરફથી તેમના અધિકૃત વકીલ શ્રી હસમુખલાલ ત્રિકમલાલ દવે, બી.એ., એલ.એલ.બી., રહે. ૪૫, ગાંધી ચોક, ધોળકા, તા. ધોળકા, જિ. અમદાવાદ, પિન કોડ ૩૮૭૮૧૦, મોબાઈલ નં. ૯૮૨૪૫ ૬૧૩૦૭, ઈ-મેઈલ hasmukh.dave@gmail.com, વચ્ચે તા. ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ થયેલ વેચાણ કરાર મુજબ નક્કી થયેલ રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ લાખ પૂરા) ની કુલ વેચાણ કિંમત પૈકી રૂપિયા ૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પૂરા) ની રકમ વેચાણ કરાર વખતે ચૂકવવામાં આવી હતી. બાકીની રકમ રૂપિયા ૨૪,૭૫,૦૦૦/- (અંકે રૂપિયા ચોવીસ લાખ પંચોતેર હજાર પૂરા) ની રકમ આજે આ દસ્તાવેજની નોંધણી સમયે રોકડા તથા ડ્રાફ્ટ નં. ૦૦૪૨૧૭, તા. ૧૪/૦૩/૨૦૨૩, બેંક ઓફ બરોડા, ધોળકા શાખા પેટે ચૂકવવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.

(૧) "ક્રિયમ ન્ન્ન્

"ઉપર પ્રમાણેના ઠરાવની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે.

"ઠરાવ નં. ૧૦૬૨ : તા. ૧૭-૧૨-૧૯૪૭ : ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૨) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૩) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૪) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૫) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૬) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૭) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૮) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૯) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે." (૧૦) ઠરાવ્યું કે ઉપરના પત્રની નકલ સાથે સ્થિર દરબાર ખાતા ખિજમતે મોકલી આપવા વિનંતી છે."

"यदि [illegible] ह। मन्यसे यदि किञ्चन मयैतत् प्रभुणेति वचो मम
दर्शयात्मानमव्यक्तं मे किमेवं विडम्बसे ॥ ३१ ॥ यदि मन्यसे हे प्रभो मया
एतत् शक्यं द्रष्टुमिति ततो हे योगेश्वर ततो मम त्वं आत्मानं दर्शय
यतो मम एतत् दर्शनं न शक्यं अतः किमर्थं मां विडम्बयसि वञ्चयसि
मायया मोहयसीत्यर्थः । अर्जुनस्य वचनं श्रुत्वा भगवान् तमाह
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः नानाविधानि दिव्यानि
नानावर्णाकृतीनि च ॥ ५ ॥ पश्य मे मम पार्थ रूपाणि शतशः सहस्रशः
अनेकशः नानाविधानि नानाप्रकाराणि दिव्यानि अप्राकृतानि नानावर्णाकृतीनि
नानावर्णानि आकृतयश्च संस्थानविशेषा येषां तानि तथोक्तानि च ॥ ५ ॥
पश्यादित्यान् वसून् रुद्रानश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि
पश्याश्चर्याणि भारत ॥ ६ ॥ पश्यादित्यान् द्वादशसंख्याकान् वसून्
अष्टसंख्याकान् रुद्रानेकादशसंख्याकान् अश्विनौ देवभिषजौ मरुतः
सप्तसंख्याकान् तथा बहूनि अदृष्टपूर्वाणि अन्यैरदृष्टानि आश्चर्याणि
आश्चर्यकराणि हे भारत ॥ ६ ॥ इहैकस्थं जगत् कृत्स्नं पश्याद्य सचराचरं
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥ ७ ॥ इह एकस्थं मम
देहे जगत् कृत्स्नं समस्तं पश्याद्य सचराचरं चराचरसहितं यच्चान्यत्
किञ्चित् द्रष्टुमिच्छसि तत्सर्वं पश्य हे गुडाकेश ॥ ७ ॥ न तु मां शक्यसे
द्रष्टुमनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥ ८ ॥
न तु मां शक्यसे द्रष्टुं अनेनैव स्वकीयेन चक्षुषा दिव्यं ददामि ते तुभ्यं
चक्षुः पश्य मे योगं ईश्वरसम्बन्धिनं सामर्थ्यम् ॥ ८ ॥

ঘ) বর্ণনা কর

૧૬ ઉપરના ૨ પ્રશ્નો પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર લખો. (૧૦)

૧) "ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે." આ વિધાનને ધ્યાનમાં રાખીને ગુરુ-શિષ્યના સંબંધો વિશે તમારા વિચારો વિસ્તારથી લખો.

૨) "ગુરુ વિના જ્ઞાન નહીં." આ વિધાનને ધ્યાનમાં રાખીને ગુરુ-શિષ્યના સંબંધો વિશે તમારા વિચારો વિસ્તારથી લખો.

ज्ञान के अनुसार ही कार्य करना चाहिए। यदि कोई व्यक्ति ज्ञान के विरुद्ध कार्य करता है तो वह अपने कर्तव्य से च्युत हो जाता है। ऐसे व्यक्ति को समाज में सम्मान नहीं मिलता। वह अपने ही मन में अपराधी की भावना से ग्रस्त रहता है। उसका जीवन अशांत और असंतुलित हो जाता है। इसलिए ज्ञान के अनुसार कर्म करना ही श्रेष्ठ है।

"ज्ञानेन हीनाः पशुभिः समानाः" — ज्ञान से रहित मनुष्य पशु के समान है। पशु में विवेक नहीं होता, वह केवल अपनी प्रवृत्तियों के अनुसार चलता है। मनुष्य को ज्ञान इसलिए दिया गया है कि वह अपने जीवन को उच्च बनाए। ज्ञान ही उसे पशुता से ऊपर उठाकर मानवता की ओर ले जाता है। जो व्यक्ति ज्ञान का प्रकाश पाकर भी अंधकार में भटकता है, उससे बड़ा अभागा कौन हो सकता है?

"ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा" — ज्ञान की अग्नि सभी कर्मों को भस्म कर देती है। यहाँ कर्म का अर्थ केवल बुरे कर्म नहीं, बल्कि वे सभी कर्म हैं जो बंधन का कारण बनते हैं। ज्ञान की अग्नि में ये सभी कर्म जलकर राख हो जाते हैं। इसका अर्थ यह नहीं कि ज्ञानी व्यक्ति कर्म नहीं करता, बल्कि वह कर्म करता है पर उनसे बंधता नहीं। वह कर्म करता है पर कर्मफल की आसक्ति से मुक्त रहता है।

"न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते" — ज्ञान के समान पवित्र इस संसार में कुछ भी नहीं है। यह वाक्य ज्ञान की महिमा को सर्वोच्च स्थान पर प्रतिष्ठित करता है। ज्ञान ही वह दीपक है जो अंधकार में प्रकाश फैलाता है, ज्ञान ही वह नौका है जो संसार-सागर से पार लगाती है, ज्ञान ही वह औषधि है जो अज्ञान के रोग को दूर करती है। इसलिए ज्ञान की प्राप्ति ही जीवन का परम लक्ष्य होना चाहिए।

"तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति" — वह ज्ञान योग में सिद्ध हुए व्यक्ति को समय आने पर अपने भीतर स्वयं प्राप्त होता है। यहाँ योग और ज्ञान का संबंध बताया गया है। योग के अभ्यास से चित्त शुद्ध होता है और शुद्ध चित्त में ज्ञान का प्रकाश स्वयं उदित होता है। इसके लिए किसी बाहरी साधन की आवश्यकता नहीं, केवल धैर्य और निरंतर अभ्यास चाहिए।

"श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः" — श्रद्धावान, ज्ञान में तत्पर और इंद्रियों को संयमित रखने वाला व्यक्ति ज्ञान को प्राप्त करता है। यहाँ श्रद्धा को ज्ञान की पहली सीढ़ी बताया गया है। बिना श्रद्धा के ज्ञान की ओर बढ़ना कठिन है। श्रद्धा का अर्थ अंधविश्वास नहीं, बल्कि गुरु और शास्त्र के वचनों पर विश्वास है। इंद्रियों का संयम इसलिए आवश्यक है कि वे मन को बाहर की ओर न खींचें।

"अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति" — अज्ञानी, श्रद्धाहीन और संशयग्रस्त व्यक्ति का विनाश होता है। यह श्लोक ज्ञान के तीन शत्रुओं को बताता है — अज्ञान, अश्रद्धा और संशय। इनमें से संशय सबसे घातक है, क्योंकि संशयग्रस्त व्यक्ति न तो दूसरों पर विश्वास करता है और न अपने ऊपर। वह हमेशा दुविधा में रहता है और कोई निर्णय नहीं ले पाता। ऐसा व्यक्ति कभी भी ज्ञान के फल का आस्वादन नहीं कर सकता।

(10)

ਪੰਜਾਬੀ ਨਿਬੰਧ

ਸਾਹਿਤ ਦੇ ਵਿਸ਼ੇ ਦੇ ਅਨੁਸਾਰ ਨਿਬੰਧ ਦੇ ਕਈ ਭੇਦ ਕੀਤੇ ਜਾਂਦੇ ਹਨ। ਕਿਸੇ ਵਿਸ਼ੇ ਦੇ ਸੰਬੰਧ ਵਿਚ ਆਪਣੇ ਵਿਚਾਰ ਪ੍ਰਗਟ ਕਰਨ ਵਾਲੇ ਨਿਬੰਧ ਨੂੰ ਵਿਚਾਰਾਤਮਕ ਨਿਬੰਧ ਕਹਿੰਦੇ ਹਨ। ਇਸ ਵਿਚ ਲੇਖਕ ਆਪਣੇ ਵਿਚਾਰਾਂ ਨੂੰ ਤਰਕ ਅਤੇ ਦਲੀਲ ਨਾਲ ਸਿੱਧ ਕਰਦਾ ਹੈ। ਵਿਚਾਰਾਤਮਕ ਨਿਬੰਧ ਵਿਚ ਲੇਖਕ ਦੀ ਸ਼ੈਲੀ ਗੰਭੀਰ ਹੁੰਦੀ ਹੈ। ਇਸ ਵਿਚ ਲੇਖਕ ਦੀ ਵਿਦਵਤਾ ਦੇ ਦਰਸ਼ਨ ਹੁੰਦੇ ਹਨ

ਮਨ ਦੇਖਦਾ ਹੈ ਕਿ ਕੋਈ ਵੀ ਸਾਧਨ ਉਸ ਦੀ ਸਹਾਇਤਾ ਨਹੀਂ ਕਰ ਰਿਹਾ, ਤਾਂ ਉਹ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਇਕੱਲਾ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਹੈ। ਇਸ ਇਕੱਲੇਪਣ ਵਿਚ ਉਹ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਬੇਵੱਸ ਅਤੇ ਨਿਰਾਸ਼ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਹੈ। ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਸ ਦੇ ਮਨ ਵਿਚ ਨਿਰਾਸ਼ਾ ਦੀ ਭਾਵਨਾ ਪੈਦਾ ਹੁੰਦੀ ਹੈ। ਇਸ ਨਿਰਾਸ਼ਾ ਦੀ ਭਾਵਨਾ ਵਿਚ ਉਹ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਅਸਹਾਇ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਹੈ। ਉਸ ਨੂੰ ਇਹ ਵੀ ਮਹਿਸੂਸ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਉਸ ਦੇ ਆਲੇ-ਦੁਆਲੇ ਦੇ ਲੋਕ ਉਸ ਦੀ ਮਦਦ ਨਹੀਂ ਕਰ ਰਹੇ। ਉਹ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਇਕੱਲਾ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਹੈ। ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਸ ਦੇ ਮਨ ਵਿਚ ਨਿਰਾਸ਼ਾ ਦੀ ਭਾਵਨਾ ਪੈਦਾ ਹੁੰਦੀ ਹੈ। ਇਸ ਨਿਰਾਸ਼ਾ ਦੀ ਭਾਵਨਾ ਵਿਚ ਉਹ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਬੇਵੱਸ ਅਤੇ ਨਿਰਾਸ਼

"ज्ञान के दीपक"

मुझे लगता है, हमें अपने अंदर झाँकने की कोशिश करनी चाहिए। हर व्यक्ति में कुछ न कुछ अच्छाई होती है, बस उसे पहचानने की ज़रूरत है। कभी-कभी हम दूसरों की गलतियों को तो तुरंत देख लेते हैं, लेकिन अपनी कमियों को अनदेखा कर देते हैं। अगर हम खुद को सुधारने की कोशिश करें, तो शायद दुनिया भी थोड़ी बेहतर हो जाए।

मेरे विचार से, हमें हर दिन कुछ नया सीखने की कोशिश करनी चाहिए। चाहे वह किताबों से हो, अनुभवों से हो या फिर लोगों से। ज्ञान ही वह दीपक है जो अंधकार को दूर कर सकता है। इसलिए, हमें कभी भी सीखना बंद नहीं करना चाहिए।

धन्यवाद

૬ ઉપકલમ ૨ ઉપયોગ

ઉપકલમ ૨ ના ઉપયોગ નીચે પ્રમાણે છે.

૧) કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈપણ પ્રકારની ભેટ, દેણગી, દાન કે ફાળો સ્વીકારવા માટે આ કલમ ૨ ના પેટા કલમ ૧ ની જોગવાઈ મુજબ પરવાનગી મેળવવી ફરજીયાત છે.

૨) પરવાનગી મેળવવા માટે કરવાની અરજી :- ઉપકલમ ૧ હેઠળ પરવાનગી મેળવવા માટે અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની રીત, તેની સાથે રજૂ કરવાના દસ્તાવેજો અને તેની સાથે ભરવાની ફી વગેરે બાબતો નિયમો દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રમાણે રહેશે.

૩) પરવાનગી આપવા અંગે :- આવી અરજી મળ્યા પછી, અરજદાર વ્યક્તિ કે સંસ્થાની પૂરતી તપાસ કર્યા પછી, તેમજ અરજદાર વ્યક્તિ કે સંસ્થાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા પછી, જો તેમ કરવું જરૂરી જણાય તો, અરજદાર વ્યક્તિ કે સંસ્થાને પરવાનગી આપવા અંગે કે પરવાનગી આપવાનો ઇન્કાર કરવા અંગે, કારણો નોંધીને, હુકમ કરશે.

૪) પરવાનગી આપવાનો ઇન્કાર કરવા અંગે :- પેટા કલમ ૩ હેઠળ પરવાનગી આપવાનો ઇન્કાર કરવામાં આવે તો, અરજદાર વ્યક્તિ કે સંસ્થા, આવો હુકમ કરવામાં આવ્યો હોય તે તારીખથી ૩૦ દિવસની અંદર, તે હુકમ સામે અપીલ કરવા માટે, કલમ ૧૦ હેઠળ નિમવામાં આવેલ અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે.

૫) પરવાનગી રદ કરવા અંગે :- આ કલમ હેઠળ પરવાનગી મેળવનાર વ્યક્તિ કે સંસ્થા, પરવાનગીની શરતોનો ભંગ કરે તો, પરવાનગી આપનાર અધિકારી, તેવી વ્યક્તિ કે સંસ્થાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા પછી, પરવાનગી રદ કરી શકશે.

૬) અપીલ :- આ કલમ હેઠળ પરવાનગી આપવાનો ઇન્કાર કરવા અંગે, અથવા પરવાનગી રદ કરવા અંગે, અપીલ અધિકારીનો હુકમ અંતિમ રહેશે.

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે રજૂ થયેલ પુરાવા તથા બંને પક્ષકારોની દલીલો ધ્યાને લેતાં આ કામે ફરિયાદી પક્ષ તરફે રજૂ થયેલ મૌખિક પુરાવા તથા ડૉક્ટરની જુબાની ધ્યાને લેતાં

"કેસર"

ગામ : તાલુકો : જીલ્લો : પીન કોડ નંબર :

તા.૧૫/૦૩/૨૦૨૪

પ્રતિ,
શ્રી મનસુખભાઈ ગોપાલભાઈ ભાલોડીયા
(કેસર મેસર્સ ભાલોડીયા ટ્રેડીંગ કંપની)
૧૦૧, ગોપાલ કોમ્પ્લેક્ષ, ગોંડલ રોડ,
રાજકોટ

વિષય : ૧૫ કિલો કેસર કેરી પાર્સલ મોકલવા બાબત.

મહાશય,

આપની જાહેરાત વાંચી આપની પાસેથી કેસર કેરી ખરીદવાની ઈચ્છા છે. તો ૧૫ કિલો કેસર કેરી પાર્સલ મોકલવા વિનંતી. કેરી ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. કેરી મોકલવા માટે પાર્સલ ખર્ચ તથા કેરીની કિંમત અમારે કેટલી ચૂકવવી તે જણાવવા વિનંતી.

આપનો વિશ્વાસુ,
મનસુખ ગોપાલ

(10)

ઉપરોક્ત ઘટનાના સાક્ષી તરીકે ફરિયાદી તથા અન્ય બે વ્યક્તિઓ હાજર હતા. આરોપીએ ફરિયાદીને ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે તું ફરિયાદ પાછી ખેંચી લે નહીં તો તને જીવતો નહીં છોડું. આ બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીએ ફરિયાદીના ઘરે જઈને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી

ઉપર

ઉપર મુજબની મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો બોજો, ભાર, ગીરો, ટાંચ, ખરીદ-વેચાણ, ભેટ, વારસાઈ હક્ક, વહેંચણી, કબજા હક્ક, ભાડા કરાર, લીઝ કરાર, ટ્રસ્ટ, ટ્રસ્ટીશીપ, ટ્રસ્ટ ડીડ, વીલ, કોર્ટ કેસ, કોર્ટ ઓર્ડર, કોર્ટ ઈન્જક્શન, કોર્ટ સ્ટે, કોર્ટ ટાંચ, કોર્ટ રીસીવરશીપ, કોર્ટ ગાર્ડીયનશીપ, કોર્ટ ટ્રસ્ટીશીપ, કોર્ટ ડીક્રી, કોર્ટ ઓર્ડર, કોર્ટ જજમેન્ટ

ન્યાયાધીશ

ઉપરોક્ત સોગંદનામાના કામે ફરિયાદી તરફે વકીલ શ્રી ભરતભાઈ ડાભી હાજર છે. આરોપી (ફરિયાદી) તરફે વકીલ શ્રી મનોજભાઈ પરમાર હાજર છે. આરોપીએ ફરિયાદ સામે કરેલ વાંધા અરજી પર બંને પક્ષકારોની દલીલો સાંભળવામાં આવી. ફરિયાદ પક્ષ તરફે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લેતાં, આ કોર્ટ એવા તારણ પર આવે છે કે આરોપી સામે પ્રથમદર્શી કેસ બનતો હોવાનું જણાય છે. આરોપીએ રજૂ કરેલ વાંધા અરજીમાં કરેલ રજૂઆતો ધ્યાને લેતાં, તેમજ ફરિયાદ પક્ષ તરફે રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લેતાં, આરોપી સામે પ્રથમદર્શી કેસ બનતો હોવાનું જણાય છે. આરોપીએ રજૂ કરેલ વાંધા અરજી નામંજૂર કરવાને પાત્ર છે. આથી આરોપીની વાંધા અરજી નામંજૂર કરવામાં આવે છે.

હુકમ

ઉપરોક્ત વિગતો ધ્યાને લેતાં, આરોપીએ રજૂ કરેલ વાંધા અરજી નામંજૂર કરવામાં આવે છે. આરોપીએ ફરિયાદ પક્ષના સોગંદનામા પર ઊલટતપાસ કરવા માટે આ કામના ફરિયાદી તથા તપાસ અધિકારીને સમન્સ કરવા માટે આ કામના રીડરને હુકમ કરવામાં આવે છે. આ કામે આરોપીને હાજર રાખવા માટે જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે છે. આરોપીએ જામીનપાત્ર વોરંટ પર જામીન મુક્ત થવા માટે રૂ. ૧૫,૦૦૦/- (પંદર હજાર પૂરા) ની રકમના જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા રજૂ કરવાના રહેશે. આરોપી હાજર થાય ત્યારે તેમની ઓળખ માટે તેમના આધારકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. આરોપીએ પોતાનું સાચું સરનામું અને મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે. આરોપીએ પોતાનું સરનામું બદલાય તો તે અંગેની જાણ કોર્ટને કરવાની રહેશે. આરોપીએ પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. આરોપીએ દેશ છોડીને જવું નહીં તેવી બાંહેધરી આપવાની રહેશે. આરોપીએ દર પંદર દિવસે એક વાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે. આરોપીએ કોઈપણ સાક્ષીનો સંપર્ક કરવો નહીં કે તેમને ધાકધમકી આપવી નહીં. આરોપીએ પુરાવાનો નાશ કરવો નહીં કે તેમાં ચેડાં કરવાં નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને જવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરવો નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું રહેઠાણ બદલવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનો મોબાઈલ નંબર બદલવો નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું બેંક ખાતું બંધ કરવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું વાહન વેચવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાની મિલકત વેચવી નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું નામ બદલવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનો ધર્મ બદલવો નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું લગ્ન કરવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું છૂટાછેડા કરવા નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું બાળક દત્તક લેવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું બાળક દત્તક આપવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું બાળક દત્તક લેવું નહીં. આરોપીએ કોર્ટની પરવાનગી વગર પોતાનું બાળક દત્તક આપવું નહીં.

ઉત્તર

ઉપર જણાવેલ કેસમાં તમારા વતી દાવા કરવા તમારા વકીલ તરીકે રોકવામાં આવેલ છે. તો આ કામે
તમારા તરફથી આ કામના કામ ચલાવવા તથા તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા બધા
કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા બધા કાગળો ઉપર સહી
કરવા તથા તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા બધા કાગળો ઉપર સહી કરવા તથા
તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા બધા કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા
બધા કામો કરવા તથા તેને લગતા બધા કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા બધા કામો
કરવા તથા તેને લગતા બધા કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા બધા કામો કરવા તથા
તેને લગતા બધા કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા
બધા કાગળો ઉપર સહી કરવા તથા તેને લગતા બધા કામો કરવા તથા તેને લગતા બધા કાગળો

ઉપરોક્ત કેસમાં ફરિયાદી (જે મૃતકના પુત્ર છે) તથા સાક્ષી નં.૨ જે મૃતકના ભત્રીજા થાય છે તેમની જુબાની ધ્યાને લેતા આ કામના આરોપીએ મૃતક સાથે અગાઉ ઝઘડો કરેલ હોય અને તે બાબતનો ખાર રાખી આ કામના આરોપીએ મૃતકને ગાળો આપી ધોકા વડે માર મારી ઈજા કરી હોવાનું જણાઈ આવે છે. આ કામના આરોપીએ મૃતકને ઈજા કરવા માટે વાપરેલ ધોકો કબજે કરવા બાકી હોય તેમજ આ કામના આરોપીને ધરપકડ કરવાની બાકી હોય તેમજ આ કામના આરોપીએ ગુનો કરવા માટે વાપરેલ મોટર સાયકલ કબજે કરવા બાકી હોય તેમજ આ કામના આરોપીને ધરપકડ કરવાની બાકી હોય તેમજ આ કામના આરોપીએ ગુનો કરવા માટે વાપરેલ મોટર સાયકલ કબજે કરવા બાકી હોય તેમજ આ કામના આરોપીએ ગુનો કરવા માટે વાપરેલ ધોકો કબજે કરવા બાકી હોય તેમજ આ કામના આરોપીએ ગુનો કરવા માટે વાપરેલ મોટર સાયકલ કબજે કરવા બાકી હોય તેમજ આ કામના આરોપીને ધરપકડ કરવાની

॥ શ્રી ગણેશાય નમઃ ॥

ગામ ઉમરાળા, તા. ઉમરાળા, જિ. ભાવનગર ના રહેવાસી મરણજનાર સ્વ. ભાઈશ્રી ભગવાનજી ઓધવજી ત્રિવેદી (ઉ.વ. ૭૫) તે ગામના જ રહેવાસી સ્વ. ભાઈશ્રી ગોપાલજી ઓધવજી ત્રિવેદી તથા સ્વ. ભાઈશ્રી ગોવિંદ

ઉપરોક્ત નિર્ણયની નકલ સાથે સામેલ કરેલ ઠરાવ મુજબ ગામ નમુના નં. ૭ ની નોંધ પ્રમાણે ખેડૂતોને ખેતી માટે જમીન ફાળવવામાં આવે છે. ખેડૂતોને ફાળવવામાં આવેલ જમીનની નોંધ ગામ નમુના નં. ૭ માં કર

ઉદાહરણ ૬ ગણિત

ઉકેલ: ધારો કે ગણિત વિષયમાં મેળવેલ ગુણ = x

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણ 6 ઓછા છે.

$\therefore$ વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણ = $x - 6$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ઇતિહાસ વિષયમાં મેળવેલ ગુણ 4 વધારે છે.

$\therefore$ ઇતિહાસ વિષયમાં મેળવેલ ગુણ = $x + 4$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ભૂગોળ વિષયમાં મેળવેલ ગુણ 2 વધારે છે.

$\therefore$ ભૂગોળ વિષયમાં મેળવેલ ગુણ = $x + 2$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ચિત્રકામ વિષયમાં મેળવેલ ગુણ 1 વધારે છે.

$\therefore$ ચિત્રકામ વિષયમાં મેળવેલ ગુણ = $x + 1$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં સંસ્કૃત વિષયમાં મેળવેલ ગુણ 3 વધારે છે.

$\therefore$ સંસ્કૃત વિષયમાં મેળવેલ ગુણ = $x + 3$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ 5 વધારે છે.

$\therefore$ અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ = $x + 5$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણ 6 ઓછા છે.

$\therefore$ વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણ = $x - 6$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ઇતિહાસ વિષયમાં મેળવેલ ગુણ 4 વધારે છે.

$\therefore$ ઇતિહાસ વિષયમાં મેળવેલ ગુણ = $x + 4$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ભૂગોળ વિષયમાં મેળવેલ ગુણ 2 વધારે છે.

$\therefore$ ભૂગોળ વિષયમાં મેળવેલ ગુણ = $x + 2$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં ચિત્રકામ વિષયમાં મેળવેલ ગુણ 1 વધારે છે.

$\therefore$ ચિત્રકામ વિષયમાં મેળવેલ ગુણ = $x + 1$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં સંસ્કૃત વિષયમાં મેળવેલ ગુણ 3 વધારે છે.

$\therefore$ સંસ્કૃત વિષયમાં મેળવેલ ગુણ = $x + 3$

ગણિત વિષયમાં મેળવેલ ગુણ કરતાં અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ 5 વધારે છે.

$\therefore$ અંગ્રેજી વિષયમાં મેળવેલ ગુણ = $x + 5$

ક્રમ ઉપરાંત કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ, ટેક્સ, ડ્યુટી વગેરે ચૂકવવાના રહેશે નહીં.

૬. ચુકવણીની શરતો : ૧૦૦% ચુકવણી ડિલિવરી પહેલાં કરવાની રહેશે. ચુકવણી ન થાય ત્યાં સુધી માલની માલિકી વેચનારની રહેશે.

૭. ડિલિવરી : માલ ઓર્ડર મળ્યાના ૧૫ દિવસની અંદર ડિલિવરી કરવાનો રહેશે. ડિલિવરી સમયે માલ ખરાબ થયો હોય તો ૨૪ કલાકની અંદર લેખિત ફરિયાદ કરવી જરૂરી છે.

૮. ગુણવત્તા : માલ ઉત્પાદકના ધોરણો મુજબ હોવો જોઈએ. ખામીવાળો માલ પરત કરવાની જવાબદારી વેચનારની રહેશે.

૯. વોરંટી : માલ ડિલિવરીની તારીખથી ૧૨ મહિના સુધી વોરંટી રહેશે. વોરંટી દરમિયાન ખામી જણાય તો વેચનાર વિનામૂલ્યે રિપેર અથવા રિપ્લેસમેન્ટ કરી આપશે.

૧૦. ફોર્સ મેજર : કુદરતી આપત્તિ, યુદ્ધ, હડતાલ જેવા સંજોગોમાં કોઈપણ પક્ષ જવાબદાર રહેશે નહીં.

૧૧. વિવાદ : આ કરાર સંબંધે કોઈ વિવાદ ઊભો થાય તો તે પરસ્પર સમજૂતીથી ઉકેલવાનો પ્રયત્ન કરવો. ન ઉકેલાય તો ન્યાયક્ષેત્ર રાજકોટ રહેશે.

૧૨. સહી : આ કરાર બંને પક્ષોએ વાંચી, સમજી અને સ્વેચ્છાએ સહી કરી છે.

વેચનાર : _____ ખરીદનાર : _____

"ગુજરાત વિદ્યાપીઠ" દ્વારા સંચાલિત ઉપરોક્ત સંસ્થા ઉપરાંત ગુજરાતમાં બીજી અનેક સંસ્થાઓ ચાલે છે. તેમાં કેટલીક સંસ્થાઓ તો ૨૫-૩૦ વર્ષથી ચાલે છે. આમ છતાં આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને કેટલા પ્રમાણમાં સિદ્ધ કરી શકી છે તે વિશે ઘણા લોકોને શંકા છે. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકી નથી એવો આક્ષેપ કરવામાં આવે છે. આ આક્ષેપ કેટલો સાચો છે તે વિશે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકી નથી એવું માનવાનું કોઈ કારણ નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકી નથી એવું માનવાનું કારણ એ છે કે આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એટલું જ નહીં પણ આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી. આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોનું મૂલ્યાંકન કરવાની કોઈ પદ્ધતિ આપણી પાસે નથી એવું કહેવું પણ યોગ્ય નથી.

ઉપરોક્ત ઠરાવ

ઠરાવ્યું કે ઉપરોક્ત ઠરાવ મુજબ ગામ તળાવ ઉંડું કરવાનું કામ ગ્રામ પંચાયત મારફતે કરાવવા માટે ગ્રામ પંચાયતને સોંપવામાં આવે છે. તે માટે ગ્રામ પંચાયતે તળાવ ઉંડું કરવાનું કામ ટેન્ડર બોલાવી ઓછામાં ઓછા ટેન્ડર મુજબ કરાવવાનું રહેશે. તે માટે ગ્રામ પંચાયતે ટેન્ડર બોલાવવા, ટેન્ડર મંજૂર કરવા, કામ કરાવવા, બીલ ચૂકવવા વગેરે તમામ સત્તા આ ઠરાવથી ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. તે માટે ગ્રામ પંચાયતે જરૂરી તમામ કાર્યવાહી કરવાની રહેશ

ઉપરોક્ત ઠરાવ

ઠરાવ્યું કે, આ સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની સામાન્ય સભા તા. ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ મળે છે. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની હાજરી ૨/૩ થી વધુ હોવાથી સંસ્થાના બંધારણ મુજબ સભાની કાર્યવાહી કાયદેસર ગણાય છે. સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની સામાન્ય સભામાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવે છે.

ઠરાવ્યું કે, સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની સામાન્ય સભામાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સભ્યોની સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવે છે. "આ સંસ્થા ધર્મ દાદા ટ્રસ્ટ, ધર્મ દાદા ટ્રસ્ટ, ધર્મ દાદા ટ્રસ્ટ" ના નામથી ઓળખાશે. આ સંસ્થાનું કાયમી સરનામું ૧૦૧, ધર્મ દાદા ટ્રસ્ટ, ધર્મ દાદા ટ્રસ્ટ, ધર્મ દાદા ટ્રસ્ટ

ક્રિયાપદ

૧) ક્રિયાપદ એટલે જે શબ્દ વાક્યમાં કંઈક કરવું કે થવું સૂચવે તેવા શબ્દને ક્રિયાપદ કહે છે.

ઉદા. ૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૨૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૩૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૪૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૫૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૬૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૭૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૮૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૧) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૨) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૩) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૪) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૫) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૬) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૭) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૮) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૯૯) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

૧૦૦) રમેશ ને - ન - ૨ ૨મ્યો :- રમેશ કરવું ક્રિયા બતાવે છે.

(૧૨)

ઉંદર કરડવાની દવા (ઉંદર મારવાની દવા) બનાવવાની રીત :-

ઘઉંનો જાડો લોટ ૧ કિલો, ખાંડ ૨૫૦ ગ્રામ, ઘી ૧૫૦ ગ્રામ, ગોળ ૨૫૦ ગ્રામ, ઝીંક ફોસ્ફાઈડ ૧૫૦ ગ્રામ, પાણી જરૂર મુજબ, ઘીમાં ગોળ ઓગાળી લેવો. ત્યારબાદ ઝીંક ફોસ્ફાઈડ સિવાયની બધી સામગ્રી ભેગી કરી તેમાં ઝીંક ફોસ્ફાઈડ ઉમેરી સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી રોટલી વણવા જેવો લોટ બાંધવો. ત્યારબાદ તેની નાની નાની રોટલી વણી લેવી. ત્યારબાદ તેને ચપ્પુ વડે ચોરસ ટુકડામાં કાપી લેવી. ત્યારબાદ તેને ઉંદર જ્યાં વધારે આવતા હોય ત્યાં મૂકી દેવી. આ રોટલી ખાવાથી ઉંદર ૨૪ કલાકમાં મરી જાય છે. આ રોટલી ખાધા પછી ઉંદર પાણી પીવે છે જેથી તેનું પેટ ફાટી જાય છે અને ઉંદર મરી જાય છે.

ઉંદર મારવાની દવા (૨) ઉંદર કરડવાની દવા :-

(૧૯૬)

ઉપરોક્ત ફરિયાદ

આમ ફરિયાદી પોલીસ ફરિયાદ લેવા કરતાં અરજી લેવા પ્રેરાય તેવું વર્તન કરતા હોય તેમ જણાય છે. આ ઉપરાંત ફરિયાદી પોતાની ફરિયાદ અરજી સ્વરૂપે આપવા તૈયાર થયા હોય તેવું પણ જણાતું નથી. આમ

૬. મરણ કે જીવન !

ભારતના પ્રાચીન ઋષિ-મુનિઓ કહેતા ગયા છે કે જીવન એ મરણની તૈયારી છે. જે માણસ મરણથી ડરતો નથી તે જીવનમાં ઘણું કરી શકે છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં મરણ એક ભયંકર વસ્તુ બની ગયું છે. મરણનું નામ પડતાં જ આપણે ધ્રૂજી ઊઠીએ છીએ. આપણે મરણથી ડરીએ છીએ. આપણે મરણથી ભાગીએ છીએ. આપણે મરણથી છુપાઈએ છીએ. આપણે મરણથી બચવા માટે ઘણા ઉપાયો પણ કરીએ છીએ. પરંતુ મરણ તો આવવાનું જ છે. મરણ તો આવીને જ રહેવાનું છે. મરણથી કોઈ બચી શકતું નથી. મરણ તો આવે જ છે. મરણ તો આવીને જ રહે છે. મરણ તો આવે જ છે. મરણ તો આવીને જ રહે છે.

મરણ એ જીવનનો અંત નથી. મરણ એ જીવનનો નવો પ્રારંભ છે. મરણ એ જીવનનો નવો અધ્યાય છે. મરણ એ જીવનનો નવો પ્રકાશ છે. મરણ એ જીવનનો નવો માર્ગ છે. મરણ એ જીવનનો નવો ઉદય છે. મરણ એ જીવનનો નવો સૂર્યોદય છે. મરણ એ જીવનનો નવો ચંદ્રોદય છે. મરણ એ જીવનનો નવો તારોદય છે. મરણ એ જીવનનો નવો ઇન્દ્રધનુષ છે. મરણ એ જીવનનો નવો વસંત છે. મરણ એ જીવનનો નવો વર્ષા છે. મરણ એ જીવનનો નવો શરદ છે. મરણ એ જીવનનો નવો હેમંત છે. મરણ એ જીવનનો નવો શિશિર છે.

મરણ એ જીવનનો નવો ઉત્સવ છે. મરણ એ જીવનનો નવો મહોત્સવ છે. મરણ એ જીવનનો નવો આનંદ છે. મરણ એ જીવનનો નવો પરમાનંદ છે. મરણ એ જીવનનો નવો બ્રહ્માનંદ છે. મરણ એ જીવનનો નવો સચ્ચિદાનંદ છે. મરણ એ જીવનનો નવો ઈશ્વર છે. મરણ એ જીવનનો નવો પરમેશ્વર છે. મરણ એ જીવનનો નવો પરમાત્મા છે. મરણ એ જીવનનો નવો ભગવાન છે. મરણ એ જીવનનો નવો પરમ ભગવાન છે.

ખાતે કુદરતી સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાની વચ્ચે આવેલ છે. આ સ્થળ ઉનાળાની ગરમીમાં પણ ઠંડું અને સુખદ વાતાવરણ ધરાવે છે, જેના કારણે અહીં દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. અહીંનું વાતાવરણ એટલું આહ્લાદક છે કે ઘણા લોકો અહીં ઘર બનાવીને કાયમ માટે વસવાટ કરવાનું પસંદ કરે છે. આ સ્થળની ખાસિયત એ છે કે અહીં ચારે બાજુ ઊંચા ઊંચા પર્વતો આવેલા છે, જેના કારણે આ સ્થળ ચારે બાજુથી સુરક્ષિત છે. આ પર્વતો પર ઘણા પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓ જોવા મળે છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ સ્થળની આસપાસ ઘણા નાના-નાના ગામડાઓ પણ આવેલા છે, જ્યાં સ્થાનિક લોકો પોતાની પરંપરાગત જીવનશૈલી જીવે છે. આ ગામડાઓમાં તમને સ્થાનિક હસ્તકલાની વસ્તુઓ, જેમ કે હાથથી બનાવેલા ગરમ કપડાં, ધાબળા અને ઘરેણાં પણ જોવા મળશે. આ સ્થળની મુલાકાત દરમિયાન તમે સ્થાનિક લોકોની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિ વિશે પણ ઘણું બધું જાણી શકો છો. આ સ્થળની મુલાકાત દરમિયાન તમે ટ્રેકિંગ, પર્વતારોહણ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. આ સ્થળ સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે એક આદર્શ સ્થળ છે. આ સ્થળની મુલાકાત દરમિયાન તમે સ્થાનિક લોકોની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિ વિશે પણ ઘણું બધું જાણી શકો છો

(૧૨૮)

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૫ હેઠળ મિલકત સંબંધી ઝઘડાના કિસ્સામાં પ્રતિબંધક હુકમ

ફરિયાદ નંબર : ૨૫/૨૦૨૪ મામલતદાર કચેરી, ઉમરાળા

ઉમરાળા તાલુકાના ગામ ધોળકિયા ખાતે આવેલ સર્વે નંબર ૧૪૨/૧ પૈકી ૧ વાળી જમીનના કબજા બાબતે ફરિયાદી ભીખાભાઈ રામજીભાઈ ધોળકિયા અને સામાવાળા વિનુભાઈ ભીખાભાઈ ધોળકિયા વચ્ચે ઝઘડો ઊભો થયો છે. ફરિયાદીનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરે છે અને સામાવાળા તેમને કબજો લેવા દેતા નથી. આ ઝઘડાને કારણે શાંતિભંગ થવાની સંભાવના હોવાથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદી તરફે વકીલ શ્રી મનસુખભાઈ વાઘેલા અને સામાવાળા તરફે વકીલ શ્રી હરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. બંને પક્ષકારોની રૂબરૂ જુબાની લેવામાં આવી હતી અને રજૂ થયેલા દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. ફરિયાદીએ પોતાના પક્ષે ૭/૧૨ ના ઉતારા, ગામ નમૂના નં. ૮-અ ની નકલ અને પાકની નોંધ રજૂ કરી હતી. સામાવાળાએ પોતાના પક્ષે વેચાણ કરારનો દસ્તાવેજ રજૂ કર્યો હતો.

આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે વિવાદિત જમીન પર ખરેખર કોનો કબજો છે અને શાંતિભંગ થવાની સંભાવના કેટલી ગંભીર છે. ફરિયાદીના કહેવા મુજબ તેઓ ૧૯૮૫ થી સતત આ જમીન પર ખેતી કરે છે અને ૨૦૨૩ ના ચોમાસામાં સામાવાળાએ ટ્રેક્ટર ફેરવીને પાક નુકસાન કર્યું હતું. સામાવાળાનું કહેવું છે કે તેમણે ૨૦૨૩ ના ઉનાળામાં જ આ જમીન ખરીદી લીધી છે અને ફરિયાદી ખોટી રીતે કબજો જમાવવાનો પ્રયાસ કરે છે.

બંને પક્ષકારોની જુબાની અને રજૂ થયેલા દસ્તાવેજોનો વિચાર કરતાં, પ્રથમદર્શી રીતે ફરિયાદીનો કબજો હોવાનું જણાય છે. વેચાણ કરારનો દસ્તાવેજ સામાવાળાના કબજાનો પુરાવો નથી, પરંતુ માત્ર વિવાદ ઊભો થયો હોવાથી આ તબક્કે કાયમી હુકમ કરવો યોગ્ય નથી. જોકે, ૭/૧૨ ના ઉતારામાં ફરિયાદીનું નામ કબજેદાર તરીકે નોંધાયેલું છે, જે તેમના પક્ષે મહત્વનો પુરાવો છે.

આથી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૫ ની પેટા-કલમ (૧) હેઠળ મને પ્રાપ્ત સત્તાની રૂએ, હું આ હુકમ કરું છું કે વિવાદિત જમીન પર કોઈપણ પક્ષકાર દ્વારા કોર્ટના આગામી હુકમ સુધી કોઈ નવું બાંધકામ કરવામાં આવે નહીં અને હાલની સ્થિતિ યથાવત જાળવવામાં આવે. આ હુકમ તા. ૧૫/૦૩/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા તેમાં ફેરફાર કરવામાં ન આવે.

સહી/- ડી. એમ. ચૌહાણ
મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઉમરાળા
તા. ૦૧/૦૩/૨૦૨૪

ધારા ૧૮૬ અન્વયે વ્યવસ્થાપન કમિટી બરોબર ચાલ્યા ન હોવાનું જણાય તો

ધારા ૧૮૭ અન્વયે વ્યવસ્થાપન કમિટીનું વિસર્જન કરી તેના સ્થાને વહીવટદાર

નિમવા બાબત

ઉપરોક્ત વિષય અને સંદર્ભ જણાવવાનું કે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ (સુધારા) અધિનિયમ, ૨૦૧૨ ની કલમ ૧૮૭ અન્વયે રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ આથી આદેશ કરવામાં આવે છે કે, નીચે જણાવેલ પ્રાથમિક શાળાનું સંચાલન કરતી વ્યવસ્થાપન સમિતિ/ટ્રસ્ટ/મંડળ/સોસાયટી/કંપની/સંસ્થા/ટ્રસ્ટ/મંડળ/સોસાયટી/કંપની/સંસ્થા ધારા ૧૮૬ અન્વયે બરોબર ચાલતી ન હોવાનું જણાતા તેનું વિસર્જન કરી તેના સ્થાને વહીવટદાર નિમવા બાબત દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વયે ધારા ૧૮૭ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી આદેશ કરવામાં આવે છે કે, નીચે જણાવેલ પ્રાથમિક શાળાનું સંચાલન કરતી વ્યવસ્થાપન સમિતિ/ટ્રસ્ટ/મંડળ/સોસાયટી/કંપની/સંસ્થા/ટ્રસ્ટ/મંડળ/સોસાયટી/કંપની/સંસ્થા

ના મેં પૂર્વક કે ઉપરોક્ત

અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા ચાલે છે. તેમાં કાપડ ઉદ્યોગ મોખરે છે. કાપડ ઉદ્યોગમાં મોટા પાયા પર કાપડ વણાટ કામ ચાલે છે. તેમાં કાપડ વણાટ કામ કરનારા કારીગરો, મજૂરો, વેપારીઓ, દલાલો, કાપડ ઉપર છાપકામ કરનારા કારીગરો, કાપડ ઉપર ભરતકામ કરનારા કારીગરો, કાપડ ઉપર ઇસ્ત્રી કરનારા કારીગરો, કાપડ ઉપર પેકિંગ કરનારા કારીગરો, કાપડ ઉપર લેબલ મારનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી બાંધનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ઉપાડનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ઉતારનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ચઢાવનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ગોડાઉનમાં મૂકનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ગોડાઉનમાંથી બહાર કાઢનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ટ્રકમાં ચઢાવનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ટ્રકમાંથી ઉતારનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ટ્રકમાં મૂકનારા કારીગરો, કાપડ ઉપર ગાંસડી ટ્રક

૨૭ ઉપવાસ કે ૨૭૦૦ ઉપવાસ

ગામમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ગામના પાદરમાં આવેલા ઘેઘૂર વડલા પર ઘણાં પક્ષીઓ માળા બાંધવા લાગ્યાં. આ પક્ષીઓમાં સૌથી વધુ સંખ્યા હતી ચકલીઓની. સવારથી સાંજ સુધી તેમનો કલરવ ગામના ઘરોમાં સંભળાતો. ગામના ખેડૂતો માટે આ પક્ષીઓ ખૂબ ઉપયોગી હતાં, કારણ કે તેઓ ખેતરમાં ઊગતા નાના જીવજંતુઓ ખાઈને પાકનું રક્ષણ કરતાં.

પરંતુ ઉનાળાના અંતે જ્યારે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું, ત્યારે ગામમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. ઝાડ પરના ઘણા માળા પવનના જોરથી નીચે પડી ગયા. ઘણાં ઈંડાં ફૂટી ગયાં અને નાનાં બચ્ચાં પણ મૃત્યુ પામ્યાં. આ દૃશ્ય જોઈને ગામના બાળકોનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે નક્કી કર્યું કે આ પક્ષીઓ માટે કંઈક કરવું જોઈએ.

આ વિચારને અમલમાં મૂકવા માટે ગામના બાળકોએ એક અનોખો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે તેઓ ૨૭ દિવસ સુધી ઉપવાસ કરશે. આ ઉપવાસ પોતાના માટે નહીં, પરંતુ પક્ષીઓના રક્ષણ માટે હતો. તેમનું માનવું હતું કે જો તેઓ ભૂખ્યા રહીને પક્ષીઓને બચાવી શકે, તો તેમના ઉપવાસ ફળદાયી બનશે.

આ નિર્ણયની જાણ થતાં ગામના વડીલો પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકે બાળકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આટલા નાના બાળકો માટે આટલા લાંબા ઉપવાસ યોગ્ય નથી. પરંતુ બાળકોનો નિશ્ચય અડગ હતો. તેમણે કહ્યું કે તેઓ પોતાની ઇચ્છાથી ઉપવાસ કરશે અને કોઈ પણ રીતે દબાણ કરવામાં આવ્યું નથી.

ઉપવાસ દરમિયાન બાળકોએ ફક્ત પાણી પીધું. તેઓ સવારે વહેલા ઊઠીને ગામની આસપાસ ફરતાં અને પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરતાં. ગામની મહિલાઓએ પણ તેમને સહકાર આપ્યો. કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં પક્ષીઓ માટે ચણ નાખવાની પરવાનગી આપી.

૨૭ દિવસ પૂરા થયા ત્યારે ગામમાં એક અનોખો ઉત્સવ ઊજવાયો. બાળકોના ઉપવાસ પૂરા થયા પછી ગામના વડીલોએ નક્કી કર્યું કે ગામમાં પક્ષીઓ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે. ગામના ચોકમાં એક મોટું પાણીનું કુંડું બનાવવામાં આવ્યું અને ખેતરોમાં ચણ માટે ખાસ જગ્યાઓ નક્કી કરવામાં આવી.

આ ઘટના પછી ગામમાં પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. ચકલીઓ ફરીથી ગામના ઘરોમાં માળા બાંધવા લાગી. બાળકોના આ નાનકડા પ્રયાસે ગામમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મોટો ફાળો આપ્યો. આ ઘટના આજે પણ ગામના વડીલો યુવાનોને યાદ કરાવે છે કે નાના બાળકો પણ મોટું પરિવર્તન લાવી શકે છે.

૨૦ કુલ્લક ને ઉપદેશ

ઉપદેશ આપે છે અને પોતે પોતાના વિષયમાં કોઈ પ્રકારનો પક્ષપાત રાખતા નથી. ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ૮૮ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૨ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૫ ૩૬૬ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૫ ૩૭૬ ૩૭૭ ૩૭૮ ૩૭૯ ૩૮૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ ૪૦૫ ૪૦૬ ૪૦૭ ૪૦૮ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૦ ૪૪૧ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૫ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪૯ ૪૫૦ ૪૫૧ ૪૫૨ ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૦ ૪૬૧ ૪૬૨ ૪૬૩ ૪૬૪ ૪૬૫ ૪૬૬ ૪૬૭ ૪૬૮ ૪૬૯ ૪૭૦ ૪૭૧ ૪૭૨ ૪૭૩ ૪૭૪ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૪૮૧ ૪૮૨ ૪૮૩ ૪૮૪ ૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૮૮ ૪૮૯ ૪૯૦ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૪ ૪૯૫ ૪૯૬ ૪૯૭ ૪૯૮ ૪૯૯ ૫૦૦ ૫૦૧ ૫૦૨ ૫૦૩ ૫૦૪ ૫૦૫ ૫૦૬ ૫૦૭ ૫૦૮ ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૧૨ ૫૧૩ ૫૧૪ ૫૧૫ ૫૧૬ ૫૧૭ ૫૧૮ ૫૧૯ ૫૨૦ ૫૨૧ ૫૨૨ ૫૨૩ ૫૨૪ ૫૨૫ ૫૨૬ ૫૨૭ ૫૨૮ ૫૨૯ ૫૩૦ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૮ ૫૪૯ ૫૫૦ ૫૫૧ ૫૫૨ ૫૫૩ ૫૫૪ ૫૫૫ ૫૫૬ ૫૫૭ ૫૫૮ ૫૫૯ ૫૬૦ ૫૬૧ ૫૬૨ ૫૬૩ ૫૬૪ ૫૬૫ ૫૬૬ ૫૬૭ ૫૬૮ ૫૬૯ ૫૭૦ ૫૭૧ ૫૭૨ ૫૭૩ ૫૭૪ ૫૭૫ ૫૭૬ ૫૭૭ ૫૭૮ ૫૭૯ ૫૮૦ ૫૮૧ ૫૮૨ ૫૮૩ ૫૮૪ ૫૮૫ ૫૮૬ ૫૮૭ ૫૮૮ ૫૮૯ ૫૯૦ ૫૯૧ ૫૯૨ ૫૯૩ ૫૯૪ ૫૯૫ ૫૯૬ ૫૯૭ ૫૯૮ ૫૯૯ ૬૦૦ ૬૦૧ ૬૦૨ ૬૦૩ ૬૦૪ ૬૦૫ ૬૦૬ ૬૦૭ ૬૦૮ ૬૦૯ ૬૧૦ ૬૧૧ ૬૧૨ ૬૧૩ ૬૧૪ ૬૧૫ ૬૧૬ ૬૧૭ ૬૧૮ ૬૧૯ ૬૨૦ ૬૨૧ ૬૨૨ ૬૨૩ ૬૨૪ ૬૨૫ ૬૨૬ ૬૨૭ ૬૨૮ ૬૨૯ ૬૩૦ ૬૩૧ ૬૩૨ ૬૩૩ ૬૩૪ ૬૩૫ ૬૩૬ ૬૩૭ ૬૩૮ ૬૩૯ ૬૪૦ ૬૪૧ ૬૪૨ ૬૪૩ ૬૪૪ ૬૪૫ ૬૪૬ ૬૪૭ ૬૪૮ ૬૪૯ ૬૫૦ ૬૫૧ ૬૫૨ ૬૫૩ ૬૫૪ ૬૫૫ ૬૫૬ ૬૫૭ ૬૫૮ ૬૫૯ ૬૬૦ ૬૬૧ ૬૬૨ ૬૬૩ ૬૬૪ ૬૬૫ ૬૬૬ ૬૬૭ ૬૬૮ ૬૬૯ ૬૭૦ ૬૭૧ ૬૭૨ ૬૭૩ ૬૭૪ ૬૭૫ ૬૭૬ ૬૭૭ ૬૭૮ ૬૭૯ ૬૮૦ ૬૮૧ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૬ ૬૮૭ ૬૮૮ ૬૮૯ ૬૯૦ ૬૯૧ ૬૯૨ ૬૯૩ ૬૯૪ ૬૯૫ ૬૯૬ ૬૯૭ ૬૯૮ ૬૯૯ ૭૦૦ ૭૦૧ ૭૦૨ ૭૦૩ ૭૦૪ ૭૦૫ ૭૦૬ ૭૦૭ ૭૦૮ ૭૦૯ ૭૧૦ ૭૧૧ ૭૧૨ ૭૧૩ ૭૧૪ ૭૧૫ ૭૧૬ ૭૧૭ ૭૧૮ ૭૧૯ ૭૨૦ ૭૨૧ ૭૨૨ ૭૨૩ ૭૨૪ ૭૨૫ ૭૨૬ ૭૨૭ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩૧ ૭૩૨ ૭૩૩ ૭૩૪ ૭૩૫ ૭૩૬ ૭૩૭ ૭૩૮ ૭૩૯ ૭૪૦ ૭૪૧ ૭૪૨ ૭૪૩ ૭૪૪ ૭૪૫ ૭૪૬ ૭૪૭ ૭૪૮ ૭૪૯ ૭૫૦ ૭૫૧ ૭૫૨ ૭૫૩ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭૫૭ ૭૫૮ ૭૫૯ ૭૬૦ ૭૬૧ ૭૬૨ ૭૬૩ ૭૬૪ ૭૬૫ ૭૬૬ ૭૬૭ ૭૬૮ ૭૬૯ ૭૭૦ ૭૭૧ ૭૭૨ ૭૭૩ ૭૭૪ ૭૭૫ ૭૭૬ ૭૭૭ ૭૭૮ ૭૭૯ ૭૮૦ ૭૮૧ ૭૮૨ ૭૮૩ ૭૮૪ ૭૮૫ ૭૮૬ ૭૮૭ ૭૮૮ ૭૮૯ ૭૯૦ ૭૯૧ ૭૯૨ ૭૯૩ ૭૯૪ ૭૯૫ ૭૯૬ ૭૯૭ ૭૯૮ ૭૯૯ ૮૦૦ ૮૦૧ ૮૦૨ ૮૦૩ ૮૦૪ ૮૦૫ ૮૦૬ ૮૦૭ ૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૧ ૮૧૨ ૮૧૩ ૮૧૪ ૮૧૫ ૮૧૬ ૮૧૭ ૮૧૮ ૮૧૯ ૮૨૦ ૮૨૧ ૮૨૨ ૮૨૩ ૮૨૪ ૮૨૫ ૮૨૬ ૮૨૭ ૮૨૮ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૩૨ ૮૩૩ ૮૩૪ ૮૩૫ ૮૩૬ ૮૩૭ ૮૩૮ ૮૩૯ ૮૪૦ ૮૪૧ ૮૪૨ ૮૪૩ ૮૪૪ ૮૪૫ ૮૪૬ ૮૪૭ ૮૪૮ ૮૪૯ ૮૫૦ ૮૫૧ ૮૫૨ ૮૫૩ ૮૫૪ ૮૫૫ ૮૫૬ ૮૫૭ ૮૫૮ ૮૫૯ ૮૬૦ ૮૬૧ ૮૬૨ ૮૬૩ ૮૬૪ ૮૬૫ ૮૬૬ ૮૬૭ ૮૬૮ ૮૬૯ ૮૭૦ ૮૭૧ ૮૭૨ ૮૭૩ ૮૭૪ ૮૭૫ ૮૭૬ ૮૭૭ ૮૭૮ ૮૭૯ ૮૮૦ ૮૮૧ ૮૮૨ ૮૮૩ ૮૮૪ ૮૮૫ ૮૮૬ ૮૮૭ ૮૮૮ ૮૮૯ ૮૯૦ ૮૯૧ ૮૯૨ ૮૯૩ ૮૯૪ ૮૯૫ ૮૯૬ ૮૯૭ ૮૯૮ ૮૯૯ ૯૦૦ ૯૦૧ ૯૦૨ ૯૦૩ ૯૦૪ ૯૦૫ ૯૦૬ ૯૦૭ ૯૦૮ ૯૦૯ ૯૧૦ ૯૧૧ ૯૧૨ ૯૧૩ ૯૧૪ ૯૧૫ ૯૧૬ ૯૧૭ ૯૧૮ ૯૧૯ ૯૨૦ ૯૨૧ ૯૨૨ ૯૨૩ ૯૨૪ ૯૨૫ ૯૨૬ ૯૨૭ ૯૨૮ ૯૨૯ ૯૩૦ ૯૩૧ ૯૩૨ ૯૩૩ ૯૩૪ ૯૩૫ ૯૩૬ ૯૩૭ ૯૩૮ ૯૩૯ ૯૪૦ ૯૪૧ ૯૪૨ ૯૪૩ ૯૪૪ ૯૪૫ ૯૪૬ ૯૪૭ ૯૪૮ ૯૪૯ ૯૫૦ ૯૫૧ ૯૫૨ ૯૫૩ ૯૫૪ ૯૫૫ ૯૫૬ ૯૫૭ ૯૫૮ ૯૫૯ ૯૬૦ ૯૬૧ ૯૬૨ ૯૬૩ ૯૬૪ ૯૬૫ ૯૬૬ ૯૬૭ ૯૬૮ ૯૬૯ ૯૭૦ ૯૭૧ ૯૭૨ ૯૭૩ ૯૭૪ ૯૭૫ ૯૭૬ ૯૭૭ ૯૭૮ ૯૭૯ ૯૮૦ ૯૮૧ ૯૮૨ ૯૮૩ ૯૮૪ ૯૮૫ ૯૮૬ ૯૮૭ ૯૮૮ ૯૮૯ ૯૯૦ ૯૯૧ ૯૯૨ ૯૯૩ ૯૯૪ ૯૯૫ ૯૯૬ ૯૯૭ ૯૯૮ ૯૯૯ ૧૦૦૦

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે રજૂ થયેલ મૌખિક પુરાવાનો સાર

ફરિયાદી તરીકે તપાસવામાં આવેલ સાક્ષી નં.૧ રમેશભાઈ પુત્ર ગોપાલભાઈ, ઉંમર વર્ષ ૩૫, ધંધો ખેતી, રહે. મોટા આંબલા, તા. ધોરાજી, જિ. રાજકોટ તેમની જુબાનીમાં જણાવે છે કે તેઓ પોતાની માલિકીની વાડીમાં કપાસનો પાક ઉગાડે છે. તેમની વાડી ગામના દક્ષિણ છેડે આવેલી છે. તા. ૧૨/૦૩/૨૦૨૩ ના રોજ સવારે આશરે ૭ વાગ્યે તેઓ વાડીએ ગયા ત્યારે તેમણે જોયું કે વાડીની પશ્ચિમ બાજુની વાડ તૂટેલી હતી અને ત્યાંથી ૩૫ થી ૪૦ ભેડ-બકરાં વાડીમાં ઘૂસી ગયાં હતાં. તેમણે બૂમાબૂમ કરીને આજુબાજુના માણસોને ભેગા કર્યા હતા.

સાક્ષી નં.૨ ભીખુભાઈ પુત્ર વાલજીભાઈ, ઉંમર વર્ષ ૫૨, ધંધો મજૂરી, રહે. મોટા આંબલા, તેઓ જણાવે છે કે તેઓ ફરિયાદીની વાડીની પાસેની વાડીમાં કામ કરતા હતા. તેમણે પણ ભેડ-બકરાંને વાડીમાં ઘૂસતાં જોયાં હતાં અને ફરિયાદીને બોલાવ્યા હતા. તેમની જુબાની મુજબ ભેડ-બકરાંના માલિક આરોપી નં.૧ અને આરોપી નં.૨ હોવાનું તેમણે સાંભળ્યું હતું.

સાક્ષી નં.૩ ડૉ. પ્રીતિબેન પુત્રી હસમુખભાઈ, ઉંમર વર્ષ ૩૨, વ્યવસાય સરકારી દવાખાનામાં મેડિકલ ઑફિસર, રહે. ધોરાજી તેઓ જણાવે છે કે તેમણે ફરિયાદીના ૧૨ ભેડ-બકરાંની તપાસ કરી હતી. તેમાંથી ૭ ભેડ-બકરાંને ઈજાઓ થયેલી હતી. તેમણે ઈજાઓ અંગેનું મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું હતું.

ઉપર મુજબ ઠરાવ કરવામાં આવે છે. તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ મળેલ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે છે કે ગામમાં આવેલ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ઊભા કરવામાં આવેલ પાકા બાંધકામ દૂર કરવા બાબત.

ગામમાં આવેલ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ઊભા કરવામાં આવેલ પાકા બાંધકામ દૂર કરવા બાબત ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ગામમાં ચાલતી ચર્ચા-વિચારણાને ધ્યાનમાં લઈ ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ઊભા કરવામાં આવેલ પાકા બાંધકામ દૂર કરવા બાબત રજૂ કરવામાં આવેલ દરખાસ્ત અંગે સામાન્ય સભામાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ગામના આગેવાનો, વડીલો તથા ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા ગામમાં આવેલ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ઊભા કરવામાં આવેલ પાકા બાંધકામ દૂર કરવા બાબત રજૂ કરવામાં આવેલ દરખાસ્ત અંગે ગામના આગેવાનો, વડીલો તથા ગામના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા ગામમાં આવેલ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી ઊભા કરવામાં આવેલ પાકા બાંધકામ દૂર કરવા બાબત

ઉપરોક્ત ફરિયાદ હકીકત પરથી ફરિયાદી વિરૂધ્ધ આરોપી ઇસમોએ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદીને ખોટી રીતે ફસાવી દેવાના ઇરાદે ફરિયાદીના ઘરે આવી ફરિયાદીના પત્ની તથા પુત્રીને ગાળો આપી ફરિયાદીને ઢોર માર મારી ઇજા પહોંચાડી ફરિયાદીના ઘરમાંથી રોકડા રૂપિયા ૩૫,૦૦૦/- તથા સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે.

ફરિયાદ

ઉપરોક્ત ફરિયાદ હકીકત પરથી ફરિયાદી વિરૂધ્ધ આરોપી ઇસમોએ ગુનાહિત કાવતરૂ રચી ફરિયાદીને ખોટી રીતે ફસાવી દેવાના ઇરાદે ફરિયાદીના ઘરે આવી ફરિયાદીના પત્ની તથા પુત્રીને ગાળો આપી ફરિયાદીને ઢોર માર મારી ઇજા પહોંચાડી ફરિયાદીના ઘરમાંથી રોકડા રૂપિયા ૩૫,૦૦૦/- તથા સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ગયા અંગેની ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે.

ત્રિ કુમારિકા ને રાજા

ત્યારે રાજાએ કહ્યું કે મારા પ્રાણ ભાઈ ન મળે ત્યાં સુધી મારે ખાવું પીવું કે સૂવું કાંઈ ન ગમે. એમ કહી રાજા ઘોડા ઉપર બેસી ચાલ્યો. ચાલતાં ચાલતાં એક ઘરડી ડોશીને ઘેર આવ્યો. ડોશીએ રાજાને ખાવા માટે રોટલો આપ્યો. રાજાએ રોટલો ખાધો. પછી ડોશીએ રાજાને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? રાજાએ કહ્યું કે મારા ભાઈ ગુમ થયા છે તેને શોધવા જાઉં છું. ડોશીએ કહ્યું કે તમારા ભાઈ ક્યાં ગયા છે તે હું જાણું છું. તમારા ભાઈ ચંદનવનમાં ગયા છે. ત્યાં એક રાક્ષસ રહે છે. તે રાક્ષસ તમારા ભાઈને ખાઈ જશે. માટે તમે ત્યાં ન જાઓ. રાજાએ કહ્યું કે મારા ભાઈ ત્યાં ગયા છે તો હું પણ ત્યાં જઈશ. ડોશીએ કહ્યું કે તમારે ત્યાં જવું હોય તો જાઓ પણ ત્યાં જઈને કોઈ ઝાડ ઉપર ચઢી જજો. રાજા ત્યાંથી ચાલ્યો. ચાલતાં ચાલતાં ચંદનવનમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર ચઢી ગયો. ઝાડ ઉપર ચઢીને જોયું તો રાક્ષસ આવતો હતો. રાક્ષસ ઝાડ નીચે આવીને ઊભો રહ્યો. રાજા ઝાડ ઉપર બેઠો બેઠો રાક્ષસને જોવા લાગ્ય

૩૦. ઉપવાસ કે ઉપવાસ

ઉપવાસ એટલે ઉપ+વાસ. ઉપ એટલે પાસે, વાસ એટલે રહેવું. ઉપવાસનો અર્થ થાય ઈશ્વર કે પોતાના આત્મા પાસે રહેવું. પણ આજે ઉપવાસનો અર્થ ઈશ્વર કે આત્મા પાસે રહેવું એવો થતો નથી. ઉપવાસ એટલે ખાવું-પીવું નહીં એવો અર્થ થઈ ગયો છે. ઉપવાસ કરનાર ઈશ્વર કે આત્મા પાસે રહેવાનો પ્રયત્ન કરે કે ન કરે, પણ ખાવું-પીવું નહીં એ નિયમ તો પાળે જ

(૧૨)

ત્રીજો દિવસ

બીજા દિવસે સવારે ઊઠીને, સ્નાન કરી લીધા પછી ચાલવાનું કામ શરૂ થયું. ચાલવાનું કામ ઘણું જ મુશ્કેલ હતું. ચાલતાં ચાલતાં ઘણી વાર ઠોકરો ખાવી પડતી હતી. ઘણી વાર ઊંચા-નીચા રસ્તા આવતા હતા. કોઈ વાર ઊંચા પર્વત પર ચઢવું પડતું હતું. ઘણી વાર ઊંડી ખીણમાં ઊતરવું પડતું હતું

ત્રીજી ઇન્દ્રિય

ગંધ : ગંધ એટલે સુગંધ, દુર્ગંધ. ઘ્રાણેન્દ્રિય દ્વારા સુગંધ-દુર્ગંધનું જ્ઞાન થાય છે. ઘ્રાણેન્દ્રિય એટલે નાકનું બાહ્ય છિદ્ર તથા અંદરનો ભાગ. નાકની અંદરની ચામડીમાં ઘ્રાણ-ચેતાના છેડા આવેલા છે. આ ચેતા મગજ સાથે જોડાયેલી છે. ગંધવાળા પદાર્થોના સૂક્ષ્મ કણો હવા સાથે ભળીને નાકમાં પ્રવેશે છે. ત્યાં ઘ્રાણ-ચેતાના છેડા સાથે અથડાય છે. તેથી ચેતામાં ઉત્તેજના પેદા થાય છે. આ ઉત્તેજના મગજ સુધી પહોંચે છે. ત્યારે આપણને ગંધનું જ્ઞાન થાય છે. ગંધ સારી કે ખરાબ હોય તો તેની અસર આપણા શરીર પર પણ થાય છે. સારી સુગંધથી આપણને આનંદ થાય છે. જ્યારે દુર્ગંધથી ઊબકા આવે છે. ઘણી વાર ઊલટી પણ થાય છે. આમ, ઘ્રાણેન્દ્રિય આપણને સારું-નરસું જણાવીને આપણું રક્ષણ કરે છે.

સ્વાદ : સ્વાદ એટલે રસ. જીભ પર આવેલી સ્વાદ-કલિકાઓ દ્વારા આપણને સ્વાદનું જ્ઞાન થાય છે. જીભ પર ઉપસેલા નાના નાના દાણા જેવા ભાગને સ્વાદ-કલિકા કહે છે. આ કલિકાઓ જીભ પર જુદી જુદી જગ્યાએ આવેલી છે. જીભના આગળના ભાગમાં મીઠાશ, પાછળના ભાગમાં કડવાશ, બાજુના ભાગોમાં ખારાશ અને ખટાશ પારખવાની કલિકાઓ આવેલી છે. આ કલિકાઓ સાથે ચેતા જોડાયેલી છે. આ ચેતા મગજ સાથે જોડાયેલી છે. ખોરાકના રસ કલિકાઓ સાથે અથડાય છે. ત્યારે ચેતામાં ઉત્તેજના પેદા થાય છે. આ ઉત્તેજના મગજ સુધી પહોંચે છે. ત્યારે આપણને સ્વાદનું જ્ઞાન થાય છે. ખોરાકમાં મીઠું, મરચું, ખટાશ, ગોળ વગેરે ભેળવવામાં આવે છે. તેનું કારણ સ્વાદ-કલિકાઓને ઉત્તેજિત કરવાનું છે. આમ, સ્વાદ-કલિકાઓ આપણને ખોરાકનો સ્વાદ પારખવામાં મદદ કરે છે. ખોરાકમાં કયો પદાર્થ કેટલો નાખવો તે પણ આપણને સ્વાદ-કલિકાઓ જ જણાવે છે. આમ, સ્વાદ-કલિકાઓ આપણું રક્ષણ કરે છે.

ક્રમાંક : ૨૦૨૦

ન્યાયાધીશ શ્રી ...

સિવિલ કોર્ટ, ...

વાદી : ...

વિરુદ્ધ

પ્રતિવાદી : ...

વાદી તરફે વકીલ : ...

પ્રતિવાદી તરફે વકીલ : ...

વાદ પ્રશ્નો : ...

વાદ પ્રશ્નો ઉપર પુરાવો લેવાની તારીખ

૬૮ ચોરી ને ધાડ

ચોરી કે ધાડ પાડવા જતી વખતે ચોરો કે ધાડપાડુઓ પોતાની સાથે જે હથિયારો રાખતા હોય તે.

ઉપરોક્ત વિષયવાળી આપની કચેરીના પત્ર ક્રમાંક: ગશિ/૨૦૨૧/૧૨૩૪ તા. ૧૫/૦૩/૨૦૨૧ થી આપશ્રીએ જણાવ્યું છે કે, ગામ: ખોડિયાર, તા. ધોરાજી, જિ. રાજકોટ ખાતે આવેલ સર્વે નં. ૨૩૪ પૈકી ૧ વાળી જમીનમાં ૧૨ મીટર પહોળો રસ્તો મંજૂર થયેલ છે. આ રસ્તો ખોડિયાર-ધોરાજી રોડને જોડતો હોવાથી જાહેર હિતમાં ખૂબ જ મહત્ત્વનો છે. પરંતુ આ રસ્તાની વચ્ચે શ્રી રામજીભાઈ ગોવિંદભાઈ પટેલની માલિકીનું પાકું મકાન આવેલું છે. આ મકાનનો અમુક ભાગ રસ્તામાં જતો હોવાથી તેઓ મકાન તોડવા તૈયાર નથી.

આ બાબતે તા. ૧૦/૦૩/૨૦૨૧ ના રોજ ગામ ચોરે જાહેર બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સરપંચશ્રી, તલાટી-કમ-મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં નક્કી થયું કે રસ્તાની પહોળાઈ ૧૨ મીટરને બદલે ૧૦ મીટર રાખવામાં આવે તો મકાનનો મોટો ભાગ બચી શકે તેમ છે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને આપશ્રીને મોકલવામાં આવ્યો છે.

ઉપરોક્ત હકીકતને ધ્યાનમાં લઈ, જાહેર હિતને ધ્યાનમાં રાખીને તથા ગ્રામજનોની લાગણીને માન આપીને રસ્તાની પહોળાઈ ૧૦ મીટર કરવા અંગે આપશ્રી ઘટતું કરશો. જો આ બાબતે કોઈ વાંધો હોય તો તે અંગે પણ જાણ કરવા વિનંતી છે.

ગાંધીજીએ "ઇન્ડિયન ઓપિનિયન"ના તંત્રી મિ. પોલાકને તા. ૨૭-૧૨-૧૯૦૬ના રોજ લખેલા પત્રમાં "જેમ્સ એલ્ન"ના પુસ્તકોનો ઉલ્લેખ કરેલો છે. આ પુસ્તકોમાંથી ગાંધીજીએ કયા પુસ્તકો વાંચ્યાં હશે તે જાણવા માટે ગાંધીજીના પુસ્તકોની યાદી તપાસતાં જણાયું કે તેમના પુસ્તકોમાં જેમ્સ એલ્નનું એક પુસ્તક "As a Man Thinketh" (૧૯૦૨) હતું. આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર "મનુષ્ય જેવો વિચાર કરે તેવો થાય" નામે ૧૯૧૨માં પ્રગટ થયું હતું. આ પુસ્તકનું ગાંધીજીએ વાંચન કર્યું હોવાનું જણાય છે. આ પુસ્તકમાં જેમ્સ એલ્ને જણાવ્યું છે કે મનુષ્ય જેવો વિચાર કરે તેવો થ

પણ જાણતા હોવા છતાં પણ સ્વાર્થી થઈ જવું, ભૂલ કરવી, ખોટું કરવું એ માનવ સહજ નબળાઈ છે. પણ આ નબળાઈ ઉપર વિજય મેળવી, પોતાની ભૂલ કબૂલ કરી, ક્ષમા માગી, પોતાની જાતને શુદ્ધ કરવી એ જ સાચા માનવનું લક્ષણ છે. આ વાત ભૂલી જઈને, પોતાની ભૂલ ઢાંકવા માટે, બીજા પર આક્ષેપ મૂકવો, એ તો ખરેખર ખોટું જ કહેવાય

ઉપર મુજબ વિગતે વર્ણવેલ મકાન તથા તેની આજુબાજુ ચારે બાજુ ચાર ફૂટ પહોળો રસ્તો, તેમજ ઉપર મુજબ વર્ણવેલ મકાનમાં આવવા જવાનો રસ્તો, તેમજ મકાનમાં આવવા જવાનો રસ્તો, તેમજ મકાનમાં આવવા જવાનો રસ્તો, તેમજ

ગોવા દાદરા ને નગર હવેલી ના ગામોના નામ ફેરફાર

"ગુજરાત રાજ્ય, કચ્છ જીલ્લા ગામોના નામ ફેરફાર બાબત" પ્રશ્ન ઉપર ચર્ચા ચાલુ થઈ. ત્યારે માનનીય સભ્ય શ્રી ગોરધનભાઈ ઝવેરભાઈ પટેલ "ઉમરગામ-૨" વિધાનસભા વિસ્તારના સભ્યશ્રી એ પ્રશ્ન પૂછેલ કે, "ગુજરાત રાજ્યના ગામોના નામ ફેરફાર કરવા બાબત ગુજરાત સરકારે કોઈ પ્રસ્તાવ મોકલ્યો છે કે કેમ ? તથા ગુજરાત રાજ્યના ગામોના નામ ફેરફાર કરવા બાબત ગુજરાત સરકારે કોઈ પ્રસ્તાવ મોકલ્યો હોય તો તે પ્રસ્તાવ કયારે મોકલ્યો છે

ગઈકાલે સાંજે ૬ વાગ્યે ગોપાલ ઠાકોરને ઘરે ગયો ત્યારે તેમના પત્ની ચંદ્રિકાબેન ઠાકોર ઘરે એકલાં હતાં. ગોપાલ ઠાકોરે તેમને પૂછ્યું કે, "કાકી, કાકા ક્યાં ગયા છે?" ત્યારે ચંદ્રિકાબેને જવાબ આપ્યો કે, "તારા કાકા તો સવારે ૧૦ વાગ્યે ખેતરે ગયા છે, પણ હજુ સુધી પાછા આવ્યા નથી." ગોપાલ ઠાકોરે કહ્યું કે, "કાકી, કાકા ખેતરે ગયા છે તો ચિંતા ન કરો. હું ખેતરે જઈને તપાસ કરી આવું છું." ત્યારબાદ ગોપાલ ઠાકોર ખેતરે ગયા. ખેતરે પહોંચીને તેમણે જોયું કે તેમના કાકા ઠાકોર ભીખાભાઈ ખેતરમાં પડ્યા છે અને તેમને ઘણી ઈજાઓ થયેલી છે. તેમણે તરત જ પોતાના મોબાઈલ ફોનથી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ફોન કરીને બોલાવી. ત્યારબાદ ગોપાલ ઠાકોરે પોતાના કાકા ભીખાભાઈ ઠાકોરને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. ત્યારબાદ ગોપાલ ઠાકોરે પોતાના કાકી ચંદ્રિકાબેન ઠાકોરને ફોન કરીને જાણ કરી કે, "કાકી, કાકાને ખેતરે ખૂબ ઈજાઓ થયેલી છે, તેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. તમે પણ ત્યાં આવી જાઓ." ત્યારબાદ ચંદ્રિકાબેન ઠાકોર પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ ભીખાભાઈ ઠાકોરની સારવાર શરૂ કરી દીધી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે, "ભીખાભાઈને માથામાં ઈજા થયેલી છે, તેથી તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે." ત્યારબાદ ગોપાલ ઠાકોર પણ ત્યાં રોકાયા હતા.

ઉપરોક્ત બાબતે આપ સહુ જિલ્લા તાલુકાના પ્રમુખશ્રીઓ તથા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા આગેવાનોને જાણ કરવા વિનંતી છે. આ કાર્યક્રમ અંગે આપના વિસ્તારમાં વધુમાં વધુ પ્રચાર થાય તે માટે આપ સહુ પોતાની રીતે પ્રયત્નશીલ રહેશો તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ અંગે આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય તો તાત્કાલિક જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી

ભાગ ૩ : ગામડાંના ગરીબ ખેડૂતોનું જીવન

ઉનાળાની ગરમીમાં ખેતરમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. ઘણા ખેડૂતો સવારે વહેલા ઊઠીને કામ શરૂ કરી દે છે, જેથી બપોરની ગરમી પહેલાં થોડું કામ પતી જાય. ઘણા ખેડૂતો પાસે પોતાની જમીન નથી હોતી. તેઓ બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરે છે. ભાડું ચૂકવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડે છે. ક્યારેક પાક સારો ન થાય તો ભાડું ચૂકવવું પણ મુશ્કેલ બની જાય છે.

ખેડૂતોની મુખ્ય સમસ્યા પાણીની છે. ઘણા વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ પૂરતો પડતો નથી. ખેતરમાં કૂવો હોય તો પણ ઉનાળામાં પાણી ઊંડું ઊતરી જાય છે. ડીઝલ પંપ ચલાવવા માટે ડીઝલ ખૂબ મોંઘું પડે છે. ઘણા ખેડૂતો પાસે પોતાનું ટ્રેક્ટર નથી હોતું, તેથી તેમને બીજાનું ટ્રેક્ટર ભાડે લેવું પડે છે. ટ્રેક્ટરનું ભાડું પણ દરરોજ વધતું જાય છે.

ખાતર અને બિયારણ પણ ખેડૂતો માટે મોટો ખર્ચ છે. રાસાયણિક ખાતરની થેલી ખૂબ મોંઘી થઈ ગઈ છે. ઘણા ખેડૂતો દેવું કરીને ખેતી કરે છે. પાક વેચ્યા પછી તેઓ પહેલાં દેવું ચૂકવે છે, પછી જ ઘરખર્ચ માટે પૈસા બચે છે. આ કારણે ઘણા પરિવારો હંમેશાં આર્થિક તંગીમાં જીવે છે.

ખેડૂતોની આવક ઓછી હોવાથી તેમનું જીવનધોરણ પણ નીચું રહે છે. ઘણા ગામડાંઓમાં હજી પાકા મકાનો ઓછાં છે. ઘણા પરિવારો કાચા મકાનમાં રહે છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પણ પૂરતી નથી. બાળકોને ભણાવવા માટે ખેડૂતોને ઘણી મહેનત કરવી પડે છે.

આમ છતાં, ખેડૂતો ખૂબ મહેનતુ અને ધીરજવાન હોય છે. તેઓ કુદરત સામે લડીને પણ અન્ન ઉગાડે છે. તેમની મહેનતને કારણે જ આપણને રોજ ભોજન મળે છે. તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ અને તેમની સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.

ખાતા પર ઉધાર લખવામાં આવે છે. ત્યારે તે ખાતાને ડેબિટ કરવું એમ કહેવાય છે. જ્યારે કોઈ ખાતામાં જમા લખવામાં આવે ત્યારે તે ખાતાને ક્રેડિટ કરવું એમ કહેવાય છે. ડેબિટ કરવું એટલે ઉધાર કરવું અને ક્રેડિટ કરવું એટલે જમા કરવું

ॐ श्री गणेशाय नमः

॥ श्री सूर्य देवाय नमः ॥

(२)

आजकाल हमारा भी समाज शिक्षा के क्षेत्र में बहुत आगे बढ़ रहा है। समाज के प्रत्येक व्यक्ति को शिक्षा के महत्व को समझना चाहिए। शिक्षा के बिना मनुष्य पशु के समान है। शिक्षा से ही मनुष्य को अच्छे बुरे का ज्ञान होता है। शिक्षा से ही मनुष्य को अपने कर्तव्यों का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने अधिकारों का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने समाज और देश के प्रति अपने कर्तव्यों का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने समाज और देश के प्रति अपने अधिकारों का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने समाज और देश के प्रति अपने कर्तव्यों और अधिकारों का पता चलता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

शिक्षा के बिना मनुष्य अंधकार में रहता है। शिक्षा से ही मनुष्य को प्रकाश मिलता है। शिक्षा से ही मनुष्य को ज्ञान मिलता है। शिक्षा से ही मनुष्य को विवेक मिलता है। शिक्षा से ही मनुष्य को बुद्धि मिलती है। शिक्षा से ही मनुष्य को सही और गलत का पता चलता है। शिक्षा से ही मनुष्य को अच्छे और बुरे का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये का पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर पता चलता है। शिक्षा से ही मनुष्य को अपने और पराये के बीच का अंतर समझ में आता है।

ઉપર મુજબની ટિપ્પણી સાથે આ ફરિયાદ અરજી કોર્ટ ફી સ્ટેમ્પ પર લખી આપવામાં આવે છે.

ફરિયાદીની સહી

ફરિયાદીનું નામ, પૂરું સરનામું, ઉંમર અને વ્યવસાય

ફરિયાદીના વકીલનું નામ, સરનામું અને વકીલાતનો નંબર

ફરિયાદીના વકીલની સહી

ફરિયાદ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની યાદી

ફરિયાદ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની નકલો

ફરિયાદ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની નકલો પર સાક્ષી તરીકે તપાસવાના સાક્ષીઓની યાદી

ફરિયાદ અરજી સાથે જોડવાના દસ્તાવેજોની નકલો પર સાક્ષી તરીકે તપાસવાના સાક્ષીઓની યાદી પર સાક્ષીઓની સહ

ਸਾਰ ਸਿੰਘ ਦੇ ਸਮਰਥ ਸੀ।

ਸਾਰ ਸਿੰਘ ਦੇ ਸਮਰਥ ਸੀ।

ઉપરોક્ત દાવાના કામે વાદી તરફે આ કામના સાક્ષી તરીકે મારા મામાના દીકરા
ભાઈ થાય છે. તેઓ વાદી તરફે જુબાની આપે છે કે "હું વાદીને ઓળખું છું.
તેમજ પ્રતિવાદીને પણ ઓળખું છું. આ દાવાની જમીન વાદીની માલિકીની
છે. તેઓ વાદીના કબજામાં ભોગવટામાં છે. તેઓ વાદીની જમીનમાં
ખેતીવાડી કરે છે. આ જમીનમાં વાદી ઘઉં, ચણા, કપાસ, તુવેર વગેરે
પાકો પકવ

ઉપરોક્ત દસ્તાવેજ : અરજદારના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત દસ્તાવેજ પુરાવામાં લેવા બાબત. (અરજી નં. ૧૪) ---- અરજદાર તરફે વકીલશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત દસ્તાવેજ પુરાવામાં લેવા બાબતની અરજી તા. ૨૭/૧૧/૨૦૧૮ ના રોજ રજૂ કરવામાં આવેલ. સદરહુ અરજી ઉપર બંને પક્ષકારોને સાંભળવામાં આવેલ. બંને પક્ષકારોની રજૂઆત ધ્યાને લેતા અરજદાર તરફે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ પુરાવામાં લેવા બાબતની અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે. અરજદાર તરફે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ પુરાવામાં લેવામાં આવે છે.

તા. ૨૭/૧૧/૨૦૧૮

વકીલ

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તથા સાહેદો તરફથી રજુ થયેલ મૌખિક પુરાવો તથા
તપાસ અધિકારીશ્રી તથા પંચો તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રીપોર્ટ તથા
ડૉક્ટરશ્રીનો રીપોર્ટ વગેરે ધ્યાને લેતાં આ કામના આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શી
કેસ ઉપલબ્ધ થતો હોવાનું જણાઈ આવે છે. આરોપીઓ તરફે વકીલશ્રી
દલીલ કરેલ કે આરોપીઓ નિર્દોષ છે તેઓ વિરૂધ્ધ કોઈ પુરાવો નથી
તેઓને ખોટી રીતે ફસાવવામાં આવેલ છે વગેરે વગેરે દલીલો કરેલ
પરંતુ આ તબક્કે આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શી કેસ ઉપલબ્ધ થતો હોવાનું
જણાતું હોઈ આરોપીઓની જામીન અરજી નામંજુર કરવા યોગ્ય જણાય છે.
હુકમ

આથી આરોપી નં. ૧ થી ૩ તથા ૪ પૈકી ૪ ની જામીન અરજી નામંજુર કરવામાં
આવે છે.

(એમ. ડી. પરમાર)
ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ

ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, ઉપરોક્ત સંદર્ભ પત્રથી આપને જણાવવામાં આવેલ કે, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ જેવા કે, જુગાર, દારૂ, ક્રિકેટ સટ્ટા, પત્તા પર રમાતા જુગાર, ઓનલાઈન જુગાર, મટકા જુગાર, ઓનલાઈન લોટરી, ઓનલાઈન ક્રિકેટ સટ્ટા, ઓનલાઈન ગેમ્બલીંગ, ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન ચીટીંગ

ઉપરોક્ત પ્રમાણે ગણતરી કરતાં ૧૦ વર્ષના અંતે ૨૦૦૦ રૂપિયાનું મૂલ્ય ઘટીને ૧૦૦૦ રૂપિયા થાય છે. આ ઘટાડાને અવમૂલ્યન કહે છે. અવમૂલ્યન એટલે કોઈ પણ મિલકતની કિંમતમાં થતો ઘસારો. આ ઘસારો કોઈ પણ મિલકતની કિંમતમાં થતો ઘટાડો છે. આ ઘટાડો મિલકતના ઉપયોગ, સમય પસાર થવો અથવા અપ્રચલિત થવાને કારણે થઈ શકે છે. અવમૂલ્યનની ગણતરી કરવા માટે ઘણી પદ્ધતિઓ છે. આપણે અહીં ત્રણ પદ્ધતિઓ વિશે જોઈશું.

(૧) સીધી લીટીની પદ્ધતિ (Straight Line Method) : આ પદ્ધતિમાં મિલકતની કિંમતમાં દર વર્ષે સમાન રકમનો ઘટાડો થાય છે. આ પદ્ધતિ સૌથી સરળ છે. આ પદ્ધતિમાં મિલકતની કિંમત, તેનું આયુષ્ય અને અંદાજિત અવશેષ મૂલ્ય જાણવું જરૂરી છે. અવશેષ મૂલ્ય એટલે મિલકતનું આયુષ્ય પૂરું થયા પછી તેની કિંમત. આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ = (મિલકતની કિંમત − અવશેષ મૂલ્ય) ÷ મિલકતનું આયુષ્ય. આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ સમાન રહે છે. આ પદ્ધતિ ઉત્પાદન કે વેચાણ સાથે સંબંધિત નથી

ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, આપ સાહેબ દ્વારા આપવામાં આવેલ ઓર્ડર મુજબ મારા ઘરે ઓર્ડર મુજબ ૧૦૦ નંગ ટોપી તૈયાર કરવામાં આવેલ છે. જે ટોપી આપ સાહેબ સુધી પહોંચાડવા માટે મારા ભાઈ મારફત મોકલવામાં આવેલ છે. જે ટોપી આપ સાહેબ સુધી પહોંચી ગયેલ હોય તો મારા ભાઈ પાસેથી રૂપિયા ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) મેળવી લેવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

[illegible]

તા. ૨૫/૧૨/૨૦૨૨

પ્રતિ,
શ્રી [illegible]
[illegible]

ના કુટુંબી સગા-સંબંધી જોડે કેટલો ઘરોબો રાખે છે તેના પર તેની સામાજિક પ્રતિષ્ઠા આધાર રાખે છે. આ સંબંધો જાળવવા માટે તેણે ઘણો સમય અને પૈસા ખર્ચવા પડે છે. આ ઉપરાંત તેણે પોતાના કુટુંબ-વર્તુળમાં થતા લગ્ન, મરણ, જન્મ, સીમંત વગેરે પ્રસંગોએ હાજરી આપવી પડે છે. આ પ્રસંગોએ ભેટ-સોગાદો આપવી પડે છે. આ બધું કરવા માટે તેણે ઘણી વાર પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ પહોંચી વળવા માટે તેણે ઘણી વાર ઊંચા વ્યાજે નાણાં ઉછીનાં લેવાં પડે છે. આ રીતે તે દેવાના બોજ નીચે દબાઈ જાય છે. આ બોજ ઉતારવા માટે તેણે પોતાની જમીન કે ઘરેણાં વેચવાં પડે છે. આ રીતે તે ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. આ ચક્રમાંથી બહાર નીકળવું તેના માટે ઘણું મુશ્કેલ બની જાય છે. આ ચક્રમાંથી બહાર નીકળવા માટે તેણે પોતાની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરવો પડે છે. આ ફેરફાર કરવા માટે તેણે પોતાની જૂની ટેવો છોડવી પડે છે. આ ટેવો છોડવી તેના માટે ઘણું મુશ્કેલ બની જાય છે. આ મુશ્કેલી

ઉપરોક્ત ઠરાવ મુજબ ઉપરોક્ત કામોના ટેન્ડર ફોર્મ તા. ૨૨/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે અને તે જ દિવસે બપોરે ૧૨:૦૦ કલાકે ટેન્ડર ખોલવામાં આવશે. ટેન્ડર ખોલવાની તારીખ કોઈ કારણોસર જાહેર રજા પડે તો ટેન્ડર ખોલવાની તારીખ પછીના કામકાજના દિવસે ટેન્ડર ખોલવામાં આવશે. ટેન્ડર ખોલવાની તારીખ પછી કોઈપણ ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં. ટેન્ડર ખોલવાની તારીખ પછી કોઈપણ ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં. ટેન્ડર ખોલવાની તારીખ પછી કોઈપણ ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં.

ટેન્ડર ફોર્મ : ટેન્ડર ફોર્મ ની કિંમત રૂ. ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) રહેશે. ટેન્ડર ફોર્મ ની કિંમત રોકડેથી અથવા ડી.ડી. થી ભરવાની રહેશે. ટેન્ડર ફોર્મ ની કિંમત પરત મળશે નહીં. ટેન્ડર ફોર્મ ની કિંમત પરત મળશે નહીં. ટેન્ડર ફોર્મ ની કિંમત પરત મળશે નહીં.

ઉપરોક્ત બાબતે આપ સાહેબશ્રીનું ધ્યાન દોરવામાં આવે છે કે આજરોજ તા.૨૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મારા ઘરે આવેલ ત્યારે મારા ઘરે કોઈ હાજર ન હોવાથી મારા પત્ની સાથે ફોન પર વાત કરતા જણાવેલ કે મારા પતિ ગઈકાલે રાત્રે ૧૧:૩૦ કલાકે ઘરે આવેલ ત્યારે તેમની તબિયત સારી ન હોવાથી તેમને ઉલ્ટી થયેલ હતી તેમજ તેમને ચક્કર આવતા હોવાથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. તેમજ તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવેલ હતું. તેમજ તેમની તબિયત સારી થયે તેમનું નિવેદન નોંધવામાં આવશે.

આથી આ નોંધ કરવામાં આવે છે.

ફરિયાદી

વધુ તપાસ કરતા આ કામના ફરિયાદી પોતાની સાથે બનેલ બનાવ અંગે જણાવેલ કે, તા.૨૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા પત્ની મારી સાથે ફોન પર વાત કરતા જણાવેલ કે મારા પતિ ગઈકાલે રાત્રે ૧૧:૩૦ કલાકે ઘરે આવેલ ત્યારે તેમની તબિયત સારી ન હોવાથી તેમને ઉલ્ટી થયેલ હતી તેમજ તેમને ચક્કર આવતા હોવાથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. તેમજ તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવેલ હતું. તેમજ તેમની તબિયત સારી થયે તેમનું નિવેદન નોંધવામાં આવશે.

ક) દરજ્જો મંજૂર કરવા બાબત (૨) ગામ કક્ષાએ

ع) مسلم مکرم ۵) حضرات ۸۰:

ઉપરોક્ત ગામના ખેડૂતોની ખેતીની જમીન ઉપર ઉપરોક્ત કારણોસર ખૂબ જ ગંભીર અસર થવાનો સંભવ છે. આ ઉપરાંત ઉપરોક્ત ગામોની ખેતીની જમીનમાં

ಕ) ಅಭಿಪ್ರಾಯ ಬರೆಯಿರಿ.

ক্রমান্বয়ে তা আরও বৃদ্ধি পেতে থাকে এবং এক পর্যায়ে তিনশত বছরের মধ্যে
দাঁড়ায় ৩৫ কোটি। ১৯৫০ সালে বিশ্বের জনসংখ্যা ছিল ২৫০ কোটি। ১৯৭০ সালে
তা বৃদ্ধি পেয়ে ৩৫০ কোটিতে দাঁড়ায়। ১৯৮০ সালে বিশ্বের জনসংখ্যা ৪৫০ কোটি
ছাড়িয়ে যায়। ১৯৯০ সালে তা ৫০০ কোটি ছাড়িয়ে যায়। ১৯৯৯ সালে বিশ্বের
জনসংখ্যা ৬০০ কোটি ছাড়িয়ে যায়। ২০১০ সালে বিশ্বের জনসংখ্যা ৭০০ কোটি
ছাড়িয়ে যায়। ২০২২ সালে বিশ্বের জনসংখ্যা ৮০০ কোটি ছাড়িয়ে যায়।
বিশ্বের জনসংখ্যা ১০০ কোটি থেকে ২০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে
১২৫ বছর। ২০০ কোটি থেকে ৩০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ৩৩
বছর। ৩০০ কোটি থেকে ৪০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ৩৩ বছর।
৪০০ কোটি থেকে ৫০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ৩১ বছর। ৫০০
কোটি থেকে ৬০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ১২ বছর। ৬০০ কোটি
থেকে ৭০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ১২ বছর। ৭০০ কোটি থেকে
৮০০ কোটিতে উন্নীত হতে সময় লেগেছে ১২ বছর।

বিশ্বের জনসংখ্যা বৃদ্ধির কারণ : বিশ্বের জনসংখ্যা বৃদ্ধির কারণ
হিসেবে নিম্নোক্ত বিষয়গুলো উল্লেখযোগ্য :

১. জন্মহার বৃদ্ধি : বিশ্বের জনসংখ্যা বৃদ্ধির অন্যতম কারণ হলো
জন্মহার বৃদ্ধি। বিশ্বের বিভিন্ন দেশে জন্মহার বৃদ্ধির কারণ বিভিন্ন। কোথাও
ধর্মীয় কারণে, কোথাও সামাজিক কারণে, কোথাও অর্থনৈতিক কারণে
জন্মহার বৃদ্ধি পেয়েছে। ধর্মীয় কারণে জন্মহার বৃদ্ধির উদাহরণ হিসেবে
ইসলাম ধর্মের কথা বলা যায়। ইসলাম ধর্মে জন্মনিয়ন্ত্রণকে নিরুৎসাহিত
করা হয়েছে। সামাজিক কারণে জন্মহার বৃদ্ধির উদাহরণ হিসেবে
আফ্রিকার কথা বলা যায়। আফ্রিকার অনেক দেশে সন্তান জন্মদানকে
নারীর সামাজিক মর্যাদার সাথে সম্পর্কিত করা হয়। অর্থনৈতিক কারণে
জন্মহার বৃদ্ধির উদাহরণ হিসেবে বাংলাদেশের কথা বলা যায়। বাংলাদেশে
কৃষিকাজে শ্রমিকের চাহিদা বেশি। তাই কৃষিকাজে শ্রমিকের চাহিদা
মেটানোর জন্য বাংলাদেশে জন্মহার বৃদ্ধি পেয়েছে।

২. মৃত্যুহার হ্রাস : বিশ্বের জনসংখ্যা বৃদ্ধির অন্যতম কারণ হলো
মৃত্যুহার হ্রাস। বিশ্বের বিভিন্ন দেশে মৃত্যুহার হ্রাসের কারণ বিভিন্ন।
কোথাও চিকিৎসা ব্যবস্থার উন্নতির কারণে, কোথাও খাদ্য উৎপাদন বৃদ্ধির
কারণে, কোথাও শিল্পায়নের কারণে মৃত্যুহার হ্রাস পেয়েছে। চিকিৎসা
ব্যবস্থার উন্নতির কারণে মৃত্যুহার হ্রাসের উদাহরণ হিসেবে বাংলাদেশের
কথা বলা যায়। বাংলাদেশে চিকিৎসা ব্যবস্থার উন্নতির কারণে মৃত্যুহার
হ্রাস পেয়েছে। খাদ্য উৎপাদন বৃদ্ধির কারণে মৃত্যুহার হ্রাসের উদাহরণ
হিসেবে ভারতের কথা বলা যায়। ভারতে খাদ্য উৎপাদন বৃদ্ধির কারণে
মৃত্যুহার হ্রাস পেয়েছে। শিল্পায়নের কারণে মৃত্যুহার হ্রাসের উদাহরণ
হিসেবে যুক্তরাষ্ট্রের কথা বলা যায়। যুক্তরাষ্ট্রে শিল্পায়নের কারণে

দেখা হলে তাকে বলবে, আমি তার সঙ্গে দেখা করতে এসেছিলাম। তার সঙ্গে আমার কিছু জরুরি কথা ছিল। সে যেন আমার সঙ্গে দেখা করে। আমি তার জন্য অপেক্ষা করব। সে যদি না আসে, তবে আমি তার বাড়িতে যাব। তার বাড়ি কোথায় তা আমি জানি। সে যদি আমার সঙ্গে দেখা করতে না চায়, তবে আমি তাকে জোর করে ধরে আনব। সে আমার কথা শুনতে বাধ্য। সে আমার কাছে ঋণী। সে আমার টাকা ধার নিয়েছে। সে টাকা সে এখনো ফেরত দেয়নি। আমি তার কাছে টাকা চাইতে এসেছি। সে যদি টাকা না দেয়, তবে আমি তার নামে মামলা করব। আমি তাকে আদালতে টেনে নিয়ে যাব। সেখানে তাকে টাকা দিতে হবে। সে যদি টাকা না দেয়, তবে তার সম্পত্তি ক্রোক করা হবে। তার বাড়ি, গাড়ি, জমি, সব কিছু বিক্রি করে আমার টাকা শোধ করা হবে। সে যদি তাতেও রাজি না হয়, তবে তাকে জেলে যেতে হবে। আমি তাকে জেলে পাঠাতে পারি। আমার ক্ষমতা আছে। আমার টাকা আছে। আমার লোকজন আছে। আমার উকিল আছে। আমার সাক্ষী আছে। আমার প্রমাণ আছে। আমার যুক্তি আছে। আমার বুদ্ধি আছে। আমার সাহস আছে। আমার ধৈর্য আছে। আমার শক্তি আছে। আমার ইচ্ছা আছে। আমার সংকল্প আছে। আমার প্রতিজ্ঞা আছে। আমার অঙ্গীকার আছে। আমার বিশ্বাস আছে। আমার ভরসা আছে। আমার আশা আছে। আমার স্বপ্ন আছে। আমার কল্পনা আছে। আমার চিন্তা আছে। আমার ভাবনা আছে। আমার ধারণা আছে। আমার মতামত আছে। আমার দৃষ্টিভঙ্গি আছে। আমার অভিজ্ঞতা আছে। আমার জ্ঞান আছে। আমার বিদ্যা আছে। আমার বুদ্ধিমত্তা আছে। আমার প্রজ্ঞা আছে। আমার বিবেচনা আছে। আমার বিবেক আছে। আমার নীতিবোধ আছে। আমার ন্যায়বোধ আছে। আমার সততা আছে। আমার সত্যবাদিতা আছে। আমার আন্তরিকতা আছে। আমার বিশ্বস্ততা আছে। আমার নিষ্ঠা আছে। আমার একাগ্রতা আছে। আমার মনোযোগ আছে। আমার কর্মদক্ষতা আছে। আমার দক্ষতা আছে। আমার যোগ্যতা আছে। আমার সামর্থ্য আছে। আমার ক্ষমতা আছে। আমার অধিকার আছে। আমার দাবি আছে। আমার প্রাপ্য আছে। আমার পাওনা আছে। আমার টাকা আছে। আমার টাকা ফেরত চাই।" তখন লোকটি বলল, "আমি তার সঙ্গে দেখা করতে এসেছিলাম। তার সঙ্গে আমার কিছু জরুরি কথা ছিল। সে যেন আমার সঙ্গে দেখা করে। আমি তার জন্য অপেক্ষা করব। সে যদি না আসে, তবে আমি তার বাড়িতে যাব। তার বাড়ি কোথায় তা আমি জানি। সে যদি আমার সঙ্গে দেখা করতে না চায়, তবে আমি তাকে জোর করে ধরে আনব। সে আমার কথা শুনতে বাধ্য। সে আমার কাছে ঋণী। সে আমার টাকা ধার নিয়েছে। সে টাকা সে এখনো ফেরত দেয়নি। আমি তার কাছে টাকা চাইতে এসেছি। সে যদি টাকা না দেয়, তবে আমি তার নামে মামলা করব। আমি তাকে আদালতে টেনে নিয়ে যাব। সেখানে তাকে টাকা দিতে হবে। সে যদি টাকা না দেয়, তবে তার সম্পত্তি ক্রোক করা হবে। তার বাড়ি, গাড়ি, জমি, সব কিছু বিক্রি করে আমার টাকা শোধ করা হবে। সে যদি তাতেও রাজি না হয়, তবে তাকে জেলে যেতে হবে। আমি তাকে জেলে পাঠাতে পারি। আমার ক্ষমতা আছে। আমার টাকা আছে। আমার লোকজন আছে। আমার উকিল আছে। আমার সাক্ষী আছে। আমার প্রমাণ আছে। আমার যুক্তি আছে। আমার বুদ্ধি আছে। আমার সাহস আছে। আমার ধৈর্য আছে। আমার শক্তি আছে। আমার ইচ্ছা আছে। আমার সংকল্প আছে। আমার প্রতিজ্ঞা আছে। আমার অঙ্গীকার আছে। আমার বিশ্বাস আছে। আমার ভরসা আছে। আমার আশা আছে। আমার স্বপ্ন আছে। আমার কল্পনা আছে। আমার চিন্তা আছে। আমার ভাবনা আছে। আমার ধারণা আছে। আমার মতামত আছে। আমার দৃষ্টিভঙ্গি আছে। আমার অভিজ্ঞতা আছে। আমার জ্ঞান আছে। আমার বিদ্যা আছে। আমার বুদ্ধিমত্তা আছে। আমার প্রজ্ঞা আছে। আমার বিবেচনা আছে। আমার বিবেক আছে। আমার নীতিবোধ আছে। আমার ন্যায়বোধ আছে। আমার সততা আছে। আমার সত্যবাদিতা আছে। আমার আন্তরিকতা আছে। আমার বিশ্বস্ততা আছে। আমার নিষ্ঠা আছে। আমার একাগ্রতা আছে। আমার মনোযোগ আছে। আমার কর্মদক্ষতা আছে। আমার দক্ষতা আছে। আমার যোগ্যতা আছে। আমার সামর্থ্য আছে। আমার ক্ষমতা আছে। আমার অধিকার আছে। আমার দাবি আছে। আমার প্রাপ্য আছে। আমার পাওনা আছে। আমার টাকা আছে। আমার টাকা ফেরত চাই।" তখন লোকটি বলল, "আমি

ભરૂચ

ઈ.સ. ૨૦૧૬

વાદી મેસર્સ ગુજરાત ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ, ભરૂચ વતી તેના અધિકૃત અધિકારી શ્રી મહેશભાઈ ચંદુભાઈ પટેલ, ઉંમર વર્ષ ૪૨, ધંધો નોકરી, રહે. ભરૂચ, તા. જિ. ભરૂચ

વિરુદ્ધ

પ્રતિવાદી શ્રી રમેશચંદ્ર મોહનલાલ શાહ, ઉંમર વર્ષ ૫૮, ધંધો વેપાર, રહે. ૧૪, સોનાપુરા સોસાયટી, ભરૂચ

વાદી તરફે વકીલ શ્રી કિરીટકુમાર ત્રિવેદી

પ્રતિવાદી તરફે વકીલ શ્રી હસમુખલાલ દવે

ચુકાદો તા. ૧૭/૦૩/૨૦૧૬

આ દાવો વાદી કંપનીએ પ્રતિવાદીના વેપારી પેઢી સામે તેમના વીજ જોડાણના બાકી બિલની રકમ વસૂલ કરવા માટે દાખલ કર્યો છે. વાદીનું કહેવું છે કે પ્રતિવાદીની પેઢી ‘શાહ ટેક્સટાઇલ્સ’ના નામે ભરૂચ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એકમમાં વીજ જોડાણ ધરાવે છે અને તેમના વપરાશ મુજબ તેમને માસિક બિલ આપવામાં આવતું હતું. વાદીનું કહેવું છે કે પ્રતિવાદીએ ઓક્ટોબર ૨૦૧૪ થી ફેબ્રુઆરી ૨૦૧૫ સુધીના કુલ ૫ બિલ પૈકી ૩ બિલની રકમ ચૂકવી નથી, જેથી કુલ રૂ. ૧,૮૬,૪૫૦/- બાકી રહે છે. વાદીએ આ રકમ વ્યાજ સાથે વસૂલ કરવા માટે આ દાવો કર્યો છે.

પ્રતિવાદીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે તેમનો વીજ વપરાશ ખૂબ ઓછો હતો અને બિલની રકમ વધારે પડતી છે. તેમણે એવો પણ બચાવ કર્યો છે કે તેમણે ડિસેમ્બર ૨૦૧૪ માં મીટર બદલવા માટે અરજી કરી હતી, પરંતુ વાદી કંપનીએ સમયસર મીટર બદલ્યું નહોતું. પ્રતિવાદીનું કહેવું છે કે તેમણે બિલ ચૂકવવાની ના પાડી નથી, પરંતુ વધારે પડતા બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ કારણોસર તેમણે દાવાની રકમ ચૂકવવાની જવાબદારી નકારી છે.

ઉપરોક્ત ઠરાવ મુજબ ગામના પ્રતિષ્ઠિત નાગરિકોની બનેલી કમિટીએ ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગામમાં જ ઉપલબ્ધ થઈ શકે તેવા ખોરાકની યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં ચોખા, ઘઉં, દાળ, શાકભાજી, ફળો, દૂધ, ઈંડાં, માંસ, માછલી વગેરેનો સમાવેશ થતો હતો. આ યાદીમાંથી વિદ્યાર્થીઓ પોતાની પસંદગી પ્રમાણે ખોરાક લઈ શકે તે માટે ગામના જુદા જુદા વિસ્તારોમાં ૧૫ જેટલી ખાણીપીણીની દુકાનો શરૂ કરવામાં આવી હતી. આ દુકાનોમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનો ખોરાક ખરીદી શકે તે માટે તેમને ટોકન આપવામાં આવ્યા હતા. આ ટોકનની કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવી હતી. આ ટોકન ખરીદવા માટે વિદ્યાર્થીઓને ૧૫ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ૧૫ રૂપિયામાંથી ૫ રૂપિયા વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સામાંથી ઉમેરવાના હતા. આ યોજનાનો અમલ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ થી શરૂ થયો હતો. આ યોજનાનો અમલ શરૂ થયા પછી ગામના સરપંચ શ્રી રમેશભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, "આ યોજના ગામના બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની છે. આપણા ગામના બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ." આ યોજનાનો અમલ શરૂ થયા પછી ગામના બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

ઉપરોક્ત ઠરાવ મુજબ ઉપર જણાવેલ ખેડૂત ખાતેદારોને ખેતીવાડી ખાતા તરફથી ઉપરોક્ત ઠરાવ મુજબ ખેતીવાડી ખાતાના

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ, અમદાવાદ ખાતે

પ્રા. પ્રતિષ્ઠા ટ્રસ્ટ વિ. ગુજરાત રાજ્ય અને બીજા

ટ્રિબ્યુનલ કેસ નં. ૧૨૩૪/૨૦૨૧

તારીખ ૧૪/૦૩/૨૦૨૨ ના રોજ ટ્રસ્ટી શ્રી મનોજ કુમાર ત્રિવેદી તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું. સામા પક્ષે સરકારી વકીલ શ્રી હિતેશ પરમાર હાજર રહ્યા. બંને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ ટ્રિબ્યુનલે નીચે મુજબ હુકમ કર્યો.

૨. અરજદાર ટ્રસ્ટ તરફે રજૂ થયેલ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટ્યુશન આપે છે. ટ્રસ્ટ પાસે પોતાની કોઈ સ્થાયી મિલકત નથી. ટ્રસ્ટ ભાડાની જગ્યામાં કાર્યરત છે. ટ્રસ્ટ પાસે કોઈ વાહન પણ નથી.

૩. સામા પક્ષે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે ટ્રસ્ટ પાસે વાહન ન હોવાનું સોગંદનામું ખોટું છે. ટ્રસ્ટ પાસે ટાટા સુમો પ્રકારનું વાહન હોવાનું જણાવ્યું હતું. જોકે આ અંગે કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો.

૪. બંને પક્ષકારોની રજૂઆત ધ્યાનમાં લેતાં ટ્રિબ્યુનલ એવું માને છે કે ટ્રસ્ટ પાસે વાહન હોવાનું સાબિત કરવાની જવાબદારી સરકારી વકીલની છે. આ અંગે કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. માત્ર મૌખિક રજૂઆત પૂરતી નથી. ટ્રસ્ટ પાસે વાહન હોવાનું સાબિત થયું નથી.

૫. ટ્રસ્ટ પાસે વાહન ન હોવાનું ધ્યાનમાં લેતાં ટ્રિબ્યુનલ એવું માને છે કે ટ્રસ્ટ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટ્યુશન આપે છે તે હેતુ ધ્યાનમાં લેતાં ટ્રસ્ટને વાહન ખરીદવા પર લાગુ પડતી ૧૨% લક્ઝરી ટેક્સની જોગવાઈમાંથી મુક્તિ આપવી યોગ્ય જણાય છે.

૬. ઉપરોક્ત તમામ હકીકતો અને રજૂઆતોને ધ્યાનમાં લેતાં ટ્રિબ્યુનલ એવું માને છે કે અરજદાર ટ્રસ્ટ તરફે રજૂ થયેલ અરજી મંજૂર કરવાને પાત્ર છે. ટ્રસ્ટ ખરીદવા ધારેલ વાહન પર લાગુ પડતી ૧૨% લક્ઝરી ટેક્સની જોગવાઈમાંથી ટ્રસ્ટને મુક્તિ આપવામાં આવે છે.

ઉપરોક્ત ગામના વતની અને હાલ ધંધાર્થે મુંબઈ રહેતા ફરિયાદી ભરતભાઈ પિતાંબરભાઈ ઠક્કર ઉંમર વર્ષ ૪૨ ધંધો વેપાર રહે. ૨૦૧, ગોકુલ એપાર્ટમેન્ટ, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૬૩ તા. બોરસદ જિ. આણંદ વાળાએ આ કામના આરોપી નં. ૧ થી ૩ વિરુદ્ધ આ કામે ફરિયાદ રજૂ કરી છે કે ફરિયાદી તથા આરોપી નં. ૧ થી ૩ વચ્ચે ઘણા વર્ષોથી મિત્રતાના સંબંધો હોઈ આરોપી નં. ૧ થી ૩ ફરિયાદીના ઘરે અવારનવાર આવતા જતા હોઈ તેમજ ફરિયાદીના ઘરે પણ આરોપીઓ અવારનવાર આવતા જતા હોઈ આરોપીઓ ફરિયાદીના ઘરની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હોઈ તેમજ ફરિયાદીના પરિવારના સભ્યોનો આરોપીઓ પર વિશ્વાસ હોઈ આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીના પરિવારના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી ફરિયાદીના પરિવારના સભ્યોને ખોટા વાયદાઓ આપી ફરિયાદીના પરિવારના સભ્યોને ખોટા વિશ્વાસમાં લઈ

ઉપરોક્ત ઠરાવ મુજબ ઉપરોક્ત ઠરાવ મુજબ ઉપરોક્ત ઠરાવ મુજબ

ઉપર મુજબ સારા ઉદ્દેશ્યથી કરેલ કામ ઉપર ટીકા કરવી એ ઘણું જ ખરાબ કામ છે. ટીકા કરનાર પોતે કોઈ પણ જાતનું સારું કામ કરી શકતો નથી. તેમજ તેનામાં કોઈ પણ જાતની સારી લાયકાત હોતી

ઉપરોક્ત બાબતો અંગે તા.૨૭/૧૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૧ વાગ્યે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભા બોલાવવામાં આવેલ છે. જેમાં ગામના તમામ નાગરિકોએ હાજર રહેવા વિનંતી છે. ગ્રામ સભામાં ગામના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. ગામના વિકાસ અંગે કોઈ સૂચન કરવું હોય તો ગ્રામ સભામાં રજૂ કર

ગામ

ઓ ગામ ૬૨૭૦

ઉમરાળા મુકુંદભાઈ ઉમેદભાઈ કુંડલીયા વગેરે મુળ માલીક ભોગવટદાર ખેડુત ગામ ઉમરાળા તા.ઉમરાળા જી.ભાવનગર વાળા ઉપરથી ખરીદ કરનાર ગામ ઉમરાળા તા.ઉમરાળા જી.ભાવનગર વાળા પાસેથી રોકડા રૂપીયા ચુકવી આપી ખરીદ કરી આપેલ જમીન ખરીદ કરનારે પોતાની માલીકીની કરી આપવા માટે ખરીદ કરનારે ખરીદ કરી આપવા માટે ખરીદ કરનારે ખરીદ કરી આપવા માટે ખરીદ કરનારે ખરીદ

ગામદેવી બાજુ ઉપર કુમાર કા નામ મોહન કા દરબાર, સોહરી બાબા કુલ દેવતા કા મુખ્ય મંદિર "ઉજ્જૈન" કા મહાકાલ મંદિર ભી ઇસી પ્રકાર કા મંદિર હૈ | ઇસકે અલાવા ઔર ભી કઈ મંદિર હૈ જૈસે "ઓમકારેશ્વર મંદિર" જો નર્મદા નદી કે બીચ મેં હૈ | ઇસકે અલાવા ઔર ભી કઈ મંદિર હૈ જૈસે "ત્રિવેણી મંદિર" જો ત્રિવેણી સંગમ પર હૈ | ઇસકે અલાવા ઔર ભી કઈ મંદિર હૈ જૈસે "ગૌરી સોમનાથ મંદિર" જો ગૌરી સોમનાથ

ના કાયમ કે ૨૦૨૩

ગામ કાયમ કે ૨૦૨૩ કે ૨૦૨૩ કે ૨૦૨૩

ન્યાયાધીશ

ફરમાવ્યું છે કે, ઉપરોક્ત ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ પુરાવો, ફરિયાદ પક્ષે રજૂ કરેલ દસ્તાવેજી પુરાવો તથા આરોપીનું નિવેદન ધ્યાને લેતાં આ કામના આરોપી વિરૂધ્ધ ઉપરોક્ત ગુનો પુરવાર થયેલ હોવાનું જણાઈ આવે છે. આરોપી વિરૂધ્ધ ગુનો પુરવાર થયેલ હોવાનું જણાઈ આવતાં આરોપીને સજા કરવા બાબતે બંને પક્ષકારોની દલીલો સાંભળવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન સરકારી વકીલશ્રી એ.એમ.પટેલ સાહેબે દલીલ કરી હતી કે આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો આપી ધમકી આપી હોવાનું ફરિયાદી તથા સાક્ષીઓની જુબાનીથી પુરવાર થયેલ છે. આરોપીએ ફરિયાદીને ઈજા પહોંચાડી હોવાનું પુરવાર થયેલ નથી. આરોપીએ ગુનો કર્યાને લાંબો સમય વીતી ગયેલ છે. આરોપી વિરૂધ્ધ અન્ય કોઈ ગુનો નોંધાયેલ નથી. આરોપી પ્રથમ વખત જ ગુનો કરેલ હોવાનું જણાઈ આવે છે. આરોપી પોતાના કુટુંબનો એકનો એક કમાઉ દીકરો

ક્રમ

ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, ઉપરોક્ત કામે આ કામના ફરિયાદી વિરૂદ્ધ આરોપીઓ તરફથી ખોટી ફરિયાદ કરવામાં આવેલ હોય, જે ફરિયાદ અન્વયે આ કામના ફરિયાદી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવેલ હોય, જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ.ચૌધરી સાહેબ, ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે. જે ગુનાની તપાસ દરમ્યાન આ કામના ફરિયાદીએ પોતાના બચાવ માટે તા.૨૭/૦૫/૨૦૨૧ ના રોજ ભરૂચ જિલ્લા પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ શ્રી ભરૂચ નાઓની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. જે અરજી તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલ હોય, જે નામંજૂર હુકમ વિરૂદ્ધ આ કામના ફરિયાદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે ક્રિમીનલ મિસ. એપ્લીકેશન નં.૭૭૭૭/૨૦૨૧ થી આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી. જે અરજી તા.૦૩/૦૬/૨૦૨૧ ના રોજ નામદાર હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય, જે મંજૂર હુકમની નકલ આ કામના ફરિયાદીના વકીલ દ્વારા તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ મેળવવામાં આવેલ હોય, જે મંજૂર હુકમની નકલ આ સાથે સામેલ રાખવામાં આવેલ છે. જે ધ્યાને લઇ આ કામના ફરિયાદીને નામદાર હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ આગોતરા જામીન અરજીની શરતોનું પાલન કરવા બાબતે હુકમ કરવા વિનંતી છે.

ફરિયાદી

વિશ્વાસુ

(૧) Covid Certificate

ક્રમાંક : ૨૦૨૨/૧૨૫૬

દાવો

વાદી : [redacted] ઉ.વ.આશરે ૪૫ ધંધો ખેતી રહે.ગામ ઉમરાળા તા.ઉમરાળા જિ.ભાવનગર

વિરુદ્ધ

પ્રતિવાદી : (૧) ભીખાભાઈ ભગવાનભાઈ ગોહિલ (૨) ભગવાનભાઈ ભીખાભાઈ ગોહિલ બંને રહે.ગામ ઉમરાળા તા.ઉમરાળા જિ.ભાવનગર

વાદીના વકીલ તરફથી દાવો દાખલ કરવા બાબત

૧. વાદી ઉપરોક્ત સરનામે રહે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રતિવાદી નં.૧ અને ૨ વાદીના સગા કાકા થાય છે.

૨. વાદીના પિતા સ્વ.[redacted] ના નામે ગામ ઉમરાળા તા.ઉમરાળા જિ.ભાવનગર ખાતે આવેલ રે.સ.નં.૧૨૫૬ પૈકી ૧ વાળી જમીન હે.આ.૧-૨૦-૦૦ ચો.મી. જમીન આવેલ છે. જે જમીન વાદીના પિતાને તેમના પિતા સ્વ.[redacted] પાસેથી વારસાઈમાં મળેલ છે. જે જમીન વાદીના પિતા સ્વ.[redacted] ના નામે ચાલતી આવેલ છે. જે જમીન વાદીના પિતા સ્વ.[redacted] ના અવસાન બાદ વાદીના નામે ચાલતી આવેલ છે. જે જમીન વાદી પોતાની માલિકીની જમીન તરીકે ભોગવટો કરી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે જમીનમાં

ઉપર કહેલા ઉપાયોનો પ્રયોગ કરવા છતાં પણ જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીના વર્તનમાં સુધારો ન લાવી શકે તો તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દેવા જોઈએ. પરંતુ આ બાબતમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. કારણ કે ઘણી વાર પત્ની પોતાના પતિ પર ગુસ્સે થઈને પિયર ચાલી જાય છે અને પછી પોતાના પતિ પાસે પાછા આવવા માટે તૈયાર થતી નથી. આવી સ્થિતિમાં પતિએ પોતાની પત્નીને પાછા બોલાવવા માટે પોતાના તરફથી પહેલ કરવી જોઈએ. પોતાના સાસરે જઈને પોતાની પત્નીને પાછા આવવા માટે વિનંતી કરવી જોઈએ. પોતાની પત્નીને પાછા બોલાવવા માટે

ಸಂಖ್ಯೆ

ಸಂಖ್ಯೆ: ಕೆಪಿಎಸ್‌ಸಿ/ಪರೀಕ್ಷೆ/ಪ್ರಕಟಣೆ/೨೦೨೨-೨೩/೧೨೩೪ ದಿನಾಂಕ: ೧೫.೦೩.೨೦೨೩

ಪ್ರಕಟಣೆ

ಕರ್ನಾಟಕ ಲೋಕಸೇವಾ ಆಯೋಗವು ಕರ್ನಾಟಕ ಆಡಳಿತ ಸೇವೆ, ಸಹಾಯಕ ಆಯುಕ್ತರು ಮತ್ತು ಇತರೆ ಹುದ್ದೆಗಳಿಗೆ ಆಯ್ಕೆ ಮಾಡಲು ಮುಖ್ಯ ಪರೀಕ್ಷೆಯನ್ನು ಈ ಕೆಳಕಂಡಂತೆ ನಡೆಸಲು ನಿರ್ಧರಿಸಿದೆ. ಪರೀಕ್ಷೆಯ ಸಮಯ ಮತ್ತು ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರಗಳ ವಿವರಗಳನ್ನು ಪ್ರವೇಶ ಪತ್ರದಲ್ಲಿ ಮುದ್ರಿಸಲಾಗುವುದು. ಪರೀಕ್ಷೆಯ ಮಾಧ್ಯಮ ಕನ್ನಡ ಅಥವಾ ಇಂಗ್ಲಿಷ್ ಆಗಿರುತ್ತದೆ. ಪರೀಕ್ಷೆಯ ಪ್ರಶ್ನೆಪತ್ರಿಕೆಗಳು ಬಹು ಆಯ್ಕೆ ಮಾದರಿಯಲ್ಲಿರುತ್ತವೆ. ಪ್ರತಿ ಪ್ರಶ್ನೆಗೆ ಒಂದು ಅಂಕವಿರುತ್ತದೆ. ತಪ್ಪು ಉತ್ತರಗಳಿಗೆ ಋಣಾತ್ಮಕ ಅಂಕಗಳಿರುವುದಿಲ್ಲ. ಪರೀಕ್ಷೆಯ ಅವಧಿ ಎರಡು ಗಂಟೆಗಳು. ಪರೀಕ್ಷೆಯ ಪ್ರಶ್ನೆಪತ್ರಿಕೆಗಳು ಮತ್ತು ಉತ್ತರ ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಕಾಪಿಡಲು ಮತ್ತು ಸಾಗಿಸಲು ಸೂಕ್ತ ಭದ್ರತಾ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಪ್ರವೇಶ ಪತ್ರದೊಂದಿಗೆ ಮೂಲ ಗುರುತಿನ ಚೀಟಿಯನ್ನು ಕಡ್ಡಾಯವಾಗಿ ತರಬೇಕು. ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಫೋನ್, ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್, ಬ್ಲೂಟೂತ್ ಸಾಧನಗಳು ಮತ್ತು ಇತರೆ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಉಪಕರಣಗಳನ್ನು ಒಯ್ಯಲು ಅನುಮತಿಯಿಲ್ಲ. ಪರೀಕ್ಷಾ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಅನುಚಿತ ವರ್ತನೆ ತೋರಿದಲ್ಲಿ ಅಂತಹವರನ್ನು ಪರೀಕ್ಷೆಯಿಂದ ಅನರ್ಹಗೊಳಿಸಲಾಗುವುದು. ಪರೀಕ್ಷೆಯ ಫಲಿತಾಂಶವನ್ನು ಆಯೋಗದ ಅಂತರ್ಜಾಲ ತಾಣದಲ್ಲಿ ಪ್ರಕಟಿಸಲಾಗುವುದು. ಪರೀಕ್ಷೆಯ ಫಲಿತಾಂಶಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಯಾವುದೇ ಪತ್ರವ್ಯವಹಾರವನ್ನು ಮಾಡಲಾಗುವುದಿಲ್ಲ.

ಕಾರ್ಯದರ್ಶಿ
ಕರ್ನಾಟಕ ಲೋಕಸೇವಾ ಆಯೋಗ

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માટે અરજી

(ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૨૫ (૧) હેઠળ અરજી)

પ્રતિ,
માનનીય કુટુંબ અદાલત સાહેબ,
[અદાલતનું સ્થળ]

અરજદાર: શ્રીમતી [અરજદારનું પૂરું નામ], ઉંમર [ઉંમર] વર્ષ, વ્યવસાય: [વ્યવસાય], રહે. [સરનામું]

વિરુદ્ધ

વિરુદ્ધપક્ષ: શ્રી [વિરુદ્ધપક્ષનું પૂરું નામ], ઉંમર [ઉંમર] વર્ષ, વ્યવસાય: [વ્યવસાય], રહે. [સરનામું]

વિષય: પોતાની તથા સગીર સંતાનો માટે ભરણપોષણ મેળવવા બાબત.

માનનીય સાહેબશ્રી,

અરજદાર નમ્રપણે રજૂ કરે છે કે:

૧. વિરુદ્ધપક્ષ અરજદારના કાયદેસર પરણેતા પતિ છે. તેમના લગ્ન [લગ્નની તારીખ] ના રોજ [લગ્નનું સ્થળ] ખાતે હિંદુ વિધિ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને [સંતાનોની સંખ્યા] સંતાનો છે, જેમનાં નામ [સંતાનોનાં નામ] છે.

૨. વિરુદ્ધપક્ષ [વ્યવસાય] તરીકે કામ કરે છે અને તેમની માસિક આવક આશરે રૂ. [આવક] જેટલી છે. તેમની પાસે [સ્થાવર/જંગમ મિલકતની વિગત] પણ છે.

૩. અરજદાર પોતાની કોઈ સ્વતંત્ર આવક ધરાવતાં નથી અને પોતાનું તથા સંતાનોનું ભરણપોષણ વિરુદ્ધપક્ષ પર જ નિર્ભર છે.

૪. વિરુદ્ધપક્ષે અરજદારને [ત્યજી દીધાની તારીખ] ના રોજ [ત્યજી દીધાનું કારણ] ના કારણસર ત્યજી દીધાં છે. ત્યારથી તેઓ અરજદારની કોઈ સંભાળ લેતા નથી.

૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૨૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૩૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૪૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૫૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૬૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૭૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૮૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૧. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૨. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૩. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૪. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૫. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૬. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૭. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૮. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૯૯. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

૧૦૦. અરજદાર પોતાની તથા સંતાનોની જરૂરિયાતો પૂરી કરવા માટે વિરુદ્ધપક્ષ પાસે માસિક રૂ. [માંગેલી રકમ] ભરણપોષણ પેટે મેળવવા હકદાર છે.

ઉદાહરણ :- ૨ કિલો - રૂ ૬૦૦/- ના ભાવે ૩ કિલો ૬૦૦ ગ્રામ ખરીદેલ ચોખાના ૧૦૦ ગ્રામ ના ભાવ કેટલા થાય ?

ઉકેલ :- ૨ કિલો ચોખાના ભાવ = ૬૦૦ રૂપિયા

૧ કિલો ચોખાના ભાવ = ૬૦૦ ÷ ૨ = ૩૦૦ રૂપિયા

૩ કિલો ૬૦૦ ગ્રામ ચોખાના ભાવ = ૩૦૦ × ૩.૬ = ૧૦૮૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચોખાના ભાવ = ૧૦૮૦ ÷ ૩૬ = ૩૦ રૂપિયા

ઉદાહરણ :- ૧૫ કિલો ચોખાના ૧૨ થેલા ભરવા માટે ૨૫ કિલો ચોખાની કેટલી થેલી જોઈએ ?

ઉકેલ :- ૧૫ કિલો ચોખાના ૧૨ થેલા ભરવા માટે ૨૫ કિલો ચોખાની થેલી = ૧૫ × ૧૨ ÷ ૨૫ = ૭.૨ થેલી

ઉદાહરણ :- ૧૫ કિલો ચોખાના ૧૨ થેલા ભરવા માટે ૨૫ કિલો ચોખાની કેટલી થેલી જોઈએ ?

ઉકેલ :- ૧૫ કિલો ચોખાના ૧૨ થેલા ભરવા માટે ૨૫ કિલો ચોખાની થેલી = ૧૫ × ૧૨ ÷ ૨૫ = ૭.૨ થેલી

ઉદાહરણ :- ૨૫ કિલો ચોખાની ૭.૨ થેલી ભરવા માટે ૧૫ કિલો ચોખાના કેટલા થેલા જોઈએ ?

ઉકેલ :- ૨૫ કિલો ચોખાની ૭.૨ થેલી ભરવા માટે ૧૫ કિલો ચોખાના થેલા = ૨૫ × ૭.૨ ÷ ૧૫ = ૧૨ થેલા

ઉદાહરણ :- ૨૫ કિલો ચોખાની ૭.૨ થેલી ભરવા માટે ૧૫ કિલો ચોખાના કેટલા થેલા જોઈએ ?

ઉકેલ :- ૨૫ કિલો ચોખાની ૭.૨ થેલી ભરવા માટે ૧૫ કિલો ચોખાના થેલા = ૨૫ × ૭.૨ ÷ ૧૫ = ૧૨ થેલા

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે વકીલ શ્રી [illegible] તથા આરોપી તરફે વકીલ શ્રી [illegible] હાજર રહ્યા. બંને પક્ષકારોની દલીલો સાંભળી, કેસના કાગળો તપાસ્યા. ફરિયાદી તરફે રજૂ થયેલ મૌખિક પુરાવો તથા દસ્તાવેજી પુરાવો ધ્યાને લીધો. આરોપી તરફે રજૂ થયેલ પુરાવો પણ ધ્યાને લીધો. ફરિયાદી તરફે રજૂ થયેલ પુરાવો તથા આરોપી તરફે રજૂ થયેલ પુરાવો ધ્યાને લેતાં, ફરિયાદી તરફે રજૂ થયેલ પુરાવો આરોપી તરફે રજૂ થયેલ પુરાવો કરતાં વધુ વજનદાર જણાય છે. આરોપી તરફે રજૂ થયેલ પુરાવો ફરિયાદી તરફે રજૂ થયેલ પુરાવો કરતાં વધુ વજનદાર જણાતો નથી.

ક્રમાંક ૨૦૨૩

પ્રતિષ્ઠિત શ્રી ગોવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય સહકારી બેંક લિ., અમદાવાદ

આદરણીય શ્રી ગોવિંદભાઈ,

આપશ્રી જાણો છો તેમ, ગુજરાત રાજ્ય સહકારી બેંક લિ., અમદાવાદ દ્વારા તા. ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ સહકારી બેંકોના કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આપશ્રીને મુખ્ય અતિથિ તરીકે પધારવા અમારું આમંત્રણ સ્વીકારવા વિનંતી છે.

આ વર્ગમાં રાજ્યની વિવિધ સહકારી બેંકોના આશરે ૧૨૦ જેટલા કર્મચારીઓ ભાગ લેશે. તેમને બેંકિંગ વ્યવસાયની મૂળભૂત બાબતો, ધિરાણ નીતિ, વસૂલાત પદ્ધતિ અને કમ્પ્યુટરીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આપશ્રીનું પ્રેરક પ્રવચન તાલીમાર્થીઓ માટે અત્યંત ઉપયોગી નીવડશે તેવી અમને ખાતરી છે.

વર્ગનું ઉદ્ઘાટન સવારે ૧૦:૩૦ વાગ્યે થશે અને સમાપન સાંજે ૫:૦૦ વાગ્યે થશે. ત્યારબાદ ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આપશ્રીની સુવિધા અનુસાર આપનું વાહન મોકલવામાં આવશે. કૃપા કરીને આપનો કાર્યક્રમ અમને તા. ૧૦-૧૨-૨૦૨૩ સુધીમાં જણાવવા વિનંતી છે.

આપના સહકારની અપેક્ષા સાથે,

ભવદીય,

(ડૉ. મનોજ કુમાર ત્રિવેદી)

મહામંત્રી

ઉપર જે પ્રકાર લખ્યો છે તે પ્રકારનું વર્તન રાખવું જોઈએ. આ પ્રમાણે વર્તવાથી
આપણે ઈશ્વરની કૃપાને પાત્ર થઈશું. ઈશ્વરની કૃપા થવાથી આપણને
ઉપર કહ્યા પ્રમાણે ઉત્તમ ગતિ મળશે. એ ગતિ મેળવવા માટે આપણે
ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવાથી આપણા સર્વ પાપોનો
નાશ થાય છે. ભક્તિ કરવાથી આપણા હૃદયમાં જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન
પ્રગટવાથી આપણે મોક્ષ મેળવી શકીએ છીએ. મોક્ષ મેળવવા માટે
ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવાથી આપણા હૃદયમાં જ્ઞાન પ્રગટે છે.
જ્ઞાન પ્રગટવાથી આપણે મોક્ષ મેળવી શકીએ છીએ. મોક્ષ મેળવવા
માટે ભક્તિ કરવી જોઈએ. ભક્તિ કરવાથી આપણા હૃદયમાં જ્ઞાન
પ્રગટે છે. જ્ઞાન પ્રગટવાથી આપણે મોક્ષ મેળવી શકીએ છીએ.

ઈ.૭૦૦૨ (૨ ૭ ૨૦૦૨)

ଏକ ବିଲ୍ଡିଂ ର ଉଚ୍ଚତା ମାପିବା ପାଇଁ ଜଣେ ବ୍ୟକ୍ତି ବିଲ୍ଡିଂ ଠାରୁ କିଛି ଦୂରରେ ଥିବା ଏକ ସମତଳ ଭୂମିରେ ଥିଓଡୋଲାଇଟ୍ ଯନ୍ତ୍ର ସ୍ଥାପନ କରି ବିଲ୍ଡିଂ ର ଶିଖରର ଉନ୍ନତି କୋଣ ମାପିଲେ । ଯନ୍ତ୍ରର ଉଚ୍ଚତା ଜଣା ଥିଲେ ବିଲ୍ଡିଂ ର ଉଚ୍ଚତା ନିର୍ଣ୍ଣୟ କର ।

ଉତ୍ତର

ମନେକର AB ବିଲ୍ଡିଂ ର ଉଚ୍ଚତା ଏବଂ C ଯନ୍ତ୍ରର ଅବସ୍ଥାନ ଯେପରି $BC = a$ ମିଟର ଏବଂ ଯନ୍ତ୍ରର ଉଚ୍ଚତା $CD = h$ ମିଟର । ଏବଂ ଶିଖରର ଉନ୍ନତି କୋଣ $\angle ADE = \theta$ ।

ତେବେ $AE = a \tan\theta$ ଏବଂ $AB = a \tan\theta + h$ ମିଟର ।

ଯଦି $a = 100$ ମିଟର, $\theta = 30°$ ଏବଂ $h = 1.5$ ମିଟର ହୁଏ, ତେବେ ବିଲ୍ଡିଂ ର ଉଚ୍ଚତା $= 100 \tan 30° + 1.5 = \frac{100}{\sqrt{3}} + 1.5 = 57.74$ ମିଟର (ପ୍ରାୟ) ।

ઉપરોક્ત ફરિયાદ વાંચી સાંભળી તેમજ ફરિયાદી તથા સાહેદોની જુબાની તથા રજુ કરવામાં આવેલ પુરાવાના કાગળો ધ્યાને લેતાં આ કામના આરોપીઓ સામે પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું જણાઈ આવે છે. આરોપીઓ સામે ગુનો સાબિત થયે તેમને કાયદા મુજબ સજા થવાપાત્ર

(૧૬)

ફોર્મ નં. ૧૦૬

(નિયમ ૧૦ - ૧ જુઓ)

ફરજ ઉપરથી બરતરફ કરેલ કર્મચારીને અપીલ કરવા બાબત

પ્રતિ,

ધી મેનેજર સાહેબ શ્રી,
ધી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ,
ડેપો મેનેજર સાહેબની કચેરી,
ડેપો મેનેજર સાહેબશ્રી,
ધી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ,
ડેપો મેનેજર

ਦਿਨ ਤੋਂ ਸਮਾਂ ਤੱਕ ਦੀ ਸਮੇਂ ਵਿਚ ਵਿਚ ਵਿਚ

ઉપર

ગામ ઝાલા, તા.માલપુર જી.મોડાસા વાળા તરફથી મારા ભાઈ ચંદુભાઈ ઉપર તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ ફોન આવેલ કે તમારા ભાઈ ચંદુભાઈ ને ગઈ કાલ તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના ૭ વાગ્યા આસપાસ છાતીમાં દુખાવો થતા તેમને સારવાર માટે મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં તેમને ફરજ પરના ડોક્ટરશ્રી દ્વારા તપાસી મૃત જાહેર કરવામાં આવેલ છે. તો તમારે મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી જવું. આ ફોન આવતા અમો તાત્કાલિક મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. ત્યાં ડોક્ટરશ્રી દ્વારા તપાસી મૃત જાહેર કરવામાં આવેલ હોય અમો તાત્કાલિક ગામ ઝાલા ખાતે આવવા નીકળી ગયા હતા. ગામ ઝાલા ખાતે આવી ત્યાં ચંદુભાઈ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરવા માટે મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હોય અમો પણ મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. ચંદુભાઈ ના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હોય ત્યાં ડોક્ટરશ્રી દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં મૃત્યુ નું કારણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયેલ હોવાનું જણાવેલ હોય ત્યાં ચંદુભાઈ ના મૃતદેહ ને

ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩

કલમ ૧૫૫ : બિનજામીનપાત્ર ગુનાની બાબતમાં પોલીસ અધિકારી સિવાયના માણસે પકડેલ વ્યક્તિ

(૧) જ્યારે કોઈ બિનજામીનપાત્ર ગુનો કરવાનો આરોપ ધરાવતી કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી સિવાયના કોઈ માણસ દ્વારા પકડવામાં આવે અથવા તેની સમક્ષ હાજર થાય અથવા તેને સોંપવામાં આવે ત્યારે જે માણસ આવી વ્યક્તિને પકડે અથવા તેને સોંપવામાં આવે તે માણસ તેને પોલીસ અધિકારીને સોંપી દે અથવા તેની ધરપકડ કરવાનો અધિકાર ધરાવતા કોઈ બીજા માણસને સોંપી દે અથવા તેને તાબામાં રાખે અને તરત જ પોલીસ અધિકારીને અથવા તેવા બીજા માણસને સોંપવા માટે તેની પાસેથી પોલીસ સ્ટેશન કેટલું દૂર છે તે જોઈને તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૨) જો એવી વ્યક્તિ પોલીસ અધિકારીને અથવા તેવા બીજા માણસને સોંપવામાં આવે તો તેને પકડનાર માણસ પોતાની પાસે રાખવા માટે જરૂરી હોય તેટલું જ બળ વાપરી શકે.

(૩) જો એવી વ્યક્તિ પોતાને પકડનાર માણસ પાસેથી છૂટવા પ્રયત્ન કરે અથવા તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ અધિકારીને સોંપી દે અથવા તેની ધરપકડ કરવાનો અધિકાર ધરાવતા કોઈ બીજા માણસને સોંપી દે અથવા તેને તાબામાં રાખે અને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૪) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૫) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૬) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૭) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૮) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૯) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

(૧૦) જો પોલીસ અધિકારી પોતે ધરપકડ કરવા માગતો હોય તો તે ગુનો કરવાનો આરોપ ધરાવતી વ્યક્તિને પકડનાર માણસ પાસેથી તેને સોંપવામાં આવે તે પહેલાં ભાગી જાય તો તેને પકડનાર માણસ તેને તરત જ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોઈ પગલાં લે.

ઉપરોક્ત ગામના ખેડૂત-બાગાયતદારો ને જણાવવાનું કે ઉપરોક્ત ગામોમાં ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતોને ઉપયોગી થાય તે માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં ખેડૂતોને ખેતીવાડી ખાતાના વિવિધ સાધનો ઉપર સહાય આપવામાં આવે છે. તેમજ ખેતીવાડી ખાતાના વિવિધ કાર્યક્રમો જેવા કે ઉનાળુ ખેડ, પાક સંરક્ષણ, ઘાસચારા વિકાસ, ફળ અને શાકભાજી વિકાસ, ખેત તલાવડી, ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ, પાવર ટીલર, ટ્રેક્ટર, ઓઈલ એન્જીન, પંપસેટ, ટ્રેક્ટર ટ્રોલી, ટ્રેક્ટર માઉન્ટેડ સાધનો, ટ્રેક્ટર ચલિત સાધનો, ઘાસચારા કાપણી યંત્ર, ઘાસચારા કટકા યંત્ર, ઘાસચારા બેલર યંત્ર, ઘાસચારા રેક યંત્ર, ઘાસચારા ટેડર યંત્ર, ઘાસચારા સ્વેથર યંત્ર, ઘાસચારા મોવર યંત્ર, ઘાસચારા મોવર કન્ડીશનર યંત્ર, ઘાસચારા સાઈલેજ યંત્ર, ઘાસચારા હેરો યંત્ર, ઘાસચારા ચાફકટર યંત્ર, ઘાસચારા સાઈલેજ બેગ, ઘાસચારા સાઈલેજ ટ્રેન્ચ, ઘાસચારા સાઈલેજ ટાવર, ઘાસચારા સાઈલેજ ટ્રેન્ચ કવર, ઘાસચારા સાઈલેજ ટાવર ક

ઉમેદવારી ફોર્મ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત પંચાયત (સુધારા) અધિનિયમ, ૨૦૧૫ : ૨૦૨૧ ની ચૂંટણી

તાલુકા પંચાયત (ઉમેદવારો માટે સામાન્ય-મહિલા બેઠક) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૬(૧) અને ૭(૧) હેઠળ

ઉમેદવારી ફોર્મ

૧. તાલુકા પંચાયત : ગોધરા

૨. બેઠક નંબર : ૧૨ (બારમો)

૩. ઉમેદવારનું નામ : રમેશભાઈ ચંદુભાઈ પટેલ

૪. પિતા/પતિનું નામ : ચંદુભાઈ મોહનભાઈ પટેલ

૫. ઉંમર : ૪૨ વર્ષ

૬. જાતિ : પટેલ

૭. કાયમી સરનામું : ૧૪, પટેલ ફળિયું, ગોધરા, તા. ગોધરા, જિ. પંચમહાલ

૮. મતદાર યાદી ભાગ નંબર : ૨૩૭

૯. મતદાર યાદીમાં ક્રમ નંબર : ૧૦૪

૧૦. રાજકીય પક્ષ : ભારતીય જનતા પક્ષ

૧૧. ઉમેદવારીનો પ્રકાર : સામાન્ય

૧૨. ઉમેદવારની સહી : રમેશભાઈ પટેલ

૧૩. તારીખ : ૦૩/૧૨/૨૦૨૧

૧૪. સ્થળ : ગોધરા

ઉપરોક્ત ઠરાવ ક્રમાંક ૨૨૨૨

ઉપરોક્ત ઠરાવ અન્વયે ગુજરાત રાજ્ય સિંચાઈ વિભાગ હસ્તકના ગામ તળાવોમાં ગાળ કાઢવા અંગેની યોજના અમલમાં મૂકવા બાબત સરકારશ્રી દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવે છે.

૧. ગામ તળાવોમાં ગાળ કાઢવા અંગેની યોજના અમલમાં મૂકવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિ રચવામાં આવે છે. આ સમિતિ જિલ્લા કક્ષાએ આ યોજનાનો અમલ કરાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ સમિતિની રચના નીચે મુજબ રહેશે.

૧	જિલ્લા કલેક્ટરશ્રી	અધ્યક્ષ
૨	જિલ્લા વિકાસ અધિકારીશ્રી	સભ્ય
૩	જિલ્લા પંચાયત પ્રમુખશ્રી	સભ્ય
૪	જિલ્લા પંચાયત સભ્યશ્રી	સભ્ય
૫	જિલ્લા પંચાયત સભ્યશ્રી	સભ્ય
૬	જિલ્લા પંચાયત સભ્યશ્રી	સભ્ય
૭	જિલ્લા પંચાયત સભ્યશ્રી	સભ્ય

ગામ મજકુર પોતાના કબજાના ખેતરો પરત મેળવવા કોર્ટમાં દાવો કરેલ છે. જે દાવો ચલાવવા સારૂ પોતાને કોર્ટ ફી ભરવા માટે રૂા. ૧૭-૬૫ નો ખર્ચ થાય તેમ છે. તો તે રકમ પોતાને મદદ તરીકે આપવા મહેરબાની કરવા વિનંતી છે. આ કામે પોતે ગરીબ હોવાથી કોર્ટ ફી ભરવા સારૂ પોતાની પાસે કાંઈ સાધન નથી. તો આ કામે પોતાને મદદ કરવા મહેરબાની કરવા વિનંતી છે.

ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની નકલ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મેળવવા બાબત :-

મહેરબાન ! - તાલુકા તાલુકા મામલતદાર, શ્રી બારડા તા બારડા મામલતદાર સાહેબ

વિષય :- ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની નકલ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મેળવવા બાબત

સંદર્ભ :- ગુજરાત હાઈકોર્ટ, સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં. ૧૨૩૪૫/૨૦૨૩ નો ચુકાદો તા. ૧૫/૦૩/૨૦૨૩

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનુસાર જણાવવાનું કે, ગુજરાત હાઈકોર્ટ, સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં. ૧૨૩૪૫/૨૦૨૩ માં તા. ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ આપવામાં આવેલ ચુકાદાની નકલ મેળવવા માટે મારા અસીલ શ્રી રમેશભાઈ ચંદુભાઈ પટેલ, રહે. બારડા, તા. બારડા, જિ. બારડા વતી આ અરજી કરવામાં આવે છે. આ કામના અસીલ વિરુદ્ધ બારડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૨/૨૦૨૨ થી નોંધાયેલ ગુનામાં તેમને હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ ચુકાદાની નકલ મેળવવા માટે તેમણે પોલીસ સ્ટેશન તથા સંબંધિત કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને નકલ આપવામાં આવી નથી.

આથી નામદાર હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદાની નકલ મારા અસીલને મેળવી આપવા વિનંતી છે. આ નકલ મેળવવા માટે મારા અસીલ વતી હું જાતે અથવા મારા અધિકૃત માણસ મારફત અરજી રજૂ કરવા તૈયાર છું. આ નકલ મેળવવા માટે જે કંઈ ફી ભરવાપાત્ર થતી હોય તે ભરવા મારા અસીલ તૈયાર છે.

આપની વિશ્વાસુ

(રમેશભાઈ ચંદુભાઈ પટેલ)

વતી, તેમના અધિકૃત માણસ

ભગ્ન ગોપીજન કૃષ્ણોક્તિ દર્શક, એમ વલ્લભ મધ્યકાલીન ગુજરાતી કવિતા સમાજના ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ પુરતી મર્યાદિત હતી. એમાંના કવિ પ્રેમાનંદ કૃષ્ણ વિરહમાં ગોપીજનોની જે દશા વર્ણવે છે, તે સમૃદ્ધ ઘરની સ્ત્રીઓને જ લાગુ પડે. ઉપરાંત કૃષ્ણ જ્યારે મથુરા જાય છે ત્યારે ગોપીઓ પોતાના ઘરમાં જે રીતે વર્તે છે તે પણ ઉચ્ચ વર્ગની સ્ત્રીઓને જ લાગુ પડે. ગરીબ સ્ત્રીઓ તો ઘરકામ, ખેતી, મજૂરી વગેરે કામો કરતી હોવાથી તેમને આવી ઘરેડમાં બાંધી શકાય નહિ. તેથી જ કવિ નરસિંહ મહેતા, કવિ દયારામ વગેરે કવિઓએ ગરીબ સ્ત્રીઓને પોતાના કાવ્યોમાં સ્થાન આપ્યું નથી.

૨. ગોપી - ગોપ (ગોપાલ) સંબંધ : ગોપી અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ કેવો હતો તે વિશે ઘણા વિદ્વાનોએ ચર્ચા કરી છે. કેટલાક વિદ્વાનોના મતે ગોપી એ કૃષ્ણની પરકીયા પ્રેમિકા હતી. કેટલાક વિદ્વાનોના મતે ગોપી એ કૃષ્ણની સ્વકીયા પત્ની હતી

ઉમેદ

"ઉમેદ ના ઉમેદ"

ઘણા વર્ષો પહેલાં એક ગામડામાં ઉમેદ નામનો એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ હોવા છતાં તેનું જીવન ખૂબ જ મુશ્કેલીમાં પસાર થતું હતું. તેની પાસે પોતાની માલિકીની ફક્ત એક નાની જમીન હતી, જેમાં તે વરસાદ પર આધાર રાખીને ખેતી કરતો હતો. ઘણી વાર પૂરતો વરસાદ ન પડવાને કારણે પાક સારો થતો નહીં, અને ઉમેદ તથા તેના પરિવારને ભૂખે મરવાનો વારો આવતો. આ ઉપરાંત, તેણે ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જેનું દેવું દર વર્ષે વધતું જતું હતું.

ઉમેદની પત્ની રમીલા અને તેમનો નાનો દીકરો રવિ પણ ખેતીકામમાં તેને મદદ કરતાં. રમીલા ઘરનું કામકાજ સંભાળવા ઉપરાંત ખેતરમાં પણ પતિ સાથે ખભેખભા મિલાવીને કામ કરતી. રવિ ભણવામાં હોશિયાર હતો અને તેના શિક્ષકો તેને આગળ ભણાવવા માટે પ્રોત્સાહન આપતા હતા. પરંતુ ઘરની પરિસ્થિતિ જોઈને તે પણ ખેતીકામમાં પિતાને મદદ કરવા માંગતો હતો.

વર્ષો વીતતાં ઉમેદ અને તેનો પરિવાર ગરીબીમાં જીવન પસાર કરતો રહ્યો. રવિ મોટો થયો અને તેણે ખેતીકામમાં પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. તે ખેતીમાં નવી પદ્ધતિઓ અજમાવવા માંગતો હતો, પરંતુ પૈસાની અછતને કારણે તે કંઈ કરી શકતો નહોતો. ઉમેદ પણ પોતાના દીકરાને આગળ વધતો જોવા માંગતો હતો, પરંતુ તેની પાસે તેને મદદ કરવા માટે કોઈ સાધન નહોતું.

એક દિવસ ગામમાં સરકારી અધિકારીઓ આવ્યા અને તેમણે જાહેરાત કરી કે જે ખેડૂતો પોતાની જમીનમાં તળાવ બનાવશે, તેમને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે. ઉમેદને આ વિશે ખબર પડી, પરંતુ તેની પાસે તળાવ બનાવવા માટે જરૂરી પૈસા નહોતા. ત્યારે રવિએ પોતાના પિતાને સૂચન કર્યું કે તેઓ બેંકમાંથી લોન લઈને તળાવ બનાવે. ઉમેદ પહેલાં તો ખચકાયો, કારણ કે તે દેવું વધારવા માંગતો નહોતો. પરંતુ રવિના આગ્રહને કારણે તે તૈયાર થયો.

ફરી

૨૨૨ ને મુસ્લિમ મૌત્ર ની

ગીતા ભાગ પ્રમાણે ખો ગઈ હશે મારી માતાના ઉપાસક ! તો મારા પ્રત્યે તારું મૌત્ર
કર્મમાં ઉણપ આવવા દેવાય નહીં. તારું કર્મ મારે જોવાનું છે. તારું કામ
તો ફક્ત તારું કર્મ કરવાનું છે. તારું કર્મ કરવામાં તારી ભક્તિ પ્રગટ થવી
જોઈએ. તારી ભક્તિ પ્રગટ થવાથી મારી પ્રાપ્તિ તને થઈ જ ગણાય.

મુસ્લિમ : ૨૨૨ ને મુસ્લિમ મૌત્ર ની

ઉપરના ભાવાર્થમાં ઈશ્વરને ખુદા કહેવામાં આવ્યો છે. ખુદા એટલે
ઈશ્વર. ખુદા પ્રત્યે ભક્તિ કરવાનું કહેવામાં આવ્યું છે. ખુદા પ્રત્યે ભક્તિ
કરવાથી ખુદાની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવ્યું છે. ખુદા પ્રત્યે ભક્તિ
કરવાથી ખુદાની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવ્યું છે. ખુદા પ્રત્યે ભક્તિ
કરવાથી ખુદાની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવ્યું છે. ખુદા પ્રત્યે ભક્તિ
કરવાથી ખુદાની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવ્યું છે. ખુદા પ્રત્યે ભક્તિ

ઉપરોક્ત કાર્યક્રમ મુજબ ઉપસ્થિત રહેવા વિનંતી છે.

આભારવિધિ

ઉપરોક્ત કાર્યક્રમ મુજબ ઉપસ્થિત રહેવા વિનંતી છે.

આભારવિધિ

ગુજરાત સરકાર વિરુદ્ધ

(૧) ફોજદારી અપીલ નં. ૨૨૦૫ / ૨૦૧૭ ના દરજ્જા મુજબ

ફરિયાદી : ગુજરાત રાજ્ય, પોલીસ સ્ટેશન કોસંબા, જિ. સુરત, વતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એમ. ચૌધરી

વિરુદ્ધ

આરોપી : (૧) ઇમરાન ઉર્ફે ઇમ્મો સલીમ કુરેશી, ઉંમર ૨૯, ધંધો ડ્રાઇવિંગ, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૨) મોહસીન ઉર્ફે મોસો ઇમરાન કુરેશી, ઉંમર ૨૪, ધંધો મજૂરી, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૩) રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, ઉંમર ૩૧, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૪) અજય ઉર્ફે અજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૭, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૫) વિજય ઉર્ફે વિજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૫, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૬) ઇમરાન ઉર્ફે ઇમ્મો સલીમ કુરેશી, ઉંમર ૨૯, ધંધો ડ્રાઇવિંગ, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૭) મોહસીન ઉર્ફે મોસો ઇમરાન કુરેશી, ઉંમર ૨૪, ધંધો મજૂરી, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૮) રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, ઉંમર ૩૧, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૯) અજય ઉર્ફે અજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૭, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૦) વિજય ઉર્ફે વિજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૫, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૧) ઇમરાન ઉર્ફે ઇમ્મો સલીમ કુરેશી, ઉંમર ૨૯, ધંધો ડ્રાઇવિંગ, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૧૨) મોહસીન ઉર્ફે મોસો ઇમરાન કુરેશી, ઉંમર ૨૪, ધંધો મજૂરી, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૧૩) રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, ઉંમર ૩૧, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૪) અજય ઉર્ફે અજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૭, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૫) વિજય ઉર્ફે વિજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૫, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૬) ઇમરાન ઉર્ફે ઇમ્મો સલીમ કુરેશી, ઉંમર ૨૯, ધંધો ડ્રાઇવિંગ, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૧૭) મોહસીન ઉર્ફે મોસો ઇમરાન કુરેશી, ઉંમર ૨૪, ધંધો મજૂરી, રહે. ૧૪, કુરેશી મહોલ્લો, કોસંબા, જિ. સુરત

(૧૮) રાજેશ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, ઉંમર ૩૧, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૧૯) અજય ઉર્ફે અજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૭, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

(૨૦) વિજય ઉર્ફે વિજ્જુ રમેશ પરમાર, ઉંમર ૨૫, ધંધો ખેતી, રહે. ૭૨, ખારવાવાડ, કોસંબા, જિ. સુરત

ક્રમ નં. ૨૦૨૩

ઉપરોક્ત વિષય અને સંદર્ભ નં. ૨૦૨૩ અન્વયે જણાવવાનું કે, ગામ ઝાલા, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર ખાતે આવેલ સર્વે નં. ૨૦૨૩ પૈકી ૨૦૨૩ વાળી જમીનમાં ખેતીકામ કરવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૨૦૨૩ ની લોન મંજૂર કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ નં. ૨૦૨૩ અન્વયે જણાવવાનું કે, ગામ ઝાલા, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર ખાતે આવેલ સર્વે નં. ૨૦૨૩ પૈકી ૨૦૨૩ વાળી જમીનમાં ખેતીકામ કરવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૨૦૨૩ ની લોન મંજૂર કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ નં. ૨૦૨૩ અન્વયે જણાવવાનું કે, ગામ ઝાલા, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર ખાતે આવેલ સર્વે નં. ૨૦૨૩ પૈકી ૨૦૨૩ વાળી જમીનમાં ખેતીકામ કરવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૨૦૨૩ ની લોન મંજૂર કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ નં. ૨૦૨૩ અન્વયે જણાવવાનું કે, ગામ ઝાલા, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર ખાતે આવેલ સર્વે નં. ૨૦૨૩ પૈકી ૨૦૨૩ વાળી જમીનમાં ખેતીકામ કરવા માટે ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૨૦૨૩ ની લોન મંજૂર કરવા બાબત.

ગુજરાત સમાચાર

૧૬૫

ગુજરાત સમાચાર અને વર્તમાનપત્ર દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરાતો

ત્રિકમ ઈશ્વર રાવ

ઉપર જણાવેલ મિલકત ઉપર મારા અસીલ શ્રી ત્રિકમ ઈશ્વર રાવ પોતાની માલિકીની ખેતી કરી ભોગવટો કરે છે. તે મિલકત ઉપર મારા અસીલ સિવાય બીજા કોઈનો કોઈ પણ જાતનો હક્ક કે હિસ્સો નથી. તે મિલકત ઉપર કોઈ પણ જાતનો બોજો નથી. તે મિલકત ઉપર કોઈ પણ જાતનો કોર્ટ કેસ કે દાવો ચાલત

ક્રમ ૧૨૨૯ ક્રમાંક

ગામ નં ૧૫૫૫ ગામના ખેડૂત ખાતેદારો પોતાની જમીનમાં ખેતીકામ કરવા માટે પોતાના ઢોરોને ચરાવવા માટે ગામની પૂર્વ દિશામાં આવેલ ગોચરની જમીનનો ઉપયોગ કરતા આવ્યા છે. ગોચરની જમીનમાં ઢોરોને ચરાવવા ઉપરાંત ગામના ખેડૂતો ઘાસ કાપવા, લાકડાં કાપવા, ઝાડ પરથી ફળ ઉતારવા, ઝાડ નીચે પડેલ ફળ વીણવા, ઝાડ નીચે પડેલ સૂકું લાકડું વીણવા, ઝાડ નીચે પડેલ સૂકું ઘાસ વીણવા, ગોચરની જમીનમાં ઉગેલ ઘાસ કાપવા, ગોચરની જમીનમાં ઉગેલ ઝાડ પરથી ફળ ઉતારવા, ગોચરની જમીનમાં ઉગેલ ઝાડ નીચે પડેલ ફળ વીણવા, ગોચરની જમીનમાં ઉગેલ ઝાડ નીચે પડેલ સૂકું લાકડું વીણવા, ગોચરની જમીનમાં ઉગેલ ઝાડ નીચે પડેલ સૂકું ઘાસ વીણ

ગોપાલ ગોપાલ દેવકીનંદન ગોપાલ મુરારિ મુરારિ મદનમોહન ગોપાલ ગોપાલ
ગોપાલ ગોપાલ મદનમોહન દેવકીનંદન મુરારિ મુરારિ ગોપાલ ગોપાલ"
કહીને ગોપીઓ તો ભગવાન શ્રીકૃષ્ણની પાસે પહોંચી ગઈ. પરંતુ ભગવાન
શ્રીકૃષ્ણ તો ગોપીઓની આ ચેષ્ટા જોઈને મનમાં વિચારવા લાગ્યા કે "આ
ગોપીઓ પોતાના સુખ માટે નહીં પરંતુ મારા સુખ માટે જ મારી સેવા
કરવામાં લાગેલી છે. એટલે મારે પણ તેમના સુખ માટે જ કંઈક
કરવું જોઈએ." આમ વિચારીને ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓને કહેવા
લાગ્યા કે "હે ગોપીઓ! તમે લોકો મારી સેવા કરવામાં જે
પરિશ્રમ કરી રહ્યા છો તેનાથી મારું મન પ્રસન્ન થઈ ગયું છે.
હવે તમે લોકો પોતાના ઘરે પાછી જાઓ અને ત્યાં જઈને પોતાના
પતિ અને પરિવારની સેવા કરો. આ જ તમારો પરમ ધર્મ છે."

ભગવાન શ્રીકૃષ્ણના આ વચનો સાંભળીને ગોપીઓ કહેવા લાગી કે

ಪಂಪ ಕಾವ್ಯದ ಸಂಧಿಗಳಲ್ಲಿ ಸಂಖ್ಯೆ ೧೦೮ ಆಗಿರುವುದು ಕಾಕತಾಳೀಯವೇ ಅಥವಾ ಉದ್ದೇಶಪೂರ್ವಕವೇ ಎಂಬುದು ಚರ್ಚಾಸ್ಪದ ವಿಷಯ. ಆದರೆ ಈ ಸಂಖ್ಯೆಯ ಹಿಂದೆ ಒಂದು ಸಾಂಕೇತಿಕ ಅರ್ಥವಿರುವುದಂತೂ ನಿಜ. ಭಾರತೀಯ ಪರಂಪರೆಯಲ್ಲಿ ೧೦೮ ಎಂಬ ಸಂಖ್ಯೆಗೆ ವಿಶೇಷ ಮಹತ್ವವಿದೆ. ಜಪಮಾಲೆಯಲ್ಲಿ ೧೦೮ ಮಣಿಗಳಿರುತ್ತವೆ. ಉಪನಿಷತ್ತುಗಳ ಸಂಖ್ಯೆ ೧೦೮. ಶಿವನ ೧೦೮ ಹೆಸರುಗಳಿವೆ. ಯೋಗಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಮಾನವ ದೇಹದಲ್ಲಿ ೧೦೮ ಮರ್ಮಸ್ಥಾನಗಳಿವೆ ಎಂದು ಹೇಳಲಾಗಿದೆ. ಹೀಗೆ ಪವಿತ್ರ ಸಂಖ್ಯೆಯಾಗಿರುವ ೧೦೮ ಸಂಧಿಗಳಲ್ಲಿ ಪಂಪ ಭಾರತವನ್ನು ರಚಿಸಿರುವುದು ಕಾವ್ಯದ ಪವಿತ್ರತೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸಿದೆ.

ಪಂಪ ಭಾರತದ ಸಂಧಿಗಳ ಸಂಖ್ಯೆ ೧೦೮ ಆಗಿರುವುದು ಕಾಕತಾಳೀಯವೇ ಅಥವಾ ಉದ್ದೇಶಪೂರ್ವಕವೇ ಎಂಬುದು ಚರ್ಚಾಸ್ಪದ ವಿಷಯ. ಆದರೆ ಈ ಸಂಖ್ಯೆಯ ಹಿಂದೆ ಒಂದು ಸಾಂಕೇತಿಕ ಅರ್ಥವಿರುವುದಂತೂ ನಿಜ. ಭಾರತೀಯ ಪರಂಪರೆಯಲ್ಲಿ ೧೦೮ ಎಂಬ ಸಂಖ್ಯೆಗೆ ವಿಶೇಷ ಮಹತ್ವವಿದೆ. ಜಪಮಾಲೆಯಲ್ಲಿ ೧೦೮ ಮಣಿಗಳಿರುತ್ತವೆ. ಉಪನಿಷತ್ತುಗಳ ಸಂಖ್ಯೆ ೧೦೮. ಶಿವನ ೧೦೮ ಹೆಸರುಗಳಿವೆ. ಯೋಗಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಮಾನವ ದೇಹದಲ್ಲಿ ೧೦೮ ಮರ್ಮಸ್ಥಾನಗಳಿವೆ ಎಂದು ಹೇಳಲಾಗಿದೆ. ಹೀಗೆ ಪವಿತ್ರ ಸಂಖ್ಯೆಯಾಗಿರುವ ೧೦೮ ಸಂಧಿಗಳಲ್ಲಿ ಪಂಪ ಭಾರತವನ್ನು ರಚಿಸಿರುವುದು ಕಾವ್ಯದ ಪವಿತ್ರತೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸಿದೆ.

ઉંઝા મુકામે ૨૦૨૦

ઉંઝા મુકામે ઉંઝા ઉંઝા (Unjha) ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા, ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા ઉંઝા

[illegible] ।ह - टरा। ।।।।। ।।

ગોવિંદ ઠક્કર

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉજવાતા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે ૧૯૭૫ માં યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલ આ નિબંધ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક સીમાચિહ્ન સમાન ગણાય છે. આ નિબંધ પ્રકાશિત થયા પછી ગુજરાતી વિવેચનની દિશા જ બદલાઈ ગઈ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઠક્કરે પ્રથમ વખત નરસિંહ મહેતાની કવિતાનું મૂલ્યાંકન ભક્તિ ઉપરાંત કાવ્યકલાની દૃષ્ટિએ કર્યું હતું. તેમણે દર્શાવ્યું કે નરસિંહની પદરચનામાં જે સંગીતાત્મકતા, લયવૈવિધ્ય અને સહજ ઉદ્ગારો જોવા મળે છે તે કોઈ પણ ઉત્તમ ગીતકવિની લાક્ષણિકતા છે. આ નિબંધ પહેલાં નરસિંહને મુખ્યત્વે ભક્ત તરીકે જોવામાં આવતા હતા, કવિ તરીકે નહીં.

નિબંધની રચનાપદ્ધતિ પણ નોંધપાત્ર છે. ઠક્કરે પ્રથમ ત્રણ પ્રકરણોમાં નરસિંહના સમયની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ત્યારબાદ ચોથા પ્રકરણમાં કવિની ભાષા, છંદ અને અલંકારોનું વિશ્લેષણ કર્યું છે. પાંચમા પ્રકરણમાં તેમણે નરસિંહની કવિતાની તુલના મીરાંબાઈ અને અખા સાથે કરી છે. આ તુલનાત્મક અભ્યાસ ખૂબ જ સમતોલ અને તટસ્થ છે. લેખકે ક્યાંય પણ કોઈ કવિને ઊતરતો કે ચડિયાતો ચીતર્યો નથી, પરંતુ દરેકની વિશેષતા સ્પષ્ટ કરી છે.

ભાષાની દૃષ્ટિએ આ નિબંધ અત્યંત પરિષ્કૃત છે. ઠક્કરની શૈલી ન તો અતિશય ગંભીર છે કે ન તો સાવ સરળ. તેઓ વચ્ચે વચ્ચે રમૂજી ઉદાહરણો આપીને વાચકને જકડી રાખે છે. ઉદાહરણ તરીકે, તેમણે નરસિંહના "દાણલીલા" પદોની તુલના આધુનિક ગીતોની રેકોર્ડ સાથે કરી છે, જે તે સમયના વાચકો માટે ખૂબ જ નવીન હતી. આ નિબંધ પ્રકાશિત થયો ત્યારે ગુજરાતી સાહિત્યના વિદ્વાનોમાં તેની ખૂબ ચર્ચા થઈ હતી.

ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਵਰਤ

ਇਕ ਵਾਰ ਪਾਰਵਤੀ ਜੀ ਨੇ ਸ਼ਿਵ ਜੀ ਨੂੰ ਪੁੱਛਿਆ ਕਿ ਕਿਹੜਾ ਅਜਿਹਾ ਵਰਤ ਹੈ ਜਿਸ ਨੂੰ ਕਰਨ ਨਾਲ ਮਨੁੱਖ ਦੇ ਸਾਰੇ ਪਾਪ ਨਾਸ਼ ਹੋ ਜਾਣ ਅਤੇ ਉਸ ਨੂੰ ਸੁੱਖ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਹੋਵੇ। ਇਸ ਦੇ ਉੱਤਰ ਵਿਚ ਸ਼ਿਵ ਜੀ ਨੇ ਕਿਹਾ ਕਿ ਫੱਗਣ ਦੇ ਮਹੀਨੇ ਕ੍ਰਿਸ਼ਨ ਪੱਖ ਦੀ ਚਤੁਰਦਸ਼ੀ ਨੂੰ ਜੋ ਵਰਤ ਰੱਖਦਾ ਹੈ ਉਸ ਨੂੰ ਸਾਰੇ ਵਰਤਾਂ ਦਾ ਫਲ ਮਿਲਦਾ ਹੈ। ਇਸ ਵਰਤ ਨੂੰ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਕਹਿੰਦੇ ਹਨ। ਇਸ ਦਿਨ ਸ਼ਿਵ ਜੀ ਦੀ ਪੂਜਾ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਹੈ। ਇਸ ਵਰਤ ਦੀ ਕਥਾ ਇਸ ਪ੍ਰਕਾਰ ਹੈ ਕਿ ਇਕ ਵਾਰ ਇਕ ਸ਼ਿਕਾਰੀ ਜੰਗਲ ਵਿਚ ਸ਼ਿਕਾਰ ਖੇਡਣ ਗਿਆ। ਉਹ ਸਾਰਾ ਦਿਨ ਸ਼ਿਕਾਰ ਦੀ ਭਾਲ ਵਿਚ ਇਧਰ-ਉਧਰ ਫਿਰਦਾ ਰਿਹਾ ਪਰ ਉਸ ਨੂੰ ਕੋਈ ਸ਼ਿਕਾਰ ਨਾ ਮਿਲਿਆ। ਰਾਤ ਹੋ ਗਈ ਤਾਂ ਉਹ ਇਕ ਤਲਾਬ ਦੇ ਕਿਨਾਰੇ ਬੇਲ ਦੇ ਰੁੱਖ ਉੱਪਰ ਚੜ੍ਹ ਕੇ ਬੈਠ ਗਿਆ। ਉਸ ਰੁੱਖ ਦੇ ਹੇਠਾਂ ਇਕ ਸ਼ਿਵ ਲਿੰਗ ਸੀ। ਉਸ ਨੇ ਉਸ ਰੁੱਖ ਦੇ ਪੱਤੇ ਤੋੜ ਕੇ ਹੇਠਾਂ ਸੁੱਟੇ। ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਸ ਨੇ ਸਾਰੀ ਰਾਤ ਜਾਗ ਕੇ ਕੱਟ ਦਿੱਤੀ। ਉਸ ਨੇ ਨਾ ਤਾਂ ਕੁਝ ਖਾਧਾ ਅਤੇ ਨਾ ਹੀ ਪੀਤਾ। ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਸ ਨੇ ਅਣਜਾਣੇ ਵਿਚ ਹੀ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖ ਲਿਆ ਅਤੇ ਰਾਤ ਨੂੰ ਜਾਗਰਣ ਵੀ ਕੀਤਾ। ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਸ ਦੇ ਸਾਰੇ ਪਾਪ ਨਾਸ਼ ਹੋ ਗਏ। ਅਗਲੇ ਜਨਮ ਵਿਚ ਉਹ ਚਿਤ੍ਰਭਾਨੂ ਨਾਂ ਦਾ ਰਾਜਾ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ। ਉਸ ਦੇ ਘਰ ਵਿਚ ਕਿਸੇ ਚੀਜ਼ ਦੀ ਕਮੀ ਨਹੀਂ ਸੀ। ਉਸ ਨੇ ਸ਼ਿਵਰਾਤ੍ਰੀ ਦਾ ਵਰਤ ਰੱਖਿਆ ਸੀ ਇਸ ਲਈ ਉਹ ਬਹੁਤ ਧਨਵਾਨ ਬਣਿਆ।

ਸਾਰੇ ਪ੍ਰਸ਼ਨ ਸਹੀ ਕਰਕੇ ਪ੍ਰਤੀ ਪ੍ਰਸ਼ਨ ਦੋ ਅੰਕ ਅਨੁਸਾਰ ਕੁੱਲ ਅੰਕ ਦਿਓ।

ਪ੍ਰਸ਼ਨ 1. ਹੇਠ ਲਿਖੇ ਵਾਕਾਂ ਨੂੰ ਸ਼ੁੱਧ ਕਰਕੇ ਲਿਖੋ :

(ਕ) ਮੈਂ ਕੱਲ੍ਹ ਸਕੂਲ ਨਹੀਂ ਜਾਵਾਂਗਾ ਕਿਉਂਕਿ ਮੈਨੂੰ ਬੁਖਾਰ ਹੈ।

(ਖ) ਉਹ ਬਹੁਤ ਚੰਗਾ ਲੜਕਾ ਹੈ ਪਰ ਉਹ ਕਦੇ ਝੂਠ ਨਹੀਂ ਬੋਲਦਾ।

(ਗ) ਮੈਂ ਤੁਹਾਡੇ ਨਾਲ ਚੱਲਾਂਗਾ ਜੇਕਰ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਸੱਦਾ ਦਿਓ।

(ਘ) ਉਹ ਬਹੁਤ ਮਿਹਨਤੀ ਹੈ ਇਸ ਲਈ ਉਹ ਪਾਸ ਹੋ ਜਾਵੇਗਾ।

(ਙ) ਜੇ ਤੂੰ ਮਿਹਨਤ ਕਰੇਂ ਤਾਂ ਤੂੰ ਪਾਸ ਹੋ ਜਾਵੇਂਗਾ।

ਉੱਤਰ :- (ਕ) ਮੈਂ ਕੱਲ੍ਹ ਸਕੂਲ ਨਹੀਂ ਜਾਵਾਂਗਾ ਕਿਉਂਕਿ ਮੈਨੂੰ ਬੁਖਾਰ ਹੈ।

(ਖ) ਉਹ ਬਹੁਤ ਚੰਗਾ ਲੜਕਾ ਹੈ ਪਰ ਉਹ ਕਦੇ ਝੂਠ ਨਹੀਂ ਬੋਲਦਾ।

(ਗ) ਮੈਂ ਤੁਹਾਡੇ ਨਾਲ ਚੱਲਾਂਗਾ ਜੇਕਰ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਸੱਦਾ ਦਿਓ।

(ਘ) ਉਹ ਬਹੁਤ ਮਿਹਨਤੀ ਹੈ ਇਸ ਲਈ ਉਹ ਪਾਸ ਹੋ ਜਾਵੇਗਾ।

(ਙ) ਜੇ ਤੂੰ ਮਿਹਨਤ ਕਰੇਂ ਤਾਂ ਤੂੰ ਪਾਸ ਹੋ ਜਾਵੇਂਗਾ।

ઉપરોક્ત મિલકત ઉપર

તા.૧૬/૧૨/૨૦૧૨ ના રોજ "ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિ." તરફથી મારા અસીલ ઉપર રૂા.૧૫,૦૦,૦૦૦/- ની રકમ માટે દાવો દાખલ કરવામાં આવેલ છે. જે દાવો મારા અસીલ તા.૨૪/૧/૨૦૧૩ ના રોજ હાજર થય

ગોવાલ ૬ ૨૧૭૦

ચિંતા કરવા લાગ્યા ; તેમણે ઘણા ઉપાયો કર્યા પણ કોઈ ઉપાયથી તેમનું દુઃખ ઓછું થયું નહિ. તેમણે ઘણા વૈદ્યો અને ડૉક્ટરોને બોલાવ્યા પણ કોઈ તેમનો રોગ મટાડી શક્યું નહિ. તેમણે ઘણી બાધા આખડી રાખી પણ કોઈ ફાયદો થયો નહિ. તેમણે ઘણા દેવ-દેવીઓની માનતા માની પણ કોઈ ફળ્યું નહિ. તેમણે ઘણા ભૂવા-ભગતોને બોલાવ્યા પણ કોઈ તેમનો રોગ મટાડી શક્યું નહિ. તેમણે ઘણા ઉપાયો કર્યા પણ કોઈ ઉપાયથી તેમનું દુઃખ ઓછું થયું નહિ. તેમણે ઘણા વૈદ્યો અને ડૉક્ટરોને બોલાવ્યા પણ કોઈ તેમનો રોગ મટાડી શક્યું નહિ. તેમણે ઘણી બાધા આખડી રાખી પણ કોઈ ફળ્યું નહિ. તેમણે ઘણા દેવ-દેવીઓની માનતા માની પણ કોઈ તેમનો રોગ મટાડી શક

(૫૬

ના ધી ઇતિ ને ૨૨૦૦

ધી મૂર્તિ :- ઉપરોક્ત ફરિયાદી તથા સાક્ષીઓ ની જુબાની તથા ફરિયાદ તથા સાક્ષીઓ ના પુરાવા ના કાગળો ધ્યાને લેતા આ કામના આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ સાબિત થાય છે તેમ જણાય આવે છે તેથી આરોપી વિરુદ્ધ કલમ ૨૨૭ મુજબ ઘડતર કરવા વાજબી અને યોગ્ય જણાય છે.

હુકમ :- આરોપી વિરુદ્ધ કલમ ૨૨૭ મુજબ ઘડતર કરવામાં આવે છે.

આરોપી વિરુદ્ધ કલમ ૨૨૭ મુજબ ઘડતર કરવામાં આવે છે.

ફરિયાદી તરફે :- શ્રી ડી. એમ. પટેલ સાહેબ

આરોપી તરફે :- શ્રી એ. એમ. પરમાર સાહેબ

ટાઈપિસ્ટ :- ૧૫.૧૨.૨૦૨૨ - ૧૨.૩૦ કલાકે

(ફરિયાદી તરફે વકીલ શ્રી એ. એમ. પરમાર સાહેબ)

આ કામના આરોપી વિરુદ્ધ કલમ ૨૨૭ મુજબ ઘડતર કરવામાં આવે છે તેમ જણાય આવે છે તેથી આરોપી વિરુદ્ધ કલમ ૨૨૭ મુજબ ઘડતર કરવામાં આવે છે. (ફરિયાદી તરફે વકીલ શ્રી ડી. એમ. પટેલ સાહેબ)

ঘটনাটি ঘটেছিল ১৯৭৫ সালের ফেব্রুয়ারি মাসে। তখন আমি ক্লাস সেভেনে পড়ি। বাবা তখন সরকারি চাকরি করতেন। আমাদের বাড়ি ছিল ঢাকার মিরপুর এলাকায়। সেখানে তখন অনেক খোলা জায়গা ছিল। আমাদের বাড়ির পাশে একটা বড় পুকুর ছিল। পুকুরের চারপাশে অনেক গাছপালা ছিল। সন্ধ্যা হলেই সেখানে ঝিঁঝিঁ পোকা ডাকত।

আমার একটা পোষা বিড়াল ছিল। তার নাম ছিল মিনি। মিনি ছিল সাদা আর কালো রঙের মেশানো। তার একটা কান ছোট ছিল। সে ছোটবেলা থেকেই আমার সঙ্গে বড় হয়েছিল। আমি স্কুল থেকে ফিরলে মিনি আমার পায়ের কাছে ঘুরঘুর করত। আমি ওকে দুধ-ভাত খাওয়াতাম।

একদিন বিকেলে আমি পুকুরপাড়ে বসে পড়ছিলাম। মিনি আমার কোলে শুয়ে ছিল। হঠাৎ দেখি একটা বড় কালো বিড়াল ঝোপের আড়াল থেকে বেরিয়ে এসে মিনির দিকে তাকিয়ে আছে। বিড়ালটা আমাদের পাড়ার নয়। আমি আগে কখনো ওটাকে দেখিনি। ওটার গায়ে অনেক বড় বড় লোম ছিল।

ઉ.ત. ૨૦૨૦

(અપૂર્ણ)

વિષય :- મોટર અકસ્માત વળતર અંગે ક્લેઇમ અરજી દાખલ કરવા બાબત.

ઉપરોક્ત વિષયના કામે અરજદારશ્રી વતી એડવોકેટશ્રી તરફથી રજૂ થયેલ અરજી અન્વયે જણાવવાનું કે અરજદારશ્રી તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ પોતાના મોટર સાયકલ પર સવાર થઈ પોતાના ઘરેથી કામ અર્થે નીકળેલ હતા ત્યારે સામેથી પુરઝડપે આવતા ટ્રક નં. જીજે ૧૨ એટી ૭૭૭૭ ના ચાલકે પોતાની ટ્રક બેદરકારીપૂર્વક ચલાવી અરજદારશ્રીના મોટર સાયકલને ટક્કર મારતા અરજદારશ્રીને ગંભીર ઈજાઓ પહોંચેલ હોય જેથી અરજદારશ્રીએ ટ્રક ચાલક વિરુદ્ધ ક્લેઇમ અરજી દાખલ કરવા વિનંતી કરેલ છે.

ઉપરોક્ત વિષયના કામે અરજદારશ્રી વતી એડવોકેટશ્રી તરફથી રજૂ થયેલ અરજી અન્વયે જણાવવાનું કે અરજદારશ્રી તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ પોતાના મોટર સાયકલ પર સવાર થઈ પોતાના ઘરેથી કામ અર્થે નીકળેલ હતા ત્યારે સામેથી પુરઝડપે આવતા ટ્રક નં. જીજે ૧૨ એટી ૭૭૭૭ ના ચાલકે પોતાની ટ્રક બેદરકારીપૂર્વક ચલાવી અરજદારશ્રીના મોટર સાયકલને ટક્કર મારતા અરજદારશ્રીને ગંભીર ઈજાઓ પહોંચેલ હોય જેથી અરજદારશ્રીએ ટ્રક ચાલક વિરુદ્ધ ક્લેઇમ અરજી દાખલ કરવા વિનંતી કરેલ છે.

ઉપરોક્ત કોર્ટ ફી ઍક્ટની કલમ ૧૦ હેઠળ ફરિયાદ કરવામાં આવે છે.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

મારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને મારી સમક્ષ સહી કરવામાં આવી હતી.

મારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને મારી સમક્ષ સહી કરવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ઉપરોક્ત કોર્ટ ફી ઍક્ટની કલમ ૧૦ હેઠળ ફરિયાદ કરવામાં આવે છે.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

મારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને મારી સમક્ષ સહી કરવામાં આવી હતી.

મારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને મારી સમક્ષ સહી કરવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ફરિયાદ કરનાર સહી કરે તે પહેલાં તેને વાંચી સંભળાવવામાં આવી હતી.

ग्रन्थ परिचय ३ २२८

(१) श्रीमद्भागवत महापुराण (मूल एवं हिन्दी अनुवाद सहित) : प्रकाशक गीता प्रेस गोरखपुर, प्रथम संस्करण (संवत् २०१८-२०१९ वि.), ८ खण्डों में सम्पूर्ण, लगभग ६००० पृष्ठ, मोटा कागज, सुन्दर छपाई, सजिल्द। श्रीमद्भागवत महापुराण के बारह स्कन्धों का यह संस्करण गीता प्रेस के संस्थापक श्रद्धेय श्री जयदयाल गोयन्दका जी के तत्त्वावधान में तैयार हुआ था। इसमें प्रत्येक श्लोक का मूल पाठ, पदच्छेद, अन्वय, शब्दार्थ और भावार्थ सहित हिन्दी अनुवाद दिया गया है। भूमिका में भागवत की रचना, रचयिता और महत्त्व पर विस्तृत विवेचन किया गया है। अनुवाद अत्यन्त प्रवाहपूर्ण और सरल है। यह संस्करण भक्तिमार्ग के साधकों के लिए अत्यन्त उपयोगी है।

૬૬ ગોપીચંદ ભરથરી

ભરથરી, તમારી ગેરહાજરીમાં રાજ્યની જવાબદારી કોણ સંભાળશે ? રાજ્યની ધુરા કોણ વહન કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની સુરક્ષા કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું પાલન કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું રક્ષણ કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું પોષણ કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું ભરણપોષણ કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું સંવર્ધન કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું સંરક્ષણ કોણ કરશે ? તમારી ગેરહાજરીમાં રાજ્યની પ્રજાનું સંગોપન

ಸಂಖ್ಯೆ

ಸಂಖ್ಯೆ ಕೆ.ಎಸ್.ಆರ್.ಟಿ.ಸಿ/ಕೆ.ಎಂ.ಪಿ.ಎಲ್/ಸಿ.ಆರ್.ಎಂ/ಎಸ್.ಎಂ.ಎಸ್/೨೦೨೨-೨೩/೧೨೫೬೭

ದಿನಾಂಕ: ೨೭.೦೨.೨೦೨೩

ಎಲ್ಲಾ ಘಟಕ ವ್ಯವಸ್ಥಾಪಕರು/ಸಹಾಯಕ ಸಂಚಾರ ವ್ಯವಸ್ಥಾಪಕರು/ಸಹಾಯಕ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧಿಕಾರಿಗಳು/ಸಹಾಯಕ ಸಂಚಾರ ಅಧೀಕ್ಷಕರು/ಸಹಾಯಕ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಭಿಯಂತರರು/ಸಹಾಯಕ ಸಂಚಾರ ನಿಯಂತ್ರಣಾ

ઉદાહરણ ૩૦૦ ઉપર વ્યાજ ગણવાનું કોષ્ટક

વ્યાજનો દર	૧ વર્ષ	૨ વર્ષ	૩ વર્ષ	૪ વર્ષ	૫ વર્ષ	૬ વર્ષ	૭ વર્ષ	૮ વર્ષ	૯ વર્ષ	૧૦ વર્ષ	૧૧ વર્ષ	૧૨ વર્ષ
૨ ટકા	૬	૧૨	૧૮	૨૪	૩૦	૩૬	૪૨	૪૮	૫૪	૬૦	૬૬	૭૨
૨½ ટકા	૭½	૧૫	૨૨½	૩૦	૩૭½	૪૫	૫૨½	૬૦	૬૭½	૭૫	૮૨½	૯૦
૩ ટકા	૯	૧૮	૨૭	૩૬	૪૫	૫૪	૬૩	૭૨	૮૧	૯૦	૯૯	૧૦૮
૩½ ટકા	૧૦½	૨૧	૩૧½	૪૨	૫૨½	૬૩	૭૩½	૮૪	૯૪½	૧૦૫	૧૧૫½	૧૨૬
૪ ટકા	૧૨	૨૪	૩૬	૪૮	૬૦	૭૨	૮૪	૯૬	૧૦૮	૧૨૦	૧૩૨	૧૪૪
૪½ ટકા	૧૩½	૨૭	૪૦½	૫૪	૬૭½	૮૧	૯૪½	૧૦૮	૧૨૧½	૧૩૫	૧૪૮½	૧૬૨
૫ ટકા	૧૫	૩૦	૪૫	૬૦	૭૫	૯૦	૧૦૫	૧૨૦	૧૩૫	૧૫૦	૧૬૫	૧૮૦
૫½ ટકા	૧૬½	૩૩	૪૯½	૬૬	૮૨½	૯૯	૧૧૫½	૧૩૨	૧૪૮½	૧૬૫	૧૮૧½	૧૯૮
૬ ટકા	૧૮	૩૬	૫૪	૭૨	૯૦	૧૦૮	૧૨૬	૧૪૪	૧૬૨	૧૮૦	૧૯૮	૨૧૬
૬½ ટકા	૧૯½	૩૯	૫૮½	૭૮	૯૭½	૧૧૭	૧૩૬½	૧૫૬	૧૭૫½	૧૯૫	૨૧૪½	૨૩૪
૭ ટકા	૨૧	૪૨	૬૩	૮૪	૧૦૫	૧૨૬	૧૪૭	૧૬૮	૧૮૯	૨૧૦	૨૩૧	૨૫૨
૭½ ટકા	૨૨½	૪૫	૬૭½	૯૦	૧૧૨½	૧૩૫	૧૫૭½	૧૮૦	૨૦૨½	૨૨૫	૨૪૭½	૨૭૦
૮ ટકા	૨૪	૪૮	૭૨	૯૬	૧૨૦	૧૪૪	૧૬૮	૧૯૨	૨૧૬	૨૪૦	૨૬૪	૨૮૮
૮½ ટકા	૨૫½	૫૧	૭૬½	૧૦૨	૧૨૭½	૧૫૩	૧૭૮½	૨૦૪	૨૨૯½	૨૫૫	૨૮૦½	૩૦૬
૯ ટકા	૨૭	૫૪	૮૧	૧૦૮	૧૩૫	૧૬૨	૧૮૯	૨૧૬	૨૪૩	૨૭૦	૨૯૭	૩૨૪
૯½ ટકા	૨૮½	૫૭	૮૫½	૧૧૪	૧૪૨½	૧૭૧	૧૯૯½	૨૨૮	૨૫૬½	૨૮૫	૩૧૩½	૩૪૨
૧૦ ટકા	૩૦	૬૦	૯૦	૧૨૦	૧૫૦	૧૮૦	૨૧૦	૨૪૦	૨૭૦	૩૦૦	૩૩૦	૩૬૦
૧૦½ ટકા	૩૧½	૬૩	૯૪½	૧૨૬	૧૫૭½	૧૮૯	૨૨૦½	૨૫૨	૨૮૩½	૩૧૫	૩૪૬½	૩૭૮
૧૧ ટકા	૩૩	૬૬	૯૯	૧૩૨	૧૬૫	૧૯૮	૨૩૧	૨૬૪	૨૯૭	૩૩૦	૩૬૩	૩૯૬
૧૧½ ટકા	૩૪½	૬૯	૧૦૩½	૧૩૮	૧૭૨½	૨૦૭	૨૪૧½	૨૭૬	૩૧૦½	૩૪૫	૩૭૯½	૪૧૪
૧૨ ટકા	૩૬	૭૨	૧૦૮	૧૪૪	૧૮૦	૨૧૬	૨૫૨	૨૮૮	૩૨૪	૩૬૦	૩૯૬	૪૩૨

ਕਰਨ ਦਾ ਹੁਕਮ ਦਿੱਤਾ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਸਿੱਧਾ ਸੁਲਤਾਨ ਦੇ ਕੋਲ ਗਿਆ ਅਤੇ ਉਸ ਨੂੰ ਕਹਿਣ ਲੱਗਾ, "ਮੈਂ ਤੁਹਾਡੇ ਲਈ ਇੱਕ ਅਜਿਹਾ ਤੋਹਫ਼ਾ ਲਿਆਇਆ ਹਾਂ ਜੋ ਕਿ ਤੁਹਾਡੇ ਤੋਂ ਪਹਿਲਾਂ ਕਿਸੇ ਵੀ ਰਾਜੇ ਕੋਲ ਨਹੀਂ ਹੈ।" ਸੁਲਤਾਨ ਨੇ ਪੁੱਛਿਆ, "ਉਹ ਕੀ ਹੈ?" ਤਾਂ ਉਸ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਇੱਕ ਅਜਿਹਾ ਘੋੜਾ ਲਿਆਇਆ ਹਾਂ ਜੋ ਕਿ ਹਵਾ ਵਿੱਚ ਉੱਡ ਸਕਦਾ ਹੈ।" ਸੁਲਤਾਨ ਨੇ ਕਿਹਾ, "ਜੇ ਇਹ ਗੱਲ ਸੱਚ ਹੈ ਤਾਂ ਮੈਂ ਤੈਨੂੰ ਅੱਧਾ ਰਾਜ ਦੇ ਦਿਆਂਗਾ।" ਤਾਂ ਉਸ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਇਹ ਘੋੜਾ ਤੁਹਾਨੂੰ ਤਾਂ ਹੀ ਦੇਵਾਂਗਾ ਜੇ ਤੁਸੀਂ ਮੇਰੀ ਸ਼ਰਤ ਮੰਨੋ। ਸ਼ਰਤ ਇਹ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਮੇਰੇ ਨਾਲ ਆਪਣੀ ਧੀ ਦਾ ਵਿਆਹ ਕਰੋ।" ਸੁਲਤਾਨ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਤੇਰੀ ਸ਼ਰਤ ਮੰਨਦਾ ਹਾਂ ਪਰ ਜੇ ਤੂੰ ਝੂਠ ਬੋਲਿਆ ਤਾਂ ਤੈਨੂੰ ਮੌਤ ਦੀ ਸਜ਼ਾ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ।" ਤਾਂ ਉਸ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਤਿਆਰ ਹਾਂ ਜੇ ਮੈਂ ਝੂਠ ਬੋਲਿਆ ਤਾਂ ਮੈਨੂੰ ਮੌਤ ਦੀ ਸਜ਼ਾ ਦੇ ਦੇਣਾ।" ਸੁਲਤਾਨ ਨੇ ਕਿਹਾ, "ਤੂੰ ਘੋੜਾ ਲਿਆ ਕੇ ਦਿਖਾ।" ਤਾਂ ਉਸ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਘੋੜਾ ਤਾਂ ਹੀ ਲਿਆਵਾਂਗਾ ਜੇ ਤੁਸੀਂ ਮੇਰੇ ਨਾਲ ਆਪਣੀ ਧੀ ਦਾ ਵਿਆਹ ਕਰੋ।" ਸੁਲਤਾਨ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਤੇਰੀ ਸ਼ਰਤ ਮੰਨਦਾ ਹਾਂ ਪਰ ਜੇ ਤੂੰ ਝੂਠ ਬੋਲਿਆ ਤਾਂ ਤੈਨੂੰ ਮੌਤ ਦੀ ਸਜ਼ਾ ਦੇ ਦੇਣਾ।" ਤਾਂ ਉਸ ਨੇ ਕਿਹਾ, "ਮੈਂ ਤਿਆਰ ਹਾਂ ਜੇ ਮੈਂ ਝੂਠ ਬੋਲਿਆ ਤਾਂ ਮੈਨੂੰ ਮੌਤ ਦੀ ਸਜ਼ਾ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ

ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ

ಶ್ರೀ ಮಾನ್ ಶ್ರೀಮತಿ ಸೌಭಾಗ್ಯವತಿ ಸರ್ವಮಂಗಳಾ ಸಮೇತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹ ದೇವರ ಪ್ರೀತ್ಯರ್ಥವಾಗಿ, ಮತ್ತು

ઉદ્ધારનું ૩ ૧૭૦૦

અકબર પાદશાહ ઉપરથી ઇનામ ઇલાકાનું ફરમાન ૨૦૦ ગામ
ઇનામ ઇલાકાનું ફરમાન ૧

ગુજરાત મોટર વાહનો નિયમો, ૧૯૮૯ ના નિયમ ૧૧૫ (૧) (ક) અને ૧૧૬ (૧) (ક) જુઓ

પરવાનો મેળવવા માટે અરજી

પ્રતિ,

ઉપર મુજબ જણાવેલ સરનામે રહેતા હું ઉંમર વર્ષ ..... ધંધો ..... મારી પાસે ..... નંબરનું ..... વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવું છું. મારું લાયસન્સ તા. ..... ના રોજ રદ થયું છે. તો મારું લાયસન્સ ફરીથી આપવા વિનંતી છે.

સ્થળ :

તારીખ :

અરજદારની સહી

ছাদের ঢালাই

ঢালাই মশলা :- ১ ভাগ সিমেন্ট ২ ভাগ মোটা বালু ৪ ভাগ ইট ভাঙ্গা বা খোয়া (১" ইঞ্চি গেজ) ছাদের ঢালাই মশলা ১:২:৪ অনুপাতে তৈরি করতে হবে। ঢালাই মশলা তৈরির পূর্বে ইট ভাঙ্গা বা খোয়া ভালভাবে ধুয়ে নি

ભાવાર્થ :- જે પુરુષ પોતાના ઘરમાં રહીને પોતાના ઘરની સ્ત્રીને ધર્મ પ્રમાણે ભોગવે છે તે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ બ્રહ્મચારી જ કહેવાય છે. પરંતુ જે પુરુષ પોતાના ઘરમાં રહીને પોતાની સ્ત્રીને ઋતુકાળ વિના પણ ભોગવે છે તે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ બ્રહ્મચારી નથી. ૧૭૫

ઋતુકાળ વિના ભોગવવાથી થતા દોષો

ऋतौ भार्यामुपेयात्तु तद्व्रतो विधिपूर्वकम् ।
ऋतुकालं विना तस्य व्रतलोपो भवेत्तयोः ॥ १७६ ॥

ઋતુકાળ વિના ભોગવવાથી થતા દોષો

ऋतौ भार्यामुपेयात्तु तद्व्रतो विधिपूर्वकम् ।
ऋतुकालं विना तस्य व्रतलोपो भवेत्तयोः ॥ १७६ ॥

ઋતુકાળ વિના ભોગવવાથી થતા દોષો

ऋतौ भार्यामुपेयात्तु तद्व्रतो विधिपूर्वकम् ।
ऋतुकालं विना तस्य व्रतलोपो भवेत्तयोः ॥ १७६ ॥

(ઉદાહરણ ૬ ચાલુ)

ઉપરના પ્રશ્નોત્તરો પરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનું વર્ણન કરવા માટે તેના વિશે જે કંઈ માહિતી મેળવવી જરૂરી હોય તેને ધ્યાનમાં રાખીને પ્રશ્નો તૈયાર કરવામાં આવે છે. આ પ્રશ્નોના ક્રમ પ્રમાણે જો વર્ણન કરવામાં આવે તો તે વર્ણન સુવ્યવસ્થિત બને છે. આ પ્રશ્નોના ક્રમ પ્રમાણે વર્ણન કરવાની રીત નીચે પ્રમાણે છે.

(૧) ગામનું નામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, ગામ કયા વિસ્તારમાં આવેલું છે તે વિશે જણાવવું.

(૨) ગામની વસ્તી, ગામમાં કયા કયા કોમના લોકો વસે છે તે વિશે જણાવવું.

(૩) ગામમાં આવેલી સગવડો જેવી કે શાળા, દવાખાનું, પોસ્ટ ઑફિસ, પાણીની સગવડ, વીજળીની સગવડ, રસ્તાની સગવડ વગેરે વિશે જણાવવું.

(૪) ગામની આસપાસ આવેલાં જોવાલાયક સ્થળો વિશે જણાવવું.

(૫) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય, ખેતીની પેદાશો, ગામમાં આવેલાં કારખાનાં વિશે જણાવવું.

(૬) ગામમાં આવેલાં મુખ્ય તહેવારો, મેળા વિશે જણાવવું.

(૭) ગામમાં આવેલાં મુખ્ય મંદિરો, મસ્જિદો, ચર્ચ વિશે જણાવવું.

(૮) ગામમાં આવેલી મુખ્ય નદી, તળાવ, કૂવા વિશે જણાવવું.

(૯) ગામમાં આવેલાં મુખ્ય વૃક્ષો વિશે જણાવવું.

(૧૦) ગામમાં આવેલાં મુખ્ય પશુઓ વિશે જણાવવું.

(૧૧) ગામમાં આવેલાં મુખ્ય પક્ષીઓ વિશે જણાવવું.

(૧૨) ગામમાં આવેલાં મુખ્ય જંતુઓ વિશે જણાવવું.

(૧૩) ગામમાં આવેલાં મુખ્ય ફૂલો વિશે જણાવવું.

(૧૪) ગામમાં આવેલાં મુખ્ય ફળો વિશે જણાવવું.

(૧૫) ગામમાં આવેલાં મુખ્ય શાકભાજી વિશે જણાવવું.

(૧૬) ગામમાં આવેલાં મુખ્ય અનાજ વિશે જણાવવું.

(૧૭) ગામમાં આવેલાં મુખ્ય કઠોળ વિશે જણાવવું.

(૧૮) ગામમાં આવેલાં મુખ્ય મસાલા વિશે જણાવવું.

(૧૯) ગામમાં આવેલાં મુખ્ય તેલીબિયાં વિશે જણાવવું.

(૨૦) ગામમાં આવેલાં મુખ્ય ખાંડ વિશે જણાવવું.

(૨૧) ગામમાં આવેલાં મુખ્ય ગોળ વિશે જણાવવું.

(૨૨) ગામમાં આવેલાં મુખ્ય મીઠું વિશે જણાવવું.

(૨૩) ગામમાં આવેલાં મુખ્ય પાણી વિશે જણાવવું.

(૨૪) ગામમાં આવેલાં મુખ્ય દૂધ વિશે જણાવવું.

(૨૫) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૨૬) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૨૭) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૨૮) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૨૯) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૩૦) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૩૧) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૩૨) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૩૩) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૩૪) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૩૫) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૩૬) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૩૭) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૩૮) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૩૯) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૪૦) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૪૧) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૪૨) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૪૩) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૪૪) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૪૫) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૪૬) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૪૭) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૪૮) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૪૯) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૫૦) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૫૧) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૫૨) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૫૩) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૫૪) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૫૫) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૫૬) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૫૭) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૫૮) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૫૯) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૬૦) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૬૧) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૬૨) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૬૩) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૬૪) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૬૫) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૬૬) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૬૭) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૬૮) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૬૯) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૭૦) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૭૧) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૭૨) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૭૩) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૭૪) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૭૫) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૭૬) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૭૭) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૭૮) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૭૯) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૮૦) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૮૧) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૮૨) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૮૩) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૮૪) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૮૫) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૮૬) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૮૭) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૮૮) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૮૯) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૯૦) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૯૧) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૯૨) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૯૩) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૯૪) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

(૯૫) ગામમાં આવેલાં મુખ્ય પનીર વિશે જણાવવું.

(૯૬) ગામમાં આવેલાં મુખ્ય ચીઝ વિશે જણાવવું.

(૯૭) ગામમાં આવેલાં મુખ્ય ઘી વિશે જણાવવું.

(૯૮) ગામમાં આવેલાં મુખ્ય માખણ વિશે જણાવવું.

(૯૯) ગામમાં આવેલાં મુખ્ય છાશ વિશે જણાવવું.

(૧૦૦) ગામમાં આવેલાં મુખ્ય દહીં વિશે જણાવવું.

আমরা কলকাতা থেকে ট্রেনে করে দিল্লি যাওয়ার পথে
এক রেলস্টেশনে কিছুক্ষণ বিশ্রাম নিয়েছিলাম। সেখানে
ট্রেন অনেকক্ষণ দাঁড়িয়ে থাকবে বলে আমরা প্ল্যাটফর্মে
নেমে পড়ি। সেখানে একটি ছোট্ট মেয়ে আমাদের
কাছে এসে ভিক্ষা চাইতে লাগল। তার বয়স
আনুমানিক ছয় বছর হবে। তার মুখে ও পোশাকে
দারিদ্র্যের ছাপ স্পষ্ট। তার সঙ্গে কোনো বড়
মানুষ ছিল না। সে একা একা ঘুরে ঘুরে
যাত্রীদের কাছে হাত পাতছিল।

আমি তাকে কিছু টাকা দিতে চাইলাম। কিন্তু
আমার সঙ্গে খুচরো টাকা ছিল না। তাই
আমি তাকে একটি বিস্কুটের প্যাকেট দিলাম।
সে প্রথমে অবাক হয়ে তাকিয়ে রইল, তারপর
খুব খুশি হয়ে প্যাকেটটি নিয়ে দৌড়ে চলে
গেল। তার সেই হাসিমুখ আমি অনেকদিন
মনে রাখব।

૨૨ કાર્તિક સુદિ ૨

પ્રાતઃ કુંવરજી, કેશવ સાથે પરસ્પર ઇષ્ટગોષ્ઠી કરતાં ચાલ્યા.

ચાલ્યા

ગામ બહાર કેટલેક દૂર ગયા-આવ્યા, કુલ મુસાફરી લગભગ ૧૫ ગાઉની (અંદાજે) થઈ હશે. ગુરુજી પોતે ઘોડા પર બેઠા હતા. કેશવ ઘોડા પર બેઠો હતો. કુંવરજી ઘોડા પર બેઠા હતા. બાકીના બધા પગે ચાલ્યા. ગુરુજીએ ઘોડા પર બેસી રહેવા ઘણો આગ્રહ કર્યો પણ કુંવરજી ઘોડા પરથી ઊતરી ગય

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૨૫ હેઠળ પત્નીને ભરણપોષણ મેળવવા બાબત.

જેમ કોઈ પુરુષ પોતાની પત્ની, પોતાનાં કાયદેસર કે ગેરકાયદેસર સગીર બાળકો કે પોતાનાં કાયદેસર કે ગેરકાયદેસર સગીર કે પુખ્ત વયનાં અપંગ બાળકો કે પોતાનાં કાયદેસર કે ગેરકાયદેસર વૃદ્ધ માતા-પિતા કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વૃદ્ધ દાદા-દાદી કે નાના-નાની કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર પુત્રવધૂ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર સાસુ-સસરા કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પુત્રવધૂ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા દાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા નાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરપરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરનાની સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરદાદી સાસુ કે પોતાની કાયદેસર કે ગેરકાયદેસર વિધવા પરપ

ઉપરોક્ત ઠરાવ મુજબ ગામ નમુના નં. ૭/૧૨ ની નકલ તથા ગામ નમુના નં. ૮-અ ની નકલ તથા ગામ નમુના નં. ૬ ની નકલ તથા ગામ નમુના નં. ૬ ની નકલ તથા ગામ નમુના નં. ૬

ગા.૨૨૭૬ ગોળ ગોળ ગોળ

ગોળ ગોળ ગોળ

৫ নং প্রশ্নের উত্তর

ক) ১৯৭১ সালের ২৬ মার্চ পাকিস্তানি সেনাবাহিনী নিরস্ত্র বাঙালির ওপর যে নৃশংস হামলা চালায়, তাকে ইতিহাসে গণহত্যা বলা হয়। এই হত্যাযজ্ঞের মূল লক্ষ্য ছিল বাঙালি জাতির মেরুদণ্ড ভেঙে দেওয়া। তারা বুদ্ধিজীবী, ছাত্র, শিক্ষক, সাংবাদিক ও সংস্কৃতিসেবীদের বেছে বেছে হত্যা করে, যাতে বাঙালি আর কখনো মাথা তুলে দাঁড়াতে না পারে। ঢাকা বিশ্ববিদ্যালয়, রাজারবাগ পুলিশ লাইন, পিলখানা ইপিআর সদর দপ্তর, রাজারবাগ, শাঁখারীবাজার, নীলক্ষেত, ইকবাল হল (বর্তমান সলিমুল্লাহ হল), জগন্নাথ হল, রোকেয়া হল, ইডেন মহিলা কলেজ, তেজগাঁও শিল্প এলাকা, মোহাম্মদপুর, মিরপুর, আদমজী জুট মিল, ডেমরা, তুরাগ নদীর তীর, কাঁটাবন, ধানমন্ডি, শান্তিনগর, মালিবাগ, মগবাজার, রামপুরা, বাড্ডা, উত্তরা, গাজীপুর, সাভার, নারায়ণগঞ্জ, চট্টগ্রাম, কুমিল্লা, যশোর, খুলনা, রাজশাহী, সৈয়দপুর, রংপুর, দিনাজপুর, কুষ্টিয়া, বরিশাল, সিলেট, ময়মনসিংহ, টাঙ্গাইল, ফরিদপুর, পাবনা, বগুড়া, নোয়াখালী, ফেনী, কক্সবাজার, সেন্টমার্টিন, হাতিয়া, সন্দ্বীপ, ভোলা, পটুয়াখালী, বরগুনা, ঝালকাঠি, পিরোজপুর, মাগুরা, নড়াইল, মেহেরপুর, চুয়াডাঙ্গা, ঝিনাইদহ, নওগাঁ, জয়পুরহাট, নাটোর, সিরাজগঞ্জ, কিশোরগঞ্জ, নেত্রকোনা, শেরপুর, জামালপুর, হবিগঞ্জ, মৌলভীবাজার, সুনামগঞ্জ, লালমনিরহাট, কুড়িগ্রাম, নীলফামারী, ঠাকুরগাঁও, পঞ্চগড়, রাঙামাটি, বান্দরবান, খাগড়াছড়ি, শ্রীমঙ্গল, ফুলবাড়ী, পার্বতীপুর, সৈয়দপুর, রংপুর, দিনাজপুর, কুষ্টিয়া, বরিশাল, সিলেট, ময়মনসিংহ, টাঙ্গাইল, ফরিদপুর, পাবনা, বগুড়া, নোয়াখালী, ফেনী, কক্সবাজার, সেন্টমার্টিন, হাতিয়া, সন্দ্বীপ, ভোলা, পটুয়াখালী, বরগুনা, ঝালকাঠি, পিরোজপুর, মাগুরা, নড়াইল, মেহেরপুর, চুয়াডাঙ্গা, ঝিনাইদহ, নওগাঁ, জয়পুরহাট, নাটোর, সিরাজগঞ্জ, কিশোরগঞ্জ, নেত্রকোনা, শেরপুর, জামালপুর, হবিগঞ্জ, মৌলভীবাজার, সুনামগঞ্জ, লালমনিরহাট, কুড়িগ্রাম, নীলফামারী, ঠাকুরগাঁও, পঞ্চগড়, রাঙামাটি, বান্দরবান, খাগড়াছড়ি, শ্রীমঙ্গল, ফুলবাড়ী, পার্বতীপুর।

ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે વકીલ શ્રી ગોપાલભાઈ ત્રિવેદી હાજર. આરોપી તરફે વકીલ શ્રી મનસુખલાલ ચતુરભાઈ પટેલ હાજર થયા. આરોપી સામે ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ ૨૫૪ હેઠળ આરોપ ઘડવા માટે મુદ્દત પડેલ છે. આજે ફરિયાદી તરફે સાક્ષી નં. ૧ થી ૪ તપાસવામાં આવેલ છે. સાક્ષી નં. ૧ તરીકે ફરિયાદી પોતે રજૂ થયા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ખેતીકામ કરે છે અને તેમની માલિકીની સર્વે નં. ૧૪૭ પૈકી ૨ વાળી જમીન આવેલી છે. તે જમીનમાં તેમણે કપાસનું વાવેતર કરેલું હતું. તા. ૧૨-૦૬-૨૦૧૯ ના રોજ સવારે આશરે ૧૦ વાગ્યે તેઓ પોતાની વાડીએ ગયા ત્યારે તેમણે જોયું કે તેમના પાકમાં ઘણા ઢોર ઘૂસી ગયા છે અને પાકને નુકસાન કરી રહ્યા છે. તેમણે બૂમાબૂમ કરતાં આરોપી પોતાના ઢોર હાંકતો હાંકતો ત્યાંથી નીકળ્યો હતો. ફરિયાદીએ આરોપીને ઢોર બાંધવા કહ્યું ત્યારે આરોપીએ ગાળો આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ ઢોરને ડામ દીધા હતા. આ બનાવ બાદ ફરિયાદીએ ગામના સરપંચ તથા આગેવાનોને જાણ કરી હતી. ત્યારબાદ સરપંચ તથા આગેવાનો આરોપીના ઘરે ગયા હતા અને સમાધાનની વાત કરી હતી. આરોપીએ સમાધાન માટે રૂ. ૫૦૦૦/- આપવાની વાત કરી હતી. ફરિયાદીએ આરોપીને રૂ. ૩૦૦૦/- આપ્યા હતા અને બાકીના રૂ. ૨૦૦૦/- પછીથી આપવાનું નક્કી થયું હતું. આ સમાધાનની વાત ફરિયાદીએ પોતાના પરિવારજનોને કરી હતી. ત્યારબાદ આરોપી ફરિયાદીના ઘરે આવ્યો હતો અને ફરિયાદીની પત્ની તથા પુત્રવધૂ સમક્ષ ફરિયાદીની માફી માંગી હતી. આ સાક્ષીની ઊલટતપાસ હજુ બાકી છે. આ સાક્ષીની ઊલટતપાસ માટે આરોપીના વકીલ તરફે મુદ્દત માંગવામાં આવી છે. ફરિયાદી તરફે વકીલ શ્રી ગોપાલભાઈ ત્રિવેદીએ વાંધો લીધો છે કે આ કેસ ઘણા સમયથી પડતર છે અને સાક્ષીની ઊલટતપાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. તેથી હવે વધુ મુદ્દત આપવી જોઈએ નહીં. આરોપી તરફે વકીલ શ્રી મનસુખલાલ ચતુરભાઈ પટેલે દલીલ કરી છે કે આરોપીના વકીલ તાત્કાલિક કોર્ટમાં હાજર થઈ શકે તેમ નથી, તેથી મુદ્દત આપવી જોઈએ. બંને પક્ષકારોની દલીલો ધ્યાનમાં લેતાં, આ કોર્ટ આરોપીના વકીલને છેલ્લી તક તરીકે મુદ્દત આપવાનું યોગ્ય માને છે. તેથી આ કેસ આગામી તા. ૨૫-૦૭-૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે રાખવામાં આવે છે. આરોપીના વકીલ તે દિવસે ઊલટતપાસ પૂરી કરે તે જરૂરી છે. જો તે દિવસે ઊલટતપાસ પૂરી નહીં થાય તો આરોપીના વકીલ તરફે કોઈ મુદ્દત આપવામાં આવશે નહીં. આ હુકમની નકલ બંને પક્ષકારોને આપવામાં આવે.

૧૨૯ ઉપદેશ મંજરી ટબો

ગાથાર્થ મોક્ષ ઇચ્છનારા જીવે સર્વત્ર પ્રયત્નથી પોતાના ચારિત્રનું રક્ષણ કરવું જોઈએ. કેમકે ચારિત્ર ગયા પછી જીવ દરિદ્રી, રોગી, અપયશવાળો, અપ્રિય, દુઃખી, મૂર્ખ, નિંદાપાત્ર, દુર્ભાગી, સ્ત્રીઓનો દ્વેષી, નીચ, અધમ, પાપી, દુર્ગતિમાં જનારો, અનંત સંસારી થાય છે. ૧૦૦

ટબાર્થ મોક્ષ ઇચ્છનારા જીવે સર્વત્ર પ્રયત્નથી પોતાના ચારિત્રનું રક્ષણ કરવું જોઈએ. કેમકે ચારિત્ર ગયા પછી જીવ દરિદ્રી, રોગી, અપયશવાળો, અપ્રિય, દુઃખી, મૂર્ખ, નિંદાપાત્ર, દુર્ભાગી, સ્ત્રીઓનો દ્વેષી, નીચ, અધમ, પાપી, દુર્ગતિમાં જનારો, અનંત સંસારી થાય છે. ૧૦૦

ભાવાર્થ: "ચારિત્ર ગયા પછી જીવ દરિદ્રી, રોગી, અપયશવાળો, અપ્રિય, દુઃખી, મૂર્ખ, નિંદાપાત્ર, દુર્ભાગી, સ્ત્રીઓનો દ્વેષી, નીચ, અધમ, પાપી, દુર્ગતિમાં જનારો, અનંત સંસારી થાય છે" એવું કહેવાથી ચારિત્રનું રક્ષણ કરવું જોઈએ એમ સમજવું. ચારિત્ર ગયા પછી જીવ દરિદ્રી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ ધનવાન હોય તો પણ તે દરિદ્રી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ ધનવાન હોય તો પણ તે ધનનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં ધનનો ઉપયોગ કરે તો જ ધનવાન કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ રોગી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ નિરોગી હોય તો પણ તે રોગી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ નિરોગી હોય તો પણ તે નિરોગીપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં નિરોગીપણાનો ઉપયોગ કરે તો જ નિરોગી કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ અપયશવાળો થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ યશવાળો હોય તો પણ તે અપયશવાળો જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ યશવાળો હોય તો પણ તે યશનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં યશનો ઉપયોગ કરે તો જ યશવાળો કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ અપ્રિય થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ પ્રિય હોય તો પણ તે અપ્રિય જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ પ્રિય હોય તો પણ તે પ્રિયપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં પ્રિયપણાનો ઉપયોગ કરે તો જ પ્રિય કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ દુઃખી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ સુખી હોય તો પણ તે દુઃખી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ સુખી હોય તો પણ તે સુખનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં સુખનો ઉપયોગ કરે તો જ સુખી કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ મૂર્ખ થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ વિદ્વાન હોય તો પણ તે મૂર્ખ જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ વિદ્વાન હોય તો પણ તે વિદ્વત્તાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં વિદ્વત્તાનો ઉપયોગ કરે તો જ વિદ્વાન કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ નિંદાપાત્ર થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ પ્રશંસાપાત્ર હોય તો પણ તે નિંદાપાત્ર જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ પ્રશંસાપાત્ર હોય તો પણ તે પ્રશંસાપાત્રપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં પ્રશંસાપાત્રપણાનો ઉપયોગ કરે તો જ પ્રશંસાપાત્ર કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ દુર્ભાગી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ સૌભાગ્યવાળો હોય તો પણ તે દુર્ભાગી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ સૌભાગ્યવાળો હોય તો પણ તે સૌભાગ્યનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં સૌભાગ્યનો ઉપયોગ કરે તો જ સૌભાગ્યવાળો કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ સ્ત્રીઓનો દ્વેષી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ સ્ત્રીઓનો રાગી હોય તો પણ તે સ્ત્રીઓનો દ્વેષી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ સ્ત્રીઓનો રાગી હોય તો પણ તે સ્ત્રીઓના રાગનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં સ્ત્રીઓના રાગનો ઉપયોગ કરે તો જ સ્ત્રીઓનો રાગી કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ નીચ થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ ઉચ્ચ હોય તો પણ તે નીચ જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ ઉચ્ચ હોય તો પણ તે ઉચ્ચપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં ઉચ્ચપણાનો ઉપયોગ કરે તો જ ઉચ્ચ કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ અધમ થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ ઉત્તમ હોય તો પણ તે અધમ જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ ઉત્તમ હોય તો પણ તે ઉત્તમપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં ઉત્તમપણાનો ઉપયોગ કરે તો જ ઉત્તમ કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ પાપી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ પુણ્યવાન હોય તો પણ તે પાપી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ પુણ્યવાન હોય તો પણ તે પુણ્યનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં પુણ્યનો ઉપયોગ કરે તો જ પુણ્યવાન કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ દુર્ગતિમાં જનારો થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ સદ્ગતિમાં જનારો હોય તો પણ તે દુર્ગતિમાં જનારો જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ સદ્ગતિમાં જનારો હોય તો પણ તે સદ્ગતિમાં જવાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં સદ્ગતિમાં જવાનો ઉપયોગ કરે તો જ સદ્ગતિમાં જનારો કહેવાય. ચારિત્ર ગયા પછી જીવ અનંત સંસારી થાય છે એટલે ચારિત્ર ગયા પછી જીવ પરિમિત સંસારી હોય તો પણ તે અનંત સંસારી જ કહેવાય. કેમકે ચારિત્ર ગયા પછી જીવ પરિમિત સંસારી હોય તો પણ તે પરિમિત સંસારીપણાનો ઉપયોગ ધર્મમાં કરતો નથી. ધર્મમાં પરિમિત સંસારીપણાનો ઉપયોગ કરે તો જ પરિમિત સંસારી કહેવાય. ૧૦૦

(১৯)

ইতি তারিখ মুকাম

বরাবর

জনাব মোহাম্মদ ইসমাইল খান সাহেব
সেক্রেটারী, আঞ্জুমানে ইসলামিয়া
ডাকঘর ও মুকাম কাঞ্চনপুর

জনাব,

আমি আপনার নিকট বিশেষ ভাবে পরিচিত হইবার জন্য এবং আঞ্জুমানে ইসলামিয়া কাঞ্চনপুরের সহিত আমার ঘনিষ্ঠ সম্পর্ক স্থাপনের উদ্দেশ্যে আপনার সহিত সাক্ষাৎ করিতে ইচ্ছা করিয়াছিলাম। কিন্তু আপনার অসুস্থতার সংবাদ পাইয়া আপনার সহিত সাক্ষাৎ করিতে সাহস পাইতেছি না। আপনার শারীরিক অসুস্থতার জন্য আমি অত্যন্ত দুঃখিত। আল্লাহ্ তা'আলার নিকট আপনার আশু আরোগ্য কামনা করিতেছি।

আঞ্জুমানে ইসলামিয়া কাঞ্চনপুরের সহিত আমার ঘনিষ্ঠ সম্পর্ক স্থাপনের উদ্দেশ্যে আমি আগামী ১৫ই জুলাই তারিখে কাঞ্চনপুর যাইতে ইচ্ছা করিয়াছি। আপনার সুবিধা মত তারিখে আমি আপনার সহিত সাক্ষাৎ করিতে চাই। আপনার সুবিধা মত তারিখ জানাইলে বাধিত হইব।

আপনার একান্ত অনুগত
আবদুল মতিন খান
৩৫, নিউ ইস্কাটন রোড
ঢাকা-২

৫০। ঈদের নামাজ

ঈদুল ফিতর ও ঈদুল আযহার নামাজকে ঈদের নামাজ বলা হয়। দু'রাকাত নামাজ ওয়াজিব। ঈদের নামাজ ঈদগাহে অথবা মসজিদে আদায় করা সুন্নাত। কোন ওজর ছাড়া ঈদের নামাজ ছেড়ে দেয়া গুনাহ। ঈদের নামাজের সময় সূর্য এক বর্শা পরিমাণ উপরে উঠার পর থেকে দ্বিপ্রহর পর্যন্ত। ঈদের নামাজ আদায় করার পূর্বে কোন নফল নামাজ পড়া মাকরূহ। ঈদের নামাজের পূর্বে সদকায়ে ফিতর আদায় করা ওয়াজিব। ঈদের নামাজের পূর্বে গোসল করা, মিসওয়াক করা, সুগন্ধি ব্যবহার করা, সুন্দর পোশাক পরিধান করা মুস্তাহাব। ঈদের নামাজের পূর্বে কিছু খাওয়া ঈদুল ফিতরের দিন সুন্নাত। ঈদুল আযহার দিন ঈদের নামাজের পর কুরবানীর গোশত খাওয়া সুন্নাত। ঈদের নামাজের পূর্বে কোন কাজ বা কথা বলা মাকরূহ। ঈদের নামাজের পূর্বে কোন মুসলমানের সাথে সাক্ষাৎ হলে তাকে ঈদের মোবারকবাদ জানানো মুস্তাহাব। ঈদের নামাজের পূর্বে কোন মুসলমানের সাথে সাক্ষাৎ হলে তাকে ঈদের মোবারকবাদ জানানো মুস্তাহাব। ঈদের নামাজের পূর্বে কোন মুসলমানের সাথে সাক্ষাৎ হলে তাকে ঈদের মোবারকবাদ জানানো মুস্তাহাব।

ઉ. શ્રી મનમોહનસિંહ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્યના વિકાસ માટે કેવા પ્રકારના સંબંધો ઇચ્છે છે તે જણાવો.

ઉત્તર :- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્યના વિકાસ માટે સારા સંબંધો ઇચ્છે છે. ગુજરાત રાજ્ય ભારતનું સૌથી વધુ વિકસિત રાજ્ય છે. ગુજરાત રાજ્ય ભારતના કુલ નિકાસમાં ૨૫ ટકા જેટલો ફાળો આપે છે. ગુજરાત રાજ્ય ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૬ ટકા જેટલો ફાળો આપે છે. ગુજરાત રાજ્ય ભારતના કુલ ઔદ્યોગિક રોકાણમાં ૧૫

ઉપરોક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતી નવલકથાના ઉદ્ભવ અને વિકાસમાં ઐતિહાસિક પરિબળોનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.

ઉ.

ફોર્મ નં. ૨૨૨૯

ગુજરાત સહકારી મંડળીઓ નિયમો ૧૯૬૫ના નિયમ ૧૩૯ (૧) હેઠળ

પ્રતિ,

ઉપવિભાગીય અધિકારી સાહેબશ્રી,
ઉપવિભાગીય કચેરી,
ઉપલેટા.

વિષય:- ઉપલેટા તાલુકા ખેતીવાડી સહકારી મંડળી લિ. ઉપલેટાની ચૂંટણી યોજવા બાબત.

ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, ઉપલેટા તાલુકા ખેતીવાડી સહકારી મંડળી લિ. ઉપલેટાની મુદત તા. ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ પૂરી થાય છે. મંડળીની ચૂંટણી યોજવા માટે મંડળીની વાર્ષિક સાધારણ સભા તા. ૨૫/૧૨/૨૦૨૪ ના રોજ મળી હતી. સભામાં ચૂંટણી યોજવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવની નકલ સામેલ છે.

મંડળીના ઉપવિધિ નિયમ ૨૩ મુજબ મંડળીના કુલ ૧૨૪૦ સભ્યો છે. તેમાંથી ૧૧૮૫ સભ્યોએ ચૂંટણી યોજવા માટે લેખિત સંમતિ આપી છે. સંમતિપત્રકો સામેલ છે. આમ, કુલ સભ્યોના ૯૫.૫૬% સભ્યોની સંમતિ મળી છે.

મંડળીના ઉપવિધિ નિયમ ૨૪ મુજબ મંડળીના કુલ ૧૨૪૦ સભ્યોમાંથી ૧૧૮૫ સભ્યોએ ચૂંટણી યોજવા માટે લેખિત સંમતિ આપી છે. સંમતિપત્રકો સામેલ છે. આમ, કુલ સભ્યોના ૯૫.૫૬% સભ્યોની સંમતિ મળી છે.

મંડળીના ઉપવિધિ નિયમ ૨૫ મુજબ મંડળીના કુલ ૧૨૪૦ સભ્યોમાંથી ૧૧૮૫ સભ્યોએ ચૂંટણી યોજવા માટે લેખિત સંમતિ આપી છે. સંમતિપત્રકો સામેલ છે. આમ, કુલ સભ્યોના ૯૫.૫૬% સભ્યોની સંમતિ મળી છે.

ભાગ

૭૦૨ કેટલીક ઉર્દૂ ગઝલો

ગઝલ ફારસીમાં : ગઝલ ફારસી સાહિત્યમાં ઘણી પ્રાચીન કાવ્યપ્રકાર છે. ગઝલનો પ્રારંભ ક્યારે થયો તે વિશે ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ ફારસી ગઝલ ઉપર અરબી કસીદાની અસર સ્પષ્ટ જોવા મળે છે. ફારસી ગઝલ પ્રારંભમાં પ્રેમ, સૌંદર્ય, મદિરા, વસંત, વિરહ, મિલન વગેરે વિષયો પૂરતી મર્યાદિત હતી. પરંતુ ધીમે ધીમે તેમાં સૂફી વિચારધારા પ્રવેશી. ફારસી ગઝલ ઉપર સૂફી વિચારધારાની ઊંડી અસર જોવા મળે છે. ફારસી ગઝલમાં ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવામાં આવ્યો છે. ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવાની પરંપરા ફારસી ગઝલમાં ઘણી જોવા મળે છે. ફારસી ગઝલમાં પ્રેમ, સૌંદર્ય, મદિરા, વસંત, વિરહ, મિલન વગેરે વિષયો પૂરતી મર્યાદિત હતી. પરંતુ ધીમે ધીમે તેમાં સૂફી વિચારધારા પ્રવેશી. ફારસી ગઝલ ઉપર સૂફી વિચારધારાની ઊંડી અસર જોવા મળે છે. ફારસી ગઝલમાં ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવાની પરંપરા ફારસી ગઝલમાં ઘણી જોવા મળે છે. ફારસી ગઝલમાં ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવામાં આવ્યો છે. ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવાની પરંપરા ફારસી ગઝલમાં ઘણી જોવા મળે છે. ફારસી ગઝલમાં પ્રેમ, સૌંદર્ય, મદિરા, વસંત, વિરહ, મિલન વગેરે વિષયો પૂરતી મર્યાદિત હતી. પરંતુ ધીમે ધીમે તેમાં સૂફી વિચારધારા પ્રવેશી. ફારસી ગઝલ ઉપર સૂફી વિચારધારાની ઊંડી અસર જોવા મળે છે. ફારસી ગઝલમાં ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવામાં આવ્યો છે. ઈશ્વરને પ્રિયતમા તરીકે કલ્પવાની પરંપરા ફારસી ગઝલમાં ઘણી જોવા મળે છે.

૬૧૮ ૬ મૂલ્ય

જેમાં ૧૦૦ ટકા ઉપરાંત ૧૦૦ ટકા સુધીનો વધારો થાય તેને ૧૦૦ ટકા ઉપરાંત ૧૦૦ ટકા સુધીનો વધારો કહેવાય. આવા વધારા

(૩૨૯

ઉ ત્તરા ધ્ય ય ન

ગોપાળ ગોકુળ ની ગોવાળણ સ્ત્રી લલિતા સાથે ગોકુળ ગામમાં રહેતા હતા. તેમને ત્યાં ઘણી ગાયો હતી. તેમાં એક ગાય ખૂબ જ સુંદર હતી. તેનું નામ કપિલા હતું. કપિલા ગાય ખૂબ જ દૂધાળ હતી. તે રોજ સવાર સાંજ ખૂબ જ દૂધ આપતી. ગોપાળ અને લલિતા કપિલાને પોતાના સંતાનની જેમ પ્રેમ કરતા હતા. કપિલા પણ તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે તેમનો અવાજ ઓળખતી હતી. તેમને જોઈને તે પૂંછડી હલાવતી હતી. તે ક્યારેય કોઈને પરેશાન કરતી નહોતી. તે ખૂબ જ શાંત સ્વભાવની ગાય હતી.

ગોપાળ અને લલિતા કપિલાને ખૂબ જ સારી રીતે રાખતા હતા. તેઓ તેને રોજ નવડાવતા હતા. તેના શરીર પર તેલ લગાવતા હતા. તેને સારું સારું ખાવાનું આપતા હતા. તેઓ તેને ક્યારેય ભૂખી રહેવા દેતા નહોતા. તેઓ તેને ક્યારેય મારતા પણ નહોતા. તેઓ તેને પ્રેમથી બોલાવતા હતા. તેઓ તેને ક્યારેય ગુસ્સે થતા નહોતા. તેઓ તેને ક્યારેય ખીજાતા પણ નહોતા. તેઓ તેને ક્યારેય ધમકાવતા પણ નહોતા. તેઓ તેને ક્યારેય ડરાવતા પણ નહોતા. તેઓ તેને ક્યારેય દુઃખી કરતા નહોતા. તેઓ તેને ક્યારેય રડાવતા પણ નહોતા. તેઓ તેને ક્યારેય હસાવતા હતા. તેઓ તેને ક્યારેય ખુશ રાખતા હતા. તેઓ તેને ક્યારેય આનંદમાં રાખતા હતા. તેઓ તેને ક્યારેય પ્રસન્ન રાખતા હતા. તેઓ તેને ક્યારેય સુખી રાખતા હતા. તેઓ તેને ક્યારેય તંદુરસ્ત રાખતા હતા. તેઓ તેને ક્યારેય બીમાર પડવા દેતા નહોતા. તેઓ તેને ક્યારેય માંદી પડવા દેતા નહોતા. તેઓ તેને ક્યારેય દવા આપતા નહોતા. તેઓ તેને ક્યારેય ઇન્જેક્શન આપતા નહોતા. તેઓ તેને ક્યારેય ડૉક્ટર પાસે લઈ જતા નહોતા. તેઓ તેને ક્યારેય ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર પડવા દેતા નહોતા. તેઓ તેને ક્યારેય ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર પડવા દેતા નહોતા. તેઓ તેને ક્યારેય ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર પડવા દેતા નહોતા.

ক) নিম্নের যে কোনো দুটি প্রশ্নের উত্তর দাও : ১০×২=২০

১। ভারতের যে কোনো একটি বিখ্যাত মন্দির সম্পর্কে তোমার জানা বিষয়গুলি লেখো।

উঃ ভারতের বিখ্যাত মন্দিরগুলির মধ্যে তামিলনাড়ুর মাদুরাই শহরে অবস্থিত মীনাক্ষী মন্দির অন্যতম। এটি দ্রাবিড় স্থাপত্যরীতির এক অসাধারণ নিদর্শন। মন্দিরটি প্রায় ১৪ একর জমির উপর বিস্তৃত। এর চারটি প্রবেশদ্বার রয়েছে, যেগুলিকে গোপুরম বলা হয়। এই গোপুরমগুলি অত্যন্ত উঁচু এবং রঙিন ভাস্কর্যে সুসজ্জিত। মন্দিরের প্রধান দেবী মীনাক্ষী এবং দেবতা সুন্দরেশ্বর। মীনাক্ষী দেবীর নাম থেকেই মন্দিরটির নাম হয়েছে মীনাক্ষী মন্দির। মন্দিরের ভিতরে রয়েছে সহস্র স্তম্ভ বিশিষ্ট হলঘর, যা স্থাপত্যশিল্পের এক অনন্য নিদর্শন। প্রতিদিন হাজার হাজার দর্শনার্থী এখানে পূজা দিতে আসেন। মন্দিরটি ধর্মীয় ও সাংস্কৃতিক উভয় দিক থেকেই গুরুত্বপূর্ণ।

২। ভারতের যে কোনো একটি বিখ্যাত মন্দির সম্পর্কে তোমার জানা বিষয়গুলি লেখো।

উঃ ভারতের বিখ্যাত মন্দিরগুলির মধ্যে তামিলনাড়ুর মাদুরাই শহরে অবস্থিত মীনাক্ষী মন্দির অন্যতম। এটি দ্রাবিড় স্থাপত্যরীতির এক অসাধারণ নিদর্শন। মন্দিরটি প্রায় ১৪ একর জমির উপর বিস্তৃত। এর চারটি প্রবেশদ্বার রয়েছে, যেগুলিকে গোপুরম বলা হয়। এই গোপুরমগুলি অত্যন্ত উঁচু এবং রঙিন ভাস্কর্যে সুসজ্জিত। মন্দিরের প্রধান দেবী মীনাক্ষী এবং দেবতা সুন্দরেশ্বর। মীনাক্ষী দেবীর নাম থেকেই মন্দিরটির নাম হয়েছে মীনাক্ষী মন্দির। মন্দিরের ভিতরে রয়েছে সহস্র স্তম্ভ বিশিষ্ট হলঘর, যা স্থাপত্যশিল্পের এক অনন্য নিদর্শন। প্রতিদিন হাজার হাজার দর্শনার্থী এখানে পূজা দিতে আসেন। মন্দিরটি ধর্মীয় ও সাংস্কৃতিক উভয় দিক থেকেই গুরুত্বপূর্ণ।

ગામના ગરાસિયા ઠાકોર (ગરાસદાર) ને તેમના ભાગમાં જે ગામ કે ગામડાં
ગરાસમાં મળ્યાં હોય તેમાં તેમને પોતાની જમીન ખેડવાનો પૂરો હક્ક હોય છે. તેમ
જ તેમને પોતાની જમીન ઉપર મકાન બાંધવાનો પણ હક્ક હોય છે. તેમ જ
તેમને પોતાની જમીનમાં ઝાડ વાવવાનો પણ હક્ક હોય છે. તેમ જ તેમને
પોતાની જમીનમાં કૂવા, તળાવ, વાવ વગેરે ખોદાવવાનો પણ હક્ક હોય છે.
તેમ જ તેમને પોતાની જમીનમાં ખેતી કરવા માટે ખેડૂતોને ખેતી કરવા
આપવાનો પણ હક્ક હોય છે. તેમ જ તેમને પોતાની જમીનમાં ખેતી કરવા
માટે ખેડૂતોને ખેતી કરવા આપવાનો પણ હક્ક હોય છે. તેમ જ તેમને
પોતાની જમીનમાં ખેતી કરવા માટે ખેડૂતોને ખેતી કરવા આપવાનો પણ
હક્ક હોય છે. તેમ જ તેમને પોતાની જમીનમાં ખેતી કરવા માટે ખેડૂતોને
ખેતી કરવા આપવાનો પણ હક્ક હોય છે. તેમ જ તેમને પોતાની જમીનમાં
ખેતી કરવા માટે ખેડૂતોને ખેતી કરવા આપવાનો પણ હક્ક હોય છે.

(ઉદાહરણ) કોઈ માણસે કોઈ વસ્તુ ખરીદી તેમાં તેણે ૧૦ ટકા નફો મેળવ્યો. જો તેણે તે વસ્તુ ૧૨૦૦ રૂપિયામાં વેચી હોય તો તેણે તે કેટલામાં ખરીદી હશે તે શોધો.

ઉકેલ: ૧૨૦૦ રૂપિયા વેચાણ કિંમત છે. તેમાં ૧૦ ટકા નફો છે. એટલે ૧૦૦ રૂપિયા વેચાણ કિંમત પર ૧૦ રૂપિયા નફો છે. તો ૧૨૦૦ રૂપિયા વેચાણ કિંમત પર કેટલો નફો થાય?

ઉપવાસ

ઉપવાસ એ કુદરત અને તંદુરસ્તીનું રક્ષણ કરવાનો એક ઉપાય છે. ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પાચનક્રિયા સુધરે છે. ઉપવાસ કરવાથી ભૂખ ઊઘડે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું લોહી બને છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું બળ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું જીવન આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું તેજ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું આયુષ્ય આવે છે.

ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પાચનક્રિયા સુધરે છે. ઉપવાસ કરવાથી ભૂખ ઊઘડે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું લોહી બને છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું બળ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું જીવન આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું તેજ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું આયુષ્ય આવે છે.

ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પાચનક્રિયા સુધરે છે. ઉપવાસ કરવાથી ભૂખ ઊઘડે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું લોહી બને છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું બળ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું જીવન આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું તેજ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું આયુષ્ય આવે છે.

ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પાચનક્રિયા સુધરે છે. ઉપવાસ કરવાથી ભૂખ ઊઘડે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું લોહી બને છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું બળ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું જીવન આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું તેજ આવે છે. ઉપવાસ કરવાથી શરીરમાં નવું આયુષ્ય આવે છે.

ઉપસંહાર

આમ, ઉપર્યુક્ત વિવેચન પરથી ફલિત થાય છે કે ગુજરાતી ભાષાના પ્રારંભિક કાળમાં જૈન સાધુઓ અને જૈન શ્રાવકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસમાં જે ફાળો આપ્યો છે તે ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતી ભાષાના પ્રારંભકાળમાં જૈન સાધુઓ અને શ્રાવકોએ ગુજરાતી ભાષાને જે સમૃદ્ધ વારસો આપ્યો છે તે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતી ભાષાના પ્રારંભકાળમાં જૈન સાધુઓ અને શ્રાવકોએ ગુજરાતી ભાષાને જે સમૃદ્ધ વારસો આપ્યો છે તે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતી ભાષાના પ્રારંભકાળમાં જૈન સાધુઓ અને શ્રાવકોએ ગુજરાતી ભાષાને જે સમૃદ્ધ વારસો આપ્યો છે તે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે. ગુજરાતી ભાષાના પ્રારંભકાળમાં જૈન સાધુઓ અને શ્રાવકોએ ગુજરાતી ભાષાને જે સમૃદ્ધ વારસો આપ્યો છે તે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે.

ઉપરના લેખમાં, પેરા નંબર ૧૦૨ માં આપેલ ટીકા વિષે, મારા તરફથી કેટલાક ખુલાસા કરવા જરૂરી છે. ટીકાકારે મારા વિષે જે કંઈ લખ્યું છે તે મારા જાણવામાં નથી. મારા વિષે કોઈ પણ ટીકા કરવાનો તેમને કોઈ હક્ક નથી. મારા વિષે તેમણ

ਤਾਂ ਦੁਖਾਂ ਮੁਲਿਆ ਸੁਖਾਂ ਦਾਰੇ ਮੁਲਤਾਨ ਤੋਂ ਦੁਰੇਟੇ ਤੱਕ ਦੀ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਖਜੂਰ ਦੇ ਦਰੱਖਤ ਹਨ। ਇਹ ਦਰੱਖਤ ਬਹੁਤ ਉੱਚੇ ਹਨ ਅਤੇ ਇਨ੍ਹਾਂ ਦੇ ਫਲ ਵੀ ਬਹੁਤ ਮਿੱਠੇ ਹੁੰਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਖੇਤ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਵਿਚ ਕਣਕ, ਜੌਂ, ਛੋਲੇ ਅਤੇ ਕਪਾਹ ਦੀ ਫਸਲ ਬੀਜੀ ਜਾਂਦੀ ਹੈ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ।

ਤੁਰੇਟੇ ਤੋਂ ਮੁਲਤਾਨ ਤੱਕ ਦੀ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਖਜੂਰ ਦੇ ਦਰੱਖਤ ਹਨ। ਇਹ ਦਰੱਖਤ ਬਹੁਤ ਉੱਚੇ ਹਨ ਅਤੇ ਇਨ੍ਹਾਂ ਦੇ ਫਲ ਵੀ ਬਹੁਤ ਮਿੱਠੇ ਹੁੰਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਖੇਤ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਵਿਚ ਕਣਕ, ਜੌਂ, ਛੋਲੇ ਅਤੇ ਕਪਾਹ ਦੀ ਫਸਲ ਬੀਜੀ ਜਾਂਦੀ ਹੈ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ। ਇਸ ਸੜਕ ਦੇ ਦੋਵੇਂ ਪਾਸੇ ਕਈ ਥਾਵਾਂ ਤੇ ਖੂਹ ਵੀ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਤੋਂ ਲੋਕ ਪੀਣ ਵਾਲਾ ਪਾਣੀ ਭਰਦੇ ਹਨ ਅਤੇ ਆਪਣੇ ਪਸ਼ੂਆਂ ਨੂੰ ਵੀ ਪਾਣੀ ਪਿਲਾਉਂਦੇ ਹਨ।

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ફરિયાદી : ઉપરોક્ત નામના ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ફરિયાદી : ઉપરોક્ત નામના ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ફરિયાદી : ઉપરોક્ત નામના ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ફરિયાદી : ઉપરોક્ત નામના ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ફરિયાદી : ઉપરોક્ત નામના ફરિયાદી તરીકે હાજર થવા બાબત.

ઉપરના બનાવ પછી ત્રણ ચાર દિવસ બાદ ફરીથી મહારાજા સાહેબ
ઉપર ઉપરાઉપરી ત્રણ ચાર કાગળો આવ્યા. તેમાં પોતાની
ઉપર ઉપરાઉપરી ત્રણ ચાર કાગળો આવ્યા. તેમાં પોતાની
ઉપર ઉપરાઉપરી ત્રણ ચાર કાગળો આવ્યા. તેમાં પોતાની

৪। নমুনা প্রশ্নোত্তর

প্রশ্ন ঃ ১। ভারতের রাষ্ট্রপতি কর্তৃক ব্যবহৃত বিশেষ ক্ষমতা সম্পর্কে আলোচনা কর।

উত্তর ঃ ভারতের রাষ্ট্রপতি কর্তৃক ব্যবহৃত বিশেষ ক্ষমতা সম্পর্কে আলোচনা করা হলো ঃ

ভারতের রাষ্ট্রপতি কর্তৃক ব্যবহৃত বিশেষ ক্ষমতা ঃ ভারতের রাষ্ট্রপতি কর্তৃক ব্যবহৃত বিশেষ ক্ষমতা নিম্নে আলোচনা করা হলো ঃ

(১) জরুরি অবস্থা ঘোষণা ঃ ভারতের রাষ্ট্রপতি জরুরি অবস্থা ঘোষণা করতে পারেন।

ঈদুল ফিতর ও ঈদুল আযহার নামাযের পূর্বে ও পরে কিছু নফল নামায রয়েছে, যা পড়া সুন্নাত। এসব নামাযের মধ্যে কোনটি কখন পড়তে হবে তা নিম্নে বর্ণনা করা হলো :

ঈদুল ফিতরের নামাযের পূর্বে কোন নফল নামায নেই। তবে ঈদের নামায শেষে বাড়ি ফিরে দু'রাকাত নফল নামায পড়া সুন্নাত। এ নামায ঈদগাহে না পড়ে বাড়িতে পড়াই উত্তম। ঈদুল আযহার নামাযের পূর্বে কোন নফল নামায নেই। ঈদের নামায শেষে বাড়ি ফিরে কোন নফল নামায পড়তে হবে না। তবে ঈদগাহে যাওয়ার পূর্বে কিছু খেয়ে নেয়া সুন্নাত।

ঈদুল ফিতর ও ঈদুল আযহার নামাযের পূর্বে ও পরে কিছু নফল নামায রয়েছে, যা পড়া সুন্নাত। এসব নামাযের মধ্যে কোনটি কখন পড়তে হবে তা নিম্নে বর্ণনা করা হলো :

ঈদুল ফিতরের নামাযের পূর্বে কোন নফল নামায নেই। তবে ঈদের নামায শেষে বাড়ি ফিরে দু'রাকাত নফল নামায পড়া সুন্নাত। এ নামায ঈদগাহে না পড়ে বাড়িতে পড়াই উত্তম। ঈদুল আযহার নামাযের পূর্বে কোন নফল নামায নেই। ঈদের নামায শেষে বাড়ি ফিরে কোন নফল নামায পড়তে হবে না। তবে ঈদগাহে যাওয়ার পূর্বে কিছু খেয়ে নেয়া সুন্নাত।

ઉપરના ફકરા ૧ થી ૩ ની વિગતો ધ્યાને લેતાં, એક તોલમાપ અધિકારી તરીકે તમે તપાસ કરવા ગયા ત્યારે તમારી સાથે કોણ કોણ હાજર હતું તે જણાવો. તમારી તપાસ દરમ્યાન તમને કેવી કેવી ગેરરીતિઓ જોવા મળી તે જણાવો. તમારી તપાસ દરમ્યાન તમને જે ગેરરીતિઓ જોવા મળી તે માટે તમે કયા કયા પગલાં લીધાં તે જણાવો. તમારી તપાસ દરમ્યાન તમને જે ગેરરીતિઓ જોવા મળી તે માટે તમે કયા કયા પગલાં લીધાં તે જણાવો. (૧૦ ગુણ)

૬ કોઈ પણ ૨ વિષયો પર નિબંધ લખો. (૨૦ ગુણ)

(૧) ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ

(૨) ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ

(૩) ગુજરાતમાં ખેતીવાડી

(૪) ગુજરાતમાં પશુપાલન

(૫) ગુજરાતમાં પાણીની સમસ્યા

(૬) ગુજરાતમાં વીજળીની સમસ્યા

(૭) ગુજરાતમાં ખનીજ સંપત્તિ

(૮) ગુજરાતમાં વસ્તી વધારો

(૯) ગુજરાતમાં બેરોજગારી

(૧૦) ગુજરાતમાં ગરીબી

ઉપરોક્ત ટેન્ડર નોટિસ

ટેન્ડર નં. ૦૧/૨૦૨૨-૨૩ - ટેન્ડર ફોર્મ :- ટેન્ડર ફોર્મ ની કિંમત રૂ. ૨૦૦/- (બસો રૂપિયા પુરા) બિન પરતપાત્ર રહેશે. ટેન્ડર ફોર્મ ની કિંમત ચેક/ડ્રાફ્ટ થી ચુકવવાની

ઉપસંહાર

ઉપર્યુક્ત વિવેચન પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતી નવલકથાના વિકાસમાં ઇતિહાસ, દેશી રાજા અને મુસ્લિમ શાસન-કાળ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ઐતિહાસિક નવલકથાઓ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ અને કલ્પનાનું સુભગ સંયોજન થયું હોય છે. ઇતિહાસ પર આધારિત હોવાથી ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસ અને કલ્પનાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ પ્રશ્ન વિવેચકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક વિવેચકોનો મત છે કે ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ અને કલ્પનાનું પ્રમાણ સરખું હોવું જોઈએ. કેટલાક વિવેચકોનો મત છે કે ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ કરતાં કલ્પનાનું પ્રમાણ વધારે હોવું જોઈએ. કેટલાક વિવેચકોનો મત છે કે ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ કરતાં કલ્પનાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. આ બધા મતોમાં કયો મત સાચો છે એ નક્કી કરવું મુશ્કેલ છે. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ અને કલ્પનાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ

ઉપરોક્ત ગુનાના કામે ફરિયાદી તરફે સાક્ષી તરીકે રજુ થયેલ ડૉક્ટર
અમરસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (ફરિયાદી) ની ઉલટતપાસ દરમ્યાન
તેમણે જણાવેલ કે મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર
તરીકે મોટર એક્સિડન્ટ કેસ તરીકે આવેલ હતો તેમ કહેવું ખોટું છે
તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ
હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ
ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ
મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું
કહેવું પણ ખોટું છે તેમજ મારી પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ
બનનાર તરીકે આવેલ હોવાનું કહેવું પણ ખોટું છે તેમજ મારી
પાસે ઇજા પામેલ વ્યક્તિ ભોગ બનનાર તરીકે આવેલ હોવાનું

(૬)

ઉદાહરણ ૩ : ઉપરોક્ત પ્રશ્નમાં ધારો કે વર્તુળ $x^2 + y^2 = 25$ ને બદલે $x^2 + y^2 = 16$ છે. તો તે જ પ્રશ્ન ઉકેલો.

ઉકેલ : ધારો કે $P(x_1, y_1)$ અને $Q(x_2, y_2)$ એ વર્તુળ $x^2 + y^2 = 16$ પરનાં બે બિંદુઓ છે કે જેથી $PQ = 6$ થાય. M એ PQ નું મધ્યબિંદુ છે. O એ ઊગમબિંદુ છે. $OM \perp PQ$ થાય.

$OP = 4$ (વર્તુળની ત્રિજ્યા)

$PM = 3$ ($PQ = 6$ નું અર્ધ)

$\therefore OM = \sqrt{OP^2 - PM^2} = \sqrt{16 - 9} = \sqrt{7}$

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 16$ ને સ્પર્શે છે.

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 25$ ને બે બિંદુઓમાં છેદે છે.

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 25$ ને બે બિંદુઓમાં છેદે છે કે જેથી $PQ = 6$ થાય.

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 25$ ને બે બિંદુઓમાં છેદે છે કે જેથી $PQ = 6$ થાય.

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 25$ ને બે બિંદુઓમાં છેદે છે કે જેથી $PQ = 6$ થાય.

$\therefore$ PQ ની મધ્યબિંદુ M આગળની સ્પર્શક $x^2 + y^2 = 25$ ને બે બિંદુઓમાં છેદે છે કે જેથી $PQ = 6$ થાય.

ઉપરના ફકરામાં વર્ણવેલ તમામ વિગતો કોઈ એક વ્યક્તિ કે સંસ્થાને લાગુ પડતી નથી. આ વિગતો વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે જુદી જુદી રીતે સાચી પડી શકે છે. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વિશે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નુકસાન પહોંચાડવું નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની બદનામી કરવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ધાર્મિક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રાજકીય લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સામાજિક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આર્થિક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વૈજ્ઞાનિક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કલાત્મક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સાહિત્યિક લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રમતગમત લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મનોરંજન લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પર્યાવરણ લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની માનવ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની બાળ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મહિલા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વૃદ્ધ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અપંગ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લઘુમતી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની બહુમતી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આદિવાસી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગ્રામીણ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શહેરી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખેડૂત અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મજૂર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વેપારી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઉદ્યોગપતિ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રાજકારણી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અધિકારી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કર્મચારી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિદ્યાર્થી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શિક્ષક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ડૉક્ટર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વકીલ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ન્યાયાધીશ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પોલીસ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સૈનિક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પત્રકાર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લેખક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કલાકાર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સંગીતકાર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નૃત્યકાર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેતા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની દિગ્દર્શક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નિર્માતા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિતરક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રદર્શક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સેન્સર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રેક્ષક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સમીક્ષક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિવેચક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઇતિહાસકાર અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂગોળવિદ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખગોળશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગણિતજ્ઞ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રસાયણશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૌતિકશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની જીવવિજ્ઞાની અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વનસ્પતિશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાણીશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂસ્તરશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની હવામાનશાસ્ત્રી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પર્યાવરણવિદ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કૃષિવિદ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પશુચિકિત્સક અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ફાર્માસિસ્ટ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નર્સ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પેરામેડિકલ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લેબોરેટરી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રેડિયોલોજી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ફિઝિયોથેરાપી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આયુર્વેદ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની હોમિયોપેથી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની યુનાની અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સિદ્ધ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નેચરોપેથી અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની યોગ અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાકૃતિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વૈકલ્પિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પરંપરાગત ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લોક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આદિવાસી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગ્રામીણ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શહેરી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખેડૂત ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મજૂર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વેપારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઉદ્યોગપતિ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રાજકારણી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અધિકારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કર્મચારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિદ્યાર્થી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શિક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ડૉક્ટર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વકીલ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ન્યાયાધીશ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પોલીસ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સૈનિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પત્રકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લેખક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કલાકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સંગીતકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નૃત્યકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેતા ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની દિગ્દર્શક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નિર્માતા ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિતરક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રદર્શક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સેન્સર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રેક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સમીક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિવેચક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઇતિહાસકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂગોળવિદ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખગોળશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગણિતજ્ઞ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રસાયણશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૌતિકશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની જીવવિજ્ઞાની ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વનસ્પતિશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાણીશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂસ્તરશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની હવામાનશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પર્યાવરણવિદ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કૃષિવિદ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પશુચિકિત્સક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ફાર્માસિસ્ટ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નર્સ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પેરામેડિકલ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લેબોરેટરી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રેડિયોલોજી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ફિઝિયોથેરાપી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આયુર્વેદ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની હોમિયોપેથી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની યુનાની ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સિદ્ધ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નેચરોપેથી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની યોગ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાકૃતિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વૈકલ્પિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પરંપરાગત ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લોક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની આદિવાસી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગ્રામીણ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શહેરી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખેડૂત ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મજૂર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વેપારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઉદ્યોગપતિ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રાજકારણી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અધિકારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કર્મચારી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિદ્યાર્થી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની શિક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ડૉક્ટર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વકીલ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ન્યાયાધીશ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પોલીસ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સૈનિક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પત્રકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની લેખક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની કલાકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સંગીતકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નૃત્યકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેતા ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની અભિનેત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની દિગ્દર્શક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની નિર્માતા ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિતરક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રદર્શક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સેન્સર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રેક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સમીક્ષક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વિવેચક ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ઇતિહાસકાર ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂગોળવિદ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ખગોળશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ગણિતજ્ઞ ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની રસાયણશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૌતિકશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની જીવવિજ્ઞાની ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની વનસ્પતિશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાણીશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની ભૂસ્તરશાસ્ત્રી ચિકિત્સા અધિકાર લાગણી દુભાવવી નહીં. આ વિગતોનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ

ઉ.ન.ઉ.

ઉ.ન.ઉ. - ઉપરના ઉત્પાદન ખર્ચમાંથી ખેડૂતને ખરેખર કેટલી રકમ મળે છે તે જાણવા માટે ઉત્પાદન ખર્ચમાંથી ઉપજની કિંમત બાદ કરવામાં આવે છે. ઉપજની કિંમત ગણવા માટે ખેડૂતને મળતા ભાવ, જાહેર કરેલા ટેકાના ભાવ કે બજારમાં પ્રવર્તતા ભાવ પૈકી કયા ભાવ ગણવા તે અંગે ખેડૂતોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. ખરેખર તો ખેડૂતને જે ભાવ મળ્યો હોય તે ભાવ ગણવાનો હોય છે.

૧ મુસ્લિમ ને ૨૭૦

મુસ્લિમ - ૧૯૫૨ સાલમાં કોલકાતા ખાતે મુસ્લિમ લીગના ૩૫ મા અધિવેશનમાં મુસ્લિમ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેમણે કરેલું પ્રવચન : -

ભાઈઓ અને બહેનો, આજે આપણે અહીં ભેગા થયા છીએ તે આપણા ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે. આપણા પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરવા બદલ હું આપનો આભાર માનું છું. આપણી સંસ્થા મુસ્લિમ લીગ ૪૫ વર્ષ પહેલાં સ્થપાઈ હતી. ત્યારથી આજ સુધી તેણે ભારતના મુસ્લિમોની ઘણી સેવા કરી છે. આપણી સંસ્થાએ ભારતના મુસ્લિમોને તેમના હક્કો અપાવવા માટે ઘણી લડત આપ

ફરજ

ફરિયાદી

વિરુદ્ધ

:આરોપી

૧. આરોપી : ૧ અને ફરીયાદી વિરુદ્ધ કોર્ટના હુકમનામા ભંગ બદલ ફોજદારી કાર્યરીતી સંહિતા કલમ-૪૫૬ મુજબ ફરીયાદ દાખલ કરવા બાબત.

૨. ફરીયાદી તથા આરોપ નં.૧ વચ્ચે દિવાની દાવો નં.૨૦૨૦/૧૨૩૪ ના કામે તા.૧૫/૦૩/૨૦૨૧ ના રોજ કાયમી મનાઈ હુકમ કરવા બાબતનો દાવો દાખલ કરેલ હતો. જે દાવો ચાલી જતા તા.૨૫/૦૬/૨૦૨૨ ના રોજ આ કામના આરોપ નં.૧ વિરુદ્ધ કાયમી મનાઈ હુકમ કરવા બાબતનો હુકમ કરવામાં આવેલ હતો. જે હુકમ આજ દિન સુધી અમલમાં છે. જે હુકમ આરોપ નં.૧ ને બરાબર સમજાવી તેની બજવણી કરવામાં આવેલ હતી

ક્રમ ૨૦૨૩

૨.૨ કુટુંબવાદ અને રાજકીય પક્ષ કોને કહે છે, પક્ષ કોને કહેવાય તેની વ્યાખ્યા આપો. ભારતમાં રાજકારણ કુટુંબ કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવો.

કુટુંબવાદ એટલે રાજકારણમાં કુટુંબના સભ્યોનું વર્ચસ્વ. ભારતમાં ઘણા રાજકીય પક્ષો કોઈ ને કોઈ કુટુંબ સાથે જોડાયેલા છે. જેમ કે, કોંગ્રેસ પર નેહરુ-ગાંધી પરિવાર, સમાજવાદી પક્ષ પર મુલાયમ સિંહ યાદવનો પરિવાર, શિવસેના પર ઠાકરે પરિવાર અને ડીએમકે પર કરુણાનિધિનો પરિવાર પ્રભાવ ધરાવે છે.

રાજકીય પક્ષ એટલે "સમાન વિચારધારા ધરાવતા લોકોનું સંગઠન જે ચૂંટણી લડીને સત્તા મેળવવાનો પ્રયત્ન કરે." પક્ષને ઓળખવા માટે તેનો ધ્વજ, ચિહ્ન અને બંધારણ હોય છે. ભારતમાં ૨૦૨૩ સુધીમાં ૨૫૦૦ થી વધુ રાજકીય પક્ષો નોંધાયેલા છે.

૨.૩ ભારતમાં રાજકીય પક્ષોની ભૂમિકા અને મહત્વ સમજાવો. પક્ષ વગરની લોકશાહી કેવી હોય તે કલ્પના કરો.

ભારતમાં રાજકીય પક્ષો લોકશાહીનો પાયો છે. તેઓ મતદારોને જોડે છે, નીતિઓ ઘડે છે અને સરકાર ચલાવે છે. પક્ષ વગરની લોકશાહીમાં દરેક ઉમેદવાર પોતાની રીતે ચૂંટણી લડે, જેથી મતદારોને કોને મત આપવો તે સમજવું મુશ્કેલ બને. પક્ષો મતદારોને સ્પષ્ટ વિકલ્પ આપે છે.

ફરી

ચૂકવણી ન કરવા બદલ - રૂા. ૨૨૦૦૦ સામે ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રી શ્રી ડી.એમ. પટેલ હાજર થયા હતા. ફરિયાદ રજૂ કરવામાં આવી હતી કે આરોપી ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂા. ૨૨૦૦૦ લઈ ગયા હતા. જે રકમ પરત કરવા માટે આરોપીને વારંવાર જણાવવામાં આવતા આરોપીએ ફરિયાદીને રૂા. ૨૨૦૦૦ નો ચેક આપેલ હતો. જે ચેક બેંકમાં રજૂ કરતા ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે પરત ફરેલ હતો. જે અંગે ફરિયાદીએ વકીલ મારફત આરોપીને નોટીસ પાઠવી હતી. જે નોટીસ આરોપીને મળી ગયા બાદ પણ આરોપીએ રકમ ચૂકવી આપેલ નહીં. જેથી ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી શ્રી ડી.એમ. પટેલ હાજર થયા હતા. આરોપી તરફે કોઈ હાજર થયા ન હતા. ફરિયાદ પક્ષ તરફે રજૂ કરવામાં આવેલ પુરાવો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૨ માસની સાદી કેદની સજા તથા રૂા. ૨૨૦૦૦ વળતર પેટે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ હતી. જે અપીલ ચાલી જતા અપીલ કોર્ટે ફરિયાદ પક્ષે રજૂ કરેલ પુરાવો ધ્યાને લઈ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી અપીલ રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ હાઈકોર્ટમાં ક્રિમીનલ રીવીઝન અરજી દાખલ કરેલ હતી. જે અરજી ચાલી જતા હાઈકોર્ટે નીચેની બંને કોર્ટનો હુકમ યથાવત રાખી અરજી રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરેલ હતી. જે પીટીશન ચાલી જતા સુપ્રીમ કોર્ટે નીચેની ત્રણેય કોર્ટનો હુકમ યથાવત રાખી પીટીશન રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ રીવ્યુ પીટીશન દાખલ કરેલ હતી. જે રીવ્યુ પીટીશન ચાલી જતા રીવ્યુ પીટીશન પણ રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ ક્યુરેટીવ પીટીશન દાખલ કરેલ હતી. જે ક્યુરેટીવ પીટીશન ચાલી જતા ક્યુરેટીવ પીટીશન પણ રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરેલ હતી. જે દયા અરજી ચાલી જતા રાષ્ટ્રપતિએ પણ દયા અરજી રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ હતી. જે રીટ પીટીશન ચાલી જતા સુપ્રીમ કોર્ટે રીટ પીટીશન રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન દાખલ કરેલ હતી. જે ક્યુરેટીવ પીટીશન ચાલી જતા ક્યુરેટીવ પીટીશન પણ રદ કરવાનો હુકમ કરેલ હતો. જે હુકમ સામે આરોપીએ ફરીથી

ફરિયાદ

તા. ૨૨/૦૬/૨૦૧૯

ફરિયાદ - ગોવિંદ કાનજી પરમાર ઉ.વ.૪૨ રહે. મોટા ભોજપરા તા. જી. સુરેન્દ્રનગર

મારા ઉપરોક્ત સરનામે મારી માલીકીની ટ્રક નં. જી.જે.૧૨ એ.ટી.૭૭૭૭ વાળી ટ્રક મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘઉંનો ભરેલ કટ્ટા ૧૦૦ ટ્રકમાં ભરી ટ્રક ચાલક ભરતભાઈ ભીખાભાઈ ભરવાડ રહે. ચોટીલા વાળાને ટ્રક ચલાવવા આપેલ હોય જે ટ્રક ચાલક ભરતભાઈ ભીખાભાઈ ભરવાડ રહે. ચોટીલા વાળાએ ટ્રકમાં ભરેલ ઘઉંનો માલ ચોટીલા ખાતે ન પહોંચાડી ટ્રકમાં ભરેલ ઘઉંનો માલ ચોરી કરી ટ્રક ચાલક ભરતભાઈ ભીખાભાઈ ભરવાડ રહે. ચોટીલા વાળાએ

ફોર્મ નં. ૨૨૯ (૨)

પ્રતિ શ્રીમતી પ્રમુખશ્રી/ચીફ ઓફિસર/ઇન્ચાર્જ અધિકારી/તલાટી-કમ-મંત્રી/સેક્રેટરી

ઉપરોક્ત ના પ્રકરણ ૬૮ ના

ગ્રામ્યજીવનના ચોમાસાના અનેકવિધ ચિત્રોમાં તે વર્ણવેલાં જૂનવાણી
ઢોર માટેના ઘાસચારાની સમસ્યા આજે પણ ઊભી જ છે. ઘાસચારાની
અછત ઉપરાંત ઢોરને થતા રોગોની સમસ્યા પણ ઓછી ગંભીર નથી.
ઢોરના રોગોમાં ખરવા-મોવાસા, ગળસૂંઢો, ચાંદી, ગાંઠિયો તાવ,
ફૂલવું, ઝાડા, ગોચરી, ગોમૂત્રી, ગોબરી, ગોળ વગેરે મુખ્ય છે.
ઢોરોના રોગોમાં ઘણા રોગો ચેપી હોય છે. ચેપી રોગોમાં ખરવા-
મોવાસા, ગળસૂંઢો, ચાંદી, ગાંઠિયો તાવ, ફૂલવું વગેરે રોગોમાં
ઢોરોને ઘણી વાર બચાવી શકાતાં નથી. ઢોરોના રોગોમાં ઘણા
રોગોમાં ઢોરોને ઘણી વાર બચાવી શકાતાં નથી. ઢોરોના રોગોમાં
ઘણા રોગોમાં ઢોરોને ઘણી વાર બચાવી શકાતાં નથી. ઢોરોના
રોગોમાં ઘણા રોગોમાં ઢોરોને ઘણી વાર બચાવી શકાતાં નથી.

ક્રમ

ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ ૧૧૨ (૧) અને ૧૧૩ (૧) હેઠળ ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઓવરલોડિંગ અને ઓવરહેંગ (ઓવરહેંગ) ફી ચૂકવવા અંગે

ટ્રાન્સપોર્ટ વાહનોના માલિકો/ડ્રાઇવરો ધ્યાન આપો કે ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ ૧૧૨ (૧) અને ૧૧૩ (૧) હેઠળ ટ્રાન્સપોર્ટ વાહનો પર ઓવરલોડિંગ અને ઓવરહેંગ ફી વસૂલવા અંગે સરકારી ઠરાવ ક્રમાંક: ટીવીએલ-૧૦૨૦૨૦-૧૨૩૪-ક, તારીખ ૧૫મી માર્ચ, ૨૦૨૦ થી અમલમાં આવ્યો છે. આ ઠરાવ મુજબ, ટ્રાન્સપોર્ટ વાહનો પર ઓવરલોડિંગ અને ઓવરહેંગ ફી વસૂલવા માટે નીચે મુજબ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.

૧. ઓવરલોડિંગ ફી:- ટ્રાન્સપોર્ટ વાહનો પર ઓવરલોડિંગ ફી નીચે મુજબ વસૂલવામાં આવશે.

ક્રમ	વાહનનો પ્રકાર	ઓવરલોડિંગ ફી (પ્રતિ ટન)
૧	૩ ટન સુધીના વાહનો	૧૫૦
૨	૩ ટનથી વધુ અને ૭ ટન સુધીના વાહનો	૨૫૦
૩	૭ ટનથી વધુ અને ૧૨ ટન સુધીના વાહનો	૪૦૦
૪	૧૨ ટનથી વધુ અને ૨૦ ટન સુધીના વાહનો	૬૦૦
૫	૨૦ ટનથી વધુ અને ૩૦ ટન સુધીના વાહનો	૮૫૦
૬	૩૦ ટનથી વધુ અને ૪૦ ટન સુધીના વાહનો	૧૨૦૦
૭	૪૦ ટનથી વધુ અને ૫૦ ટન સુધીના વાહનો	૧૫૦૦
૮	૫૦ ટનથી વધુ અને ૬૦ ટન સુધીના વાહનો	૨૦૦૦
૯	૬૦ ટનથી વધુ અને ૭૫ ટન સુધીના વાહનો	૨૫૦૦
૧૦	૭૫ ટનથી વધુ અને ૧૦૦ ટન સુધીના વાહનો	૩૫૦૦
૧૧	૧૦૦ ટનથી વધુ અને ૧૨૫ ટન સુધીના વાહનો	૪૫૦૦
૧૨	૧૨૫ ટનથી વધુ અને ૧૫૦ ટન સુધીના વાહનો	૫૫૦૦
૧૩	૧૫૦ ટનથી વધુ અને ૨૦૦ ટન સુધીના વાહનો	૭૫૦૦
૧૪	૨૦૦ ટનથી વધુ અને ૨૫૦ ટન સુધીના વાહનો	૧૦૦૦૦
૧૫	૨૫૦ ટનથી વધુ અને ૩૦૦ ટન સુધીના વાહનો	૧૨૫૦૦
૧૬	૩૦૦ ટનથી વધુ અને ૩૫૦ ટન સુધીના વાહનો	૧૫૦૦૦
૧૭	૩૫૦ ટનથી વધુ અને ૪૦૦ ટન સુધીના વાહનો	૧૮૦૦૦
૧૮	૪૦૦ ટનથી વધુ અને ૪૫૦ ટન સુધીના વાહનો	૨૨૦૦૦
૧૯	૪૫૦ ટનથી વધુ અને ૫૦૦ ટન સુધીના વાહનો	૨૬૦૦૦
૨૦	૫૦૦ ટનથી વધુ અને ૫૫૦ ટન સુધીના વાહનો	૩૦૦૦૦
૨૧	૫૫૦ ટનથી વધુ અને ૬૦૦ ટન સુધીના વાહનો	૩૫૦૦૦
૨૨	૬૦૦ ટનથી વધુ અને ૬૫૦ ટન સુધીના વાહનો	૪૦૦૦૦

ધોરણ ૭ ગુજરાતી

૧૫ ગણપતિ ઉત્સવ : નિબંધ - ગદ્યપદ્ય વિભાગ

ગણપતિ ઉત્સવ ભારતના પ્રાચીન ઉત્સવોમાંનો એક ઉત્સવ છે. ભાદરવા સુદ ચોથથી દસ દિવસ ચાલતો આ ઉત્સવ ગણપતિ ભગવાનનો જન્મદિવસ ગણાય છે. ગણપતિ ભગવાનને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. આ ઉત્સવ ઘરમાં તથા જાહેર સ્થળોએ ઉજવવામાં આવે છે. ઘરમાં ઉજવવામાં આવતા ઉત્સવને ઘરગણપતિ કહેવામાં આવે છે. જાહેર સ્થળોએ ઉજવવામાં આવતા ઉત્સવને સાર્વજનિક ગણપતિ કહેવામાં આવે છે. ઘરમાં ઉજવવામાં આવતા ઉત્સવમાં ઘરના સભ્યો ઉપરાંત સગાં-સંબંધીઓ પણ ભાગ લે છે. જાહેર સ્થળોએ ઉજવવામાં આવતા ઉત્સવમાં ઘણા લોકો ભાગ લે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઘરમાં કે જાહેર સ્થળોએ સ્થાપવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ માટીની બનાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર મુકુટ પહેરાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર હાર પહેરાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર ફૂલોની માળા પહેરાવવામાં આવે છે. ગણપતિ ભગવાનની મૂર્તિ ઉપર સુંદર ફૂલોની માળા પહેરાવવામાં આવે છે.

ગામ ઉતારા પત્રક

ગામ ઉતારા પત્રકમાં ગામની ખાનાવાર વિગતો દર્શાવવામાં આવે છે. આ પત્રકમાં ગામની વસ્તી, જમીન, પાક, સિંચાઈ, કર અને બાકી જેવી માહિતીનો સમાવેશ થાય છે. તલાટી-કમ-મંત્રી ગામ નમૂના નં. ૭ અને ૮ અ તૈયાર કરે છે. આ પત્રક ગામના વહીવટી કામકાજ માટે અત્યંત મહત્ત્વનું દસ્તાવેજ ગણાય છે.

ગામ ઉતારા પત્રક એ ગામની વહીવટી માહિતીનો સંગ્રહ છે. તેમાં ગામની વસ્તી, ઘરોની સંખ્યા, જમીનનો પ્રકાર, પાકની વિગત, સિંચાઈની સુવિધા, કરની આકારણી અને બાકી રકમ જેવી બાબતોની નોંધ કરવામાં આવે છે. આ પત્રક દ્વારા ગામની સમગ્ર સ્થિતિનો ખ્યાલ આવે છે. તલાટી-કમ-મંત્રી દર વર્ષે આ પત્રક અદ્યતન કરે છે.

આ પત્રક તૈયાર કરવા માટે તલાટી-કમ-મંત્રી ગામની મુલાકાત લે છે અને ખાતેદારોની વિગતો એકત્ર કરે છે. ત્યારબાદ આ માહિતી રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. પત્રક તૈયાર થયા બાદ તેની એક નકલ તાલુકા પંચાયત કચેરીમાં મોકલવામાં આવે છે. આ પત્રક ગામના વિકાસ આયોજન માટે પણ ઉપયોગી બને છે.

ગામ ઉપર ચઢાઈ કરી. ગામ લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે ગામની ચારે બાજુ ખાઈ ખોદી હતી. ખાઈ ઓળંગીને ગામમાં પ્રવેશવા માટે ખાઈ પર પુલ બાંધવામાં આવ્યો હતો. પુલ પર ગામના લોકોએ મોટી સંખ્યામાં ઊભા રહીને તીર-કામઠાં વડે મુસલમાનોનો સામનો કર્યો. પરંતુ મુસલમાનોએ પુલ પર ચઢીને ગામ લોકોને હરાવ્યા

ઉ.ત.

ઉ.ત. ના પ્રશ્ન ૨ ના જવાબ

૨ (અ) નીચે આપેલ પ્રશ્નો પૈકી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો : ૧૦

(૧) ઉત્તર ધ્રુવ પર સૂર્ય ક્યારે ઊગે છે ?

ઉત્તર ધ્રુવ પર સૂર્ય ૬ મહિના સુધી ઊગેલો રહે છે. ૬ મહિના સુધી સૂર્ય અસ્ત થતો નથી. ૬ મહિના સુધી સૂર્ય અસ્ત થયેલો રહે છે. ૬ મહિના સુધી સૂર્ય ઊગેલો રહે છે

ઉદાહરણ

ઉદાહરણ ૧૦ : મકાનનું ભાડું ૨૦% વધારવામાં આવ્યું છે. ભાડું વધ્યા પછી મકાનનું ભાડું ૧૨૦૦ રૂપિયા થાય છે, તો ભાડું વધ્યા પહેલાં મકાનનું ભાડું કેટલું હતું ?

ઉકેલ : ધારો કે, ભાડું વધ્યા પહેલાં મકાનનું ભાડું ₹ x હતું.

ભાડું ૨૦% વધ્યું.

∴ ૧૦૦ રૂપિયાનું ભાડું ૧૨૦ રૂપિયા થાય.

∴ ૧ રૂપિયાનું ભાડું $\frac{120}{100}$ રૂપિયા થાય.

∴ x રૂપિયાનું ભાડું $\frac{120}{100} \times x$ રૂપિયા થાય.

∴ $\frac{120}{100} \times x = 1200$

∴ $x = \frac{1200 \times 100}{120}$

∴ $x = 1000$

∴ ભાડું વધ્યા પહેલાં મકાનનું ભાડું ૧૦૦૦ રૂપિયા હતું.

ઉદાહરણ ૧૧ : ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષમાં કેટલા ટકા રસ્તાઓ હતા ?

ઉકેલ : ધારો કે, ૨૦૦૮ના વર્ષમાં x ટકા રસ્તાઓ હતા.

૧૦૦ કિલોમીટર રસ્તાઓ ૧૦૦ + x કિલોમીટર રસ્તાઓ થયા.

∴ ૧ કિલોમીટર રસ્તાઓ $\frac{100 + x}{100}$ કિલોમીટર રસ્તાઓ થયા.

∴ ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ $\frac{100 + x}{100} \times 12000$ કિલોમીટર રસ્તાઓ થયા.

∴ $\frac{100 + x}{100} \times 12000 = 13440$

∴ $100 + x = \frac{13440 \times 100}{12000}$

∴ $100 + x = 112$

∴ $x = 12$

∴ ૨૦૦૮ના વર્ષમાં ૧૨ ટકા રસ્તાઓ હતા.

સ્વાધ્યાય (૨૨)

૧. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષમાં કેટલા ટકા રસ્તાઓ હતા ?

૨. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૧૨ના વર્ષમાં કેટલા ટકા રસ્તાઓ થયા ?

૩. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષ કરતાં ૨૦૧૨ના વર્ષમાં કેટલા ટકા રસ્તાઓ વધ્યા ?

૪. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષ કરતાં ૨૦૧૨ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ વધ્યા ?

૫. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૧૨ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ થયા ?

૬. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ હતા ?

૭. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષ કરતાં ૨૦૧૨ના વર્ષમાં કેટલા ટકા રસ્તાઓ વધ્યા ?

૮. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૧૨ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ થયા ?

૯. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ હતા ?

૧૦. ૨૦૦૮ના વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦૦ કિલોમીટર રસ્તાઓ હતા. ૨૦૧૨ના વર્ષમાં ૧૩૪૪૦ કિલોમીટર રસ્તાઓ થયા. તો ૨૦૦૮ના વર્ષ કરતાં ૨૦૧૨ના વર્ષમાં કેટલા કિલોમીટર રસ્તાઓ વધ્યા ?

ઉપર

ગામ તા.પાટણ જી.પાટણ ૩૮૪૨૬૫, મોબા.નં.૯૪૨૭૨૭૨૭૨૭ તા.૨૬/૦૨/૨૦૨૦ ના રોજ ૧૧ વાગ્યે મારા પિતા સ્વ.ચંદુલાલ ગોકળદાસ પરીખ તથા મારા માતા સ્વ.ચંદ્રિકાબેન ચંદુલાલ પરીખ ના સ્મરણાર્થે તેમના નામે ટ્રસ્ટ બનાવી તેમના નામે ધર્માદા કામો કરવાની ઇચ્છા છે. આ ટ્રસ્ટ ધર્માદા કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ ની કચેરીમાં રજીસ્ટર કરાવવાનું છે. આ ટ્રસ્ટ ધર્માદા કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ ની કચેરીમાં રજીસ્ટર કરાવવા માટે ટ્રસ્ટ ડીડ તૈયાર કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનુસાર જણાવવાનું કે, મારા પિતા સ્વ.ચંદુલાલ ગોકળદાસ પરીખ તથા મારા માતા સ્વ.ચંદ્રિકાબેન ચંદુલાલ પરીખ ના સ્મરણાર્થે તેમના નામે ધર્માદા કામો કરવાની ઇચ્છા છે. આ ટ્રસ્ટ ધર્માદા કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ ની કચેરીમાં રજીસ્ટર કરાવવાનું છે. આ ટ્રસ્ટ ધર્માદા કમિશ્નરશ્રી ગુજરાત રાજ્ય અમદાવાદ ની કચેરીમાં રજીસ્ટર કરાવવા માટે ટ્રસ્ટ ડીડ તૈયાર કરવા બાબત

ધર્મેશ વિપિનભાઈ પરમાર (ઉદ્યોગ મંત્રાલય વિદ્યાર્થી) ને ત્યાં ૨૦૨૩ ની દિવાળી પર ચોરી થઈ. તેમના ઘરમાંથી રોકડા ૨૫ હજાર રૂપિયા અને સોનાની ચેઈન ચોરાઈ ગઈ. આ ચોરી અંગે ધર્મેશભાઈએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ૧૫ હજાર રોકડા અને ચેઈન રિકવર કરી હતી. આ ચોરીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ સગીર વયના હોવાથી તેમને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ધર્મેશભાઈના ઘરે કામ કરતો હોવાથી તેને ઘરની તમામ માહિતી હોવાથી તેણે જ ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ૧૫ હજાર રોકડા અને ચેઈન રિકવર કરવામાં આવ્યા હતા

(٢٥ ٤٨٤) "وَلَمَّا جَاءَ مُوسَىٰ لِمِيقَاتِنَا وَكَلَّمَهُ رَبُّهُ قَالَ رَبِّ أَرِنِي أَنظُرْ إِلَيْكَ قَالَ لَن تَرَانِي وَلَٰكِنِ انظُرْ إِلَى الْجَبَلِ فَإِنِ اسْتَقَرَّ مَكَانَهُ فَسَوْفَ تَرَانِي فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُ لِلْجَبَلِ جَعَلَهُ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ" (الأعراف ٧/١٤٣) وقد ذكر المفسرون أن موسى عليه السلام لما سأل ربه الرؤية وأخبره الله أنه لن يراه في الدنيا أمره أن ينظر إلى الجبل، فإن ثبت مكانه فسوف يراه هو، وإن اندك فلن يراه. فلما تجلى ربه للجبل جعله دكا، أي مستويا بالأرض، وخر موسى مغشيا عليه من هول ما رأى. فلما أفاق قال: سبحانك تبت إليك، أي من سؤالي الرؤية في الدنيا، وأنا أول المؤمنين بأنك لا تراك أحد في الدنيا. وقد ذكر بعض المفسرين أن المراد بالجبل جبل زبير، وقيل غير ذلك. وقد ذكر ابن جرير الطبري وغيره من المفسرين أن الله تجلى للجبل بإصبع من أصابعه، وقد ورد في ذلك حديث رواه الإمام أحمد في مسنده عن ابن مسعود رضي الله عنه، ولكن في إسناده نظر، والله أعلم. وقد ذكر ابن جرير عن بعض السلف أن الله تجلى للجبل بخنصر يده اليمنى، وقيل بطرف إبهامه، وقيل غير ذلك. وقد ذكر ابن جرير عن بعض السلف أن الله تجلى للجبل بخنصر يده اليمنى، وقيل بطرف إبهامه، وقيل غير ذلك. وقد ذكر ابن جرير عن بعض السلف أن الله تجلى للجبل بخنصر يده اليمنى، وقيل بطرف إبهامه، وقيل غير ذلك.

ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಸಾರ್ವಜನಿಕರಿಂದ ಸಲಹೆಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸಲಾಗಿದೆ: ಈ ಕುರಿತು ಸಲಹೆಗಳಿರುವ ಸಾರ್ವಜನಿಕರು ತಮ್ಮ ಸಲಹೆಗಳನ್ನು ಸಂಬಂಧಪಟ್ಟ ಪೊಲೀಸ್ ಠಾಣೆಗಳಿಗೆ ಅಥವಾ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯ ಅಧಿಕೃತ ಇಮೇಲ್ ವಿಳಾಸಕ್ಕೆ ಕಳುಹಿಸಿಕೊಡಬಹುದಾಗಿದೆ. ಸಲಹೆಗಳನ್ನು ಸ್ವೀಕರಿಸಲು ಕೊನೆಯ ದಿನಾಂಕವನ್ನು ಇಲಾಖೆಯು ಶೀಘ್ರದಲ್ಲಿಯೇ ಪ್ರಕಟಿಸಲಿದೆ. ಸಾರ್ವಜನಿಕರಿಂದ ಬಂದಿರುವ ಸಲಹೆಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಂತಿಮ ನಿರ್ಧಾರವನ್ನು ಕೈಗೊಳ್ಳಲಾಗುವುದು ಎಂದು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯ ಮೂಲಗಳು ತಿಳಿಸಿವೆ.

ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಅಳವಡಿಕೆಯಿಂದ ಅಪರಾಧ ಪ್ರಕರಣಗಳ ತನಿಖೆಗೆ ಸಹಾಯವಾಗಲಿದೆ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯ ಸಾರ್ವಜನಿಕರಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಆದರೆ ಕೆಲವು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಸಂಖ್ಯೆ ಹೆಚ್ಚಿಸುವ ಬಗ್ಗೆ ಕೆಲವರು ಆತಂಕ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಪಡೆಯಲು ಇಲಾಖೆ ನಿರ್ಧರಿಸಿದೆ. ಸಲಹೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲು ಸಾರ್ವಜನಿಕರು ಸಂಬಂಧಪಟ್ಟ ಠಾಣೆಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದಾಗಿದೆ.

ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಅಳವಡಿಕೆಯಿಂದ ಅಪರಾಧ ಪ್ರಕರಣಗಳ ತನಿಖೆಗೆ ಸಹಾಯವಾಗಲಿದೆ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯ ಸಾರ್ವಜನಿಕರಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಆದರೆ ಕೆಲವು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಸಂಖ್ಯೆ ಹೆಚ್ಚಿಸುವ ಬಗ್ಗೆ ಕೆಲವರು ಆತಂಕ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಪಡೆಯಲು ಇಲಾಖೆ ನಿರ್ಧರಿಸಿದೆ. ಸಲಹೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲು ಸಾರ್ವಜನಿಕರು ಸಂಬಂಧಪಟ್ಟ ಠಾಣೆಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದಾಗಿದೆ.

ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಅಳವಡಿಕೆಯಿಂದ ಅಪರಾಧ ಪ್ರಕರಣಗಳ ತನಿಖೆಗೆ ಸಹಾಯವಾಗಲಿದೆ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯ ಸಾರ್ವಜನಿಕರಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಆದರೆ ಕೆಲವು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಸಂಖ್ಯೆ ಹೆಚ್ಚಿಸುವ ಬಗ್ಗೆ ಕೆಲವರು ಆತಂಕ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಪಡೆಯಲು ಇಲಾಖೆ ನಿರ್ಧರಿಸಿದೆ. ಸಲಹೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲು ಸಾರ್ವಜನಿಕರು ಸಂಬಂಧಪಟ್ಟ ಠಾಣೆಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದಾಗಿದೆ.

ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಅಳವಡಿಕೆಯಿಂದ ಅಪರಾಧ ಪ್ರಕರಣಗಳ ತನಿಖೆಗೆ ಸಹಾಯವಾಗಲಿದೆ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯ ಸಾರ್ವಜನಿಕರಲ್ಲಿ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಆದರೆ ಕೆಲವು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾಗಳ ಸಂಖ್ಯೆ ಹೆಚ್ಚಿಸುವ ಬಗ್ಗೆ ಕೆಲವರು ಆತಂಕ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಪಡೆಯಲು ಇಲಾಖೆ ನಿರ್ಧರಿಸಿದೆ. ಸಲಹೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲು ಸಾರ್ವಜನಿಕರು ಸಂಬಂಧಪಟ್ಟ ಠಾಣೆಗಳನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದಾಗಿದೆ.

ઉપર

ઉપર મુજબ જણાવેલ મિલ્કત ફરજ-મુક્તિ માંગતા દસ્તાવેજ રજૂ કરનાર પક્ષકારો પૈકી કોઈ પક્ષકાર, અરજદાર કે તેમના વકીલ હાજર રહેવા ઇચ્છતા નથી. તેમજ આ કામે કોઈ વાંધો રજૂ કરવા માંગ

ક્રમાંક ૦૦૦

ક્રમ

ફરજ નિયમો

ખાણ ખોદકામ કરતી વખતે કામદારોએ પાળવાની સાવચેતીઓ અને નિયમો

ખાણ ખોદકામ કરતી વખતે કામદારોએ નીચે મુજબની સાવચેતીઓ રાખવી જરૂરી છે. જો કોઈ કામદાર આ નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧. ખાણમાં પ્રવેશતા પહેલાં દરેક કામદારે પોતાની સાથે સલામતીના સાધનો જેવા કે હેલ્મેટ, સેફ્ટી બૂટ, ગ્લોવ્ઝ અને ટોર્ચ લાઈટ રાખવી ફરજિયાત છે.

૨. ખાણમાં પ્રવેશતા પહેલાં અને બહાર નીકળ્યા પછી દરેક કામદારે પોતાની હાજરી હાજરી પુસ્તકમાં નોંધાવવી ફરજિયાત છે. (ખાણ અધિનિયમ, ૧૯૫૨ ની કલમ ૪૫ મુજબ)

૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે દારૂ પીધેલી હાલતમાં કામ કરવું નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે ધૂમ્રપાન કરવું નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના જ્વલનશીલ પદાર્થો રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના વિસ્ફોટક પદાર્થો રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના હથિયારો રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના પ્રાણીઓ રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના ખોરાક રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના પીણાં રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના ધાતુના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાચના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના રબરના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૨૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૩૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૪૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૫૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૬૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૭૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૮૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૯૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૧. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૨. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૩. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૪. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૫. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૬. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૭. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૮. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાપડના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૦૯. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના કાગળના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

૧૧૦. ખાણમાં કામ કરતી વખતે કોઈપણ કામદારે પોતાની સાથે કોઈપણ પ્રકારના લાકડાના ટુકડા રાખવા નહીં. આવું કરતા ઝડપાયેલ કામદાર સામે તાત્કાલિક શિ

મહેરબાની કરીને આપવા વિનંતી છે. આપનો વિશ્વાસુ

(સહી)

(નામ)

ઉપરોક્ત મુજબ સહી કરનાર (૧) ઉપરોક્ત ઓળખીતી મિલકત મારા કબજામાં છે અને તે મારી માલિકીની છે તેમજ તેમાં કોઈ બોજો કે ભાગીદારી નથી. (૨) મિલકત ઉપર કોઈ જાતનું દેવું નથી. (૩) મિલકત ઉપર કોઈ જાતનો કેસ મુકદ્દમો નથી. (૪) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો સ્ટે ઓર્ડર નથી. (૫) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો મનાઈ હુકમ નથી. (૬) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો જપ્તીનો હુકમ નથી. (૭) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો ટાંચનો હુકમ નથી. (૮) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો રિસીવરનો હુકમ નથી. (૯) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો વોરંટનો હુકમ નથી. (૧૦) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો હુકમ નથી. (૧૧) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૨) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૩) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૪) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૫) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૬) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૭) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૮) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૧૯) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી. (૨૦) મિલકત ઉપર કોઈ જાતનો કોર્ટનો કોઈ પણ જાતનો કેસ મુકદ્દમો નથી.

ક્રમ

ઉપરોક્ત કેસમાં -૨૦૧૭ ના રોજ કોર્ટ હુકમ કરેલ હોય જે હુકમ મુજબ ફરિયાદી તરફે સાક્ષી તપાસવા માટે ફરિયાદી તરફે સાક્ષી તપાસવા માટે ફરિયાદી તરફે સાક્ષી તપાસવા માટે

ક્રમાંક ૨૦૨૨ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫

ઉપરોક્ત વિષય અને સંદર્ભ નંબર વાળા પત્રના અનુસંધાનમાં જણાવવાનું કે, ગામ ચોરવાડ તા. માણાવદર જિ. જૂનાગઢ ખાતે આવેલ સર્વે નંબર ૧૨૨૨ પૈકી ૧ વાળી જમીન ૦-૪૦-૦૦ હે.આ. જમીનમાં ખેડૂતોએ પોતાના ઉપયોગ માટે ખોદેલ કુવાનું પાણી ખારું હોવાથી પીવાલાયક નથી. આ જમીનમાં ખેડૂતો ખેતી કરી શકતા નથી. આ જમીનમાં ખેડૂતોએ પોતાના ઉપયોગ માટે ખોદેલ કુવાનું પાણી પીવાલાયક બનાવવા માટે ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળવા અંગે ખેડૂતોએ કરેલ રજૂઆત ધ્યાને લઈ આ જમીનમાં ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળવા અંગે ભલામણ કરવા વિનંતી છે.

આ સાથે ગામ ચોરવાડ તા. માણાવદર જિ. જૂનાગઢ ખાતે આવેલ સર્વે નંબર ૧૨૨૨ પૈકી ૧ વાળી જમીનનો ૭/૧૨ અને ૮-અ ની નકલ સામેલ છે.

આભાર સહ,

ભવદીય,

ಸಂಪಾದಕರು ಪ್ರಜಾವಾಣಿ, ಕನ್ನಡ ಪ್ರಭ, ಉದಯವಾಣಿ, ಸಂಯುಕ್ತ ಕರ್ನಾಟಕ, ಹೊಸದಿಗಂತ, ಕರ್ಮವೀರ, ಕನ್ನಡಪ್ರಭ, ಸುಧಾ, ತರಂಗ, ಮಯೂರ, ಮಂಗಳ, ತುಷಾರ, ಕಸ್ತೂರಿ, ಮಲ್ಲಿಗೆ, ಕರ್ಮವೀರ, ಪ್ರಜಾಮತ

ક્રમ

ન્યાયાધીશ શ્રી ...

ગામ પાસે ઉભેલ ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી, ટ્રક ચાલક કમલેશભાઈ ...
ટ્રક ચાલક ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી ટ્રક લઈ ...
આરોપીઓ ટ્રક ચાલક ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી ટ્રક ...
:- ફરિયાદ ટૂંકમાં એવી છે કે - ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ ...
ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી ટ્રક લઈ ...
ગામ પાસે ઉભેલ ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી, ટ્રક ચાલક કમલેશભાઈ ...
ટ્રક ચાલક ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી ટ્રક લઈ ...
આરોપીઓ ટ્રક ચાલક ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ વાળી ટ્રક ...
:- ફરિયાદ ટૂંકમાં એવી છે કે - ફરિયાદી પોતાની ટ્રક નં. જી.જે.૧૨ એ.વી.૭૨૨૨ ...

ઉદાહરણ ૧૨.૨૦

ફાઈલ ટાઈપ્સ ઓફ ફાઈલ્સ અને ફોલ્ડર્સ :- કમ્પ્યુટરમાં ફાઈલ ઓપન કરવા માટે ફાઈલ પર ડબલ ક્લિક કરવામાં આવે છે. ફાઈલ ઓપન થવા માટે તેનું એક્સટેન્શન જાણવું જરૂરી છે. ફાઈલ એક્સટેન્શન ફાઈલના નામ પછી ડોટ (.) પછી લખવામાં આવે છે. ફાઈલ એક્સટેન્શન ફાઈલનો પ્રકાર દર્શાવે છે. ફાઈલ એક્સટેન્શન ફાઈલ ઓપન કરવા માટે કયો પ્રોગ્રામ વાપરવો તે નક્કી કર

૬ ભાગ્યશ્રી ચરિત્ર

ચરિત્ર ભાગ્યશ્રી મહાસતીજી, ઉજ્જૈનના મહા તપસ્વિની, ગુરુ બાળબ્રહ્મચારિણી ૧૦૮ પૂજ્યશ્રી ગજકુંવરજી મહાસતીજીના શિષ્યા વિદુષી મહાસતી શ્રી ચંદનબાળાજી (ઉજ્જૈન) દ્વારા લિખિત "ભાગ્યશ્રી ચરિત્ર" ભાગ ૧ લો પ્રકાશિત થયો હતો. જેમાં ભાગ્યશ્રીના પૂર્વ ભવોનું વર્ણન હતું. ત્યારબાદ ભાગ્યશ્રીના વર્તમાન ભવનું વર્ણન ભાગ ૨ જામાં પ્રકાશિત થયું હતું.

ગયા મહિને આ સમયે "ઉનાળામાં ઉત્પાદન ન વધારવા" બદલ ઓપેક પ્લસ પર ટીકા થઈ રહી હતી. "ઉનાળામાં ઉત્પાદન ન વધારવા" બદલ ઓપેક પ્લસ પર ટીકા થઈ રહી હતી. (ઉનાળામાં ઉત્પાદન ન વધારવા) બદલ ઓપેક પ્લસ પર ટીકા થઈ રહી હતી. ઉનાળામાં ઉત્પાદન ન વધારવા

ઉપરોક્ત ઠરાવ મુજબ ઉપરોક્ત કામ (કામનું વર્ણન) ની વિગતવાર અંદાજપત્રક તથા ડ્રોઈંગ સાથેની દરખાસ્ત તા. ..... ના રોજ આ કચેરીને પ્રાપ્ત થયેલ છે. આ દરખાસ્ત ઉપર વિચારણા કરતાં નીચે મુજબ નિર્ણય કરવામાં આવે છે.

(૧) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ મંજૂર કરવામાં આવે છે. આ રકમ નીચે મુજબ ખર્ચ કરવાની રહેશે.

(૨) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૩) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૪) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૫) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૬) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૭) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૮) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૯) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૦) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૧) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૨) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૩) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૪) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૫) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૬) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૭) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૮) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૧૯) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

(૨૦) આ કામ માટે રૂા. ..... (રૂપિયા ..... પૂરા) ની રકમ ..... ના હેડ નીચે ..... ના પેટા હેડ નીચે ..... ના વર્ષના અંદાજપત્રકમાં જોગવાઈ કરવામાં આવે છે.

ન્યાયાધીશ : તમારા વકીલ ક્યાં છે ?

આરોપી : મારા વકીલ તો ઘણા હતા પણ મારા ગુનાની વાત સાંભળીને બધા મારો કેસ લડવાની ના પાડી ગયા. છેવટે એક વકીલ મારો કેસ લડવા તૈયાર થયા. પણ તેમણે મારી પાસે ફી પેટે પૈસા માંગ્યા. મારી પાસે પૈસા ન હોવાથી મેં તેમને કહ્યું કે હું તમને પૈસા નહીં આપી શકું. ત્યારે તેમણે કહ્યું કે તમારે પૈસા આપવાની જરૂર નથી. તમે મારી ફી ચોરીને આપજો. આમ તેમણે મારો કેસ લડવા માટે ફી પેટે ચોરી કરવાની મને છૂટ આપી. આથી મેં ચોરી કરી હતી.

ન્યાયાધીશ : તમારા વકીલનું નામ શું છે ?

આરોપી : મારા વકીલનું નામ ચોરીલાલ છે.

ન્યાયાધીશ : ચોરીલાલ ! આ કેવું નામ ? ચોરીલાલ નામ તો કોઈનું હોઈ શકે ખરું ?

આરોપી : સાહેબ, મારા વકીલનું નામ ચોરીલાલ જ છે. તેમણે પોતાનું નામ બદલાવ્યું નથી.

ન્યાયાધીશ : તમારા વકીલ ચોરીલાલ ચોરી કરવાની તમને છૂટ આપે છે ?

આરોપી : હા સાહેબ, તેમણે મને ચોરી કરવાની છૂટ આપી છે.

ન્યાયાધીશ : તમારા વકીલ ચોરીલાલ ચોરી કરવાની તમને છૂટ આપે છે ? (ન્યાયાધીશ ચોરીલાલ નામ સાંભળીને ચોંકી ઊઠે છે.)

ત્રિ મહારાજ ૧૬૧૭

ઉપ્ર મહારાજ ૧૬૧૭ ના વર્ષમાં ઉપ્રમાં

ઉપરોક્ત ફરિયાદ હકીકત પરથી ગુનો દાખલ કરી, ફરિયાદી તથા સાહેદોની જુબાની લઈ, આરોપીની ધરપકડ કરવા તજવીજ કરવી જરૂરી જણાય છે.

ફરિયાદી (ફરિયાદ કરનાર) તરફથી પોતે જાતે અથવા પોતાના વકીલ મારફતે હાજર થવું. આરોપી હાજર થાય તે પહેલાં કે પછી ફરિયાદી તથા સાહેદોની જુબાની નોંધવી. ફરિયાદી તથા સાહેદોની જુબાની નોંધતી વખતે, તેમણે કરેલી ફરિયાદ મુજબ તેમની જુબાની નોંધાય છે કે કેમ તે જોવું

ક્રમાંક : ૧૦૨

ગુજરાત વકફ ટ્રિબ્યુનલ, અમદાવાદ

વકફ કેસ નં. ૧૦૨/૨૦૨૧

૧. મોહમ્મદ ઇસ્માઇલ ઇબ્રાહીમ કુરેશી, ઉં.વ. ૬૨, રહે. ૧૪, નૂરાની મસ્જિદ પાસે, દરિયાપુર, અમદાવાદ શહેર.

૨. હાજી અબ્દુલ કરીમ સૈયદ, ઉં.વ. ૭૧, રહે. ૩૦૨, મદીના એપાર્ટમેન્ટ, રિલીફ રોડ, અમદાવાદ શહેર.

૩. ઝુબેદાબેન મોહમ્મદ યુનુસ મન્સૂરી, ઉં.વ. ૫૮, રહે. ૭, બાગે ફિરદૌસ સોસાયટી, સરખેજ, અમદાવાદ શહેર.

૪. અલ્હાજ નૂરમોહમ્મદ ગુલામનબી શેખ, ઉં.વ. ૭૫, રહે. ૨૧, મસ્જિદ ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫. ફાતિમાબેન અબ્દુલ રહીમ પટેલ, ઉં.વ. ૬૦, રહે. ૫૫, ગુલશન પાર્ક સોસાયટી, વટવા, અમદાવાદ શહેર.

૬. મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ મેમણ, ઉં.વ. ૪૮, રહે. ૧૨, મેમણ વાડી, ખાનપુર, અમદાવાદ શહેર.

૭. રઝિયાબેન ઇકબાલ હુસેન મલેક, ઉં.વ. ૫૩, રહે. ૬૦૪, સિલ્વર સ્ક્વેર, સેટેલાઇટ રોડ, અમદાવાદ શહેર.

૮. મોહમ્મદ ઝુબેર અબ્દુલ કાદર ચૌહાણ, ઉં.વ. ૩૯, રહે. ૨૩, ચૌહાણ ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯. સૈયદ મોહમ્મદ અલી સૈયદ મોહમ્મદ બુખારી, ઉં.વ. ૬૭, રહે. ૧૦૧, બુખારી મંઝિલ, ગોધરા, જિ. પંચમહાલ.

૧૦. ઝરીનાબેન મોહમ્મદ ઇદ્રીસ મન્સૂરી, ઉં.વ. ૪૫, રહે. ૧૮, મન્સૂરી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧. હાજી અબ્દુલ રઝાક ઇબ્રાહીમ ભટ્ટી, ઉં.વ. ૭૨, રહે. ૧૫, ભટ્ટી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૨૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૩૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૪૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૫૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૬૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૭૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૮૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૯૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૦૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૧૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૨૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૩૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૪૯. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૦. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૧. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૨. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૩. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૪. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૫. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૬. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૭. ફરીદાબેન મોહમ્મદ ઇસ્માઇલ ઘાંચી, ઉં.વ. ૫૦, રહે. ૩૩, ઘાંચી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧૫૮. મોહમ્મદ ઇમરાન અબ્દુલ વહાબ કુરેશી, ઉં.વ. ૩૪, રહે. ૨૭, કુરેશી ફળિયું, ધોળકા, જિ. અમદાવાદ.

૧

ચિત્ર ૧૦

ચિત્ર ૧૦ માં દર્શાવેલ ગોળાકાર કે ચક્રાકાર ભાગ કોને કહે છે તે જણાવો.

"ચક્રાકાર ભાગ" એટલે વર્તુળના બે ત્રિજ્યા અને તેમની વચ્ચેના ચાપ વડે બનતો વર્તુળનો ભાગ. ચિત્રમાં ∠AOB = 90° હોવાથી OA અને OB વચ્ચેનો ભાગ ચક્રાકાર છે.

ચક્રાકાર ભાગ કોને કહે છે તે સમજાવવા માટે વર્તુળના કેન્દ્ર O થી બે ત્રિજ્યા OA અને OB દોરો. આ બે ત્રિજ્યા વર્તુળ પર જે ચાપ બનાવે છે તે ચાપ AB અને ત્રિજ્યા OA અને OB વચ્ચેનો વર્તુળનો ભાગ એટલે ચક્રાકાર ભાગ. ચિત્રમાં ∠AOB = 90° હોવાથી OA અને OB વચ્ચેનો ભાગ ચક્રાકાર છે.

ચક્રાકાર ભાગ કોને કહે છે તે સમજાવવા માટે વર્તુળના કેન્દ્ર O થી બે ત્રિજ્યા OA અને OB દોરો. આ બે ત્રિજ્યા વર્તુળ પર જે ચાપ બનાવે છે તે ચાપ AB અને ત્રિજ્યા OA અને OB વચ્ચેનો વર્તુળનો ભાગ એટલે ચક્રાકાર ભાગ. ચિત્રમાં ∠AOB = 90° હોવાથી OA અને OB વચ્ચેનો ભાગ ચક્રાકાર છે.

(૧૯૯)

ઉપરોક્ત ઠરાવ

ગામના દરેક પુખ્ત ઉંમરના સ્ત્રી-પુરૂષ કુટુંબના વડીલ સભ્યોની ખાસ સભા તા. ૧૬-૬-૧૯૪૨ ના રોજ સવારના ૧૦ કલાકે ગામના ચોરાવાળી જગ્યાએ મળી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવે છે.

ઠરાવ :- ૧ - આ ગામના પટેલ શ્રી ભગવાનદાસ ખુશાલદાસ, ગામના વહીવટદાર તરીકે ચાલુ રહે અને ગામના વહીવટ સંબંધી તમામ કામકાજ તેમની સલાહ અને સંમતિથી કરવું.

૨ - ગામના વહીવટ સંબંધી તમામ કામકાજ માટે પટેલ સાહેબ ગામના ચોકીદાર મારફત ગામના દરેક કુટુંબના વડીલ સભ્યોને ખબર મોકલી બોલાવી શકશે અને તેમ કરવા તેમને સત્તા આપવામાં આવે છે.

૩ - ગામના વહીવટ સંબંધી તમામ કામકાજ માટે પટેલ સાહેબ ગામના ચોકીદાર મારફત ગામના દરેક કુટુંબના વડીલ સભ્યોને ખબર મોકલી બોલાવી શકશે અને તેમ કરવા તેમને સત્તા આપવામાં આવે છે.

૪ - ગામના વહીવટ સંબંધી તમામ કામકાજ માટે પટેલ સાહેબ ગામના ચોકીદાર મારફત ગામના દરેક કુટુંબના વડીલ સભ્યોને ખબર મોકલી બોલાવી શકશે અને તેમ કરવા તેમને સત્તા આપવામાં આવે છે.

ખેડા જિલ્લા કલેક્ટરશ્રી, નડિયાદ.

વિષય :- ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગામોમાં ખેતીવાડી પાકોમાં ભારે નુકસાન કરતા ભૂંડોના ત્રાસમાંથી રક્ષણ મેળવવા બાબત.

ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે, કઠલાલ તાલુકાના ગામોમાં ખેતીવાડી પાકોમાં ભૂંડોના ત્રાસથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભૂંડોના ત્રાસથી ખેડૂતોને બચાવવા માટે ખેતરની ફરતે વાડ કરવા માટે ખેડૂતોને સહાય આપવા બાબતે ખેડા જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વયે ખેડા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ તથા દરખાસ્ત સાથે સામેલ છે.

આ ઉપરાંત ખેડા જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને ભૂંડોના ત્રાસથી રક્ષણ મેળવવા માટે ખેતરની ફરતે વાડ કરવા માટે સહાય આપવા બાબતે ઠરાવ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વયે ખેડા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ તથા દરખાસ્ત સાથે સામેલ છે.

ઠરાવ :- ખેડા જિલ્લા પંચાયત હસ્તકના કઠલાલ તાલુકાના ગામોમાં ખેતીવાડી પાકોમાં ભૂંડોના ત્રાસથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભૂંડોના ત્રાસથી ખેડૂતોને બચાવવા માટે ખેતરની ફરતે વાડ કરવા માટે ખેડૂતોને સહાય આપવા બાબતે ખેડા જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અન્વયે ખેડા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ તથા દરખાસ્ત સાથે સામેલ છે.

૧૦૧૨ ફાગણ સુદ ૧૫ ગુરુવાર

૧. ગામના ચોરા પાસે ઊભેલું ગાડું જોઈને ગાડાવાળાને ઓળખી કાઢવો.

૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૨૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૨૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૨૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૨૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૨૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૩૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૩૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૩૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૩૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૩૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૩૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૪૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૪૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૪૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૪૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૪૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૪૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૫૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૫૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૫૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૫૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૫૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૫૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૬૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૬૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૬૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૬૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૬૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૬૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૭૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૭૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૭૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૭૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૭૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૭૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૮૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૮૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૮૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૮૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૮૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૮૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૯૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૯૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૯૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૯૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૯૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૯૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૦૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૦૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૦૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૦૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૦૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૦૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૧૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૧૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૧૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૧૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૧૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૧૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૨૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૨૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૨૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૨૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૨૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૨૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૩૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૩૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૩૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૩૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૩૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૩૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૪૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૪૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૪૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૪૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૪૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૪૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૫૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૫૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૫૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૫૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૫૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૫૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૬૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૬૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૬૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૬૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૬૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૬૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૭૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૭૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૭૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૭૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૭૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૭૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૮૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૮૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૮૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૮૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૮૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૮૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૯૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯૧. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૯૨. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯૩. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૯૪. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯૫. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૯૬. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯૭. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૧૯૮. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

૧૯૯. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે જવાબ આપવો.

૨૦૦. ગાડાવાળાએ ગાડામાં ભરેલા માલ વિશે પૂછપરછ કરવી.

ફરજો બજાવવા બાબત.

પ્રકરણ ૧૧ : ૨૦૧૭

૧૧૧. (૧) દરેક ગામ માટે ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ની રચના કરવાનો અને તેમની ફરજો બજાવવાનો રાજ્ય સરકારને અધિકાર રહેશે.

(૨) ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ના સભ્યો ગ્રામ પોલીસ અધિકારીના હુકમ નીચે કામ કરશે અને તેમની ફરજો બજાવવા માટે તેમને સમયાંતરે જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે વર્તશે.

૧૧૨. (૧) ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ના સભ્યો, ગ્રામ પોલીસ અધિકારીના હુકમ નીચે કામ કરતા હોય ત્યારે, ગ્રામ પોલીસ અધિકારીની ગેરહાજરીમાં, ગ્રામ પોલીસ અધિકારીની ફરજો બજાવવા માટે તેમને સમયાંતરે જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે વર્તશે.

(૨) ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ના સભ્યો, ગ્રામ પોલીસ અધિકારીની ગેરહાજરીમાં, ગ્રામ પોલીસ અધિકારીની ફરજો બજાવવા માટે તેમને સમયાંતરે જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે વર્તશે.

૧૧૩. (૧) ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ના સભ્યો, ગ્રામ પોલીસ અધિકારીની ગેરહાજરીમાં, ગ્રામ પોલીસ અધિકારીની ફરજો બજાવવા માટે તેમને સમયાંતરે જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે વર્તશે.

(૨) ગ્રામ પોલીસ અધિકારી, ગ્રામ રક્ષક દળ અને ગ્રામ સંરક્ષણ દળ-ના સભ્યો, ગ્રામ પોલીસ અધિકારીની ગેરહાજરીમાં, ગ્રામ પોલીસ અધિકારીની ફરજો બજાવવા માટે તેમને સમયાંતરે જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે વર્તશે.

ગામ

ગામ નમૂના નં. ૧૧૬

ગામ નમૂના નં. ૧૧૬ ગામ નમૂના નં. ૧૧૬ ગામ નમૂના નં. ૧૧૬

ઉપાસના

ઉપાસના એટલે ઈશ્વરની સમીપ બેસવું, તેમની સાથે એકરૂપ થવું. ઈશ્વરની ઉપાસના કરવાથી આપણા હૃદયમાં પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, સદ્‌ગુણ, સદ્‌વિચાર, સદ્‌વર્તન વગેરે ગુણોનો વિકાસ થાય છે. ઉપાસના કરવાથી આપણા મનમાં રહેલા દુર્ગુણો, દુર્વિચારો, દુર્વર્તન વગેરે દોષોનો નાશ થાય છે. ઉપાસના કરવાથી આપણા મનમાં રહેલા કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર વગેરે વિકારોનો નાશ થાય છે. ઉપાસના કરવાથી આપણા મનમાં રહેલા ભય, શોક, ચિંતા, ઉદ્વેગ વગેરે દૂર થાય છે. ઉપાસના કરવાથી આપણા મનમાં રહેલા અહંકાર, મમત્વ, રાગ, દ્વેષ વગેરે દૂર

ના નામના કુટુંબના વડા તરીકે તેમની સામાજીક જવાબદારી નિભાવવા તેમજ પોતાની
પોતાના કુટુંબની કાયમી મિલકત, પોતાની માલિકીના ઘરમાં રહેવાનો પોતાનો
અધિકાર/હક્ક ટકાવી રાખવા તેમજ પોતાની કાયદેસરની જવાબદારીઓ નિભાવવા
તેમજ પોતાની વકિલાત અને વકિલાતના વ્યવસાયમાં કાયમી ધોરણે ટકી રહેવા
પોતાની માલિકીનું ઘર ખાલી કરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના
ઉભી થઈ છે. જો પોતાને ઘર ખાલી કરવું પડે તો પોતાની વકિલાત ઉપર
માઠી અસર પડે તેમ છે. તેમજ પોતાના કુટુંબ માટે બીજું ઘર ભાડે રાખવું
પોસાય તેમ નથી. તેમજ પોતાની માલિકીનું ઘર ખાલી કરવું પડે તો પોતાના
કુટુંબ માટે બીજું ઘર ભાડે રાખવા માટે પોતાની પાસે પુરતી આર્થિક
સગવડ

સમાચાર

/ આ સમાચાર મળતાં જ ગામના દરેક ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. ગામના વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે આ ખુશીના પ્રસંગે ગામમાં એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવું. ગામના ચોકમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો. ગામની બધી સ્ત્રીઓ ભેગી મળીને મીઠાઈઓ બનાવવા લાગી. ગામના યુવાનોએ ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યું. ગામના ભોજન સમારંભમાં આજુબાજુના ગામોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ

ધર્મ કર્મ ક્રિયા ભાવ ભેદ રૂપ ચિદ્વિલાસ નામ ધરે, તે ચિદ્વિલાસ નામ ધરે, તે ચિદ્વિલાસ નામ ધરે, તે

ઉપરોક્ત ગામોના ખાતેદારોને જણાવવામાં આવે છે કે ઉપર જણાવેલ ગામોની સીમમાં આવેલ સર્વે નંબર 282 પૈકી 3 હે.આર.ચો.મી. વાળી જમીન ખેડૂત ખાતેદારોની ખેતીની જમીનમાં વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સિંચાઈ માટે પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અમલમાં મુકવા માટે ઉપરોક્ત જમીન સંપાદન કરવાની થાય છે. આ જમીન સંપાદન કરવા માટે જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૪(૧) મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે સદર જમીન સંપાદન કરવા માટે કલમ ૫(૧) મુજબ વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે અન્વયે કુલ ૧૨ વાંધા અરજીઓ મળેલ હતી. જે વાંધા અરજીઓ ઉપર તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ સુનાવણી રાખવામાં આવેલ હતી. જે સુનાવણી વખતે વાંધા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવેલ હતા. જે વાંધા અરજીઓ ઉપર ધ્યાને લઈ જમીન સંપાદન અધિકારી, ઉપલેટા પ્રાંત-૨ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ વાંધા અરજીઓ રદ કરવા અંગેનો હુકમ કરવામાં આવેલ છે. જે હુકમ તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ જમીન સંપાદન અધિકારી, ઉપલેટા પ્રાંત-૨ દ્વારા સહી કરવામાં આવેલ છે. જે હુકમ અન્વયે જમીન સંપાદન અધિકારી, ઉપલેટા પ્રાંત-૨ દ્વારા જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૬(૧) મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે ઉપરોક્ત ગામોની સીમમાં આવેલ સર્વે નંબર 282 પૈકી 3 હે.આર.ચો.મી. વાળી જમીન ખેડૂત ખાતેદારોની ખેતીની જમીનમાં વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અમલમાં મુકવા માટે ઉપરોક્ત જમીન સંપાદન કરવાની થાય છે. આ જમીન સંપાદન કરવા માટે જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૪(૧) મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે સદર જમીન સંપાદન કરવા માટે કલમ ૫(૧) મુજબ વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જે વાંધા અરજીઓ ઉપર તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ સુનાવણી રાખવામાં આવેલ હતી. જે સુનાવણી વખતે વાંધા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવેલ હતા. જે વાંધા અરજીઓ ઉપર ધ્યાને લઈ જમીન સંપાદન અધિકારી, ઉપલેટા પ્રાંત-૨ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ વાંધા અરજીઓ રદ કરવા અંગેનો હુકમ કરવામાં આવેલ છે. જે હુકમ તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ જમીન સંપાદન અધિકારી, ઉપલેટા પ્રાંત-૨ દ્વારા સહી કરવામાં આવેલ છે. જે હુકમ અન્વયે

ঘনশ্যাম চক্রবর্তী ও তাঁর স্ত্রী সুধাময়ী দেবী ছিলেন নিঃসন্তান। তাঁদের একমাত্র ভাগ্নে অনিমেষ ছোটবেলা থেকেই মামার বাড়িতে মানুষ। অনিমেষের বাবা-মা দুর্ঘটনায় মারা যাওয়ার পর সে মাত্র সাত বছর বয়সে এই বাড়িতে আসে। তখন থেকে এই বাড়িই তার পৃথিবী। ঘনশ্যাম তাকে নিজের ছেলের মতোই ভালোবাসতেন, কিন্তু সুধাময়ী দেবীর ভালোবাসা ছিল আরও গভীর, আরও নিঃশব্দ। তিনি কখনো মুখে বলতেন না, কিন্তু অনিমেষের প্রতিটি প্রয়োজন তিনি আগে বুঝে নিতেন।

বাড়িটি ছিল পুরোনো আমলের দোতলা। নিচতলায় ঘনশ্যাম তাঁর ওষুধের দোকান চালাতেন, আর উপরতলায় ছিল তিনটি ঘর, একটি রান্নাঘর এবং একটি ছোট ঠাকুরঘর। অনিমেষের ঘরটি ছিল পশ্চিম দিকের কোণে, যেখান থেকে সকালবেলা রোদ এসে পড়ত তার পড়ার টেবিলে। সে ঘরের জানালা দিয়ে দেখা যেত পাশের বাড়ির টিনের চাল, একটি জামরুল গাছ, আর দূরে রেললাইনের ধার দিয়ে মাঝে মাঝে ছুটে যাওয়া ট্রেন। ট্রেনের শব্দ শুনলে সে বুঝতে পারত, এখন বেলা এগারোটা বাজে।

ঘনশ্যাম চক্রবর্তী ও তাঁর স্ত্রী সুধাময়ী দেবী ছিলেন নিঃসন্তান। তাঁদের একমাত্র ভাগ্নে অনিমেষ ছোটবেলা থেকেই মামার বাড়িতে মানুষ। অনিমেষের বাবা-মা দুর্ঘটনায় মারা যাওয়ার পর সে মাত্র সাত বছর বয়সে এই বাড়িতে আসে। তখন থেকে এই বাড়িই তার পৃথিবী। ঘনশ্যাম তাকে নিজের ছেলের মতোই ভালোবাসতেন, কিন্তু সুধাময়ী দেবীর ভালোবাসা ছিল আরও গভীর, আরও নিঃশব্দ। তিনি কখনো মুখে বলতেন না, কিন্তু অনিমেষের প্রতিটি প্রয়োজন তিনি আগে বুঝে নিতেন।

বাড়িটি ছিল পুরোনো আমলের দোতলা। নিচতলায় ঘনশ্যাম তাঁর ওষুধের দোকান চালাতেন, আর উপরতলায় ছিল তিনটি ঘর, একটি রান্নাঘর এবং একটি ছোট ঠাকুরঘর। অনিমেষের ঘরটি ছিল পশ্চিম দিকের কোণে, যেখান থেকে সকালবেলা রোদ এসে পড়ত তার পড়ার টেবিলে। সে ঘরের জানালা দিয়ে দেখা যেত পাশের বাড়ির টিনের চাল, একটি জামরুল গাছ, আর দূরে রেললাইনের ধার দিয়ে মাঝে মাঝে ছুটে যাওয়া ট্রেন। ট্রেনের শব্দ শুনলে সে বুঝতে পারত, এখন বেলা এগারোটা বাজে।

ઉમેદવાર

ઉમેદવાર વિભાગ (દારૂબંધી) કુલાનાયક એ ઉમેદવાર, શ્રી રણ સમાન લેવાદારોની ઉ
પ્રમુખ ઉમેદવાર જે શ્રી ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર-ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર
ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર
ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર
ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર
ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર
ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર ઉમેદવાર

ધ્રુવ કનૈયા ગોસ્વામી : ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ઉત્તર ધ્રુવ પર પ્રથમ માનવ-સંચાલિત અભિયાન પૂર્ણ કરનાર ટીમ બની. ૨૦૨૬ ઉત્તર ધ્રુવ અભિયાન ટીમના સભ્યો ધ્રુવ પર પહોંચ્યા ત્યારે તાપમાન માઇનસ ૪૨ ડિગ્રી સેલ્સિયસ હતું. ટીમે ૪૦૦ કિલોમીટરનું અંતર ૧૮ દિવસમાં કાપ્યું. દરરોજ સરેરાશ ૨૨ કિલોમીટર ચાલવું પડ્યું. ટીમના સભ્યોએ ૧૨૦ કિલોગ્રામ વજનની સ્લેજ ખેંચી હતી. ખોરાક અને બળતણ ઉપરાંત તંબુ, સ્લીપિંગ બેગ અને વૈજ્ઞાનિક સાધનો પણ સ્લેજ પર જ હતાં. ટીમે ૧૮ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલવું પડ્યું. દરરોજ સરેરાશ ૨૨ કિલોમીટર ચાલવું પડ્યું

ધોરણ ૧૦

૧. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર લખો. ૧૦

(૧) ઉત્તરપ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોનું વર્ણન કરો.

(૨) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં કાશી અને પ્રયાગ વિશે માહિતી આપો.

(૩) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં પાટલિપુત્ર અને ચંપા વિશે માહિતી આપો.

(૪) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં મથુરા અને હસ્તિનાપુર વિશે માહિતી આપો.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર લખો. ૧૦

(૧) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં કૌશાંબી અને વારાણસી વિશે માહિતી આપો.

(૨) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં પ્રયાગ અને પાટલિપુત્ર વિશે માહિતી આપો.

(૩) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં ચંપા અને મથુરા વિશે માહિતી આપો.

(૪) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં હસ્તિનાપુર અને કૌશાંબી વિશે માહિતી આપો.

૩. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર લખો. ૧૦

(૧) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં વારાણસી અને પાટલિપુત્ર વિશે માહિતી આપો.

(૨) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં ચંપા અને પ્રયાગ વિશે માહિતી આપો.

(૩) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં મથુરા અને કૌશાંબી વિશે માહિતી આપો.

(૪) ગંગા નદીના કિનારે વસેલા પ્રાચીન નગરોમાં હસ્તિનાપુર અને વારાણસી વિશે માહિતી આપો.

ઉપરોક્ત કામના ફરિયાદી તથા સાહેદોની ફરિયાદ તથા જુબાની ધ્યાને લેતા આ કામના આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું જણાઇ આવતા આ કામના આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ કામ ચલાવવા સારૂ પુરતો આધાર જણાઇ આવતો હોવાથી

ન્યાયાધીશ શ્રી જે.જે. દવે

ના કુટુંબ પ્રત્યે કે કુટુંબના સભ્ય, સ્નેહીજન, મિત્ર એવી કુદરતમાંની સજીવ કે નિર્જીવ વસ્તુ પ્રત્યે પોતાની ફરજ બજાવવામાં કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ, કોઈ પણ પ્રકારનું કુદરતી કે માનવસર્જિત પ્રદૂષણ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત હોનારત, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આફત, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત કટોકટી, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત મુશ્કેલી, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત સમસ્યા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત વિપત્તિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત વિપદા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપદા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત કરુણાંતિકા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત કારમી કે ભયાનક ઘટના, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર સ્થિતિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર હાલત, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્દશા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ગતિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્ય, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ ઘટના, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ હાલત, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ દુર્દશા, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ દુર્ગતિ, કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત ભયાનક કે ભયંકર દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના

ઉપરોક્ત ખાતા નંબર વાળા કબજેદાર ખાતેદારોની માલિકીની ઉપરોક્ત જમીનો પૈકી ગામ હદ્દમાં આવેલ રેલ્વે,રસ્તા,નદી,તળાવ તથા બીનખેતી મિલકતો સિવાયની ખેતીની જમીનો પૈકી ખેડાણ હેઠળની જમીનોમાં ઉભા પાકોને નુકશાન થવાની શક્યતા હોવાથી તેમજ

ઉદાહરણ તરીકે "ઈ" સ્વરની માત્રા ધરાવતા શબ્દોનું વાંચન કરાવવું.

ઉદાહરણ :- કિરણ, કિરીટ, કિશોર, કિશન, કિસ્મત, કિસાન, કિશોરી, કિસ્મતી, કિસાની, કિરીટી, કિશોરભાઈ, કિસ્મતભાઈ, કિસાનભાઈ, કિરીટભાઈ, કિશોરીબેન, કિસ્મતીબેન, કિસાનીબેન, કિરીટીબેન

ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૩ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૩ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૪ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૪ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ પાસે ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું.

ઉપરોક્ત ઉદાહરણ - ૨ પ્રમાણે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવવું. ત્યારબાદ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ પાસે

ઉમેદવાર

ઉપરોક્ત ઉમેદવાર, ઉપરોક્ત સરનામે રહેતા મતદાર યાદીના ભાગ નંબર ૨૭૯ ક્રમાંક નંબર ૧૨૫૫ ની મતદાર યાદીમાં નોંધાયેલ મતદાર છે. તેમની ઉમેદવારી સામે કોઈ વાંધો રજૂ કરવામાં આવેલ નથી. તેમની ઉમેદવારી ચૂંટણી અધિકારી, ૧૪૨-ધારી વિધાનસભા મતવિસ્તાર (અ.જા.જા.) ની તા.૧૬/૧૨/૨૦૨૨ ના રોજ મળેલ સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. તેમજ તેમના ટેકેદારો પૈકી કોઈ પણ ટેકેદાર મતદાર યાદીમાં નોંધાયેલ મતદાર નથી. તેમજ તેમના ટેકેદારો પૈકી કોઈ પણ ટેકેદાર કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય

ઉદ્ધવ

ઉદ્ધવ ગોપીઓને કહે છે કે તમારો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ખરેખર પ્રશંસનીય છે. તમારા જેવી ગોપીઓ જ્યાં હોય ત્યાં ભક્તિ ઊભરા

ઉપરોક્ત ફરિયાદ અંગે ફરિયાદી તથા સાક્ષીઓની જુબાની તથા રજૂ રાખેલ પુરાવાના દસ્તાવેજો તથા ફરિયાદ પક્ષના વકીલ તથા આરોપી તરફે વકીલશ્રીની દલીલો ધ્યાને લેતાં આ કામે ફરિયાદી તરફે રજૂ રાખેલ પુરાવા પરથી આરોપી સામે ગુનો પુરવાર થયેલ હોવાનું જણાઈ આવે છે. આરોપી તરફે વકીલશ્રીએ રજૂ કરેલ ચુકાદાઓ આ કામના તથ્યો સાથે સુસંગત જણાતા નથી. આરોપીએ ગુનો કર્યાનું જણાઈ આવે છે. આરોપીને સજા કરવા બાબતે ફરિયાદી તરફે વકીલશ્રીએ કરેલ રજૂઆત ધ્યાને લેતાં આરોપીને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ મહત્તમ સજા કરવા રજૂઆત કરેલ છે. આરોપ

ભાગ્યશાળી થવાય છે. તેમાંથી કોઈ એક પણ ગુણ જેનામાં હોય તે વિદ્યાર્થી
ખરેખર ભાગ્યશાળી છે. તેમાંથી કોઈ પણ ગુણ જેનામાં ન હોય તે વિદ્યાર્થી
ખરેખર કમનસીબ

ચિત્ર ૨૨૭

ઉદાહરણ ૨૨૭ : નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો :

(૧) ગુજરાતના કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૨) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૩) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૪) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૫) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૬) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૭) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૮) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૯) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

(૧૦) તમારા વિસ્તારમાં કોઈ પણ બે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોય તો તેનું વર્ણન કરો.

ઉપરોક્ત ગામે આવેલ સર્વે નંબર વાળી જમીનમાં ખેડૂત ખાતેદારોને ખેતી વિષયક જરૂરિયાત માટે ધિરાણ મેળવવા માટે ખેડૂત ખાતેદારોએ પોતાની જમીન ગીરો મુકવા માટે ગામ નમુના નં. ૭/૧૨ અને ૮-અ ની નકલો તથા ૬૦ વર્ષ જુની ફેરફાર નોંધની નકલ તથા

ઉદાહરણ ૨૦ : ૧૦૦ મીટર ઊંચા મકાનની અગાશી પરથી એક છોકરો પથ્થર ઉપરની દિશામાં ઊભી રીતે ફેંકે છે. પથ્થર ફેંકવાની ક્ષણથી 4 સેકન્ડ પછી પથ્થર મકાનથી કેટલો દૂર હશે તે શોધો. પથ્થરનો વેગ ફેંકવાની ક્ષણે 20 મીટર/સેકન્ડ છે. પથ્થર ફેંકવાની ક્ષણથી 4 સેકન્ડ પછી પથ્થરનું સ્થાન શોધો. પથ્થર ફેંકવાની ક્ષણથી 4 સેકન્ડ પછી પથ્થરનો વેગ શોધો. પથ્થર ફેંકવાની ક્ષણથી 4 સેકન્ડ પછી પથ્થરનું પ્રવેગ શોધો. પથ્થર ફેંકવાની ક્ષણથી 4 સેકન્ડ પછી પથ્થરનું સ્થાન, વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ

ન્યાયાધીશ સાહેબ

વિષય :- ખોટી ફરિયાદ કરવા બાબત.

આથી આ કોર્ટને જણાવવાનું કે, મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે.

આ કામના ફરિયાદી શ્રી ..... એ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે. મારા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. ફરિયાદી મારા પર ખોટો આરોપ મૂકી મારી બદનામી કરવા માંગે છે. આ ફરિયાદ ખોટી હોવાનું મારું નિવેદન આ સાથે રજૂ કરું છું. આ ફરિયાદ ખોટી હોવાનું સાબિત કરવા મારી પાસે પુરાવા છે

(૧૦)

(૧)

৭	,,	৭	,,
৮	,,	৮	,,
৯	,,	৯	,,
১০	,,	১০	,,
১১	,,	১১	,,
১২	,,	১২	,,
১৩	,,	১৩	,,
১৪	,,	১৪	,,
১৫	,,	১৫	,,
১৬	,,	১৬	,,
১৭	,,	১৭	,,
১৮	,,	১৮	,,
১৯	,,	১৯	,,
২০	,,	২০	,,
২১	,,	২১	,,
২২	,,	২২	,,
২৩	,,	২৩	,,
২৪	,,	২৪	,,
২৫	,,	২৫	,,
২৬	,,	২৬	,,
২৭	,,	২৭	,,
২৮	,,	২৮	,,
২৯	,,	২৯	,,
৩০	,,	৩০	,,
৩১	,,	৩১	,,
৩২	,,	৩২	,,
৩৩	,,	৩৩	,,
৩৪	,,	৩৪	,,
৩৫	,,	৩৫	,,
৩৬	,,	৩৬	,,
৩৭	,,	৩৭	,,
৩৮	,,	৩৮	,,
৩৯	,,	৩৯	,,
৪০	,,	৪০	,,
৪১	,,	৪১	,,
৪২	,,	৪২	,,
৪৩	,,	৪৩	,,
৪৪	,,	৪৪	,,
৪৫	,,	৪৫	,,
৪৬	,,	৪৬	,,
৪৭	,,	৪৭	,,
৪৮	,,	৪৮	,,
৪৯	,,	৪৯	,,
৫০	,,	৫০	,,

৫১	,,	৫১	,,
৫২	,,	৫২	,,
৫৩	,,	৫৩	,,
৫৪	,,	৫৪	,,
৫৫	,,	৫৫	,,
৫৬	,,	৫৬	,,
৫৭	,,	৫৭	,,
৫৮	,,	৫৮	,,
৫৯	,,	৫৯	,,
৬০	,,	৬০	,,
৬১	,,	৬১	,,
৬২	,,	৬২	,,
৬৩	,,	৬৩	,,
৬৪	,,	৬৪	,,
৬৫	,,	৬৫	,,
৬৬	,,	৬৬	,,
৬৭	,,	৬৭	,,
৬৮	,,	৬৮	,,
৬৯	,,	৬৯	,,
৭০	,,	৭০	,,
৭১	,,	৭১	,,
৭২	,,	৭২	,,
৭৩	,,	৭৩	,,
৭৪	,,	৭৪	,,
৭৫	,,	৭৫	,,
৭৬	,,	৭৬	,,
৭৭	,,	৭৭	,,
৭৮	,,	৭৮	,,
৭৯	,,	৭৯	,,
৮০	,,	৮০	,,
৮১	,,	৮১	,,
৮২	,,	৮২	,,
৮৩	,,	৮৩	,,
৮৪	,,	৮৪	,,
৮৫	,,	৮৫	,,
৮৬	,,	৮৬	,,
৮৭	,,	৮৭	,,
৮৮	,,	৮৮	,,
৮৯	,,	৮৯	,,
৯০	,,	৯০	,,
৯১	,,	৯১	,,
৯২	,,	৯২	,,
৯৩	,,	৯৩	,,
৯৪	,,	৯৪	,,
৯৫	,,	৯৫	,,
৯৬	,,	৯৬	,,
৯৭	,,	৯৭	,,
৯৮	,,	৯৮	,,
৯৯	,,	৯৯	,,
১০০	,,	১০০	,,

"ओ" "पाछा पाँव" तो "पाछा पाँव" नहीं कहा जाता। "पाछा पाँव" का प्रयोग
ऐसे व्यक्ति के लिए होता है जो किसी काम को करते करते बीच में ही
छोड़ दे। "ओ" का प्रयोग प्रायः स्त्रियाँ ही करती हैं। पुरुष
प्रायः इसका प्रयोग नहीं करते। "ओ" के साथ "जी" लगाकर
आदर भी प्रकट किया जाता है। जैसे "ओ जी, आप तो
बड़े निर्दयी निकले।"

(2)

ದೇವರಮನೆ ದೇವಸ್ಥಾನ, ಸಂಪಿಗೆಯ ದೇವಸ್ಥಾನ ಹೀಗೆ ಮುಂತಾದ ಕಡೆಗಳಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯ ಪ್ರಕಾರ ಪೂಜೆ ಮಾಡಿಸಿಕೊಂಡು ಬರುತ್ತಿದ್ದರು. ಈ ಸಂಪ್ರದಾಯವು ಸುಮಾರು ೨೦ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದು ಇದಕ್ಕೆ ಸುಮಾರು ೨೦೦ ರೂಪಾಯಿಗಳಷ್ಟು ಖರ್ಚು ಬರುತ್ತಿತ್ತು. ಈ ಖರ್ಚನ್ನು ಭರಿಸಲು ಸಾಧ್ಯವಾಗದೆ ಇರುವುದರಿಂದ ಈ ಸಂಪ್ರದಾಯವನ್ನು ಕೈಬಿಡಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಈ ಸಂಪ್ರದಾಯವನ್ನು ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗಲು ಸಹಾಯಧನ ಕೊಡಬೇಕೆಂದು ಕೋರಿಕೊಂಡಿರುತ್ತಾರೆ.

ಈ ಸಂಪ್ರದಾಯವನ್ನು ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗಲು ಸಹಾಯಧನ ಕೊಡಬೇಕೆಂದು ಕೋರಿಕೊಂಡಿರುವ ಮನವಿಯನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಸಹಾಯಧನ ಕೊಡಲು ಸರ್ಕಾರಕ್ಕೆ ಶಿಫಾರಸ್ಸು ಮಾಡಲು ಕೋರಿದೆ.

ಇಂತಿ ತಮ್ಮ ವಿಶ್ವಾಸಿ,

ಸಹಾಯಕ ಆಯುಕ್ತರು

ભાગ્યશ્રી પોતાના મોબાઈલ ફોનમાં ડૂબી ગયેલી હતી. તેણે ઘરમાં પ્રવેશતા જ ધ્યાન ન આપ્યું. પરંતુ જ્યારે તેણે ઉપર જોયું ત્યારે તેની આંખો ફાટી ગઈ. તેની સામે તેનો પતિ વિક્રમ ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો અને ઉદાસી બંનેના ભાવ હતા. તેના હાથમાં ભાગ્યશ્રીનો ફોન હતો. તેણે ધીમા પણ કઠોર અવાજે પૂછ્યું, "આ શું છે, ભાગ્યશ્રી? આ જ તારું કામ છે? આખો દિવસ ઘરનું કામ પડ્યું રહે અને તું આવા ફોટા પાડવામાં અને મોકલવામાં સમય બગાડે છે?"

ભાગ્યશ્રી ગભરાઈ ગઈ. તેણે ક્યારેય વિક્રમનો આવો ગુસ્સો જોયો નહોતો. તેણે ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો, "ના, વિક્રમ, તમે ખોટું સમજો છો. આ તો ફક્ત..." પરંતુ વિક્રમે તેને વચ્ચેથી જ અટકાવી દીધી. તેણે કહ્યું, "મને ખબર છે કે આ ફક્ત શું છે. તું આ ફોટા તારા મિત્રોને બતાવવા માટે પાડે છે, જેથી તેઓ તારા વખાણ કરે. પણ તું ભૂલી ગઈ કે આપણે અહીં કોઈ મોડેલ નથી. આપણે એક સામાન્ય પરિવાર છીએ, અને મારી પત્નીએ આ રીતે વર્તન કરવું યોગ્ય નથી."

ભાગ્યશ્રીને પહેલી વાર સમજાયું કે તેનો પતિ તેની પ્રવૃત્તિને કેટલી ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે ફોન પાછો લેવા માટે હાથ લંબાવ્યો, પરંતુ વિક્રમે ફોન પોતાના ખિસ્સામાં મૂકી દીધો. તેણે કહ્યું, "આ ફોન હવે મારી પાસે રહેશે. જ્યારે તું આ ઘરની જવાબદારીઓ પ્રત્યે ગંભીર બનીશ, ત્યારે જ હું તને આ પાછો આપીશ." આટલું કહીને વિક્રમ ઓફિસ જવા માટે નીકળી ગયો.

(૨)

પરીક્ષા વિભાગ

પ્રશ્ન ૩ નીચે પૈકીના કોઈ પણ બે પ્રશ્નના જવાબ લખો. કોઈ પણ બે જવાબના
ગુણ સરખા છે. (૧૦)

(૧) ગુજરાતી ભાષાના વિકાસમાં મુદ્રણ કળાનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ વિધાન
સમજાવો. ગુજરાતી ભાષાના વિકાસમાં મુદ્રણ કળાનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. મુદ્રણ
કળાના વિકાસ પહેલાં હસ્તપ્રતોનો યુગ હતો. હસ્તપ્રતો લહિયાઓ પાસે લખાવવી પડતી
હતી. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને ખર્ચાળ હતી. પરિણામે પુસ્તકોની નકલો ઓછી
પ્રમાણમાં તૈયાર થતી અને તે સામાન્ય લોકોની પહોંચની બહાર રહેતી. મુદ્રણ કળાના
વિકાસને કારણે પુસ્તકોની નકલો ઝડપથી અને મોટી સંખ્યામાં તૈયાર થવા લાગી.
પરિણામે પુસ્તકો સામાન્ય લોકોની પહોંચમાં આવ્યાં. ગુજરાતી ભાષાના પ્રારંભિક
પુસ્તકોમાં ધાર્મિક ગ્રંથો, કથાઓ અને કાવ્યોનો સમાવેશ થતો હતો. મુદ્રણ કળાના
વિકાસને કારણે આ પુસ્તકોનો વ્યાપ વધ્યો અને વાચકોની સંખ્યામાં પણ વધારો થયો.
પરિણામે ગુજરાતી ભાષાનું સાહિત્ય વધુ સમૃદ્ધ બન્યું. આમ, મુદ્રણ કળાએ
ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ગુજરાત હાઈકોર્ટ

ફોજદારી અપીલ નં. ૧૨૩૪/૨૦૨૧

૧૫ ઓક્ટોબર ૨૦૨૧

ન્યાયમૂર્તિ કિરણ ચંદ્રશેખર મહેતા, ન્યાયમૂર્તિ સોનલ વિનોદ દેસાઈ

અપીલકર્તા વતી વકીલ રમેશ ભીખાભાઈ પટેલ, પ્રતિવાદી વતી સરકારી વકીલ કુમારી હેતલ જયંતીલાલ ઠાકોર

ચુકાદો

ન્યાયમૂર્તિ સોનલ વિનોદ દેસાઈ : આ અપીલ અરજદાર મુકેશ ભીખાભાઈ પરમાર દ્વારા સેશન્સ કોર્ટ, ખેડા-નડિયાદના તા. ૦૩/૦૬/૨૦૨૧ના રોજ ફોજદારી કેસ નં. ૪૫૬/૨૦૧૯માં આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. નીચલી અદાલતે અપીલકર્તાને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ ૩૦૭ હેઠળ દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અપીલકર્તાએ આ ચુકાદાને પડકારીને જામીન પર મુક્ત થવાની માંગણી કરી છે.

ફરિયાદી પક્ષનો કેસ એવો છે કે તા. ૧૪/૦૭/૨૦૧૯ના રોજ સાંજે આશરે ૬:૩૦ વાગ્યે ફરિયાદી રમેશભાઈ ભીખાભાઈ પરમાર પોતાના ઘરની બહાર ઊભા હતા ત્યારે અપીલકર્તા મુકેશ પરમાર ત્યાં આવ્યો અને ફરિયાદીના પુત્ર વિશાલ પરમાર સાથે ઝઘડો કરવા લાગ્યો. ફરિયાદીનો આક્ષેપ છે કે અપીલકર્તાએ પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે વિશાલ પર ત્રણ વાર હુમલો કર્યો, જેમાં તેને પેટ અને છાતીના ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત વિશાલને સારવાર માટે સરકારી હોસ્પિટલ, નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

ભરતે તેમનું પ્રથમ ઉદાહરણ જોઈ લીધા બાદ તેમણે પોતાની ઓફિસમાં પોતાની સામે બેઠેલા ગ્રાહકને પોતાની સમક્ષ ઊભા રહેવા કહ્યું. ગ્રાહક ઊભો થયો. ભરતે તેને પોતાની સામે ખુરશી પર બેસવા કહ્યું. ગ્રાહક બેઠો. ભરતે તેને પોતાની સામે ટેબલ પર પડેલી પેન્સિલ ઉપાડવા કહ્યું. ગ્રાહકે પેન્સિલ ઉપાડી. ભરતે તેને પેન્સિલ ટેબલ પર મૂકવા કહ્યું. ગ્રાહકે પેન્સિલ ટેબલ પર મૂકી. ભરતે તેને ટેબલ પર પડેલો કાગળ ઉપાડવા કહ્યું. ગ્રાહકે કાગળ ઉપાડ્યો. ભરતે તેને કાગળ પર પેન્સિલ વડે ચોરસ દોરવા કહ્યું. ગ્રાહકે કાગળ પર ચોરસ દોર્યો. ભરતે તેને કાગળ પર દોરેલા ચોરસની અંદર ત્રિકોણ દોરવા કહ્યું. ગ્રાહકે ચોરસની અંદર ત્રિકોણ દોર્યો. ભરતે તેને ત્રિકોણની અંદર વર્તુળ દોરવા કહ્યું. ગ્રાહકે ત્રિકોણની અંદર વર્તુળ દોર્યું. ભરતે તેને પેન્સિલ ટેબલ પર મૂકવા કહ્યું. ગ્રાહકે પેન્સિલ ટેબલ પર મૂકી. ભરતે તેને ટેબલ પર પડેલો કાગળ ઉપાડવા કહ્યું. ગ્રાહકે કાગળ ઉપાડ્યો. ભરતે તેને કાગળ પર પેન્સિલ વડે ચોરસ દોરવા કહ્યું. ગ્રાહકે કાગળ પર ચોરસ દોર્યો. ભરતે તેને ચોરસની અંદર ત્રિકોણ

ગામ ધણીયાણી ગામ ધણીયાણી ગામ ધણીયાણી ગામ ધણીયાણી

(૮) દાખલાનાં દાખલાઓ

૧. ૧૦૦ ગ્રામ પાણીમાં ૨૫ ગ્રામ ખાંડ ઓગાળવામાં આવે છે. તો ખાંડના દ્રાવણમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા થાય?

ઉકેલ: ૧૦૦ ગ્રામ પાણીમાં ૨૫ ગ્રામ ખાંડ ઓગાળવામાં આવે છે.
તો ખાંડના દ્રાવણનું વજન = ૧૦૦ + ૨૫ = ૧૨૫ ગ્રામ
૧૨૫ ગ્રામ દ્રાવણમાં પાણીનું પ્રમાણ ૧૦૦ ગ્રામ છે.
૧ ગ્રામ દ્રાવણમાં પાણીનું પ્રમાણ $\frac{૧૦૦}{૧૨૫}$ ગ્રામ છે.
૧૦૦ ગ્રામ દ્રાવણમાં પાણીનું પ્રમાણ $\frac{૧૦૦}{૧૨૫} \times ૧૦૦ = ૮૦$ ગ્રામ છે.
∴ ૧૨૫ ગ્રામ દ્રાવણમાં પાણીનું પ્રમાણ ૮૦ ટકા છે.

ફરિયાદ :-

૧. ફરિયાદી ઉપરોક્ત નામે રહે. ગામ તા. જિલ્લા વાળા ઉપર ફરિયાદ કરે છે કે સામાવાળા ગામ તા. જિલ્લા વાળા ફરિયાદીના ગામ ખાતે આવેલ પોતાની માલિકીની જમીન સર્વે નં. ૧૨૩ પૈકી ૧ વાળી જમીનમાં ટ્રેક્ટર ચલાવી ખેડ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદી ત્યાં ગયા હતા અને સામાવાળાને ખેડ કરતા અટકાવતા સામાવાળાએ ફરિયાદીને ગાળો આપી ધમકી આપી હતી કે "તું અહીંથી જતો રહે નહીં તો તને જાનથી મારી નાખીશું" તેમ કહી ધમકી આપી હતી.

૨. આમ સામાવાળાએ ફરિયાદીને ગાળો આપી ધમકી આપી ગુનો કર્યો છે.

૩. ફરિયાદીની ફરિયાદ ધ્યાને લઈ સામાવાળા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી સામાવાળાની ધરપકડ કરી કાયદેસર કામ ચલાવી સામાવાળાને સજા કરવા નામદાર કોર્ટને વિનંતી છે.

સાક્ષીઓ :-

૧. ફરિયાદી

પરિશિષ્ટ ૨ (ચાલુ)

ઉપર્યુક્ત પ્રમાણે ઉપરોક્ત કાર્યવાહી કર્યા બાદ તેમજ પ્રથમ "ક" તથા "ખ" ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ, ઉમેદવારે પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, જાતિ, વૈવાહિક સ્થિતિ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, ધંધો, નોકરી, હોદ્દો, પગાર ધોરણ, પોતાની સહી તથા ફોટોગ્રાફ સ્પષ્ટ રીતે ચોંટાડવો. ત્યારબાદ ઉમેદવારે પોતાના ફોટોગ્રાફ પર તથા ફોર્મ પર પોતાની સહી કરવી. ત્યારબાદ ઉમેદવારે પોતાનું ફોર્મ ભરવા માટે જરૂરી ફી ભરપાઈ કરવી. ફી ભરપાઈ કર્યા બાદ ઉમેદવારે પોતાનું ફોર્મ ભરવા માટે જરૂરી

ઇસ્લામમાં લગ્નસંબંધ

જીવનસાથી પસંદગીમાં કુટુંબ તથા સમાજનો પ્રભાવ ઓછો કરવા માટે ઘણા યુવક-યુવતીઓ પોતાની રીતે જીવનસાથી પસંદ કરી લે છે. આવા કિસ્સામાં પણ નિકાહ કરવાની જરૂર છે. નિકાહ વગર પતિ-પત્ની તરીકે સાથે રહેવું એ વ્યભિચાર ગણાય છે. આવા સંબંધથી જન્મેલાં બાળકો પણ કાયદેસર ગણાતાં નથી. તેમને વારસામાં કશું મળતું નથી. આવા સંબંધથી ઇસ્લામ ધર્મ પ્રમાણે ગંભીર ગુનો બને છે. આવા ગુનેગારોને કડક સજા કરવાની જોગવાઈ ઇસ્લામી કાયદામાં છે. આ સજા ઘણી કઠોર છે. તેથી ઘણા લોકો આવું કૃત્ય કરતાં ડરે છે. આમ, આ સજા સમાજમાં ગુનાનું પ્રમાણ ઘટાડવામાં ઘણી અસરકારક પુરવાર થઈ છે.

(ક) વ્યભિચાર

૨૨૫૦ ૦૬૬૫૫

૧૯૬૬૫૫૦ ૬૬૬૬૫૫ ૬૬૬૬

દામોદરભાઈ ડાહ્યાભાઈ, ખરીદનાર તરીકેના.

કાલોલ, તા. કાલોલ પોતાની કાયમી જગ્યા ઉપર હયાત હોવા
સિવાય, તથા કોઈ પણ કારણસર, તથા મોજાર કરવામાં આવતા ન
હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના વાંધા તકરાર
ધરાવતા હોય તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસની
અંદર લેખિતમાં પુરાવા સાથે નીચે સહી કરનાર ઉપર રજીસ્ટર્ડ
પોસ્ટથી અથવા રૂબરૂ રજુ કરવા. ત્યારબાદ કોઈ વાંધા તકરાર
રજુ કરવામાં આવશે નહિ તો તે બાબતે કોઈ વાંધા તકરાર
નથી તેમ માની આ મિલ્કત ઉપરનો અમારો હક્ક કાયમ
રહેશે તેમ માની આ મિલ્કત ખરીદવા અમો તૈયાર થયા છીએ.

કાલોલ, તા. ૨૦/૧૧/૨૦૧૯

ખરીદનાર વકીલનું નામ અને સહી

ખરીદનાર વકીલનું સરનામું

દેવદેવાનાં દર્શનાર્થે પોતાના ઉતારાની નજીક આવેલ

પ્રસિદ્ધ દેવળોનાં દર્શનાર્થે જતી વખતે ત્યાં કુલીઓ મારફતે

પોતાના સામાનની ઉપાડ કરાવવી પડે છે. પરંતુ મુસાફરો

પોતાની સાથે ઓછામાં ઓછો સામાન રાખે તો કુલીઓ પર

થતો ખર્ચ ઘણો બચી જાય છે. કુલીઓ પણ ઓછો સામાન

ઉપાડવાનું પસંદ કરે છે. કારણ કે તેમને ઓછી મજૂરી

મળે છે. પરંતુ ઓછો સામાન લઈ જવાનો અર્થ એવો

નથી કે જરૂરી વસ્તુઓ પણ ન લઈ જવી. (મારા

વિચારો પ્રમાણે) જરૂરી વસ્તુઓ તો લઈ જ જવી

જોઈએ. પરંતુ બિનજરૂરી વસ્તુઓ ન લઈ જવી

એમ કહેવાનો મારો આશય છે. પ્રવાસમાં જરૂરી

વસ્તુઓ કઈ કઈ છે તે આપણે જોઈ ગયા. પરંતુ

ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓ પણ સાથે રાખવી

જોઈએ. જેમ કે, ઓઢવા પાથરવા માટે ધાબળો

અથવા રજાઈ, ખાવા માટે ભાખરી, ચોખા, ખાંડ

વગેરે. ઉપરાંત ઉનાળામાં ઠંડા પાણી માટે સુરાહી

અથવા કોથળો પણ સાથે રાખવો જોઈએ. ઉપરાંત

ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાની પણ સગવડ

હોવી જોઈએ. ઉપરાંત ઉનાળામાં ઠંડા પાણીથી

નહાવાની પણ સગવડ હોવી જોઈએ. ઉપરાંત

ઉનાળામાં ઠંડા પાણીથી નહાવાની પણ સગવડ

હોવી જોઈએ. ઉપરાંત ઉનાળામાં ઠંડા પાણીથી

નહાવાની પણ સગવડ હોવી જોઈએ. ઉપરાંત

সেবাশ্রমের সেক্রেটারি সমীপেষু

মান্যবর মহাশয়, আমার পরম শ্রদ্ধেয় পিতৃদেব গত ১৫ই ফাল্গুন তারিখে ৬৫ বৎসর বয়সে পরলোক গমন করিয়াছেন। তাঁহার মৃত্যুর পর হইতে আমি ও আমার মাতা একাকী হইয়া পড়িয়াছি। আমার পিতৃদেব সেবাশ্রমে যে টাকা দান করিয়াছিলেন তাহার সুদ হইতে বিধবা মাতা ও আমার ভরণপোষণ হইবে বলিয়া তিনি সেবাশ্রমে ঐ টাকা রাখিয়াছিলেন। সেবাশ্রম হইতে যাহাতে আমরা ঐ টাকার সুদ পাইতে পারি তাহার ব্যবস্থা করিতে আজ্ঞা হয়।

દારુલઉમાર દારુસ્સોફા મોહલ્લા દરિયાપુર અમદાવાદ.

મોબા. નમાજ દરમ્યાન કોઈ વ્યક્તિ પર ઈજા કરવાનો પ્રયત્ન કરવા બદલ પોલીસ ફરિયાદ

ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાવાને કારણે લોકડાઉન અમલમાં છે. આ સમયે મસ્જિદોમાં પાંચ વખતની નમાજ પણ બંધ છે. ત્યારે ગત શુક્રવારે જુમ્માની નમાજ પઢવા માટે મસ્જિદમાં ગયેલા એક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ફરિયાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, ગત શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે મોહલ્લા દરિયાપુરની મસ્જિદ દારુસ્સોફામાં જુમ્માની નમાજ પઢવા માટે ૩૦ થી ૪૦ વ્યક્તિઓ ભેગા થયા હતા. ત્યારે ૧૨.૪૫ વાગ્યે મસ્જિદમાં પ્રવેશ કરી રહેલા ૨૫ વર્ષીય યુવાન પર ૩૫ વર્ષીય વ્યક્તિ ધારિયા જેવું હથિયાર લઈને ધસી આવ્યો હતો. જોકે, ત્યાં હાજર અન્ય વ્યક્તિઓએ તેને પકડી લીધો હતો. આ ઘટના બાદ ફરિયાદી યુવાને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, ફરિયાદી યુવાન મસ્જિદમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે આરોપી ધારિયા જેવું હથિયાર લઈને ધસી આવ્યો હતો. આ

ઉપરોક્ત ઠરાવ પ્રમાણે ગામોના ખેડૂતોએ

ભરવાનું.

ગામ નમુનો

૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ૮૮ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦

૧૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૧૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૧૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૧૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૧૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૨૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૩૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૪૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૫૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૬૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૭૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૮૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૧ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૨ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૩ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૪ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૫ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૬ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૭ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૮ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૯૯ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

૧૦૦ મી કલમ હેઠળ ઠરાવેલ ખેડૂતોની કુલ સંખ્યા

કુલ ખેડૂતોની સંખ્યા

કુલ રકમ

ઉપરોક્ત ઠરાવ પ્રમાણે ગામોના ખેડૂતોએ ભરવાનું કુલ રકમ

મુસ્લિમ કુટુંબ કાયદા અનુસાર મિલકતની વહેંચણી

૧૨૫. મુસ્લિમ કુટુંબ કાયદા અનુસાર મિલકતની વહેંચણી કરવા માટે નીચે મુજબ ૧૨ કિસ્સાઓ આપવામાં આવ્યા છે. આ કિસ્સાઓ ઉકેલવા માટે નીચે મુજબ ૧૨ પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે નીચે મુજબ ૪ વિકલ્પો આપવામાં આવ્યા છે. આ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(૧) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૨) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, એક પુત્રી અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૩) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, એક પુત્રી અને બે પુત્રો છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૪) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૫) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૬) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, એક પુત્રી અને બે પુત્રો છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૭) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૮) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, એક પુત્રી અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૯) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, એક પુત્રી અને બે પુત્રો છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૧૦) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૧૧) એક મુસ્લિમ પુરુષનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેની પત્ની, એક પુત્રી અને બે પુત્રો છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

(૧૨) એક મુસ્લિમ સ્ત્રીનું અવસાન થયું છે. તેના વારસદારોમાં તેનો પતિ, બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેની મિલકતની વહેંચણી કેવી રીતે થશે?

ઉપરોક્ત ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.એમ.ચૌધરી સાહેબ પાસે હોઇ તેઓ
(તપાસનીશ) હાજર મળી આવતા, તેમને ફરીયાદ તથા સાહેદોના જાબાનીથી
જાણવા મળેલ કે, ફરીયાદી શ્રી મનોજભાઇ ગોવિંદભાઇ પરમાર રહે.ગામ
ઉમરા વાળાની ભેંસ ગઇ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૦૬/૦૦ વાગ્યા
આસપાસ ઘરની બાજુમાં આવેલ ખુલ્લા વાડામાં બાંધેલ હતી. જે ભેંસ
ફરીયાદી તથા સાહેદોએ ભેંસ ચોરી થયેલ હોવાની આજુબાજુ તપાસ કરતા
મળી આવેલ નહી. જેથી ફરીયાદી તથા સાહેદોએ ભેંસ ચોરી થયેલ હોવાની
ખાત્રી થતા ફરીયાદ આપતા ગુનો દાખલ થયેલ છે. આ કામે ફરીયાદી
તથા સાહેદોની જાબાની તપાસતા ગુનો બનવા પામેલ હોવાનું જણાય છે.
આ કામે આરોપી (૧) ભરતભાઇ ઉર્ફે ભરો ગોવિંદભાઇ પરમાર રહે.ગામ
ઉમરા વાળો ગુનો કબુલ કરતો હોઇ તેની ધરપકડ કરવાની હોઇ તેમજ
ગુનાના કામે ચોરી થયેલ ભેંસ કબ્જે કરવાની હોઇ તેમજ ગુનાના કામે
ચોરી થયેલ ભેંસ પૈકી ૧ ભેંસ કબ્જે કરેલ હોઇ તેમજ ગુનાના કામે
ચોરી થયેલ ભેંસ પૈકી ૧ ભેંસ કબ્જે કરેલ હોઇ તેમજ ગુનાના કામે
ચોરી થયેલ ભેંસ પૈકી ૧ ભેંસ કબ્જે કરેલ હોઇ તેમજ ગુનાના કામે

ખરીદનારનાં નામ અને સહીવાળું લેખિતમ

૧૫૭૫ ના વર્ષ "ખાતા" ની ૧૫ મી તારીખે ગામ કુરજ ના રહેવાસી મેં ૧૫ લોકોએ ગામ ના પટેલ રામ મેર ના દીકરા લીલા મેર ની હાજરીમાં ઘઉં ની ખરીદી કરી. કુલ ૨૩૦ મણ ઘઉં ખરીદ્યા. ભાવ હતો ૧૨ રૂપિયા મણ. ચુકવણી રોકડા રૂપિયામાં થઈ. ખરીદનારોમાં ૪ વેપારી અને ૧૧ ખેડૂતો હતા. ખરીદેલ ઘઉં ગામના ગોદામમાં રાખવામાં આવ્યા. ત્યાંથી તે ૨૦ દિવસમાં ઉપાડી લેવાના હતા. ગોદામનો ચોકીદાર ભીમા કોળી હતો. તેને મહિને ૩ રૂપિયા પગાર મળતો. ખરીદનારોમાં ૩ જણા નિરક્ષર હતા. તેમણે પોતાની જગ્યાએ અંગૂઠાનું નિશાન કર્યું. લેખિતમ લખનાર ગામના મુનીમ હતા. તેમણે પોતાની સહી કરી. સાક્ષી તરીકે ગામના બે વડીલોએ સહી કરી

(૨૬)

ઉપરોક્ત ઠરાવ અન્વયે ઉમેદવારોએ રજૂ કરવાના પ્રમાણપત્રોનો નમૂનો

હું ..... ગામ/શહેરનો રહેવાસી/રહેવાસી મારા પિતા/પતિ શ્રી ..... ના વંશ/કુટુંબનો છું. મારા પિતા/પતિ ..... ગામ/શહેરના રહેવાસી હતા. તેઓ ..... વર્ષ પહેલાં ..... ગામ/શહેરમાં સ્થાયી થયા હતા. મારા પિતા/પતિ ..... ના વંશ/કુટુંબના હોવાથી હું ..... ગામ/શહેરમાં સ્થાયી થયો છું

ઉપરોક્ત ઠરાવની નકલ મોકલી આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

(ગુજરાત સરકારના ખાસ અધિકારી)

ઉપર પ્રમાણે ઠરાવ થયો છે તેની જાણ આપને કરવામાં આવે છે.

આપનો વિશ્વાસુ

(ગુજરાત સરકારના ખાસ અધિકારી)

ઉપર પ્રમાણે ઠરાવ થયો છે તેની જાણ આપને કરવામાં આવે છે.

આપનો વિશ્વાસુ

(ગુજરાત સરકારના ખાસ અધિકારી)

ಅರ್ಜಿದಾರರು ಸಲ್ಲಿಸಿರುವ ಅರ್ಜಿಯಲ್ಲಿ ಕೋರಿರುವಂತೆ ಅರ್ಜಿದಾರರ ಪರ ವಕೀಲರು ಹಾಜರಾಗಿದ್ದು ಪ್ರತಿವಾದಿಯ ಪರ ಯಾರೂ ಹಾಜರಾಗಿರುವುದಿಲ್ಲ. ಅರ್ಜಿದಾರರ ಪರ ವಕೀಲರು ಅರ್ಜಿಯಲ್ಲಿ ಕೋರಿರುವಂತೆ ಪ್ರತಿವಾದಿಯ ವಿರುದ್ಧ ಆದೇಶ ಮಾಡಲು ಕೋರಿದರು.

ಅರ್ಜಿದಾರರ ಪರ ವಕೀಲರು ಪ್ರತಿವಾದಿಯು ಅರ್ಜಿದಾರರಿಗೆ ಸೇರಿದ ಜಮೀನಿನಲ್ಲಿ ಅಕ್ರಮವಾಗಿ ಪ್ರವೇಶಿಸಿ ಅಲ್ಲಿ ಬೆಳೆದಿದ್ದ ಬೆಳೆಯನ್ನು ನಾಶಪಡಿಸಿರುವುದಾಗಿ ಹಾಗೂ ಅರ್ಜಿದಾರರಿಗೆ ಜೀವ ಬೆದರಿಕೆ ಹಾಕಿರುವುದಾಗಿ ಆಕ್ಷೇಪಣೆ ಸಲ್ಲಿಸಿರುವುದಾಗಿ ಹಾಗೂ ಪ್ರತಿವಾದಿಯ ವಿರುದ್ಧ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಲು ಅರ್ಜಿದಾರರು ಸಲ್ಲಿಸಿರುವ ದೂರಿನ ಪ್ರತಿಯನ್ನು ಹಾಜರುಪಡಿಸಿರುವುದಾಗಿ ಹಾಗೂ ಪ್ರತಿವಾದಿಯ ವಿರುದ್ಧ ಪೊಲೀಸರು ಯಾವುದೇ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳದಿರುವುದಾಗಿ ಹೇಳಿದರು. ಅರ್ಜಿದಾರರ ಪರ ವಕೀಲರು ಹೇಳಿಕೆಯನ್ನು ಪರಿಶೀಲಿಸಿದೆ. ಅರ್ಜಿದಾರರ ಪರ ವಕೀಲರು ಹೇಳಿಕೆಯಲ್ಲಿ ಹೇಳಿರುವ ಅಂಶಗಳು ಪ್ರಥಮದರ್ಶನಕ್ಕೆ ಸಕಾರಣವಾಗಿ ಕಂಡುಬರುತ್ತವೆ.

ગરીબ ને મુસલમાન કરવા લોભ આપવા કિં. પ્રા. શાળા ઉપરાંત ઉર્દૂ શાળા ખોલવા
તથા બીજા ઘણા પ્રકારે ઇસ્લામ ધર્મ ફેલાવવા ઘણા પૈસા ખર્ચાય છે.

ઉપરોક્ત હકીકત ઉપરથી જણાશે કે ગરીબ મુસલમાનોને ઇસ્લામ ધર્મ પાળવા માટે
કેટલી બધી સગવડો આપવામાં આવે છે. આ સગવડો ઉપરાંત ઇસ્લામ ધર્મ પાળવાથી
ગરીબ મુસલમાનોને ઘણા પ્રકારના ટેક્સોમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત ઇસ્લામ ધર્મ
પાળવાથી ગરીબ મુસલમાનોને ઘણા પ્રકારના ટેક્સોમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત
ઇસ્લામ ધર્મ પાળવાથી ગરીબ મુસલમાનોને ઘણા પ્રકારના ટેક્સોમાંથી મુક્તિ મળે છે.

ન્યાયિક અધિકારી વર્ગ ની ભરતી

ની દૃષ્ટિ ફેરવી જાય તો તેમાં તેમનો વાંક ગણાય નહીં. આવા સંજોગોમાં ન્યાયાધીશ પોતાની ફરજ બજાવવામાં કસૂર કરે છે એમ કહી શકાય નહીં. આ

[১৩৯]

ঈশান বন্দ্যোপাধ্যায় ও তাঁর সমসাময়িকেরা

ঈশান বন্দ্যোপাধ্যায় ও তাঁর সমসাময়িকেরা

ঈশান বন্দ্যোপাধ্যায় ও তাঁর সমসাময়িকেরা

ঈশান বন্দ্যোপাধ্যায় ও তাঁর সমসাময়িকেরা

ঢাকা বিশ্ববিদ্যালয়

স্নাতক (সম্মান) ১ম বর্ষ পরীক্ষা ২০১৩

বিষয়: বাংলা

পূর্ণমান: ১০০

সময়: ৩ ঘণ্টা

[প্রান্তিক নম্বর ডানপাশে দেখানো হয়েছে]

১। নিম্নলিখিত যে কোনো একটি বিষয়ে প্রবন্ধ রচনা করো: ২০

ক) বাংলা কথাসাহিত্যে নারীর অবস্থান

খ) বাংলা নাটকে সমাজচিত্র

গ) বাংলা কবিতায় প্রকৃতি ও পরিবেশ

২। নিম্নলিখিত যে কোনো একটি বিষয়ে সংক্ষিপ্ত টীকা লেখো: ১০

ক) বাংলা উপন্যাসে ঐতিহাসিক চেতনা

খ) বাংলা ছোটগল্পে গ্রামীণ জীবন

গ) বাংলা সাহিত্যে মুক্তিযুদ্ধের প্রভাব

৩। নিম্নলিখিত যে কোনো একটি বিষয়ে সংক্ষিপ্ত টীকা লেখো: ১০

ক) বাংলা উপন্যাসে ঐতিহাসিক চেতনা

খ) বাংলা ছোটগল্পে গ্রামীণ জীবন

গ) বাংলা সাহিত্যে মুক্তিযুদ্ধের প্রভাব

৪। নিম্নলিখিত যে কোনো একটি বিষয়ে সংক্ষিপ্ত টীকা লেখো: ১০

ক) বাংলা উপন্যাসে ঐতিহাসিক চেতনা

খ) বাংলা ছোটগল্পে গ্রামীণ জীবন

গ) বাংলা সাহিত্যে মুক্তিযুদ্ধের প্রভাব

વિષય :- ડાંગ જિલ્લા પોલીસ વડાશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતા (ખાનગી ડ્રાઈવર) તરીકે નોકરી કરતા ડ્રાઈવરોને "ઓવર-ટાઈમ" ચુકવવા બાબત.

સવિનય સાદર જણાવવાનું કે ડાંગ જિલ્લા પોલીસ વડાશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતા ડ્રાઈવરોને ઓવર-ટાઈમ ચુકવવા બાબતે ડાંગ જિલ્લા પોલીસ વડાશ્રી તરફથી તા. ૧૫/૦૫/૨૦૧૯ ના રોજ ઠરાવ કરવામાં આવેલ છે. જે ઠરાવ મુજબ

ત્રણ દિવસ પછી ઇન્દ્રજિત ફરી આવ્યો. આ વખતે તેની સાથે ચાર રાક્ષસો હતા. તેમણે પોતાની ઓળખ આપી કે તેઓ રાવણના સૈનિકો છે અને તેમને સીતાની રક્ષા માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાવણ સીતાને ધમકાવીને કે લાલચ આપીને તેનો નિર્ણય બદલવા માગે છે. તેમણે સીતાને ચેતવણી આપી કે તેમની સાથે સહકાર ન કરવાથી તેમને ભારે મુશ્કેલી પડશે. સીતાએ ફરી એકવાર તેમની વાત માનવાનો ઇનકાર કર્યો. ત્યારે તેમણે ધમકી આપી કે તેઓ બળપ્રયોગ કરીને પણ સીતાને લઈ જશે. સીતાએ ફરી એકવાર તેમને ચેતવણી આપી કે જો તેમણે તેમની સાથે બળપ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનો નાશ થશે. આ સાંભળીને રાક્ષસો ગુસ્સે થયા અને તેમણે સીતા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમના પહોંચતા પહેલાં જ ત્રિજટા ત્યાં આવી પહોંચી અને તેણે રાક્ષસોને ભગાડી મૂક્યા. ત્રિજટાએ સીતાને કહ્યું કે તેણે સ્વપ્નમાં જોયું છે કે શ્રીરામ લંકા પર વિજય મેળવશે અને સીતાને પાછા લઈ જશે. ત્રિજટાએ સીતાને ધીરજ રાખવા અને શ્રીરામ પર વિશ્વાસ રાખવા કહ્યું. ત્રિજટાની વાત સાંભળીને સીતાને થોડી રાહત થઈ. તેમણે ત્રિજટાનો આભાર માન્યો અને કહ્યું કે તેમને શ્રીરામ પર પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે તેઓ શ્રીરામના આગમનની રાહ જોઈ રહ્યા છે. ત્રિજટાએ સીતાને ખાતરી આપી કે શ્રીરામ ટૂંક સમયમાં લંકા પર વિજય મેળવશે અને સીતાને પાછા લઈ જશે. ત્રિજટાની વાત સાંભળીને સીતાને ખૂબ જ આનંદ થયો. તેમણે ત્રિજટાને ભેટી પડ્યા અને કહ્યું કે તેમણે તેમને ખૂબ જ મોટી ખુશખબર આપી છે. ત્રિજટાએ સીતાને કહ્યું કે તેણે સ્વપ્નમાં જોયું છે કે શ્રીરામ

ઇસ્લામ ધર્મ ના ૨૩૦ પ્રશ્નોત્તરી

ઇસ્લામ ધર્મ ની ઉત્પત્તિ ક્યારે થઈ? ઇસ્લામ ધર્મ ના સ્થાપક કોણ છે?
ઇસ્લામ ધર્મ ના પવિત્ર ગ્રંથ નું નામ શું છે? ઇસ્લામ ધર્મ ના પાંચ મુખ્ય સિદ્ધાંતો કયા છે?
ઇસ્લામ ધર્મ ના અનુયાયીઓ ને શું કહેવામાં આવે છે? મુસ્લિમ સમાજ માં સ્ત્રીઓ નું સ્થાન કેવું છે?
ઇસ્લામ ધર્મ માં લગ્ન વિધિ કેવી રીતે થાય છે? ઇસ્લામ ધર્મ માં છૂટાછેડા વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં વારસાઈ હક્કો કેવી રીતે નક્કી થાય છે? ઇસ્લામ ધર્મ માં ગુલામી પ્રથા વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં યુદ્ધ વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં શાંતિ વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં ન્યાય વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં ચોરી વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં વ્યાજ વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં જુગાર વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં દારૂ વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં ડુક્કર વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં ખોરાક વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં પોશાક વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં સ્વચ્છતા વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં પ્રાર્થના વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં રોઝા વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં હજ વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં ઝકાત વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં દાન વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં પડોશી વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં માતા-પિતા વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં બાળકો વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં વૃદ્ધો વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં બીમાર વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં મૃત્યુ વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં કબર વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં પુનર્જન્મ વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં સ્વર્ગ વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં નરક વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં ફરિશ્તા વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં જિન્ન વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં શૈતાન વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં જાદુ વિશે શું કહેવામાં આવ્યું છે?
ઇસ્લામ ધર્મ માં ભવિષ્ય વિશે શું કહેવામાં આવ્યું છે? ઇસ્લામ ધર્મ માં નસીબ વિશે શું કહેવામાં આવ્યું છે?

LIBRARY
Mahabodhi Seminary
Jorhat

ગુજરાત રાજ્ય અભિલેખાગાર, ગાંધીનગર

ગામના દરમાન તો ઘણ દીધ.

מאמרה ה' מפקיד א

כיוונו את עיקרי הדברים הן שהן הקדים ה' שלוחיה

(1401)

" ה' ס. שלפני מ להדיוט כ בדי הדר שהיה הלו, ופ' ונתן 200 . כלו מהן.

כיוון / עקרי ס ר"ל שמא יאמר בזוכסלן. — — — 001 זה 05 הם, 150 מהם

~~שהוקם ורוק לנוהג גמור זאת הדבר דומה הלו, אשר 125 זה 75 מהם 150 מהם שהוקם~~
בזוכסלן

ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਹਰਿਰਾਇ ਜੀ ਦੇ ਸਮੇਂ ਤੋਂ ਹੀ ਸਿੱਖ ਸੰਗਤਾਂ ਦੀ ਆਵਾਜਾਈ ਇਸ ਰਸਤੇ ਰਾਹੀਂ ਹੁੰਦੀ ਰਹੀ ਹੈ। ਇਸ ਰਸਤੇ ਦੇ ਕਈ ਪੜਾਵਾਂ ਉੱਤੇ ਗੁਰੂ ਸਾਹਿਬਾਨ ਦੇ ਚਰਨ ਪਏ ਹਨ। ਇਸ ਰਸਤੇ ਦੇ ਕਈ ਪੜਾਵਾਂ ਉੱਤੇ ਗੁਰਦੁਆਰੇ ਸੁਸ਼ੋਭਿਤ

ਸਾਹਿਬ ਸਿੰਘ ਜੀ ਨੇ ਇਸ ਸਾਖੀ ਦੇ ਅਖੀਰ ਵਿਚ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਇਹ ਸਾਖੀ ਭਾਈ ਮਨੀ ਸਿੰਘ ਜੀ ਦੀ ਲਿਖੀ ਹੋਈ ਹੈ। ਪਰ ਇਸ ਸਾਖੀ ਦੇ ਅਖੀਰ ਵਿਚ ਇਹ ਵੀ ਲਿਖਿਆ ਹੈ ਕਿ ਇਹ ਸਾਖੀ ਭਾਈ ਮਨੀ ਸਿੰਘ ਜੀ ਨੇ ਭਾਈ ਦਯਾ ਰਾਮ ਪਾਸੋਂ ਸੁਣ ਕੇ ਲਿਖੀ ਹੈ। ਇਸ ਤੋਂ ਇਹ ਸਿੱਧ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਇਹ ਸਾਖੀ ਭਾਈ ਮਨੀ ਸਿੰਘ ਜੀ ਦੀ ਲਿਖੀ ਹੋਈ ਨਹੀਂ ਹੈ।

ਦਰਖਾਸਤ ਕੀਤੀ ਕਿ ਦੋ ਸਮਾਜਕ ਕੁਸ਼ਲ ਅਤੇ ਸਮਾਜ ਸੇਵਕ ਵਿਅਕਤੀ ਮੁਹੱਈਆ ਕਰਵਾਏ ਜਾਣ।

ਸਮਾਜਿਕ ਸਮਰਥਨ ਸਮਾਜ ਭਲਾਈ ਵਿਭਾਗ ਵੱਲੋਂ ਕੀਤੇ ਜਾ ਰਹੇ ਪ੍ਰੋਗਰਾਮ ਅਤੇ ਸਕੀਮਾਂ ਦੇ ਸਿਲਸਿਲੇ ਵਿਚ ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਸਕੀਮਾਂ ਦੇ ਲਾਭਪਾਤਰੀਆਂ ਦੀ ਸਹਾਇਤਾ ਕਰਨ ਲਈ ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਅਫ਼ਸਰ (ਸਮਾਜ ਭਲਾਈ) ਦੀ ਅਸਾਮੀ ਸਿਰਜਣ ਦੀ ਤਜਵੀਜ਼ ਹੈ। ਇਸ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

ਇਸ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਅਫ਼ਸਰ (ਸਮਾਜ ਭਲਾਈ) ਦੀ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਅਫ਼ਸਰ (ਸਮਾਜ ਭਲਾਈ) ਦੀ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਅਫ਼ਸਰ (ਸਮਾਜ ਭਲਾਈ) ਦੀ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

ਸਮਾਜਿਕ ਸੁਰੱਖਿਆ ਅਫ਼ਸਰ (ਸਮਾਜ ਭਲਾਈ) ਦੀ ਅਸਾਮੀ ਨੂੰ ਸਿਰਜਣ ਲਈ ਵਿੱਤੀ ਪ੍ਰਭਾਵ ਦਾ ਵੇਰਵਾ ਹੇਠ ਦਰਜ ਹੈ:

התנ"ך והשפעתו על העולם

מאת **יהושע הדרי**

התפשטות הנצרות הביאה בעיקבותיה התעניינות רבה של נכרים בספרי הקדש של עם ישראל. ואין פלא: אבות הנצרות, רובם יהודים, שאבו את השראתם מהתנ"ך וראו בו אבן ופינה לתורתם החדשה. אדירה היתה אמונתם, כי הספרים נכתבו ברוח אלהים. דברי התנ"ך היו להם למופת. עקב זה רבו התרגומים וגבר העיון בספרי התנ"כ. כי, בעיד הנוצרים ממוצא יהודי יכלו להעזר באופן חפשי בתנ"כ במקור הרי לגבי הנוצרים ממוצא נכרי היה זה ספר התום. הילכך נאלצו להעזר בתרגומים. רבה, אפוא, תרגומים: שלמים וחלקיים, תרגומי התאמה והטעמה. עד אמצע המאה השניה לספירה החדשה היתה היונית שפת הכנסיה ולכן רבי התרגומים ליוונית. עם ערוב המאה השניה השתמשה הכנסיה ברומה, גליה וספרד בלטינית. בהתחלת המאה השלישית תורגם התנ"כ ללטינית, סורית, קופטית. כל התרגומים נעשו על פי תרגום "השבעים". רק במאה הרביעית תורגם התנ"כ ללטינית מהמקור העברי ע"י הירונימוס לפי פקודת האפיפיור. תעודת התרגום, לפי הודעת המתרגם, היתה להביא לידי בטוי מלא את המקור ולמסור לידי אנשי הדת מכשיר יעיל במלחמת הוכוחים עם היהודים. במלאכת התרגום נאלץ הירונימוס להעזר ברבנים ונאלץ היה, לפי הדגשת מקורות קתוליים, לשלם בעד עזרה זו בזהב רב. אליבא דאמת, נעזרו אנשי דת קתוליים לעתים קרובות מאד בעבודת תרגום או מקר בידיעותיהם של מלומדים יהודים. יש ואפילו נזדמנו להם היו מזמינים רבנים למנזרים לתכלית זאת. מכל מקום, היה תרגום הירונימוס מיסכם ע"י הכנסיה הקטולית. אף כיעצת טרנט, שנתכנסה מאית שנים לאחר המאורע, לניכח סכנת הריפורמציה, ב־1564, סמכה מחדש את ידה על תרגום זה. האפיפיור בגלוי דעתו ציין, כי "התרגום היה נכון ומדויק וללא ספק". האפיפיור שבא לאחריו בצע תרגום חדש שנבדל מהקודם בשלשת אלפים פסוקים.

עם הרחבת תחומיה של הנצרות שפעו ורבו התרגומים של התנ"כ לשפות שונות. במאה הרביעית תורגם התנ"כ לארמנית. הגשית, גרגית. התרגום האתיופי עלה יפה להפליא ונעלם במאה השבע עשרה בלחץ הרוסיפיקציה של הכנסיה הלאומית הרוסית. במאה השביעית בוצע תרגום לסורית. מיד לאחר זה, עם עלית הערבים, החלו התרגומים לערבית. במאה התשיעית לסלבית יתרגים חלקי לגרמנית. במאה השלש עשרה היה קיים תרגום מלא בצרפתית. התנ"כ הפך לספר עמים. במאה השישית היו קיימים תרגומים לשמונה שפות: במאה החמש עשרה — לעשרים וארבע שפות; במאה השש עשרה — לשלושים שפות. עתה קיים התנ"כ בתרגום ל־1082 שפות קיים תרגום לאספרנטו. קיים גם תנ"כ לפי שיטת ברייל בשביל עוורים.

התנועה לריפורמציה חוללה גאות רבה בתפוצת התנ"כ, עוד לפני תרגומו המהולל של לוטר היו קיימים ארבעה עשרה תרגומים חלקיים ושלמים של התנ"כ לגרמנית. אבל הריפורמציה העלתה את העיון בתנ"כ למעלת עיקרון דתי. לוטר והריפורמיסטים, שבאו אחריו, ראו בתנ"כ לא רק סמכות דתית יחידה, אלא אף, אמצעי לגאולה. "התנ"כ — הדת שלנו" — חזרו והצהירו הפרוטסטנטים; "תנ"כ בידי הנפש", מאמין הכרחי הוא לגאולת הנפש". מכאן התפיצה הגדולה של התנ"כ. התרגום של לוטר נעשה על פי המקור. לפי תנ"כ בהוצאת גרשון בן משה סוציניו מאיטליה. אף לוטר נעזר בעבודת התרגום ברבנים. מכאן ואילך נמצא התנ"כ בכל בית פרוטסטנטי. עמים רבים מאמצים את ספר הספרים בדבקות דתית.

כמה טופסי התנ"כ היו קיימים בתקופה הקדומה בארץ? אפשר לשער, כי היו מעטים מאד: כידוע. בעשתה ההעתקה בידים והיתה זאת עבודה מיגעת, הטעונה שקידה רבה, התמדה והוצאות רבות. הדבר היה אפשרי רק לאדם בעל נכסים רבים. בראשונה נכתבו המגילות על ספירוסים, אחר כך על גויליס. רק במאה התשיעית החל השמוש בנייר. שהובא מהמזרח הרחוק. ההעתקה נעשתה ע"י חובבים, ששעתם פנויה, וכן ע"י סופרים מיוחדים. בתקופות מסויימות השתמשו בעבודת עבדים. האסור של קרל הגדול על העסקת ילדים בעבודת העתקה מעיד, כי הדבר היה נפוץ בזמנים ההם. האפשר היה להמנע במלאכה קשה זו מטעויות. שבושים? צורת ההעתקה היתה רבגונית בהתאם למקום ורוח הזמן. במזרח נהגו להוסיף ציורים בשולי המגילות. במערב שלבו עטורים מרהיבים עין בראש פרק או אף בגוף המגילה. פארו אותיות בראש כל פרק. בספריה של דיזין בצרפת אפשר להתפעל מטופס נהדר של התנ"כ בתרגומו של א. הרדינג. יש והשתמשו בגויליס יקרי ערך, בדיו צבעוני, כחול, זהב, כסף. הקטעים האדיקים התרעמו על מתי חופש הדמיון במלאכת ההעתקה. גם הקראים התנגדו להוספת עטורים וציורים. ההעתקה היהודית שנעשתה ע"י סופרים מיוחדים, שהתיחסו לעבודתם ביראת כבוד רבה, שמרה על נוסח מוסכם. מכל מקום, כל עוד ההעתקה היתה מלאכת ידים לא יכול היה הספר להיות נחלת המונים רבים.

*

הדפוס אפשר להביא את התנ"כ לכל בית, לכל איש ואשה אצל כל עם ועם. התנ"כ היה הספר הראשון שיצא מתחת מכבש הדפוס בשנות 56—1453. אבל האמצאה היתה בראשיתה ויכולת התפיקה היתה מועטה למדי. מהדורה שלמה של ספרי התנ"כ כללה מאה עד מאתיים ספר... שכלול הדפוס בא לאט לאט. האביר פון קנשטין יכול היה להציר בגאוה, כי בשנות 1719—1710 הוציא לאור.. 40.000 ספרי התנ"כ. בשנת 1949 היתה תפוצת התנ"כ ביפאן בלבד... 1.900.000 טופסים. הוצאה היהודית של התנ"כ ראתה אור מאוחר למדי: בית דפוס, שהתקין לראשונה אותיות עבריות והדפיס ספרים עבריים היה של אברהם בן חיים די טינטורי באיטליה בשנת 1474. שלש שנים אחר מכך יצאו לאור 300 טופסים של חלקי התנ"כ בהדפסה יהודית. ב־1482 ראה אור התנ"כ הראשון בהוצאה רבנית בבית דפוס בונציה, מקום של העטורים והציורים ירשו תדפיסים של הטובי עץ.

אצל עמים רבים היה התנ"כ הספר הראשון בשפת אם, שיצא מתחת מכבש הדפוס. אצל עמים רבים שימש, איפוא, התנ"כ יסוד לספרית לאומית בשפת המוני העם. תרגום התנ"כ היה מלאכה שחייבה מאמץ לשוני רב, הצריך כנוס אוצרות השפה, נפוי מעולה ודיוק רב. התנ"כ העשיר את אמצעי הבטוי, עדן את הניב, סגל צורה תיאם סגנון. הוא פיתח כושר מבע דק של הרגשות והרהורים, להט נפשי ודכאון רוח. הוא שמש סולם אל התרבות ואל רוממית המחשבה. היא העלה את הקורא על כנפי מעוף פיוטי למרומי הרקיע; גרף בתוכה, הלהיב בבואה, צלל אל תהומות ההוויה. התנ"כ קרע אופקים חדשים למחשבה אצל המוני העמים, קסם במרשגים נעלים של רחמים, אחוה, צדק סוציאלי, אחרית הימים. הוא הכשיר לתת פירקן לרטט הנפש ורחש הלב, לזעקה ולצהלה, ליגון ולשמחה, לזעם ולסליחה. הוא הרעיד הנפשות החיריות של עמים ושבטים בחיל ורעדה מפני עבירה ועונש. יהרעיף עליהם טל של נחמה ותקוה. פתח בפניהם שערי חרטה ותשובה. התנ"כ לטש שפיות מהתנ"כ, טינטורו מפליא לספר בשפת המכחול על קורות ישראל במדבר; בדי רמברנד מאוכלסים דמויות התנ"כ; רובנס מעלה את משפט שלמה; מוריללו מצייר את דמות איוב; בליק ממחיש את חזון יחזקאל, המלכה אסתר, דניאל בגוב האריות. דורה מחיה את התנ"כ במערכת ציורים מסבירה. טיסו מעטיר ציורים שובבים הלב על רקע התנ"כ. ובזמן האחרון — לגרנד מעמיק להסביר את התנ"כ בעפרון ובמכחול אמן. התנ"כ נעשה חלק בלתי נפרד של חייהם הפנימיים של עמיב, של טובי הוגי הדעות, של אמנים ויוצרים. הוא מרעיד את דמיונם ומפרה את כח היצירה. המשכן, המנורה, בית המקדש הם חלק של הפולקלור של עמים רבים.

הלהט הדתי שגאה עם הדבקות של המונים בתנ"כ וההזדהות רוחו, העלתה את אנשי הצלילים למרומים נעלים — להמתיק סוד עם כרובים ומלאכים, להלל את בורא העולם בהלל ובזמרה, להכנע בפניו בנגונים נוגים. הנפש הנפעמת בהתלהבות דתית בהשפעת התנ"כ מנסה לתת ארשת רחשיה בשירה האומרת כסוף ותפלה זכה והשתפכות ורוממות רוח ותחנונים והללויה. הקלויניסטים טפחו בענין רב את הנעימה הדתית המלווה פרקי תהלים. הם הנהיגו שירה בצבור של מזמורים. גורדינל הצרפתי מעתיק לשפת הצלילים את תרגומי התהלים של מרו. בך והנדל מבטאים בעומק יבעות, בגיל ובשמחה את רוח התהלים. אף היידן הקאטולי נושא זמרה בהשראת התנ"כ. בטהיבן וגליק נאבקו עם עצמם כדי להביע את שוועת "מן המעמקים". מנדלסון, מוקסם מרוח אישותו של הנביא יוצר את "אליהו". שטראוס נמשך לעלילת יוסף ויוצר את הפנטומינה "אגדת יוסף". סן סאנס יוצר את "שמשון ודלילה"; פון קלינן את שולמית. יצירותיהם של בלוך והונגר ומייו בימינו מעידות קבל עולם על עצמת השראת התנ"כ על דמיונם היוצר של מגי הצלילים עד היום הזה.

משך אלפים בשנה שמר התנ"כ על הברית בין עם ישראל וארץ ישראל. הודות להכרת העולם בקדושת התנ"כ רווחה בעולם ומלואו הכרה חרישית בבעלות עם ישראל על ארץ ישראל. כל הנסיונות להפקיע ממנו את התנ"כ עלו בתוהו. הודות להקרבה וההזדהות של העם עם ספר היוחסין שלו. התנ"כ שמש לנו בגולה תחליף המולדת — מולדת נודדת לאומה. על יסוד התנ"כ קמה מדינת ישראל.

עד למינימום — אינני יודע איזה מינימום — או ככל האפשר עד אפס. אין חוק במדינת ישראל מחייב השתקת התנועה בכלי רכב ביום כיפור ובכל זאת רחובות ודרכים הם ריקים מתנועת כלי רכב ביום כיפור. האוכלוסיה כולה שומרת מרצונה הטוב ובלי כל כפיה או „לחץ ציבורי" על קדושת היום מבלי ליחס, בחלקה הגדול, קדושה לרוב הביטויים הדתיים.

השפעת מסורת או הרגל בלבד אינם מסבירים את היחס הזה. מסורת יהרגל איבדו את כוחם בשטחים רחביש מאד. מנין היחס המיוחד ליום כיפור דוקא?

זו מידה „כל המאמינים" אמנם מגיבים במה שהם אומרים לפי נוסח התפילה; וההסתייגות חלה אולי במידה לא קטנה גם על אלה החושבים עצמם לדתיים, אך בודאי על הרוב הגדול של ההמונים שרק ביום כיפור ממלאים את בתי הכנסת.

הדגשתי את הוידויים ואת התחנונים על סליחה שהם מטילים את חותמם על יום כיפור, מפני שהסתירה בין נוסח התפילה, נראית גדולה ביותר. והיות מתפלל האינדיבידואלי עם מובן דברי התיפלה, נראית גדולה ביותר. והיות והתוכן הנפשי של יום כיפור, — כפי שגם השם אומר — הוא דוקא בהשגת הסליחה, אשר נקנית ע"י הוידוי והחרטה, נעשית הפליאה גדולה ביותר על המקום המיוחד שתופס בכל עם ישראל חג אשר משולל היאחזות בזכרונות היסטוריים.

אבל דברי הימים מלאים דוגמתם בכל שטח, בפוליטיקה, בספרות, במדע. הם הנם בני חלוף. בני קימא הם לא הכוונות, כי אם יצירות שיוזמו ע"י צדיקים וחטאים כאחד.

ואין, נדמה, עיד אומה, היודעת כמו האיטלקים, לבור מתוך המוץ ההיסטורי את הנצה.

בתוך המון של יום ראשון הלכנו לכנסית הוואטיקן. נשים צדקניות טבלו ידיהן בקערת אבן תחת דמותה של מדונה יהצטלבו. נשקו אצבעות רגלו של סט.־פטרוס המאובן בדמות שנתנו לו אמן. כמרים שרתו באגפים המרובים, הקהל עומד על רגליו, מקשיב לתפלה, כורע לפי צליל פעמון, ומצטלב. ובתוך ההמון עברו מאות אנשים ספרי הדרכה בידיהם, והם מהלכים בין המתפללים כדרך שמהלך מבקר במוזיאון.

הללו היו בבית תפלה, והללו במשכן אמנות. אלה ואלה תחת גג אחד.

בבית הכנסת בפלורנץ מתקיים המנין בזכותם של קבצנים בטלנים, ברוח עניות ורוחו נשתמרה לנצח, קשט לפני שש מאות שנה את בימת הקארדינאל שלו במאות דמויות של שיש — האמנם חשוב אם הקארדינאל, בשר ודם, רצה להתנשא על פני חבריו האחרים?

בלבו של סט.־פטר, כנסית היאתיקן המשתרעת על מרחב של 15,000(!) מטרים מרובעים, מתנשאת מלאכת מחשבת בזהב ובאבן של אמן אשר קבע בה דבורים עוקצות. חוקרים מאוחרים יודעים לספר כי זו היתה נקמתו היחידה שניתנה לו נגד הקארדינאל שלו שהיה חוטא עם אשתו — האמנם חשוב אם „איש האלהים" נתגלה בזוהמתו? האמנם חשוב כי גני אוסטיה עם חמש מאות המזרקות הוקמו סביב ארמונו בפקודת הקארדינל, בנה של לוקרציה בורג'יה החוטאת? האם בכלל חשוב שבית מדיצ'י הפלורנטיני, אדיר הכח, מינה אחד מצאצאיו בן הי"ג לקארדינל?

כל אלה הם קריזוזים היסטוריים.

אבל דברי הימים מלאים דוגמתם בכל שטח, בפוליטיקה, בספרות, במדע. הם הנם בני חלוף. בני קימא הם לא הכוונות, כי אם יצירות שיוזמו ע"י צדיקים וחטאים כאחד.

ואין, נדמה, עיד אומה, היודעת כמו האיטלקים, לבור מתוך המוץ ההיסטורי את הנצה.

בתוך המון של יום ראשון הלכנו לכנסית הוואטיקן. נשים צדקניות טבלו ידיהן בקערת אבן תחת דמותה של מדונה יהצטלבו. נשקו אצבעות רגלו של סט.־פטרוס המאובן בדמות שנתנו לו אמן. כמרים שרתו באגפים המרובים, הקהל עומד על רגליו, מקשיב לתפלה, כורע לפי צליל פעמון, ומצטלב. ובתוך ההמון עברו מאות אנשים ספרי הדרכה בידיהם, והם מהלכים בין המתפללים כדרך שמהלך מבקר במוזיאון.

הללו היו בבית תפלה, והללו במשכן אמנות. אלה ואלה תחת גג אחד.

בבית הכנסת בפלורנץ מתקיים המנין בזכותם של קבצנים בטלנים, ברוח עניות ורוחו נשתמרה לנצח, קשט לפני שש מאות שנה את בימת הקארדינאל שלו במאות דמויות של שיש — האמנם חשוב אם הקארדינאל, בשר ודם, רצה להתנשא על פני חבריו האחרים?

בלבו של סט.־פטר, כנסית היאתיקן המשתרעת על מרחב של 15,000(!) מטרים מרובעים, מתנשאת מלאכת מחשבת בזהב ובאבן של אמן אשר קבע בה דבורים עוקצות. חוקרים מאוחרים יודעים לספר כי זו היתה נקמתו היחידה שניתנה לו נגד הקארדינאל שלו שהיה חוטא עם אשתו — האמנם חשוב אם „איש האלהים" נתגלה בזוהמתו? האמנם חשוב כי גני אוסטיה עם חמש מאות המזרקות הוקמו סביב ארמונו בפקודת הקארדינל, בנה של לוקרציה בורג'יה החוטאת? האם בכלל חשוב שבית מדיצ'י הפלורנטיני, אדיר הכח, מינה אחד מצאצאיו בן הי"ג לקארדינל?

כל אלה הם קריזוזים היסטוריים.

אבל דברי הימים מלאים דוגמתם בכל שטח, בפוליטיקה, בספרות, במדע. הם הנם בני חלוף. בני קימא הם לא הכוונות, כי אם יצירות שיוזמו ע"י צדיקים וחטאים כאחד.

ואין, נדמה, עיד אומה, היודעת כמו האיטלקים, לבור מתוך המוץ ההיסטורי את הנצה.

בתוך המון של יום ראשון הלכנו לכנסית הוואטיקן. נשים צדקניות טבלו ידיהן בקערת אבן תחת דמותה של מדונה יהצטלבו. נשקו אצבעות רגלו של סט.־פטרוס המאובן בדמות שנתנו לו אמן. כמרים שרתו באגפים המרובים, הקהל עומד על רגליו, מקשיב לתפלה, כורע לפי צליל פעמון, ומצטלב. ובתוך ההמון עברו מאות אנשים ספרי הדרכה בידיהם, והם מהלכים בין המתפללים כדרך שמהלך מבקר במוזיאון.

הללו היו בבית תפלה, והללו במשכן אמנות. אלה ואלה תחת גג אחד.

בבית הכנסת בפלורנץ מתקיים המנין בזכותם של קבצנים בטלנים, ברוח עניות

תפילה

חיתוך עץ של בודקו

תפילה שבהיכל שלמה, ראיתי מלצר העומד דום לשמע ה„קדושה" מתוך היכל שלמה... ובהיכל פנימה ראיתי בשבת בין השמשות צעירים בגיל 18—20 יושבים מסובים לשולחן וחבר כנסת אחד, מן הידועים, יושב ומגיד שיעור בתלמוד. והבחורים שואלים שאלות כהלכה ומראים ענין רב בסוגיה הנלמדת. ואף הם הודו יאמרו, שבאו לכאן תחילה בגלל ה„יופי של המקום".

אכן, אף זו אחת הדרכים שבהן תלך היהדות החרדית כדי להביא דברה לשכבות רחבות־רחוקות. כי יש להתחשב ב„קול השופר" של תקופתנו. דרוש לא רק „מקל נועם", כי אם גם היכל נועם — ויתכן שבדרך זו נזכה, ש„קול השופר" יתחזק וילך.

יומן מסעות באירופה

זה הבית לה'

מאת יצחק זיו־אב

רומא, ספטמבר 1958.

בית הכנסת בפלורנץ עומד בתוך גן מטופח. תחילה ראינוהו מלמעלה, בסיור מאורגן ע"י חברת התיירות האיטלקית. עלינו על גבעה מעל לעיר, פיאצצה מיכלאנג'לו, והמדריך הצביע על כיפה ירוקה, כנסיה חסרת צלב, „זהו בית הכנסת היהודי, הוא יפה מאד", אמר הוא. למחרתו הלכנו לתפילת מנחה.

זכרתיו עוד מימי מלחמת העולם השניה, כאשר חנינו, פלוגת צבאיות, בצפון איטליה. הבית עמד בחורבנו. הנאצים, לא הפיסטים, חללוהו בחקפה הקצרה בה היטלר השתלט על איטליה. הם הפכו אותו לאורוה, פוצצו את עמודי השיש הפנימיים. עקרו את המוזאיקה. ובקתות רובים שברו את הדלתות ההטובות של ארון הקודש. אבל גם מתוך החורבן קרן יופיו של בית אלקים. „עשרה מבני משפחתי נלקחו על ידי הנאצים ולא חזרו", מזכיר לנו השמש. זה עתה סיימנו מנחה בחברת עשרה בטלנים ו„קדיש" אחד, החבור האבל קפץ על וספה — נערה על המרשב האחורי — ונעלם בסיבוב של רחוב. הבטלנים ישבו על ספסל של אבן וחילקי ביניהם את נדבתנו. ואנו, חבורת אורחים שנזדמנה במקרה — יהודים, ישראלים, אמריקנים וסקוטים — עלינו על פני רצפת המוזאיקה אל בית מוזאיקה, מחודשים לגמרי. חידוד של בית הכנסת הפלורנטיני היה היפוכו הגמור של הפשטות הקיצונית אשר בבית הכנסת הפורטוגזי הישן באמסטרדאם.

אבל, ראה, כל דבר נאה במקומו!

סיפרתי על קבוצת קאתולים ממילאנו אשר עמדה מסומרת במקומה בתוך הפשטות הלא־קאתולית של בית התפלה באמסטרדאם. עתה עמדנו אנחנו מול הפאר ה„קאתולי" של הסינגוגה שלנו — והיינו גאים, בדיוק כמו שהתרוממנו באוירה של עתיקות הולנד. כאן, בין המונומנטים האמנותיים של הכנסיה הקאתולית, היו דרושים גם לנו הזהב והמוזאיקה, והפריסקות, והכיפה המתנשאת מעל לבתי פלורנץ.

כי האמנות היתה לחלק בלתי נפרד של הדת באיטליה.

הכנסיה היתה המניע והשומר של נכסי אמנות נצחיים. כך נמשך דורות.

זכות זו איש אינו יכול ליטול ממנה.

הלכנו, כמובן, לקאתידראלה במילנו. עלינו אל מתחת לכיפת סט.־פטר ברומא. סמוך לשער טיטוס ראינו טקס נשואים בבאזיליקה עתיקה, צלילי עוגב ושירה, פרחים הרבה, חבורת כמרים בלבן נוצץ נעה לאטה, והאדם — בסמוקינג, בטראפציה ופניגים — כורע חסר נשימה, מורא הנצח עליו. שוטטנו בין אלפי המצבות האמנותיות בבית הקברות (ובו חלקה יהודית) של מילאנו — מוזיאון תחת כיפת השמים.

בפיזה, באפלולית הקאתידראלה מן המאה הי"א, ביקשנו לפתור חידה אנושית — חידתו של אמן אשר שמונה שנים עבד בשיש בשני סנטימים ליום! אבל הרעב נשכח, ונשכח עלבונו של אדם, נשתמרה היצירה. ניקולה פיזאנו — איש פיזה — אשר מת יום ביומו מא מצאנו את בית הכנסת נעול, בפתח הגיטו היהודי. היהדות — לא כקבוצה דתית, אלא גזעית — נאבקת על קיומה. נשואי תערובת תילשים בשר מגופה. בורות חותרת תחת יסודותיה. בתוך הפאר של פלורנץ (כמו בתוך המשטות היפה של אמסטרדם) אנו בתת־גוננות.

אבל מאהורי מסך יצירותיהם של מיכלאנג'לו וברניני, וניקולה פיזאנו, ומאות אהרים, פיעלת יום יום אדמיניסטרציה תקיפה של הקאתוליות. היא איננה תמימה, ואין לה פרטנסיות להיראות תמימה, כמו טקס הברכה של האפיפיור פיוס ה־12. ראינוהו במעון הקיץ שלו יוצא אל קהל מבקרים. הם נצטופפו בהצר אטומה מימי הבינים והוא יצא אליהם, וממרומי מרפסת קטנה, פשט ידיו ונענע אותן לברכה. אחר כך זז אחורנית ומתח ידיו בסימן של יישו הצלוב ומלמל אליהם תפלה. מעבר להצר, בכפר העני, כרכרו ברחוב תרנגולות, תגרנים מכרו דברי קדושה וצעיפים שחורים לכיסוי ראשן של נשים בתי קפה מלאו את הפיאצצה בשולחנות. הדיאר הקטן עשה ביזנס גדול בגלויות — כמו אותה הנזירה אשר בדאר הואתיקן מתחת לכיפת ס"ט־פטרוס, זוג פועלים לגם יין בבית המרזח המלוכלך. קרבתו של האב הקדוש שלהם, משכה אליהם תיירים, והכפריים הפכו את התיירים לביזנס. ארבעת הרגעים של ברכת האפיפיור קיימו משפחות רבות בכפר הקטן.

אך לא הברכה היא סמל הקאתוליות של דורנו. סמל הפעילות המדינית שלה הוא בית משרדים מודרני במס. 1 ויאה דללה קונסיליאציונה (רחוב ההתפייסות) בפתח ככר הקוללונדה הנפלאה של ברניני בסט.־פטרוס. כאן שוכן מרכז התניעה הקאתולית באיטליה. ומכאן משפיעה באלפי דרכים גלויות ונסתרות על מדיניות הארץ מאז, בשנת 1929, השלים מוסוליני עם הכנסיה והתם אתה על קונקורדאט אשר ההזיר אותה לפעילות אזרחית.

שלושים שנה אחרי זה החלו מורים קאתולים בבתי ספר להשפיע על הילדים תורת נצרות. הם החזירו שעת תפלה, ובשעת תפלה, כמובן גם את ההצטלבות, ולפתע הועמדו הורים יהודים בפני דילמה איטליה הליברלית מאד בפני בעיה שלא ידעוה — ילדיהם החלו להרגיש כי הם יהודים, בשביל להיות דומים בכל לחבריהם בכתה היה עליהם להצטלב כמותם.

מחיר זה בעד הקוסמופוליטיות שלהם לא רצו לשלם אפילו מנהיגים סוציאליסטים יהודים. לא להיות יהודים, בבקשה! אבל להצטלב כנוצרים — לא ולא!

וככל שהדבר יראה משונה במאה העשרים — הלחץ לחיים יהודים מחודשים החל לבוא בעקיפין מויאה קונסיליאציונה...

המנינים בבתי התפלה שלנו ריקים הם, אבל החלה מתפתחת תנועה של בתי ספר יהודים. בראש המעשה העמידו עצמם הציונים והרבנים. „מאה אלף לירטות לשנה (לערך 350 לירות שלנו) אני משלם לשנה לקהלה, להחזיק בית ספר", סיפר לי מול שעריו הנעולים של בית הכנסת ברומא מהנדס יהודי מזקין. הוא ציוני. הוא היה שבע רצון.

מויאה קונסיליאציונה התפשט בחירות הכלליות האחרונות הסלוגאן „הצבע והצבע כהלכה!", וכל איטלקי ידע כי האימרה הבלתי פוליטית כבכול. אומרת גלויות „תן קולך למוסד הקאתוליני" — ויש לזאת משמעות עצומה בארץ בה הקהל עולה שבוע שבוע ברגל אל האפיפיור.

הכנסיה והמדינה קבעו מקומם בקונסטיטוציה האיטלקית. „כל אחד פר על בשטח שלו, עצמאי ובלתי־תלוי", אבל היום אנו קוראים בעתונות הגדולה, כי נדרשת כל ה„פיניזי" של המוח האיטלקי בשביל ליצור את הרושם כאילו הפורמולה עדיין פועלת.

ידיו של האפיפיור שלוחות אל המדינה.

הפרק הזה יהיה עוד שלושים עמודים ארוך מדי.

חלוקת הפרקים ואי חלוקת הפרקים [illegible] כלל לאו שאלה אלא
שיקול דעתו של המחבר. אולי היה עדיף לחלק את הפרק הזה

ક્રમાંક : ૧૧૫

ઉપરોક્ત બે મુલ્યાંકન અહેવાલ તપાસતાં જણાય છે કે બંને અહેવાલમાં ઉત્તરવહીમાં લખેલા જવાબોનું મૂલ્યાંકન કરવામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. એક મૂલ્યાંકનકારે ઉમેદવારના જવાબોને ખૂબ જ સારા ગણ્યા છે, જ્યારે બીજા મૂલ્યાંકનકારે તે જ જવાબોને ખૂબ જ નબળા ગણ્યા છે. આ પરિસ્થિતિમાં ઉમેદવારને ન્યાય આપવા માટે ત્રીજા મૂલ્યાંકનકારની નિમણૂક કરવી જરૂરી છે. ત્રીજા મૂલ્યાંકનકારનો અહેવાલ જે પણ આવે તે અંતિમ ગણવામાં આવશે અને તે મુજબ ઉમેદવારનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉપરોક્ત હકીકતો ધ્યાનમાં લઈ, આથી ઠરાવવામાં આવે છે કે ઉમેદવારની ઉત્તરવહીનું ત્રીજા મૂલ્યાંકનકાર પાસે પુનઃ મૂલ્યાંકન કરાવવામાં આવે અને ત્રીજા મૂલ્યાંકનકારનો અહેવાલ આવ્યા બાદ ઉમેદવારનું પરિણામ જાહેર કરવામાં આવે.

ומאחרים לעזוב את המקום כדי שלא יצטרכו
שיעשו לזמן רב, כי כולם יודעים שהם
הכי טובים בשביל, וכל אחד מהם
יודע שהוא יכול לעשות את זה
יותר טוב מכל אחד אחר. ואם
אחד מהם יעזוב, כולם יצטרכו
לעשות את העבודה שלו בנוסף
לשלהם, ואז כולם יהיו עייפים
ולא יוכלו לעשות את זה
טוב כל כך.

[illegible]

ઉત્તરવહી ચકાસણી અંગે સૂચનાઓ

૧. પરીક્ષક તરીકે નિમણૂક થયેલ વ્યક્તિએ પોતાને ફાળવવામાં આવેલ વિષયની ઉત્તરવહીઓ જ ચકાસવાની રહેશે. અન્ય વિષયની ઉત્તરવહીઓ ચકાસવા માટે આપવામાં આવશે નહીં.

૨. ઉત્તરવહી ચકાસણી માટે પરીક્ષકને પ્રતિ ઉત્તરવહી રૂ. ૧૫-૨૫ લેખે મહેનતાણું ચૂકવવામાં આવશે. મહેનતાણું ચૂકવવા માટે પરીક્ષકે પોતાનું બૅંક ખાતું ધરાવતી બૅંકની વિગતો તથા રદ કરેલ ચેક અથવા પાસબુકની નકલ સાથે રાખવી ફરજિયાત છે.

૩. ઉત્તરવહી ચકાસણી માટે પરીક્ષકને ઉત્તરવહી મળ્યાની તારીખથી ૧૫ દિવસની અંદર ચકાસણી પૂર્ણ કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ચકાસણી પૂર્ણ ન કરનાર પરીક્ષકનું નામ કાયમ માટે પરીક્ષક યાદીમાંથી કમી કરવામાં આવશે.

૪. ઉત્તરવહી ચકાસતી વખતે લાલ શાહીની પેન જ વાપરવી. પેન્સિલ કે અન્ય રંગની શાહીનો ઉપયોગ કરવો નહીં. ખોટા જવાબ પર ક્રૉસ (×) કરવું અને સાચા જવાબ પર ટિક (✓) કરવું.

૫. ઉત્તરવહીમાં ક્યાંય પણ પરીક્ષકે પોતાની ઓળખ છતી થાય તેવું કોઈ નિશાન કરવું નહીં. ઉત્તરવહીમાં પરીક્ષકનું નામ, સહી કે અન્ય કોઈ ઓળખ દર્શાવવી નહીં.

૬. ઉત્તરવહીમાં ગુણ ચકાસણી પૂર્ણ થયા બાદ દરેક પાનાના ઉપરના ખૂણામાં ગુણ લખવા અને કુલ ગુણ પ્રથમ પાનાના નિર્ધારિત સ્થાને સ્પષ્ટ અક્ષરે લખવા. ગુણ ચકાસણીમાં કોઈ ભૂલ ન રહે તે માટે પરીક્ષકે ગુણ ફરીથી ચકાસવા.

૭. ઉત્તરવહીમાં ક્યાંય પણ ખાડાખોડ કરવી નહીં. ખોટું લખાણ કાઢવા માટે પ્રવાહી સુધારક (વ્હાઇટનર) કે બ્લેડનો ઉપયોગ કરવો નહીં. ખોટું લખાણ એક સીધી લીટીથી રદ કરવું.

૮. ઉત્તરવહીમાં પરીક્ષકે કોઈ પણ પ્રકારની નોંધ, ટિપ્પણી કે અભિપ્રાય લખવો નહીં. ઉત્તરવહી ચકાસણી અંગે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો પરીક્ષકે પોતાના વિષય સંયોજકનો સંપર્ક કરવો.

૯. ઉત્તરવહી ચકાસણી પૂર્ણ થયા બાદ ઉત્તરવહીઓ, ગુણપત્રક અને મહેનતાણાના બિલ સંબંધિત કચેરીમાં જાતે જમા કરાવવાના રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા મોકલવામાં આવેલ ઉત્તરવહીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

૧૦. ઉત્તરવહી ચકાસણી અંગે કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાશે તો પરીક્ષકની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષણ કાર્ય માટે તેમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

૬૨ ૧૨૫ (૬૨૫) ૧૨૦ ૧૨૦૦ ૧૨૦૦ ૧૨૦

ક્રિયા ૬ મૂલ્ય ૭

૧) જીવ બનાવવા માટેના કોષ કયા કયા

બનાવવા જોઈએ તે કોષ કયા કયા

કોષમાં કેટલા રંગસૂત્રો હોવા જોઈએ તે

કોષ કયા કયા ભાગોમાંથી બને છે તે

કોષના ભાગોનાં નામ લખો.

૨) જીવ બનાવવા માટે કોષ વિભાજન

કેટલી વખત થવું જોઈએ તે વિભાજન

કયા કયા પ્રકારનું હોવું જોઈએ તે

વિભાજન દરમ્યાન કોષમાં કયા કયા

ફેરફારો થવા જોઈએ તે ફેરફારોનાં

નામ લખો.

૩) જીવ બનાવવા માટે કોષ વિભાજન

દરમ્યાન કોષમાં કયા કયા ફેરફારો

થવા જોઈએ તે ફેરફારોનાં નામ

લખો. કોષ વિભાજન દરમ્યાન

કોષમાં થતા ફેરફારોનું વર્ણન

કરો. કોષ વિભાજન દરમ્યાન

કોષમાં થતા ફેરફારોનું વર્ણન

કરો. કોષ વિભાજન દરમ્યાન

ન્યાયાધીશ

ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ ની કલમ ૨૪૩ હેઠળ

ફરિયાદ નં. ૧૨૩/૨૦૨૩

ફરિયાદી : રાજ્ય વતી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. બી. પટેલ

વિરુદ્ધ

આરોપી : (૧) રમેશ ભીખાભાઈ ચૌહાણ, ઉં.વ. ૩૪, રહે. ૭, ગોકુલ સોસાયટી, રેલવે ફાટક પાસે, જૂનાગઢ

(૨) સુરેશ ભીખાભાઈ ચૌહાણ, ઉં.વ. ૩૨, રહે. ઉપરોક્ત

આરોપી નં. (૧) હાજર. આરોપી નં. (૨) ગેરહાજર.

ફરિયાદ પક્ષ તરફે પી.એસ.આઈ. શ્રી એ. બી. પટેલ હાજર.

આરોપી નં. (૧) તરફે વકીલ શ્રી કે. એમ. દવે હાજર.

આરોપી નં. (૨) તરફે વકીલ શ્રી કે. એમ. દવે હાજર.

આરોપી નં. (૧) ને તેમની સામે મૂકવામાં આવેલ આરોપ વાંચી સંભળાવવામાં આવ્યો. તેમણે આરોપ કબૂલ કરવાનો ઇનકાર કર્યો અને કેસ ચલાવવાની માંગણી કરી.

આરોપી નં. (૨) ને તેમની સામે મૂકવામાં આવેલ આરોપ વાંચી સંભળાવવામાં આવ્યો. તેમણે આરોપ કબૂલ કરવાનો ઇનકાર કર્યો અને કેસ ચલાવવાની માંગણી કરી.

ફરિયાદ પક્ષ તરફે સાક્ષી નં. ૧ થી ૫ ની જુબાની નોંધવામાં આવી. સાક્ષી નં. ૧ ફરિયાદી પોતે છે. સાક્ષી નં. ૨ પંચ તરીકે હાજર રહેલ છે. સાક્ષી નં. ૩ તપાસ અધિકારી છે. સાક્ષી નં. ૪ ડૉક્ટર છે. સાક્ષી નં. ૫ ફોરેન્સિક નિષ્ણાત છે.

આરોપી નં. (૧) તરફે સાક્ષી નં. ૧ થી ૩ ની જુબાની નોંધવામાં આવી. સાક્ષી નં. ૧ આરોપી નં. (૧) પોતે છે. સાક્ષી નં. ૨ આરોપી નં. (૧) ના પિતા છે. સાક્ષી નં. ૩ આરોપી નં. (૧) ના પાડોશી છે.

આરોપી નં. (૨) તરફે કોઈ સાક્ષી હાજર થયો નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા પૈકી પંચનામું, ધરપકડ પંચનામું, ઘટનાસ્થળનો નકશો, ડૉક્ટરનો પ્રમાણપત્ર, ફોરેન્સિક અહેવાલ, ઓળખ પરેડનું પંચનામું, તથા આરોપી નં. (૧) ની કબૂલાતનું પંચનામું રજૂ થયેલ છે.

આરોપી નં. (૧) તરફે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ થયેલ નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ થયેલ નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ મુદ્દામાલ પૈકી ૧૦ તોલા સોનાના દાગીના, ૫૦ તોલા ચાંદીના દાગીના, રોકડ રૂ. ૨૫,૦૦૦/-, મોબાઈલ ફોન ૩, મોટરસાયકલ ૧, તથા ગુનામાં વપરાયેલ છરી ૧ મળી કુલ ૬ વસ્તુઓ રજૂ થયેલ છે.

આરોપી નં. (૧) તરફે કોઈ મુદ્દામાલ રજૂ થયેલ નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ મુદ્દામાલ રજૂ થયેલ નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા મુદ્દામાલ પૈકી કોઈ પણ વસ્તુ સામે આરોપી નં. (૧) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા મુદ્દામાલ પૈકી કોઈ પણ વસ્તુ સામે આરોપી નં. (૧) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા મુદ્દામાલ પૈકી કોઈ પણ વસ્તુ સામે આરોપી નં. (૧) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા મુદ્દામાલ પૈકી કોઈ પણ વસ્તુ સામે આરોપી નં. (૧) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તથા મુદ્દામાલ પૈકી કોઈ પણ વસ્તુ સામે આરોપી નં. (૧) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

આરોપી નં. (૨) તરફે કોઈ વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.

D. A. G. 1957

ਸਮਾਜ ਦੇ ਹਰ ਵਰਗ ਦੇ ਵਿਕਾਸ ਲਈ ਕੰਮ ਕਰਨ ਵਾਲੀ ਸੰਸਥਾ ਹੈ। ਇਸ ਦੇ ਮੈਂਬਰ ਸਮਾਜ ਦੇ ਹਰ ਵਰਗ ਵਿਚੋਂ ਹਨ

ಪ್ರಕಾಶಕರ ಸಂಘದ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಸಂಘದ ಸದಸ್ಯರಿಗೆ ಸುತ್ತೋಲೆ ಕಳುಹಿಸಿ ಹೊಸ ದರಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿದರು. ಕೆಲವು ಪತ್ರಿಕೆಗಳು ಈ ಬದಲಾವಣೆಯನ್ನು ಮೊದಲೇ ಗಮನಿಸಿ ತಮ್ಮ ಚಂದಾ ಬೆಲೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸಿದ್ದವು; ಇನ್ನು ಕೆಲವು ಕೆಲವು ತಿಂಗಳು ಕಾದು ನೋಡಿ ನಿರ್ಧರಿಸಿದವು.

ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾಗಿದ್ದ ಶ್ರೀ ಎಂ. ಎಸ್. ಪಟವರ್ಧನ್ ಅವರು ಈ ಬದಲಾವಣೆಯನ್ನು ಸ್ವಾಗತಿಸಿದರು. ಅಂಚೆ ಇಲಾಖೆಯು ಪತ್ರಿಕೆಗಳ ಪ್ರಸರಣಕ್ಕೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಬೇಕು ಎಂಬುದು ಅವರ ಅಭಿಪ್ರಾಯವಾಗಿತ್ತು. ಆದರೆ ಕಾಗದದ ಬೆಲೆ ಏರಿಕೆಯ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಈ ಕ್ರಮ ಅನಿವಾರ್ಯವೆಂದೂ ಅವರು ಒಪ್ಪಿಕೊಂಡರು. ಆದರೆ ಸಣ್ಣ ಪತ್ರಿಕೆಗಳಿಗೆ ಈ ಏರಿಕೆ ಭಾರವಾಗಿ ಪರಿಣಮಿಸಬಹುದೆಂಬ ಆತಂಕವನ್ನೂ ಅವರು ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು.

ಕೆಲವು ಪತ್ರಿಕೆಗಳು ಈ ಏರಿಕೆಯನ್ನು ಪ್ರತಿಭಟಿಸಿ ಕೆಲವು ತಿಂಗಳು ಅಂಚೆ ಮೂಲಕ ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಕಳುಹಿಸುವುದನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದವು. ಆದರೆ ಚಂದಾದಾರರಿಂದ ಒತ್ತಡ ಹೆಚ್ಚಾದಾಗ ಅವು ಮತ್ತೆ ಅಂಚೆ ಮೂಲಕ ಕಳುಹಿಸಲು ಪ್ರಾರಂಭಿಸಿದವು. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಈ ಬದಲಾವಣೆಯಿಂದ ಪತ್ರಿಕೆಗಳ ಪ್ರಸರಣದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಇಳಿಕೆ ಕಂಡುಬಂದಿತು. ಆದರೆ ಇದು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿತ್ತು ಎಂದು ಸಂಘದ ವರದಿಗಳು ತಿಳಿಸುತ್ತವೆ.

ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਸਾਲ 2021-22 ਦੌਰਾਨ ਸੂਬੇ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਜ਼ਿਲ੍ਹਿਆਂ ਵਿੱਚ ਸਥਾਪਿਤ ਕੀਤੇ ਜਾਣ ਵਾਲੇ ਨਵੇਂ ਸਰਕਾਰੀ ਕਾਲਜਾਂ ਦੀ ਸੂਚੀ

ਜਲੰਧਰ ਜ਼ਿਲ੍ਹੇ ਦੇ ਨਕੋਦਰ ਅਤੇ ਫਗਵਾੜਾ ਵਿਖੇ ਦੋ ਨਵੇਂ ਸਰਕਾਰੀ ਕਾਲਜ ਖੋਲ੍ਹੇ ਜਾਣਗੇ

ਚੰਡੀਗੜ੍ਹ, 14 ਜੁਲਾਈ: ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਸਾਲ 2021-22 ਦੌਰਾਨ ਸੂਬੇ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਜ਼ਿਲ੍ਹਿਆਂ ਵਿੱਚ ਸਥਾਪਿਤ ਕੀਤੇ ਜਾਣ ਵਾਲੇ ਨਵੇਂ ਸਰਕਾਰੀ ਕਾਲਜਾਂ ਦੀ ਸੂਚੀ ਜਾਰੀ ਕਰ ਦਿੱਤੀ ਗਈ ਹੈ। ਇਸ ਸੂਚੀ ਅਨੁਸਾਰ ਜਲੰਧਰ ਜ਼ਿਲ੍ਹੇ ਦੇ ਨਕੋਦਰ ਅਤੇ ਫਗਵਾੜਾ ਵਿਖੇ ਦੋ ਨਵੇਂ ਸਰਕਾਰੀ ਕਾਲਜ ਖੋਲ੍ਹੇ ਜਾਣਗੇ। ਇਸ ਫੈਸਲੇ ਨਾਲ ਜਲੰਧਰ ਦਿਹਾਤੀ ਖੇਤਰ ਦੇ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਉੱਚ ਸਿੱਖਿਆ ਲਈ ਜ਼ਿਲ੍ਹਾ ਹੈੱਡਕੁਆਰਟਰ ਜਾਣ ਦੀ ਲੋੜ ਨਹੀਂ ਪਵੇਗੀ, ਜਿਸ ਨਾਲ ਉਨ੍ਹਾਂ ਦੇ ਸਮੇਂ ਅਤੇ ਆਵਾਜਾਈ ਖਰਚੇ ਦੋਵਾਂ ਵਿੱਚ ਕਾਫ਼ੀ ਬੱਚਤ ਹੋਵੇਗੀ।

ਸਿੱਖਿਆ ਮੰਤਰੀ ਸ. ਹਰਜੋਤ ਸਿੰਘ ਬੈਂਸ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਨਕੋਦਰ ਵਿਖੇ ਖੋਲ੍ਹੇ ਜਾਣ ਵਾਲੇ ਕਾਲਜ ਵਿੱਚ ਬੀ.ਏ. ਅਤੇ ਬੀ.ਕਾਮ ਦੀਆਂ ਕਲਾਸਾਂ ਸ਼ੁਰੂ ਕੀਤੀਆਂ ਜਾਣਗੀਆਂ, ਜਦਕਿ ਫਗਵਾੜਾ ਵਿਖੇ ਵਿਗਿਆਨ ਵਿਸ਼ਿਆਂ ਦੀ ਪੜ੍ਹਾਈ ਵੀ ਸ਼ਾਮਲ ਕੀਤੀ ਜਾਵੇਗੀ। ਉਨ੍ਹਾਂ ਕਿਹਾ ਕਿ ਇਨ੍ਹਾਂ ਕਾਲਜਾਂ ਲਈ ਲੋੜੀਂਦੀ ਅਸਾਮੀਆਂ ਦੀ ਭਰਤੀ ਪ੍ਰਕਿਰਿਆ ਵੀ ਜਲਦ ਹੀ ਸ਼ੁਰੂ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ ਤਾਂ ਜੋ ਅਕਾਦਮਿਕ ਸੈਸ਼ਨ ਸ਼ੁਰੂ ਹੋਣ ਤੱਕ ਇਹ ਕਾਲਜ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਕਾਰਜਸ਼ੀਲ ਹੋ ਸਕਣ।

ਉਨ੍ਹਾਂ ਕਿਹਾ ਕਿ ਸੂਬੇ ਦੇ ਪੇਂਡੂ ਖੇਤਰਾਂ ਵਿੱਚ ਉੱਚ ਸਿੱਖਿਆ ਦੀ ਪਹੁੰਚ ਨੂੰ ਵਧਾਉਣਾ ਸਰਕਾਰ ਦੀ ਪਹਿਲ ਹੈ ਅਤੇ ਇਸ ਫੈਸਲੇ ਨਾਲ ਹਜ਼ਾਰਾਂ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਸਿੱਧਾ ਲਾਭ ਮਿਲੇਗਾ। ਇਸ ਤੋਂ ਇਲਾਵਾ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਮੋਗਾ ਅਤੇ ਮਲੇਰਕੋਟਲਾ ਜ਼ਿਲ੍ਹਿਆਂ ਵਿੱਚ ਵੀ ਦੋ-ਦੋ ਨਵੇਂ ਕਾਲਜ ਖੋਲ੍ਹਣ ਦੀ ਤਜਵੀਜ਼ ਹੈ, ਜਿਸ ਦੀ ਰਸਮੀ ਮਨਜ਼ੂਰੀ ਅਗਲੀ ਕੈਬਨਿਟ ਮੀਟਿੰਗ ਵਿੱਚ ਲਈ ਜਾਵੇਗੀ।

ש ל ו ם.

בשלו בשפת שם בדוק ב

והללו שם יש ב, ואפה כפי שהוזכר יותר לעיל שם בשפת ובדם

כלא הללו שם בשפת ב, ובשפת הדיבור אנו כן כתב הללו שם בשפת ובדם

אשרי אם שם בשפת ב, ובשפת הדיבור אנו כן כתב הללו שם בשפת

הללו שם יש ב, הללו בשפת ב, אבל אם בשפת הדיבור בעתיד

הללו שם יש ב, הללו בשפת ב, ואף בשפת הדיבור בעתיד

(בניגוד לשפת הכתיבה, בדוגמה לפני כן) הללו הוא תמיד בשפת

בדוק הלשון שפה שפת תנועה פרט לניקוד שאינו הללו בשפת ב

ואלה בהערות שטחיות בשפת כ"א

ופלוגתא דרבי יוחנן וריש לקיש, דאמר רבי יוחנן משום רבי יוסי, אפילו הכי
מודים חכמים לרבי יוסי בזה שהלך אחר רוב בני העיר, שרוב בני העיר היו
נוהגים כרבי יוסי, שהיה דר שם הרבה. ואמר ריש לקיש, מחלוקת זו
בשלא נתערבו בהן אחרים, אבל נתערבו בהן אחרים אין הולכין אחר רוב
העיר, ואף על פי שרוב בני העיר כרבי יוסי, שמיעוט אחרים שבהן
כרבי יהודה. ואמר רבי יוחנן משום רבי יוסי, הלכה כרבי יהודה
בפלוגתא דרבי יוסי.

ותעלוץ שמיה ארצך.

כאן יחלה הזמן בעלמו אשר נגע אחיכו. וקבל עצת רבן
ועזה שפאר בו רבינו עלמ עשרת תורה הכתובה הוונו בן התורה
כן ארבל בעלאב בתריסרוות ובאר כיצד אנשי אנשי הדורות.
הלכות ועהוות ביע. כאן רב וופלן ענקע סוגי. ואוטר כ שלשם

שיש בדבר תורה שאין לו אב אין נוהגין בו מנהג אבלות ואין מזכירין עליו יזכור ואין אומרין עליו קדיש אלא אם כן היה לו אב ואם אחד מהם בלבד ואפילו אשה ואפילו קטן בן יום אחד אומרין עליו קדיש ויזכור ואם היה לו אב ואם ואחד מהם בלבד ואפילו אשה ואפילו קטן בן יום אחד אומרין עליו קדיש ויזכור